

# આગમ દરિયો રણે ભરિયો

પ.પૂ.ગ. આચાર્યદિવ શ્રીમદ્ વિજય જ્યથોષસૂરીશ્વરજી મ.સા.

# मुल्ता घराना कोजारी

मु. पो. सिंहद्वारा,  
ज़ीला: जालोर राज.)  
फ़ोन-343 041.

- १) अंडाया }  
    |  
    ३५०-४१
- २) २८५ - २५७ अल्पकास्टोट्रिप्पल  
    वार्ड
- ३) बोराचा गो. गो. वार्ड नं. १७
- ४) २५१४११२। = गो. वार्ड
- ५) अमाप्ता - १६२३ वार्डी, १३३८ वार्डी,  
    त्रिलो. गो. वार्डी, वार्डी ..
- ६) २५१३१२०८८।
- ७) २५१८१२०८८।

ॐ ह्री अहं श्री शंभेश्वर पार्श्वनाथाय नमः  
श्री प्रेम-भुवनभानुसूरि-धर्मघोषविजय सद्गुरुभ्यो नमो नमः

# आगम दरियो रत्ने भरियो

: लेखक :

प.पू. प्रवयनगारुडी आचार्यदेव श्रीमद्  
विजय भुवनभानुसूरीश्वरजु महाराजाना पट्टालंकार  
प.पू. गीतार्थशिरोमणि गच्छापिपति आचार्यदेव  
श्रीमद् विजय जयघोषसूरीश्वरजु म.सा.

: संपादक :

प.पू. मुनि श्री सत्यकांतविजयजु म.सा.

: प्रकाशक :  
दिव्यदर्शन द्रष्ट,  
उट-कलिकुंड सोसायटी,  
मळबीपुर चार रस्ता,  
धोणका-३८७८१०.

પ્રકાશન સંવત  
વિ.સं. ૨૦૫૪

: મૂલ્ય :  
રૂ. ૪૦-૦૦

નકલ  
૧૦૦૦

: સુષૃતના સહભાગી :  
પુખરાજજી રીખવચંદજી મહેતા  
પાલો (પીડવાડાવાળા)  
તથા  
એક સદગૃહસ્થ - મુંબઈ

દિવ્યદર્શન ટ્રસ્ટ.  
૩૬, કલિકુંડ સોસાયટી,  
મફલીપુર ચાર રસ્તા,  
ઘોળકા. જી. અમદાવાદ  
પીન : ૩૮૭૮૧૦

રસિકલાલ રત્નલાલ શાહ  
એલ. કે. ટ્રસ્ટ બિલ્ડિંગ,  
પાંચકુવા,  
અમદાવાદ-૧.

અરવિંદભાઈ જે. શાહ  
૮૬, શેખ મેમણ સ્ટ્રીટ,  
૧ લે મારો, મુંબઈ-૧.

લાલભાઈ ત્રીકમભાઈ  
ઇપ્પદ, હાજાપટેલની પોળ,  
શાંતિનાથની પોળમાં,  
કેલિકો ડેમ પાછળ,  
સીલીફ રોડ,  
અમદાવાદ-૧.

પ્રાસિસ્થાન

મુદ્રક : હિરીટ ગ્રાફિક્સ, અમદાવાદ-૧. ફોન : ૫૩૫૨૬૦૨

# પુષ્ટક વીચિત્રા પહેલાં

સાગર ગાગરમાં સમાય શી રીતે ?

૧ તોલા પારામાં ૧૦૦ તોલા સોનું સમય સમાય શી રીતે ?  
મગજમાં ન બેસે તેવી વાત પણ... નાના મોટા સુભાષિત ને જુઓ તો આ  
વાત સહજ બેસી જાય...

૨ લીટી કે ૪ લીટીના એ સુભાષિતના એકેક પદમાં કેવી ગંભીર  
વાતો ભરી હોય છે તે તો કો'ક શાની ગુરુભગવંત એને ખોલે.... દેખાડે....  
સમજાવે.... તો જ એ વાતો-ગઢન પદાથો... નાના સુભાષિતમાં સમાયેલી છે  
એ આપણાને સમજાય...

રાસાયણિક ધનવન્તરી વૈધ જ પ્રક્રિયા વિશેષથી જેમ ૧ તોલા  
પારામાં સમાયેલું ૧૦૦ તોલા સોનું કાઢી શકે છે....

હિમાલયની શિખરે સ્થિત શંકર જ ગાગર જેવી નાનકડી જટામાંથી  
ગંગા જેવી નદીઓના ઘોખ વહાવી શકે છે.... પૂર્વભવની કોઈ અગમ્ય  
વિશિષ્ટ જ્ઞાનોપાસનાનું પીઠબળ અને વર્તમાનમાં સ્વ.પૂ.આ.શ્રી વિજય  
પ્રેમસૂરીશ્વરજી મહારાજ અને સ્વ.પૂ.આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી  
મહારાજ આ બતે ગુરુદેવો આચાર્યભગવન્તોની અસીમ કૃપાબળે અલૌકિક  
કથોપશમ રૂપ પ્રક્રિયા દ્વારા ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય  
જયધોપસૂરીશ્વરજી મહારાજે સુભાષિત જેવા નાનકડા એકેક પદ -  
પંક્તિમાંથી જે ઉધાડ કર્યો છે... જે સુંદર સરણ ભાષામાં બોધ આપ્યો છે...  
વાંચતાં લાગે કે બસ વાંચ્યા જ કરીએ... વાંચ્યા જ કરીએ... કેવી સરસ  
વાતો લખી છે.... “નિશ્ચય પામેલામાં વ્યવહાર અવશ્ય હોય છે... તેમજ  
નિશ્ચય પામવા માટે પણ વ્યવહાર અવશ્ય હોવો જોઈએ...” વાચકને કેવી  
સરળતાથી વ્યવહારધર્મની વાત જ્ઞાવવાનું કર્યું! અને બીજી એક વાત....

‘વાખાણ અને લખાણ’ બેમાં ઘણો ફેર છે...

બોલનારા કદાચ બોલે અને કાંઈક ફેરફાર હોય તો બીજા વાક્ય  
દ્વારા અને સુધારે... જ્યારે લખાણ કરનારે વક્તાના આશયને પકડવાનો...  
વક્તાની બધી વાતો પકડવાની... વાચકને સુગમ પડે તેમ પીરસવાનું.. વગેરે  
અનેક વાતોનો ખ્યાલ રાખવો જોઈએ... જે કામ ખૂબ સારી રીતે મુનિશ્રી

સત્યકાંત વિજયજીએ કર્યું છે...

ચાલો સાગરમાં દૂબકી મારીએ...

ગાગરને ઓળખી લઈએ...

કૃ. પં. નંદિલૂધણાવિજય

શ્રી શંખેશ્વર પાર્થનાથાય નમ:  
શ્રી પ્રેમ-ભુવનમાનુ-જ્યયધોપસૂર્દિ-સૂર્યકાંતવિજયેભ્યો નમ:  
એં નમ:

## કંઈક કણેવા જૈવું

સાગર.... અફાટ અને અગાધ.....  
ન તેનો છેડો મળો, ન તેનું તળીયું જરૂર  
દૂર દૂર દેખતા નજર થાકી આય,  
તો ય કિનારો ના દીસે,  
ડૂબકી લગાવીએ તો જટ  
પેટાળ ય હાથવગું ન થાય.  
આવા સાગરનો પણ કિનારો મેળવે છે  
કેટલાક વહાણવટીયાઓ,  
તો તેના તળીયે પહોંચે છે કેટલાક મરજીવાઓ.  
મરજીવાને જોઈએ છે રતો,  
પાણીદાર ને જળહળતા.  
લાલ લીલા ને સફેદ.  
અનેક જાતના ને વિવિધ ભાતના.  
આવા રતો કિનારે તો કયાંથી મળો ?  
સાહસને ધારણ કરી ડૂબકી લગાવી  
મધદરિયે પહોંચે તો હાથ લાગે,  
બાકી કિનારે તો  
કોડી અને ઢીપલાઓ જ પડ્યા હોય.  
પરંતુ બધા લોકો મરજીવા બની શકતા નથી.  
સાહસ ખેડવું તે દરેકના ગજામાં નથી હોય.  
લોક તો મરજીવાએ લાવેલા રતો જ જુએ છે.  
તેની પાછળ કરાયેલ પુરુષાર્થ-મહેનત  
સાથે તેઓને જાગો સંબંધ નથી હોતો,  
તો મરજીવો પણ તેઓની ખુશામતની આશા રાખતો નથી.  
પ્રભુના મુખમાંથી નીકળેલ

અને ગાંધિપરો દ્વારા રચાયેલ આગમો પણ  
 સાગરની ઉપમાને ધારણા કરી શકે તેમ છે.  
 અનેક સુભાષિત રૂપી રલો આમાં રહેલા છે.  
 એક મરજીવાની જેમ આગમ સમુદ્રમાં દૂબકી લગાવી  
 પૂજયપાદ દાદાગુરુદેવ ગરછાખિપતિ  
 આચાર્યદેવશ્રી વિજય જયધોષસૂરીશ્વરજી મહારાજાને  
 આપણી સમકાળ આપણે સમજી શકીએ,  
 ગ્રહણ કરી શકીએ તેવા અનેક સુભાષિતો મૂક્યા છે.  
 તેઓએ પૂર્ણપાર્થ કરી રલો કાઢ્યા અને જગત સમકાળ મૂક્યા,  
 આપણે લઈશું તો કલ્યાણ આપણું થશે.  
 ઉપેક્ષા પ્રમાણ કરીશું તો તુકશાન પણ આપણને જ છે.  
 શું કરવું તે સ્વભાવારિત છે.  
 આ પુસ્તકને વારંવાર એકાગ્રતાથી વાંચવામાં આવશે તો  
 અચૂક એકાદ વાક્યરળ પ્રાણ થતાં  
 આપણું દારિદ્ર ટણશે.  
 આ પુસ્તક માટે માત્ર એક નાની વિનંતીને સ્વીકારીને  
 સુંદર અને માર્મિક પ્રસ્તાવના લખી આપનાર  
 પ.પુ.પ. શ્રી નંદીભૂષણ વિ.મ. ઋણ મસલકે ચઢાવું છું.  
 મૂળ મેટરને વ્યવસ્થિત કરવામાં અને  
 મુફ સંશોધન વિ. કાર્યોમાં  
 મુનિરાજ શ્રી સંયમબોધિ વિ.મ.નો  
 સહયોગ સાંપડયો છે. તો  
 મુનિરાજ શ્રી ઉદ્યપદર્શન વિ.મહારાજે પ્રેમ કોપી તૈયાર કરી  
 આ કાર્યને સરળ બનાવ્યુ છે.  
 પ્રાંતે પૂજયપાદ ગુરુદેવશ્રીને  
 એક જ વિનંતી કરું છું કે  
 આવા સુંદર લેખો લખીને  
 આપણા જેવા અણાની જીવોને  
 પ્રભુનો માર્ગ બતાવે, સમજાવે.....

૪ સત્યકાંત વિ.

## સાહિત્ય રલનિધિ

● ભાવનાનું ઉદ્ઘાન (બીજુ આવૃત્તિ)	૧૩-૦૦
● ચલો શાંતિ કે ઉપવનમે (હિંદી)	૧૦-૦૦
● ચિત્ત સૌંદર્ય (બીજુ આવૃત્તિ)	૮-૦૦
● દર્શન સુધા	૨૮-૦૦
● પંચસૂત્ર સ્વાધ્યાય	૧૧-૦૦
● કર્મકલંકને દૂર નિવારો	૧૧-૦૦
● ચિંતન ચંદરવો	૧૨-૦૦
● વહે મીઠી વાણી (ત્રીજુ આવૃત્તિ)	૧૨-૦૦
● હીરો એક પાસા અનેક	૩૦-૦૦
● ગુરુવંદન પચ્ચકુખાણ ભાધ્યના રહસ્યો	૧૦-૦૦
● એક ઉડુયન મુક્કિત ભણી	૧૨-૦૦
● શ્રાવક જન તો તેને કહીએ	૧૨-૦૦
● પાને પાને વસંત	૨૦-૦૦
● અમૃતવાણી લો પીછાણી	૧૮-૦૦
● સાધનાથી સિદ્ધિ ભણી	૨૫-૦૦
● ગીતાર્થની વાણી અનુભવની ખાણી	૧૬-૦૦
● આગમ દરિયો રલે ભરીયો	૪૦-૦૦

## દુર્લભો રત્નકોટ્યાડપિ ક્ષળોડપિ મનુજાયુષः ।

**મનુષ્ય** આયુષ્યની એક ક્ષણ પણ કરોડો રત્નો કરતાં (કરોડો રત્નની પ્રાપ્તિ કરતાં) પણ દુર્લભ છે.

(૧) અસંખ્ય રત્નોના વિમાનાધિપતિ દેવો પણ મનુષ્યભવ પામી શકતા નથી. અસંખ્ય દેવો તિર્યાચમાં ઉત્પત્ત થાય છે.

(૨) કરોડો રત્નની પ્રાપ્તિ માટે જે પુષ્ય જોઈએ તેના કરતાં પણ મનુષ્યભવની એક ક્ષણ મેળવવા વધારે પુષ્ય જોઈએ.

(૩) ચક્રવર્તીઓ પોતાના છાંબે ખંડનું રાજ્ય આપીને પણ આયુષ્ય વધારી શકતા નથી.

(૪) મનુષ્યભવના આયુષ્ય દ્વારા અનુત્તર સુધીના સ્વર્ગ અને મોક્ષ મેળવી શકાય છે.

(૫) શુભ અધ્યવસાય વગર કરોડો રતોથી પણ મનુષ્યપણું મળતું નથી.

(૬) ગર્ભજ પર્યામ મનુષ્યની અપેક્ષાએ મનુષ્ય આયુષ્યની ક્ષણ સંઘાતા જીવોને જ મળે છે.

મનુષ્ય આયુષ્યથી જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ધર્મની આરાધના થઈ શકે છે, જે ફક્ત રતોથી થઈ શકતી નથી. જેમ રતો કરતા મનુષ્યભવનું આયુષ્ય કિમતી છે તેમ મનુષ્યભવમાં પૂર્ણ આયુષ્ય, ઈન્દ્રિયપૂર્ણાતા, આર્થકોત્ત્ર, આર્થકુળ, ધર્મની પ્રાપ્તિ, ધર્મની શ્રદ્ધા, ધર્મનું શ્રવણ, ધર્મના પરિષ્ણામ અને ધર્મનું આચરણ, આ બધું કરોડો રતોથી પણ મળી શકતું નથી, પણ અનંત પુષ્ય બેગું થાય ત્યારે મળે છે.

લોહી, ચામડી, આંખ-કાનના પડદા વગરે આજે અબજોના ખર્ચે પણ વેજાનિકો બનાવી શકતા નથી, કિન્તુ જીવ પોતાના પુષ્યથી આ બનાવી શકે છે.

પાંચે ઈન્દ્રિયોના વિષયો મનુષ્ય કરતાં પણ દેવલોકમાં ઘણાં ઉત્તમ છે, જીતાં દેવલોકના આયુષ્ય કરતા મનુષ્યના આયુષ્યની કિમત વધારે છે, કારણ દેવલોકમાં વેરાજ્ય અને સમ્બગ્રદર્શન કોઈકને જ મળે છે, બધાને નહિ, વળી તે ટકાવવા પણ કહાનું છે અટલે ત્યાંથી સંસારમાં રખડવાનું ઊભું જ રહે છે. જ્યારે મનુષ્ય લોકમાં આવા કિમતી આયુષ્યને જો વેડફે નહિ, કુટુંબ-ધન-પરિવાર અને

માજમજામાં જો જીવન ગુમાવે નહિ અને શક્ય શક્તિ ફોરવી ધર્મ કરે તેનો કિમતી એવો મનુષ્યભાવ સાર્થક થાય છે, બાકીનાનો રતથી કાગ ઉડાવ્યા જેવો નિર્ઝળ અને મૂર્ખામી સુચવતો થાય છે. જેમ સંપૂર્ણ રીતે બંધ ઘરમાં જામી પડેલા અંધારાને ખસેડવા પ્રકાશનું એક કિરણ પર્યામ છે, ઘાસની ગંભીરોના ઢગને કે ઉકરડાઓના ખડકલાઓને બાળવા એક ચિનગારી બસ થઈ પડે છે, કોઈ નિર્ધનીયાની આજનું દરિદ્રતાને ખતમ કરવા એકાદ મહામૂલુ રત જ સફળ થઈ જાય છે... તેમ રાચીમાચીને કરેલા અનંતાનંત પાપોના ઢગલાઓને ખલાસ કરવા મનુષ્ય જન્મની એકાદ ક્ષણ પર્યામ થઈ પડે છે. ઉત્કૃષ્ટ અધ્યવસાયોની નિસરણીએ ચઢેલો જીવ જ્પાતાબંધ ગુણસ્થાનકોના મજલાઓને સર કરતો લોકના અગ્રભાગે બેસવાની યોગ્યતા મેળવી લે છે. પ્રસરયંત્ર રાજર્ષિ, ભરત ચક્રવર્તી, પૃથ્વીયંત્ર-ગુણસાગર, ઈલાચીકુમાર આદિના દ્રષ્ટાંતો ક્ષણવારમાં થઈ જતી અજબ-ગજબની ઉથલાપાથલોનો તાદૃશ્ય ચિતાર આપી જાય છે.

માણસના જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવતી હોય છે, જેના ઉપર ભવિષ્યનો આખો ઠિઠિલાસ લખાતો હોય છે. જો તે ક્ષણે યોગ્ય નિર્ષય લેવાય તો જિંદગી જતી જીવાય, જો ગાંધેલ કે નિઃસત્ત્વ બન્યા તો વર્ષોની સાધના પાણીમાં ગયા વિના ન રહે. અનંતા કાળથી મોહરાજાની સામે ચાલતા સંગ્રહમાં મોહના સૈન્યને પરાજિત કરવાની, જતનો બુંગિયો ફુંકવાની અને આત્માની અનંત સમૃદ્ધિને પામવાની તક એક માત્ર મનુષ્યભવ જ આપે છે. આથી જ તો મનુષ્યજન્મની મહત્તમાન ગુણગાન ગાતા શાખકાર પરમર્થિઓ થાકતા નથી. "મણુઆ તુમમેવ સચ્ચં" જેવા ટંકશાળી વચ્ચનોથી ચાર ગતિ, ચોર્યાશી લાખ પોનિ અને અસંખ્ય ઉત્પત્તિસ્થાનોની વચ્ચે પણ મનુષ્ય જન્મને શ્રેષ્ઠ ગણાવ્યો છે, તો ક્ષાંક દશ-દશ-દ્રષ્ટાંતોથી તેની દુર્લભતા બતાવી છે. આવા દુર્લભ મનુષ્યભવમાં એક જ કામ કરવાનું હોય. અનાદિકાળથી જામી પડેલી કુવાસનાઓ, કુસંસકારો અને કુકર્માને ખલાસ કરવાનું. એક એક આરાધનાઓ અનંતાનંત કર્માને કાપવાની તાકાત ધરાવે છે, અને તેથી જ પ્રત્યેક ક્ષણ આવી આરાધનાઓમાં લયલીન જનવામાં પસાર કરવાની છે અને એમાં જો ગાંધેલ રવ્યા તો અનંતકાળની દુર્ગતિ લમણે જિંકાઈ જાય. તેથી જ તો સુભાપિતકાર મનુષ્ય જીવનની ક્ષણનો આટલો મહિમા બતાવે છે.

નરકના, નિગોદના કે તિર્યંચના ભવોમાં કારમી વેદનાઓ અસંખ્ય કે અનંતકાળ સુધી બોગવી બોગવીને પણ જે કર્મ ન ખપાવી શકીએ તે દેવ-ગુરુ પ્રત્યેના આદર-બહુમાનથી બરેલી આજાનુસારી આરાધનાઓ ક્ષણવારમાં ખપાવી શકે છે. આરાધનાઓની તકને જિલ્લી લેવાથી અનંતકાળના ભવભ્રમણથી બચી જવાય, ગાફેલ રહેવામાં ભવભ્રમણ વધી જાય. નિર્ઝાય આપણે કરવાનો છે.

લાખો વિમાનોના અધિપતિ ઈન્દ્રો માધું પટકીને મરી જાય, તરફડે, જૂરે છતાં આ આરાધના કરવાનું સૌભાગ્ય એમના હાથમાં નથી. નરકના જાલિમ દુઃખોથી રીબાતો નારકીનો જીવ દુઃખ બોગવવામાંથી ઉંચો આવે તો આરાધના યાદ આવે ને? અને કદાચ યાદ આવી જાય તો યું પરવશપણું આરાધના ક્ષયાંથી કરવા દે? જ્યારે તિર્યંચના ભવોમાં અજ્ઞાન એવું છે કે આરાધનાની તક જ દેખાતી કે સમજાતી નથી ત્યારે મનુષ્યનો ભવ જ એક એવો છે, જેમાં આરાધનાની બધી જ સામગ્રી પરિપૂર્ણ રીતે મળેલી છે, સમજણ પણ છે, તક પણ છે. માટે મનુષ્યભવની કિમત સમજી, પ્રમાદ છોડી, ધર્મભાવના અને ધર્મ આરાધનામાં પ્રયત્ન કરવો ઉચ્ચિત છે.

વિષયોમાં સદા ઉદ્દિગ્ર રહેનાર અને ધર્મમાં કાળજીથી પ્રયત્ન કરનાર મનુષ્યને જેમ દેવલોક મળે છે, તેમ દેવોમાં જે હંમેશા વૈરાગ્ય ટકાવી રાખી ત્યાંના બોગોની ઉપેક્ષા કરી, ઉદાસીન રીતે કાળ પસાર કરે તેને મનુષ્ય આયુષ્ય બંધાય છે.

દુર્લભ મનુષ્ય આયુષ્ય દેવોને વૈરાગ્ય અને રત્નત્રધીની તીવ્ર ઈચ્છાના બળ ઉપર મળે છે. માટે મનુષ્યભવની દેવભવના અંતર દ્વારા સાનુબંધતા મોક્ષ સુધી જેમને જોઈએ, (દેવભવના આંતરે સતત મનુષ્યભવ જોઈએ) તેમણે જીવનમાં મોજશોખ, કપડા, ઘરેણા, ખાનપાન વગેરે બધી જ અનુકૂળતા અને વિષયો ઉપર વૈરાગ્ય ધારણ કરવો, વધારવો અને શક્ય ત્યાગ કરવો.

દેવ-ગુરુ, ધર્મ તથા ધર્મની ભક્તિ-વિનય-બહુમાન રાખનાર, સમ્પકૃત્વના આચારનું પાલન કરનાર તથા શ્રુતશાન અને શ્રદ્ધા વધારતો જનાર જીવ સંસારમાં ગુંચવાતો નથી, ધર્મમાં કંટાળતો નથી, એના દ્વારા સાનુબંધ ધર્મ અને વૈરાગ્ય એને ભવોભવ મળતા જ રહે છે અને જો વચ્ચે બીજા વાવાજોડાથી ઉંઘો ન ચેતે તો પાંચ સાત ભવમાં આત્મા મોક્ષ પામે છે. માટે પાપ પ્રવૃત્તિ ઘટાડવી અને ધર્મની આરાધનામાં ઉધમ કરી મનુષ્ય જન્મની ક્ષણોને સાર્થક કરવી.

## ॥ सज्जाय समो तवो नत्य ॥

**મો**કનો ઉપાય શું ?

કિયા કે જ્ઞાન ?

તપ કે સ્વાધ્યાય ?

નિશ્ચય કે વ્યવહાર ?

આ પ્રશ્નોનો જવાબ એ આપી શકાય કે જેનું જે સ્વરૂપ હોય તેનો તે ઉપાય હોય, બીજા ઉપાયો સહકારી કારણ હોય.

મોક્ષમાં કિયા નથી, જ્ઞાન છે, તેથી જ્ઞાન એ મોક્ષનું પ્રપાન કારણ છે. જ્ઞાન ક્રંતુ અને કેટલું એ પછી વાત.

મોક્ષમાં કાયકલેશ જેવો ભાબ તપ નથી, પરંતુ સ્વરૂપમગ્રતા-સ્વરૂપ સ્થિરતારૂપ અભ્યંતર તપ છે, જે ધ્યાનની પરાકાણ સ્વરૂપ છે.

મોક્ષમાં વ્યવહાર નથી, પરસ્પર કે વ્યક્તિગત કોઈ પ્રવૃત્તિ નથી, મોક્ષ આત્મગુણમાં સ્થિરતા કે રમણતારૂપ પરાકાણનો નિશ્ચય છે.

જ્ઞાન ગુણ, સ્વાધ્યાય ગુણ, નિશ્ચય આ બધા લોકમાં અવ્યવહાર્ય છે, અને અસલીની જેમ નકલી પણ હોય છે.

(૧) માટે ભિથ્યાત્મીના છા પૂર્વ સુધીના જ્ઞાનને પણ અજ્ઞાન કહ્યું.

(૨) શ્રદ્ધા વગરનો સ્વાધ્યાય એ અભ્યંતર તપ નથી.

(૩) શક્ય સંયોગમાં જે નિશ્ચય વ્યવહાર ન લાવે તે સાચો નિશ્ચય નથી.

જેમ જ્ઞાનની પરિણાતિવાળા નિઃશુક, નિર્દ્ય બનતા નથી, તેમ કેવળજ્ઞાની વેપ લેવાની ના પણ પાડતા નથી.

માટે જ્ઞાનને ભાવિત કરવા કિયા છે. સ્વાધ્યાયને સહાયક-પોષક તપ છે. વ્યવહાર નિશ્ચયને પામવા માટે છે.

માટે જે કિયા પછી જ્ઞાનની પરિણાતિ ન હોય, જ્ઞાનનો ઉદેશ ન હોય, જ્ઞાનીને અનુસરવાનું ન હોય, જ્ઞાનનું નિયંત્રણ ન હોય તે કિયા મોક્ષમાર્ગ ન કહેવાય.

જે જ્ઞાન સંહિત્ય-ભ્રમ-વિપરીતરૂપે હોય, પરિણાતિ વગરનું હોય, જ્ઞાનના કાર્યને કરતું ન હોય, બીજા જ્ઞાનીને સ્વીકારતું ન હોય, જ્ઞાનના અનુસારે વર્તવાની તૈયારી કે ભાવનાવાળું ન હોય તે વસ્તુસ્થિતિએ જ્ઞાન નથી અને મોક્ષમાર્ગ પણ નથી.

સંહિત્ય વગેરે જ્ઞાનથી કાર્ય સફળ ન થતા વિપરીત કાર્ય થાય, પરિણાતિ એટલે જ્ઞાન જેવું જ્ઞાને તેવી સચોટ માન્યતા-શ્રદ્ધા-હેય વસ્તુને જ્ઞાન દ્વારા દેખણું બતાવવા છતાં તેવી માન્યતા-શ્રદ્ધા-સંવેદન ન હોય તો હેય તરીકેનું જ્ઞાન એ વાસ્તવમાં જ્ઞાન નથી, પણ પોપટપાઠ છે. જ્ઞાનનું કાર્ય પાપથી નિવૃત્તિ, પશ્ચાત્તાપ, સાવધાની, ધર્મકાર્યમાં સાનંદ પ્રવૃત્તિ, ઉલ્લાસ, બીજાના કાર્યમાં સહાયકતા, અનુમોદના વગેરે હોય. જ્યાં આવું ન જ્ઞાનાય ત્યાં જ્ઞાનનું કાર્ય ન હોવાથી તે સમ્યગ્જ્ઞાન નથી.

જે જ્ઞાની બીજા જ્ઞાનીને સ્વીકારે નહિ તેને પોતાનું જ્ઞાન સંપૂર્ણપણે સન્ય છે તેવો વિશ્વાસ નથી, બીજાનો અપલાપ છે, પોતાનું અભિમાન છે. સર્વજ્ઞ ક્યારે પણ બીજા સર્વજ્ઞનો અપલાપ નથી કરતા, માટે જ આગમગ્રંથોમાં અવારનવાર શબ્દ વપરાયો છે, “નિબેભિ” જેનો “આમ હું અને અનંતા તીર્થીકરદેવો કહે છે,” તેવો અર્થ કરેલ છે. જેને બીજા જ્ઞાનીનો Support ન હોય તેવા છદ્ધસ્થનું જ્ઞાન પ્રમાણભૂત બનતું નથી. આ વાતને સૂક્ષ્મતાથી સમજવી. માટે જ શાખમાં વિધિ બતાવી કે ગીતાર્થ બીજા ગીતાર્થને વાત જ્ઞાને, પૂછે. તે વિધિ જેમાં ન હોય તે જ્ઞાન મોક્ષમાર્ગરૂપ બનતું નથી.

જ્ઞાન આત્મસ્વરૂપમાં રહેવા માટે તથા રાગ-દેખના નિગ્રહ માટે છે. તેથી તે જ જ્ઞાન સાચું કહેવાય, જે આત્મસ્વરૂપપ્રામિના ઉપાયોમાં પ્રવૃત્તિ અને રાગ-દેખ-મોહ-અજ્ઞાનના કરણોથી નિવૃત્તિ કરાવે. સાથે સાથે અશક્ય પરિસ્થિતિમાં-અશુભ પ્રવૃત્તિમાં પશ્ચાત્તાપ અને ઉદાસીનતા; શુભ પ્રવર્તનમાં આનંદ, અપ્રવર્તનમાં પશ્ચાત્તાપ વગેરે ભાવો પેદા કરાવે. આવું આત્મસંવેદન પ્રગતાવે તે જ જ્ઞાન મોક્ષમાર્ગ બની શકે.

જ્ઞાનાભ્યાસ અને ભાવનાથી કિયા શુદ્ધ-તીવ્ર અનુભવયુક્ત બને છે, જે મોક્ષ મેળવવા માટે પાવરફુલ બને છે. ભાવના વગર અને જ્ઞાનાભ્યાસ વગર કિયા શુદ્ધ પરિણાતિવાળી થતી નથી. તેથી તે મોક્ષમાર્ગ બનતી નથી.

જીવમાં જે સંસાર અનાદિ કાળથી છે તે કિયાથી કે જ્ઞાનથી? પાપબંધ અને પુણ્યબંધની તીવ્રતા કિયાથી કે તે કિયામાં ભળતા ચિત્તના ઉપયોગરૂપ આનંદથી?

જવાબ એક જ આપો શકાય કે સાતમી નરક હોય કે સર્વાર્થસિદ્ધપણું હોય, સંસાર હોય કે મોક્ષ; આ બધું જ કિયાને નિમિત બનાવીને કે નિમિત બનાવ્યા વિના શાન કે અશાનં દારા પેદા થતા મનના સંકલ્પ-વિકલ્પ, વિવેક, વિચારણા આદિના ફળરૂપ છે. તેથી મુખ્યત્વે શાન જ પ્રધાન કારણ બને છે. કિયા અને ભાવના જેમ જેમ શાનનું વિશુદ્ધિકરણ કરે તેમ તેમ મોક્ષ નિકટ આવે.

તે જ રીતે જો સ્વાધ્યાય જેવી વસ્તુ સાધુ કે શ્રાવકના જીવનમાં ન હોય, શાખસર્જન-અભ્યાસ ન હોય તો કિયાઓ કોના આપારે ? એની શુદ્ધિ-વૃદ્ધિ-પોષકાનું શાન ક્યાંથી થાય ? યુગલિક કાળમાં વિશેષ કિયાઓ નથી, માટે શાનની જરૂર નથી. છેઠા આરામાં પણ પરાધીનતા અને વિશેષ કિયા નથી, માટે વિશેષ શાન નથી. નારક તિર્યચમાં પણ એ અવસ્થા છે. પરંતુ કર્મભૂમિમાં કિયાનું નિયંત્રણ-સંશોધન-સંમાર્જન-વિશિષ્ટકરણ વગેરે શાન દારા થાય છે. આજે ભણવાનું બંધ થાય તો જેમ લોકવ્યવહારમાં અંધેર થાય તેમ શાસન અને મોક્ષમાર્ગ પણ શાન-વ્યવહાર વગર શૂન્ય થાય.

માટે બધી કિયાઓનો પ્રાણ શાન છે. શાખમાં જેને ૧૫ દિવસમાં અડધી ગાથા પણ ન આવડે તેને પણ રોજ ૨૫૦૦ નવકાર ગણવારુપે પરાવર્તન નામનો સ્વાધ્યાય કહ્યો છે, પરંતુ અભ્યાસ વગર ફક્ત તપ કરવાનો કહ્યો નથી. અને તપ કરનાર સાથે સાથે અભ્યાસ કરે તો તે તપને સાનુંબંધ કહ્યો છે. અભ્યાસના યોગ વગરના તપને નિરનુંબંધ કહેલ છે. શાન એ શ્રદ્ધાપોપક છે, કિયાપોપક છે, ચારિત્રપોપક છે. તે બાબ્દ તપ અને શેષ અભ્યંતર તપને પણ પુછ કરે છે. કેવળજ્ઞાન પણ શુભભાવનારૂપી શાનથી થાય છે. વૈરાગ્ય પણ શાનસ્વરૂપ છે. વૈયાવચ્ચ માટે પણ શાન જોઈએ. સંસ્થા કે ગચ્છના સંચાલન માટે પણ શાન જોઈએ. આમ આરાધનાના બધા જ યોગોને શાન પોષે છે.

શાસનપ્રભાવના માટે જરૂરી મંત્ર-તંત્ર-વાદીપરાજ્ય વગેરે માટે પણ તે તે શાખોનું શાન જરૂરી છે. પ્રભુએ પોતાના શાનથી કરેલા સંશેષ નિરાકરણથી ૧૧ ગણધરો શાસનને પ્રાપ્ત થયા. ત્રિપદીથી ગણધરદેવો પણ દ્વારાંગી રચે છે. માટે શાન પરોપકારકપણ છે. જે બાબ્દ તપ અભ્યંતર તપનો પોપક બને તે સાનુંબંધ; જે રોપક બને તે વ્યવહાર ધર્મ મોક્ષમાર્ગ ન બને.

માટે શાસનમાં રહેલા સાધુ અને શ્રાવકને આચારજ્ઞાન, આશ્રવ-સંવરણું શાન, નિર્જરાના ઉપાયોનું શાન, બંધના કારણોનું શાન-આ બધું સૂક્ષ્મરૂપે જરૂરી છે.

નિશ્ચય એ પણ આત્મપરિણાતિરૂપ જ્ઞાન સહકૃત છે. વ્યવહાર એ પરિણાતિનો ઉત્પાદક-વર્ધક-રક્ષક છે. નિશ્ચય એ મોક્ષ છે, મોક્ષમાર્ગ છે. વ્યવહાર જે નિશ્ચયપ્રાપ્ત છે તે પણ મોક્ષમાર્ગ છે.

બાધ્યમાં ભલે કિયા, તપ કે વ્યવહારમાં વિશેષ ઊડાજ જોવાતું ન હોય, છતાં તે જરૂર જ્ઞાનીને પરતંત્ર હોય, જ્ઞાન સહકૃત હોય, જ્ઞાનની રૂચિવાળા હોય તો તે મોક્ષમાર્ગ તરીકે મનાય.

કિયાથી જ્ઞાન આવે, તપથી ભાવના અને સ્વાધ્યાય આવે, તેમજ વ્યવહારથી નિશ્ચય આવે. માટે બાધ્ય વ્યવહારમાં કિયા, તપ અને વ્યવહાર જ પ્રધાન બને. તેનાથી આંતરિક ગુણો રૂપ આંતરિક મોક્ષમાર્ગ પ્રગટે.

અસદું આચારથી જેમ ઔદ્ઘિક ભાવો ઉત્પત્ત થાય છે, તેમ સદું આચારથી ક્ષયોપશમભાવ ઉત્પત્ત થાય અને એની પરાકાશા ક્ષાયિક ભાવમાં પરિણમે છે.

માટે પરમાત્માને જ્ઞાન ભેગી કિયા મૂકી, સ્વાધ્યાય ભેગો તપ મૂક્યો, નિશ્ચય સાથે વ્યવહાર બતાવ્યો. જેના જીવનમાં સ્વાધ્યાય છે તે તપસ્વી છે. જેના જીવનમાં સ્વાધ્યાય નથી તે ગૌણ તપસ્વી છે. માટે સ્વાધ્યાયપૂર્વક તપ કરતા રહેવું.

તપ કે અન્યયોગોમાં આગળ વધનાર તે તે યોગોમાં નબળા જીવો પર અરુચિ કરી શકે, પરંતુ સ્વાધ્યાયથી કેળવાયેલી પરિણાતિવાળો અન્ય પર અરુચિ ન કરી શકે. કુરગૃહ મહાત્મા પર ચાર તપસ્વીઓને અરુચિ થઈ, પરંતુ કુરગૃહને તે ચાર તપસ્વીઓએ ઘોર અકાર્ય કરવા છતાં તેમના પર અરુચિ ન થઈ તે પરિણાતિનો જ પ્રભાવ. આમ તપથી જે પરિણાતિ ઊભી ન થઈ શકે તે સ્વાધ્યાયથી ઊભી થઈ શકે. માટે સ્વાધ્યાય એ જ પ્રધાન મોક્ષમાર્ગ છે.

તપ સહેલો છે, માત્ર કાયકાયરૂપ છે, માનપ્રાપ્ત છે જ્યારે જ્ઞાન કઠીન છે, મગજ કસવું પડે, બાધ્ય પ્રવૃત્તિઓ છોડવી પડે, પંચાત છોડવી પડે. તપસ્વી તપ કરી બાધ્ય પ્રવૃત્તિ કરી શકે.

જ્ઞાનને વધારવા માટે પોષણરૂપ અને જ્ઞાનની અશુદ્ધ પરિણાતિને સુધારવા દ્વારા શોધક તપ છે. માટે અશુદ્ધ કે અખૂરા જ્ઞાનીને તપ કરવો પડે, જ્યારે કેવળજ્ઞાનીને છેલ્લે અશસણ સિવાય નિત્ય ભક્ત હોય છે, કારણ જ્ઞાનની પરાકાશા પ્રાપ્ત થઈ ગઈ છે.

તપ કરતા સ્વાધ્યાયમાં વધારે નિર્જરા છે, કારકો મનની સતત ઉપયોગ પ્રવૃત્તિ છે. મનના ઉપયોગ વગર સ્વાધ્યાય, અર્થચિંતન શક્ય નથી. તપની સાથે સ્વાધ્યાય વિકસે તો તપ ઉપાદેય અને અભ્યાસ ઘટે-બંધ પડે તો તે તપને પ્રધાનતા ન અપાય, એ હેઠાં જેવો કહેવાય.

તપના ગ્રંથ કાર્યો છે :- (૧) ઈચ્છારોધ, (૨) કખાયદમન અને (૩) ઈન્દ્રિયદમન. તે ગ્રંથો કાર્યો સ્વાધ્યાયરૂપ તપવાળાને સર્વાંગે હોય છે. બાબુ તપસ્વીને ઈન્દ્રિયનિગ્રહ આંશિક છે, જ્ઞાનીને સર્વાંગે છે.

તપ દેહનો નિગ્રહ કરે; જ્ઞાન મનનો નિગ્રહ કરે. જે મનનો નિગ્રહ કરે તે કખાયનિગ્રહ અને વિષયનિગ્રહ કરી શકે. બાબુ તપસ્વી દુર્ધ્વાનમાં ચડી શકે; જ્ઞાનથી પરિણત જ્ઞાની દુર્ધ્વાનમાં ન ચડે, મનને સમજાવે-રોકે, આથી જ્ઞાન વગરના તપસ્વીની વિશેષ ઊર્મલ નથી હોતી.

ધર્મા અણાગારની સર્વશ્રેષ્ઠતા માત્ર તેમની તપસ્વિતાને આભારી નહોતી, પણ સતત ધ્યાનયુક્ત અને ૧૧ અંગના જ્ઞાણકાર-ભણેલા પણ હતા માટે હતી.

તપની મર્યાદા છે, પરિમાણ છે તેથી ત્યાં અટકવું પડે છે, ત્યારે જ્ઞાનની, ભાવનાની પરિણાતિની કોઈ મર્યાદા જ નથી હોતી, અપરિમિત હોય છે. તેથી તે છેક કેવળજ્ઞાન સુધી લઈ જઈ શકે છે.

જીવનના બધા કેત્રોમાં, બોલવા-ચાલવા વગેરેમાં હેઠ-ઉપાદેયપણું જ્ઞાન બતાવે. માટે જ્ઞાન એ પ્રધાન આંખ છે. જ્ઞાનીની ધોડી કિયા પણ પ્રકૃષ્ટ ફળને આપે, જેમ મરુદેવીમાતાને ભાવના જ્ઞાને મોક્ષ આપ્યો.

તેથી તપની સાથે સ્વાધ્યાયને પણ પ્રાધાન્ય આપી ભાવના અને પરિણાતિ કેળવવી જોઈએ, જેથી શીખ્રાતિશીધ સિદ્ધિગતિમાં જવાય.



## પ્રથ ભજુરમિદ વિષયસુખસૌહદમ ॥

**સં**સાર રસિક જીવ એટલે અનુકૂળ પર્યાયોમાં સુખી અને પ્રતિકૂળ પર્યાયોમાં દુઃખી બનનાર... અનું જીવન રાગદ્રેષ પર્યાયોથી, રુચિ-અરુચિયથી તથા આર્ત-રૈદ્ર ધ્યાનની વિબ્લલતાથી વ્યામ હોય છે. ઈષ્ટજ્ઞનનો સંયોગ, વિષયસુખ, સંપત્તિ આદિની ગ્રામિ, આરોગ્ય વગેરે અવસ્થાઓમાં જીવને હુંક, આનંદ, સુખના કારણની બુદ્ધિ હોય છે. તેથી તે તે અવસ્થામાં માનસિક આસક્તિવાળો હોય છે. આવી વસ્તુ પ્રામ થવાની પૂર્વભૂમિકામાં પણ પ્રસત્ર બને છે. અને તેનો વિયોગ, નાશ અથવા તેની શક્યતા જીવને અસ્વસ્થ બનાવે છે.

ઈષ્ટજ્ઞ એટલે મનગમતી વ્યક્તિ. તેનો સંયોગ થાય એથી જીવ આનંદિત, પરંતુ આ સંયોગ અનિત્ય હોવાથી, એ પહેલા પરલોક જાય, સ્થાનાંતરે જાય અથવા આપણે પરલોક જવું પડે ત્યારે વિશેષ આર્તધ્યાન અને હૃદયમાં દુઃખ થાય. પરંતુ પહેલેથી જ આ સંયોગ અવશ્ય મોડા વહેલા છુટવાનો છે, છોડવાનો છે એ રીતે વારંવાર ચિત્તમાં ભાવિત કરીએ તો જીવની તેના પ્રત્યેની માનસિક આસક્તિ તૂટતી જાય. તેથી સંયોગના કાળમાં પણ વિશેષ રાગ વગર સ્વસ્થ રહે છે અને વિયોગ કાળમાં પણ વૈરાગ્ય તીક્ર બને છે. તે જ રીતે ક્યારેક સામી વ્યક્તિનું વલણ બદલાય અને આપણને ઈષ્ટને બદલે વિરોધી તરીકે જુંબે ત્યારે પણ આપણે ઈષ્ટપણાની અનિત્ય ભાવનાથી ભાવિત હોવાથી સામાની અરુચિ પર અકળાતા નથી. એ રીતે પ્રત્યેક સંયોગ નાશવંત હોવાથી જીવ જો અનિત્યપણાનું ભાવન કરે તો તે સંયોગ પ્રત્યેની મમતાને ઘટાડનાર થાય છે.

એ રીતે બાબુ ક્રદિ અને સંપદાઓ ક્યારેય કોઈની થઈ નથી અને થવાની નથી. વળી ક્યારે પણ નિત્ય-શાચ્છત બની નથી એવું વિચારી આસક્તિ ઘટાડે. ઓદ્યિક ભાવની અવસ્થાઓ અને કાયોપશમ ભાવની અવસ્થાઓ બધી જ નાશવંત છે, એમ સમજુને જીવ સદા એનો સદૃષ્યોગ કરતો રહે, અશક્ય સ્થાનમાં ઉપેક્ષા-ઉદાસીનપણું રાખતો રહે. આ બધું ત્યારે જ શક્ય બને જુયારે અનિત્યભાવનાથી જીવ ભાવિત બને.

અનિત્યપણાનું ભાવન કરવાથી બાહ્ય સામગ્રીની મહત્વા અને એનાથી આપણો મહત્વા આપણા મનમાંથી નાશ પામે છે. તેથી તેના માટે તીવ્રતર પાપ પ્રવૃત્તિઓ થતી નથી.

વિષય સુખ એટલે બધી જ જાતની અનુકૂળ સામગ્રીઓ, પાંચ ઈન્ડ્રિયના અનુકૂળ વિષયો. આમાં જીવનો જે રાગ-આસક્તિ છે તે નાશવંત સમજવાથી ઘટે છે. આરોગ્ય પણ કોઈનું કાયમી રહેતું નથી. તેથી આરોગ્યપણામાં જીવ સનતકુમારનું દ્રષ્ટાંત વિચારી ગર્વ કરે નહીં. એનો સહૃપ્યોગ ધર્મ કરવાથી, તપ-ત્યાગ-સંયમની આચરણાથી થાય છે. બાહ્ય શક્તિ નાશવંત અને નિરર્થક છે. સદ્ગતિ કે દુર્ગતિ આપવામાં જીવની વિવેકદ્રષ્ટિ કે અવિવેકદ્રષ્ટિ નિમિત્ત છે. આ વિવેકદ્રષ્ટિ એટલે જ શક્તિ અને સામગ્રીને પ્રધાનતા ન આપતા તેનો સારા સ્થાનમાં સહૃપ્યોગ કરવો અને અસ્થાને કે અશક્ય સ્થાને તેની ઉપેક્ષા કરવી. જે શક્તિ-સામગ્રી-સમૃદ્ધિને પ્રધાનતા આપી તેનાથી પોતાનું પ્રધાનપણું સમજે અને એ જ્યાં ત્યાં, જેમ તેમ વાપરે તો તે અવિવેકપણું છે અને દુર્ગતિનું કારણ છે.

માટે ધર્મી માણસ મરતી વખતે ગમે તેટલી ધન વગેરે ઝલ્લિ હોય તેને વોસિરાવે છે. આ વોસિરાવવું એટલે કે બાહ્યથી છૂટતા પહેલા ફુદ્યથી આપણે છોડવું. ફુદ્યથી ત્યારે જ છૂટી શકે જ્યારે બધાની નશરતા અને અસારતા સમજાઈ ગઈ હોય.

સંસારની સારી કે નરસી અવસ્થામાં નાશવંતપણાનું જ્ઞાન આવ્યા પછી જીવ રાગાંધ ન થાય તેમ દેખીલો પણ ન બને. મધ્યસ્થ ભાવ-સમતાભાવમાં રમ્યા કરે.

જીવને સુખમાં નાશવંતપણાની બુદ્ધિ નથી. તેથી ગાઢ પાપ અને રાગ કરે છે અને દુઃખમાં અનિત્યપણાનો વિચાર નથી તેથી વધારે અકળાય છે. માટે અનિત્યપણાની ભાવનાથી વીર્ય આવે અને સમતા પણ આવે.

ક્ષાપિકભાવ અને સિદ્ધ અવસ્થા સિવાયની બધી અવસ્થાઓનો આત્મગુણોની સાધના માટે તેમજ પ્રભુ આજ્ઞાની આરાધના કરવામાં સહાયકરૂપે ઉપ્યોગ કરવો. બાકી સંસાર આખો હેય અને ઉપેક્ષણીય છે. તેથી અનિત્ય ભાવનાનું કાર્ય સંસારની બધી અવસ્થાઓને હેય અને ઉપેક્ષણીય તરીકે જોવાનું જીવ જો કરે તો રાગ-દેખથી ઉપર ઊઠી સમતાભાવને આત્મસાતું કરી સમાપ્તિ, સદ્ગતિ ને છેવટે સિદ્ધિગતિ પામી શકે.

## मनोरोधे निरुद्ध्यन्ते कर्माण्यपि समन्ततः

**જ**वना संसार के मोक्ष, सद्गति निश्चित करवामां क्रायानी प्रवृत्ति करतां  
मननी विचारणा वधारे बाग भज्ये छे. प्रवृत्तिमां रस, जोम, शक्ति  
रेडवानुं काम मनना विचारो करता होय छे तेथी ज ज्ञवनुं लक्ष्य ए विचारोने  
पवित्र करवानुं होवुं जोઈभे. विचारो अंगेनुं ज्ञवनुं लक्ष्य ए विचारोने पवित्र  
करवानुं होवुं जोઈभे. विचारो अंगेनुं आगवुं मानसशाळ शाळोमां समायेलुं  
ज छे. विचारोना उत्पत्तिस्थान, अने शुद्धिकरणाना उपायो बधुं सर्वज्ञ भगवंते  
सचोट रीते बताव्युं छे.

विचारो घटाडवाना, शुद्ध करवाना, अंकुशमां राखवाना उपायो.

विचारो आवे छे. (१) कर्मना उदयथी (२) विपरीत ज्ञानथी (३) नरसा  
संयोगथी (४) पाप भावनाओथी अने (५) पापीओनी प्रेरणाथी.

आ बधी रीते जे विचारो आवे छे तेमां ज्ञव ज्यारे पराधीन होय छे  
त्यारे विचारोने घटाडी शक्तो नथी अने पाप बांधीने, दुर्गतिना कर्म बांधीने  
दुर्गतिमां पहोंची जाय छे. संसारी ज्ञवोने आ पांचना करणे लगभग विचारो  
आवता होय छे. हलकु वांचन, टी.वी., वीडीओ वर्गेरे पांचमां प्रकारमां आवे.  
गतानुगतिक वृत्ति, आंधिणु अनुकरण वर्गेरे त्रीज्ञामां आवे.

आ पांचने जे अटकावे, सुधारे अने ऐना विरोधि पांचनो आश्रय करे  
तेना विचारो घटे, सुधरे, अंकुशमां रहे.

उक्त पांच प्रकारना विचारना उत्पत्तिस्थानोने केरववाना उपायो :-

(१)→ विचारो कर्माना उदयथी आवे छे. माटे ए विचारो आवे त्यां  
शाळशान तेमज्ज भावनाना आलंबनथी ते तपासवुं के आवता विचारो औद्यिक  
भावना छे के क्षयोपशम भावना; आत्माने हितकारी छे के नुकशानकारी;  
आराधनामां सहायक छे के बाधक.

जो औद्यिक भावना होय, आत्माने नुकशानकारी होय, साधनामां बाधक  
होय तो तेनी प्रधानता न अंकवी, अने छोडी देवा, गौष्ठ करवा.

આ રીતે જે વિચારોને જીવ હેઠ સમજે, ગૌર્ગા ગણે, પ્રધાનતા ન આપે  
તે ઘટતા આવે.

કર્મના ઉદ્યોને રોકવા ભાવનાઓ, જાગૃતિ, અનાયતન-ત્યાગ, આયતન  
સેવન, સમ્યગ્જ્ઞાન અને વિચારોની જાંચ-તપાસ વગેરે ઉપાયો કરવા જોઈએ.  
તેનાથી કર્મના ઉદ્યો રોકાય-વિચારો રોકાય. જેમ કે માણસ જ્યારે ગુસ્સાના  
આવેશમાં હોય અને એને ભૂલ સમજાય તો ગુસ્સો તરત જતો રહે છે.  
મદનરેખાએ પોતાના પતિ યુગબાહુને કોપના નુકશાન બતાવ્યા તો ગુસ્સો ગયો.  
ચંડકોશિકસર્પને જાતિસ્મરણાથી કપાયનું નુકશાન દેખાયું કે તરત ગુસ્સો ગયો.

(૨)→ વિપરીત જ્ઞાનથી અશુભ વિચારો સતત પ્રવર્તે છે. તેની સામે  
સમ્યગ્જ્ઞાન, નિર્ધંદક વિચારોના નુકશાન, સમતા-સમાધિ-શાંતિના-સ્વસ્થતાના  
લાભ, સંસારનું સ્વરૂપ, જીવોની ભવિતવ્યતા અને કર્મપરાધીન અવસ્થાના  
ચિંતનથી જીવ અશુભ વિચારોથી મુક્ત બને છે. વિચારોના વાવાજોડામાં તકાતો  
નથી. માટે પરિસ્થિતિ, વ્યક્તિ કે પ્રસંગને સમ્યગ્જ્ઞાનથી જોતા શીખવું.  
શાલાઅધ્યયન અને પુનઃ પુનઃ પરાવર્તનથી આ જ્ઞાન થાય અને પાપ વિચારો,  
અશુભ વિચારો, નકામા વિચારો નિવૃત્ત થાય છે.

(૩)→ નરસા નિમિત્તોથી જીવને અનાદિકાલીન સંસ્કારના કારણે આહારાદિ  
સંજ્ઞા, કોષાદિ કપાય, ઈન્દ્રિય વિષયક રાગદ્રોષ અને તેનું ખેંચાણ થાય છે. શુભ  
સંયોગોમાં આ વિચારો સ્વયં શાન્ત થાય છે. માટે જ્યાં રાગદ્રોષકપાયજ્ય,  
વિષયત્યાગ, ઈન્દ્રિયજ્ય વગેરે સંયોગ હોય, ત્યાં વસ્તવાથી સહજ રીતે પાપવિચારો  
અટકે. ધર્મ આત્માના સંપર્કમાં ધર્મના વિચારો આવે. પાપી આત્માના સંપર્કમાં  
પાપવિચારો આવે. જેવું જોવા મળે, જેવું સાંભળવા મળે, વાંચવા મળે તેમ જીવ  
એવો થતો જાપ માટે અતિવિશિષ્ટ ધર્મ થયા વગરનાએ સદા સારા સંયોગોમાં  
જ રહેવું.

(૪)→ પાપની વિચારણાથી પણ પાપ વધે. નવરા બેસવાથી, જેમ તેમ  
વિચારવાથી, જે તે જોવાથી વાંચવાથી પાપ ભાવનાઓ ઉત્પત્ત થાય છે. જેમ  
આહાર જોવાથી, તેની વિચારણાથી ખાવાની ઈચ્છા અને વિચારણા થાય છે.  
જેમ ભયની વાતો સાંભળવાથી-જોવાથી ભય જાગે છે. જેવી જેવી વિચારણા  
કરીએ તેવું મન ઘડાય છે. માટે મનને શુભકાર્યમાં સત્તવશાળી બનાવવા શુભ  
ભાવના વાંચન વગેરે કરવા.

(૫)→ પાપની પ્રેરણા કરવી નહિ. પાપની પ્રેરણા કોઈ આપે તે સાભળવી નહિ. પાપની સલાહ અશુભ વાંચનથી, ટી.વી. જોવાથી, વીડીયોથી, નાટકથી પણ મળે. માટે તેવા નિમિત્તોથી સદા દૂર રહેવું. શુભ વિચારણા ઉત્પત્ત થાય, તેવી પ્રેરણા મળે તેવા વાંચન વગેરે કરવા.

તેથી શાખવાંચન-પરાવર્તન, ધર્મ લોકોની સાથે સંપર્ક, સજ્જન-શિષ્જનોનો પરિચય આ સદા શુભ પ્રેરણાનું કારણ બને છે.

જીવ જેમ જેમ શુભ જ્ઞાન, શુભ વિચારણા, અને શુભ વ્યક્તિના પરિચયમાં આવે તેમ તેમ અશુભ વિચારો ઉપર અંકુશ આવે, વિચારો ઘટે.

જે શાંત અને સ્વસ્થ છે તેના પર અશુભ વિચારોનું જોર નથી ચાલતું.

તામસભાવવાળા પર અશુભ વિચારોનું જોર વધારે ચાલે, તેનાથી રાજસવાળા પર ઓછું, અને તેના કરતા સાત્ત્વિકભાવવાળાને અશુભ વિચાર ઓછા આવે. કપાયપરવશને સંકલ્પ-વિકલ્પો વધારે, વિખ્યપરવશ ન હોય પણ અનુકૂળતાપ્રિય સુખશીલીયો હોય તેને એથી અલ્ય હોય અને અનુકૂળતા પ્રતિકૂળતાને સમ ગણનારને નકામા વિચારો પ્રાયઃ ન હોય.

આવું જીવન જીવી વિચાર ઘટાડવા મ્રયલ કરવો.



## ગર્હિતેષુ ગાઢમપ્રવૃત્તિરિતિ

**ર**લો-જવેરાત-સોનામહોરો જેવો કિમતી ચીજોને સાચવવા પેટી-ડબ્બો-તિજોરી વગેરે સુરક્ષિત સાધનો જોઈએ અને વિનાશક વસ્તુથી દૂર રહેવું જોઈએ. એમ આત્મગુણોના ખજાનાના રક્ષણ માટે શુભ પ્રવૃત્તિ જોઈએ અને અશુભનો ત્યાગ જોઈએ. વિનાશક જે પ્રવૃત્તિ હોય એમાં પ્રવૃત્ત થાવ એટલે રક્ષણ થાય નહિ. શાહુકાર, પોલીસ, ચોકીદાર, સુપ્રીન્ટેન્ડન્ટ વગેરે સાથે ભાઈબંધી કરીએ તો રક્ષણ થાય, અને ગુંડા સાથે ભાઈબંધી કરીએ તો સીધો ચાલે ત્યાં સુખી તો રક્ષણ કરે પણ પડે તો એ જ ખૂન કરે.

ધર્મ આત્મા જે હોય એને શું કરવું પડે કે જેથી એનો ધર્મ જાય નહિ ? કેટલા પૈસા મેળવ્યા પછી પૈસા ખાલી ન થઈ શકે ? છે કોઈ નિયમ ? એવી રીતે આપણો કેટલો ધર્મ કર્યા પછી ધર્મભ્રષ્ટ ન થઈએ ? ગમે તેટલા પાપ કરીએ, પાપ લાગે જ નહિ, એવી ભૂમિકા ક્યાં મળે ? ક્યાંથ નહિ. રાજી હોય તે જેમ તેમ રાજ્યવ્યવહાર ચલાવે તો રાજભ્રષ્ટ ન થાય એવું બને ? ન બને. ઉપરના કે નીચેના બધા માટે આ કાયદો લાગે કે ગર્હિતેષુ ગાઢમપ્રવૃત્તિરિતિ-

એટલે જાણી જોઈને પાપમાર્ગ પ્રવર્તન કરવું નહિ. ભૂલથી થઈ જાય તો પાછા ફરવું. જેમ એક ટૂંકો અને એક લાંબો રસ્તો હોય, ટૂંકા રસ્તે અર્ધો ફલ્લાંગનું અંતર કાપતાં લાગે કે આ તો ભારોભાર કાંટાથી ભરેલો છે, તો માણસ અર્ધો ફલ્લાંગ પાછા ફરીને પણ લાંબો, સારો રસ્તો પકડે છે. તેમ રસ્તો ખરાબ હોય, વાંકો હોય તો પણ છોડવો પડે. ધર્મમાં વાંકી વસ્તુ કઈ ? ધર્મ આત્માનો સંસાર ધર્મમાં વિઘ્ન ન કરે એવો હોય અને સંસારી આત્માનો ધર્મ સંસારમાં વિઘ્ન ન કરે એવો હોય.

અહીંયા ગાઢમપ્રવૃત્તિરિતિ કહે છે. તો સામાન્યથી ગર્હિતમાં પ્રવૃત્તિવાળો સંસારી હોય. ગર્હિત કોને કહેવાય ? સંસારી આત્મા હોય તો તે બીજો કોઈ સ્વાર્થ આવે એટલે બહાનું બતાવે, કારણો બતાવીને ધર્મ પ્રવૃત્તિમાંથી છટકે. ધર્મ એ પ્રવૃત્તિને ફરજ સમજી પૂરી કરે. એટલે યોગ્ય વ્યક્તિ પાસે, પ્રસંગે ન જવું એ પણ ગર્હિત છે. માંદા માણસની શાતા પૂછવા કોણ ન જાય ? સામાન્યથી

સંસારી પણ જાય; પણ વેપાર વગેરેની સીજન હોય તો ? સંસારી આત્મા વ્યવહાર સાચવવા જાય અને ધર્મી આત્મા સમાધિ આપવા, ધર્મ આપવા જાય, એના આત્માને ટાઢક વળે માટે જાય. હવે બીમારના આત્માને ટાઢક વળે તેના માટે કોઈ સંસારી જાય ખરો ? એનું મન મૂંજાતું હોય તો કોઈ સંસારી એને શાંતિથી પૂછે ખરા ? કેમ નથી પૂછતાં ? તો કે સંસારી આત્માને લાગે કે પૂછીએ અને એ કંઈ બતાડે તો આપણે ક્યાં ગણામાં ફાંસલો નાંખવો માથાકૂટ આપણે શું કામ કરવી ? સાંત્વન આપવા પણ સંસારી તૈયાર નથી. એકબાજુ ઘરમાં જઘડો ચાલતો હોય, બીજબાજુ છોકરા ઉધા ચાલતા હોય અને તીજબાજુ માણસ મરવા પડ્યો હોય ત્યારે સંસારી જવ ઉપેક્ષા કરે, ધર્મી આત્મા સાંત્વન આપે. એ રીતે ધર્મી આત્મા કોઈપણ જઘડામાં ભાગ લે ? આપણા બે લાખ રૂપિયા આપણો જ સગો ભાઈ જાય, દબાવી લે, ત્યારે ધર્મી આત્મા શું કરે ? અને સંસારી આત્મા શું કરે ?

ભાઈની સામે કોઈ ચઢવું, જઘડો કરવો એ ગર્હિત પ્રવૃત્તિ કહેવાય કે બીજું કંઈ ? માબાપની સામે જઘડો કરવો એ પ્રવૃત્તિ કેવી કહેવાય ? વહુ સાસુ-સસરા સાથે જઘડો કરે તે કેવું કહેવાય ? સાસુ-સસરા અથવા માબાપ અથવા ગુરુ ભૂલ વગર પણ જે ઠપકો આપે એને સાંભળવો એ ધર્મની યોગ્યતા કહેવાય. અને સામે જવાબ આપવો, ઉશ્કેરાઈ જવું, જઘડો કરવો, પ્રતિકૂળ વર્તવું એ ગર્હિત કહેવાય. આજુબાજુમાં પાણોશી સગા કાંઈ પૂછે અને આપણા મોઢે બળાપા નીકળે, આપણાથી ગુસ્સામાં આવીને ક્યારેક કોઈકની સામે બોલાઈ જાય તો એ હજુ ક્ષાત્ર્ય ગણાય, પણ કોઈ આપણા મોઢામાં આંગળા નાંખીને બોલાવડાવે અને આપણો બકવાટ કરીએ એ શું કહેવાય ? આજે કોની આગળથી વાત કઢાવવી હોય તો ન કઢાવી શકાય ? આપણો ભત્રીજો પોતાના બાપને ગાળ ટેતો હોય, એ કારણે એને ઘરેથી કાઢી મૂકે અને આપણા ઘરે તે છોકરો આવે તો ન રહાય કેમકે આજે બાપને ગાળો દે છે, કાલે આપણી સાથે વાંધો પડતાં, આપણે ત્યાંથી છૂટો પડી બીજે જ્યાં જરો ત્યાં આપણાને ગાળ દેશે.

આજે માણસને આખું જગત સારું લાગે, પણ કુટુંબ અને આજુબાજુવાળા જ ખરાબ લાગે છે. કુટુંબ અને આજુબાજુવાળા ખરાબ છે અને જગત સારું છે? ના, તો આ માન્યતા કોના ઘરની થાય છે ? સ્વાર્થના ઘરની. જે પોતાના સ્વાર્થના કારણે પોતાના આજુબાજુનાને ખોટા ગણો એ ધર્મને યોગ્ય કહેવાય ? એવી

વ्यक्तिने संघ, साधु, श्रावक, कुटुंब वच्चे રહेवानु थाय તો એ બધાને પણ ખરાબ માનશે. એવા આત્માને ધર્મ ન અપાય, પહેલા સમ્યગ્રદર્શન છે સમ્યક્-ચારિત્ર? જેને સાધુ પર આદર નહિ એના ચારિત્રની કિમત કેટલી? એના શ્રાવકપણાની કિમત કેટલી? શાખમાં તો એમ કહું છે કે સાધુને બીજા સાધુ પર આદર ન હોય તો એ સાધુમાં સમ્યગ્રદર્શન પણ નથી ને સમ્યગ્રચારિત્ર પણ નથી. કોઈનામાં શક્તિ ઓછી હોય, ઉલ્લાસ ન થતો હોય ને ઓછી આરાધના કરે તો નભી શકે પણ સાધુ પર આદર ન હોય એ નભી ન શકે. જેને શેઠ પર, મુનિમ પર, આદરભાવ ન હોય એવા માણસનું શેઠ શું કરે? રજા આપે કે બીજું કંઈ? કર્મરાજ પણ જેને ધર્મ પર આદર ન હોય તેને રજા આપે એટલે? જૈનધર્મમાંથી બાકાત કરે. દેવલોકમાં ડિલ્બપિકપણામાં, ચંડાળપણામાં કોણ ઉત્પત્ત થાય? તપ ઓછો કરે, પ્રત પચ્ચકખાંડ ઓછા કરે એ ઉત્પત્ત થાય? ના, જેને તપ, સંયમ, સંયમી, જ્ઞાની, તપસ્વી, સંઘ પર અનાદર, તિરસ્કાર, અવગણના, નિંદાના ભાવ હોય એ આત્મા દેવલોકમાં ચંડાળ તરીકે ઉત્પત્ત થાય. બીજા પર તિરસ્કાર, અરુચિ કરવી એ ધર્મા આત્મા માટે ગાઢ અપ્રવૃત્તિ છે.

પોતાની પ્રશંસા બીજા કરે એ સારું કે ખોટું? બાપ બેઠા હોય ને દીકરાની પ્રશંસા અજાણ્યો માણસ આવ્યો હોય એ કરે એ સારું કે ખોટું? સામાન્ય ધોરણથી દીકરાની ગેરહાજરીમાં દીકરાની પ્રશંસા થાય, હાજરને શું કહેવાનું?

આપણે આપણી જ પ્રશંસા કરીએ અથવા સભા બેગી થઈ આપણી પ્રશંસા કરે તો એ ગર્હિત કે અગર્હિત? જૂનાકાળમાં કંઈ સારું કાર્ય થયું હોય તો પોતે હારતોરા પહેરી લેતા કે માબાપને હારતોરા પહેરાવવામાં આવતા હતા? મા-બાપને. કારણ કંઈ? વડીલ છે, એમનાથી જ મને આ કાર્ય કરવાની બુદ્ધિ થઈ છે, માનપત્રને યોગ્ય તો વડીલો જ છે. આપણે આપણી પ્રશંસા કરાવીએ તો ગર્હિત કહેવાય. મોટી વ્યક્તિની મોટાઈ એમની નથી, પણ પુણ્યની છે. પુણ્ય ઉત્પત્ત થાય છે ભગવાનના શાસનથી, ભગવાનના શાસનના રૂપક તરીકે ગુરુ છે. મોટા પુરુષ એમ કહે કે આ કામ મારાથી થયું છે તો એમનું પુણ્ય અટકે, પરમાત્મા, ગુરુનો પસાય છે એમ કહે તો પુણ્ય વધે. એમનો ઉપકાર માને તો મોટાઈ વધે, અને ન માને તો મોટાઈ સમામ થાય.

એ જ રીતે વધુ ખાવું, વધુ બોલવું, ગમે તેમ બોલવું, અકાળે બોલવું એ પ્રવૃત્તિ ખરાબ કહેવાય.

ગર્હિત પ્રવૃત્તિ બે પ્રકારે :- (૧) લૌકિક અને (૨) લોકોત્તર.

લૌકિક ગર્હિત પ્રવૃત્તિના ગ્રંથ પ્રકાર છે. વગર ફોગટનું બીજાને દુઃખ આપવું એ લૌકિકમાં ગર્હિત છે. બીજા નંબરે કારણ હોય ત્યાં વિવેક વિના બીજાને દુઃખ આપવું અને ત્રીજા નંબરે, કોઈ માંગણી કરે તો એના પર ઉપકાર ન કરવો, એની ઉપેક્ષા કરવી. આ ગર્હિત પ્રવૃત્તિ છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણે બધી પ્રવૃત્તિ આપણા સ્વાર્થ માટે જ કરીએ છીએ. પરંતુ હવે શાસનને પામેલા આપણી પ્રવૃત્તિ બીજાને ઉપકારી હોવી જોઈએ, અને કમસે કમ બીજાને દુઃખી કરનારી ન જ હોવી જોઈએ.

લોકોત્તરમાં ગર્હિત શું? પ્રથમ તો અન્યની નિંદા. દુનિયામાં કોણ દોષ વગરનું છે? કોણી ભૂલ થતી નથી? કોણે અજ્ઞાન નથી? એકની ભૂલ બીજાને કહીએ, કોઈની ભૂલ છદ્રેચોક જાહેર કરીએ, ટીકા-ટીપ્પણનો વિપ્પય બનાવીએ, કોઈની પણ વાત કોઈને કહીએ, એકબીજાને વાત કરીએ, સંઘની શિસ્ત મુજબ ન વતીએ, શ્રાવકના આચાર, સાધુના આચાર ન જાણીએ તે ગર્હિત કહેવાય. આજે મોટી વ્યક્તિઓને પણ પ્રતિકમણ, પણ્યક્ષબાળ આવડતું નથી એ ગર્હિત કહેવાય. એટલે જે જે પ્રમાણના, કષાયના સ્થાન હોય તે છોડવા જોઈએ.

સિદ્ધાર્થ અને શિવભૂતિ (દિગમ્બર મત કાઢનાર) - આ બસે ધરમાં રાત્રે મોડા આવે. એને કારણે માઝે તેમને ધરમાં આવવા ન દીધા, અને કહું, "જ્યાં ધર ખુલ્લું જણાય ત્યાં જાઓ. એ કારણે ઉપાશ્રયે આવ્યા.

મોડા આવ્યા એને ધરવાળાએ અંદર ન લીધા કારણ કે મોડા આપવું એ ગર્હિત પ્રવૃત્તિ છે. ગર્હિત પ્રવૃત્તિ કરનારા હોય એનો ત્યાગ કરવો. બાપના નામે દીકરો ગમે ત્યાંથી ગમે તેટલા પેસા લઈ આવતો હોય તો બાપ છાપામાં પણ દીકરાનું નામ છાપાવી એની ગર્હિત પ્રવૃત્તિનો, ટેકાનો ત્યાગ કરે. એટલે શું થયું? ગર્હિત પ્રવૃત્તિને સંસારી પણ ટેકો ન આપે; તો સંધ, સાધુ ટેકો આપે?

એટલે એક તો, ગર્હિત પ્રવૃત્તિમાં આપણે પ્રવૃત ન થવું. એવી પ્રવૃત્તિઓ અટકાવવી. બીજું, એવી પ્રવૃત્તિમાં ટેકો આપનારની સાથેનો પણ વ્યવહાર બંધ કરવો. તમે જે છોકરાને કાઢી મૂકો એને તમારા ભાઈ જો ટેકો આપે તો તમે એની સાથે ન બોલો. એટલે સૌ પ્રથમ ધર્મની યોગ્યતા છે-ગર્હિત પ્રવૃત્તિ જાણવી. જ્ઞાનથી આચારની યોગ્યતા મળતે છે. પણ કોઈ જ્ઞાનનો નિષેધ કરે તો? બુદ્ધિ ન

હોય એ ગુણ કે દોષ ? શાલ ભણીને સ્વતંત્ર થઈ શકાય, જ્યારે કોઈ કહે, “હું તો ગુરુ જેમ કહે એમ કરીશ, ગુરુ પરતંત્ર રહીશ, પણ શાલ ભણું જ નહિ” તો શું ? ગુરુ પરતંત્ર રહેવું એ તો સારું જ છે, પણ શાખાભ્યાસ જ ન કરવો, એ શું ? સ્વતંત્ર રહેવા કરતાં શાલ ન ભણીને ગુરુ પરતંત્ર રહેવું, આમ કહેનાર નિંદ્ય બને છે. આપણી બધી શક્તિ વપરાય તે કામની કે રાખી મૂકેલી કામની? જરૂર પડે ત્યારે વપરાય એ કામની. શ્રાવકપણામાં આગળ વધવા ૧૨ પ્રત જાણવા લેવા પડે. લીધા નથી, એનો અર્થ કે પ્રત પચ્ચકુખાણામાં કેટલો લાભ થાય તેની આપણને ખબર નથી.

આજ સુધી પ્રત પચ્ચકુખાણ લીધા નથી તેનો અર્થ એ છે કે આપણા હદ્દ્યમાં પ્રતની કિમત નથી. છોકરો બે-પાંચ વર્ષનો થાય, સમજણો થાય ત્યારથી પેસાનો સંગ્રહ કરે. ક્યાં સુધી સંગ્રહ ચાલુ રહે ? આંખ મીચાય ત્યાં સુધી. પેસાનો સંગ્રહ કરવા માટેનું ભાન શાના કારણે છે ? પેસાની કિમત છે, પેસો હશે તો જ જોઈશે તે મલશે, આવી સમજણ આવે ત્યારથી ભાન આવે, એમ પ્રત પચ્ચકુખાણામાં વધારો નથી થતો કારણ કે પ્રત પચ્ચકુખાણાની કંઈ કિમત લાગતી નથી, આપણને લાભ દેખાતો નથી. ઉલ્લા પ્રત પચ્ચકુખાણ બસે આડા આવે છે એમ લાગે છે. એક પણ કરેલ પ્રત પચ્ચકુખાણ આત્મા પર ઘણા ઘણા અંકુશ મૂકે છે.

લોકમાં જેને ગર્હિત ન મનાતું હોય એને સામાન્યથી માણસ ગર્હિત ન માને. જે વાત લોક વ્યવહારમાં રૂઢ થઈ જાય એ નિંદાપાત્ર હોવા છતાં કોઈ એને નિંદ્ય ન માને. ટી.વી., વીડીયો, છાપા વગેરે જે કાંઈ લોક વ્યવહારમાં નિંદ્ય નથી ગણાતું એ આપણને એના પ્રત્યેના ગર્હિતપણામાંથી અગર્હિતપણામાં લઈ જાય છે, આપણી એના પ્રત્યેની ગર્હિતપણાની બુદ્ધિ જ દૂર કરી નાંખે છે.

અહિતકારી, અશિષ્ટ એવું સત્ય બોલવું એ પણ ગર્હિત છે. સાચાને સાચું કહેવાય? કાણાને કાણો કહીએ તો આપણને કાણા થવાનું પાપ બંધાય. મૂર્ખાને મૂર્ખો કહીએ તો મૂર્ખા થવાનું પાપ બંધાય. ગાંડાને ગાંડો, લંગડાને લંગડો, તોતડાને તોતડો, બોબડાને બોબડો કહીએ તો જેવું કહીએ એવા જ થવાનું પાપ બંધાય. સારા રૂપમાં હોય અને સારું કંબું તો પુણ્ય બંધાય. જ્ઞાનીને જ્ઞાની કહીએ તો જ્ઞાનાવરણીય કર્મ તૂટે અને અજ્ઞાનીને અજ્ઞાની કહેતા વધારે જ્ઞાનાવરણીય કર્મ બંધાય. વિનયીને વિનયી કહીએ એનાથી આપણા આત્મામાં યોગ્યતા વધે, અને ઉદ્ધતને ઉદ્ધત કહેતા આપણા આત્મામાં ઉદ્ધતાઈ આવે.

ધર્મ આત્માને જ્યાં જ્યાં ભૂલ દેખાય ત્યાં સુધારવાની તૈયારી રાખે. સંસારી આત્માની તેવી તૈયારી ન હોય. જેને પોતાની ભૂલ ન દેખાય, ભૂલ સ્વીકારવાની તૈયારી ન હોય, એનું નામ ગર્હિત. એટલે એક માણસ પોતાની ભૂલ સમજાયા પછી વાતને આડીઅવળી કરે એ ધર્મને યોગ્ય રહે કે ન રહે? કલ્યસૂત્રમાં આવે છે કે રોહગુમે જીવ, અજીવ અને નોજીવ-આ જીવની સ્થાપના કરી. સારામાં સારો, ઉગ્ર બુદ્ધિવાળો સાધુ હતો. એના ગુરુએ કહું કે હવે તું વાદસભામાં જઈને એટલું જ જણાવ કે આ તો સામાને ભર્મિત કરવા મેં આ જીવની સ્થાપના કરી બતાવી. વાસ્તવમાં આવું નથી. અને તેણે આમ કરવાની ના પાડી, આ શું થયું? ભૂલ ન સ્વીકારવાના કરશે ઉગ્ર જ્ઞાન, ચારિત્ર, વિનય, તપ બધું સમામ. અને તે ગુરુ સામે છ મહિના સુધી વાદમાં ઉત્ત્યા. એની પાસે બુદ્ધિ, જ્ઞાન હતાં, ભષોલો હતો, તેથી વાદમાં ઊભો રહ્યો. એટલે સારા માટે કરેલી પ્રવૃત્તિ પણ ગર્હિત કરેવાઈ. માન, કોષ, લાભ વગેરેથી કરેલી સારી પ્રવૃત્તિ પણ ગર્હિત કરેવાય. આપણી વાત એટલી જ કે કખાય, વિષય, વિવેકહીનતાને આધીન જે પ્રવૃત્તિ થાય એ ગર્હિત કરેવાય. એ પ્રવૃત્તિઓને છોડતા રહેવું.

અનંતજ્ઞાની પરમાત્માના શાસનને આપણા કદમ્બમાં વસાવવા માટે જીવ વસ્તુ છે - (૧) હેય (૨) ઉપાદેય અને (૩) સામાન્ય=મધ્યમ પરિસ્થિતિમાં મધ્યમ વસ્તુ. એટલે શું? શાક્યમાં દરેક વસ્તુના બે લેંદ બતાવ્યા છે : હેય અને ઉપાદેય. પણ તાત્કાલિક હેય વસ્તુ કઈ? સૂક્ષ્મ રીતે હેય લઈએ ત્યારે પુદ્ગલની બધી વસ્તુ હેય કરેવાય અને તાત્કાલિક હેય વસ્તુ લઈએ ત્યારે પહેલા મોટા પાપ છોડવાના, પછી એનાથી નાના પાપ છોડવાના અને પછી તેનાથી પણ નાના પાપ છોડવાના. નાનું પાપ પણ હેય છે જ, છતાં પહેલા દ્રષ્ટિમાં ક્યા આવે? જેમ ખાવાનું બંધ ન થઈ શકે, પણ એક મહિનો મિઠાઈ કે અભક્ષ્ય નહિ ખાવું, તો એ થઈ શકે.

સામાન્યથી હેય વસ્તુ વિશિષ્ટ રીતે આત્માને બાધક હોય છે. દરેક ભૂમિકામાં અમુક અમુક આચરણ હેય હોય એટલે એ બિલકુલ ચાલે નહિ. ડેક્ટરો ઓપરેશન કરતી વખતે એના બે ચાર કલાક પહેલાં ખાવાનું બંધ કરાવે. મોટું ઓપરેશન હોય તો છ-આઠ કલાક પહેલાં પણ ખાવાનું બંધ કરાવે. એવી રીતે જગતની અંદર જે ગર્હિત અને નિંદનીય પ્રવૃત્તિઓ છે, વિશિષ્ટ કોટિની હેય છે. એના પ્રત્યે આપણા કદમ્બનું વલણ કેવું જોઈએ? બંધ કરવાના વલણવાળું. જેને વિશિષ્ટ

કોટિની હેય ન લાગે એવા માણસોને એમાં પ્રવર્તતા વાર ન લાગે, એવી જ રીતે, જે વિશિષ્ટ કોટિનું ઉપાદેય ન લાગે ત્યાં પણ એમ જ સમજવું.

જેને હેય-ઉપાદેયની સમજણ બુદ્ધિ હોય તે બીજી પ્રવૃત્તિઓમાં જેંચાય નહિ. બજારમાંથી જતા હોઈએ ત્યારે દરેક દુકાનોનું જેંચાણ લાગે ? નાનો છોકરો હોય ને બજારમાંથી જતો હોય તો કઈ દુકાન પર જેંચાણ ન હોય ? બધી દુકાનમાં જોપા કરે ને “આ લો” “આ લો” કલ્યા કરે. એવી રીતે સંસારી આત્માનું જેંચાણ આ સંસારની દરેક પ્રવૃત્તિમાં હોય. જે કોઈ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, માન-પાન છે ત્યાં બધે જ જેંચાણ હોય. પછી એ નિંદનીય પ્રવૃત્તિ હોય તો પણ જેંચાણ હોય.

પાપોપદેશ આપવો નહિ. અનર્થદંડમાં પાપોપદેશ આવે. શાખકિયા, શાખાદાન આવે એમ અનર્થદંડ પણ આવે. કોઈકને ચઘ્પુ ભેટ આપવું કે કોઈકને ચઘ્પુ કેમ વાપરવું એ શીખવાડવું-એ બેમાં વધારે પાપ ક્યાં ? ચઘ્પુ વાપરતા શીખડાવું એમાં, એક ચઘ્પુ આપો, બે આપો કે ૫૦ ચઘ્પુ આપો, ને એની સામે પાપોપદેશ આપીએ તેનું પાપ કેટલું? એક પાપ શીખવાડો એની પાછળ હજાર પાપ કરતા શીખે.

શાખમાં એક કથાનક આવે છે કે ચૌદ પૂર્વની અંદર યોનિપ્રાભૃત શાખ આવે છે. એમાં કઈ કઈ વસ્તુ બેગી કરવાથી શું શું નિર્માણ થાય છે એની વાત છે. રલ ઉત્પન્ન થાય, તિર્યંગ ઉત્પન્ન થાય, વાધ અને સિંહ વગેરે પણ થાય.

એક આચાર્યભગવંત તેમના શિષ્યને રાત્રિના સમયે આ શાખ શીખવાડી રહ્યા હતા. કોઈ સાંભળનારો સાંભળી ગયો. માછલીને ઉત્પન્ન કરવાની વાત હતી. એણે ઘરે જઈ સાંભળ્યા પ્રમાણે શરૂ કરી દીધું ને પુષ્પ હોય એટલે સીધેસીધું હાથ લાગે. એમ કરતાં હજારો જીવોનો કંચ્ચરધાણ નીકળી ગયો. આચાર્ય મહારાજે ઉપદેશ નથી આપ્યો પણ આચાર્ય કહેતા હતા ત્યારે કાન દઈને સાંભળી લીધી. થોડા દિવસો પછી એ જ માણસ આચાર્ય મહારાજને વનદન કરવા આવે છે ને કહે, “હું આપના પ્રભાવે આટલું પામ્યો.” ભૂલ કેટલી ? આચાર્ય મ.સા. બીજા સાંભળે એટલા મોટા અવાજે શીખવાડતા હતા આ મોટી ભૂલ. આ પાપ બંધ કરવાનો રસ્તો ક્યો ? આચાર્ય ભગવંતે એને કહ્યું, “હું તને રલ કેમ બને તે બતાવું. શા માટે તારે આટલી હિંસા કરવી પડે. હું તને સરળ રસ્તો બતાવું” આ વાત એણે કબૂલ કરી. એને તો વિશાસ હતો. આ વાત કોઈને કહેશે નહિ

એવી કબૂલાત કરી. મહારાજ સાહેબે તેને કહ્યું, “આ રૂમમાં તારે એક કલાક રહેવું અને આમ આમ કરવું. આમ કરીને દ્રષ્ટિવિપ સાપ ઉત્પત્ત કરવાનો યોગ જીતાડ્યો. અને યોગ એવો હતો કે આ પણ મર્ઝ અને સાપ પણ પોતે મરી જાય.

વિશિષ્ટ હેય જે છે એ વિશિષ્ટ પાપસ્થાન છે, વિશિષ્ટ અધિકરણ છે, વિશિષ્ટ નિંદનીય છે. એ બધા પ્રત્યે આપણી લાગણી તિરસ્કારવાળી જોઈએ. સીનેમા થીયેટર પાસેથી જઈએ ત્યારે બોડ જોવાની લાગણી થાય કે તિરસ્કારની? શ્રાવકથી કસાઈખાનાના લતામાંથી પસાર ન થવાય. જેના પર ભારોભાર તિરસ્કાર હોય એ વસ્તુનું સાંનિધ્ય ન ગમે, એ જગ્યાથી જવાનું ન ગમે, એનું નામ પણ સાંભળવું ન ગમે તો એને તિરસ્કાર કહેવાય. એટલે જેમ જેમ પરિચ્ય કરતાં જઈએ તેમ તેમ તિરસ્કાર ઘટતો જાય. માટે જ “ગાઢમપ્રવૃત્તિરિતિ” કહ્યું. એટલે જેના પર તિરસ્કાર હોય તે ગર્હિત, નિંદનીય સમજે.

હેય અને નિંદનીયમાં ડેર કેટલો? સામાન્ય પાપ પ્રવૃત્તિ તે હેય અને વિશિષ્ટ કોટિથી મર્યાદાને ઓળંગીને જે પાપ પ્રવૃત્તિ કરવી તે નિંદનીય કહેવાય. પદ્ધતિસર અંકુશમાં રાખીને જે કામ થાય એ હેય. હેય પાપ છે, માટે હેયમાં પણ જો અતિરેક થાય તો નિંદનીય કહેવાય.


ત્રિપૂર વાસુદેવે કાનમાં સીસું રેડાવ્યું-આ પ્રવૃત્તિ નિંદનીય ગણાય. સજી મોટી, ગુંઢો નાનો. શિક્ષાની બુદ્ધિ વિષયોમાં હેયપણાની બુદ્ધિ નહોલી માટે થઈ. જો વિષયોમાં હેયતાની બુદ્ધિ હોત તો આવો રૈદ્રતાનો કષાય ચેડે જ નહિ. નિંદનીય પ્રવૃત્તિ અને તેની રૂચિ આપણા હૃદયના સંસ્કારને ગુમાવે.

**પ્રશ્ન :-** આખી પ્રવૃત્તિ ઉપાદેય હોય પણ એમાં થોડું જ હેય હોય તો?

**જવાબ :-** લાડવા કર્યા હોય, પણ અંદર થોડું જેર નાંખ્યું હોય તો?

શાસ્કે કુરુટ-ઉત્કુરુટની કોઈ દિવસ પ્રશંસા ન કરી. જેમણે માસક્ષમજીના પારણે માસક્ષમજી કર્યા હતા, જેમની સેવામાં દેવતા રહેતા હતા, છતાં પ્રશંસા નથી થઈ. એનું કારણ શું? વરસાદ ન આવવાથી માણસ મરવા માંડ્યા. લોકોએ પથરબાળ કરી. તેમણે વિવેક ગુમાવ્યો અને આવેશ ઉત્પત્ત થયો, ને શાપ આય્યો, “હે દેવ! આ કુશાલાનગરીમાં તું વરસાદ વરસાવ. પેંદર દિવસ વરસાવ. મુશળધાર વરસાવ અને જેવો દિવસે તેવો રાત્રે વરસાવ.” બતેના પરિણામ કેવા થયા? આ હેય કે નિંદનીય? આ સંસારના કોઈપણ કાર્યો તીવ્રતા પામીને

નિંદનીય બને છે. ધર્મ માણસ બધી જ જગ્યાએ વિચારપૂર્વક અને અંકુશપૂર્વક વર્તતો એ ધર્મને પચાવી શકે. આપણો પાપની પ્રવૃત્તિમાં કેટલા અંશમાં પ્રવર્તવાનું? બધાં પાપસ્થાનક નિંદનીય-હેય છે. આનો અર્થ એ કે આ પાપસ્થાનોને જીવનમાં અંકુશમાં રાખવા પડે. અંગ્રે જો અંકુશમાં રહે તો કામ લાગે (રાંધવા વગેરેમાં) અને જો અંકુશ બહાર જાય તો ઘર પણ બાળી નાખે. રાગની તીવ્રતાએ ભ્રબ્રદત્ત ચક્કવર્તીનું શું થયું? આંધળો હોવા છતાં છેલ્લે 'કુરુમતિ, કુરુમતિ' કરીને થાંભલાને ભેટવા લાગ્યો. બધા માટે નિંદનીય બન્યો. રાગ તીવ્ર બનતા નિંદનીય કાર્ય કરે તો દેખભાવ વધતા પોતાના માબાપને ગાળ દેનારા પણ છોકરાઓ હોય છે ને? આથી જો ગઈંત પ્રવૃત્તિઓથી બચવું હોય તો તીવ્ર રાગ દેખને પેદા કરે તેવી પ્રવૃત્તિઓને છોડતા આવવું, રાગ દેખ પાપબુદ્ધિને પેદા કરે છે. પાપબુદ્ધિથી પાપપ્રવૃત્તિઓ થાય છે. બીજનો નાશ કરવાથી વૃક્ષ જ ન પેદા થાય તેમ પાપબુદ્ધિ નાશ પામે તો પાપપ્રવૃત્તિ ઉત્પત્ત જ ન થાય.



## ॥ પાપિએષુ ભવસ્થિતિઃ ચિન્ત્યા ॥

**પા**પી જીવોની પણ ભવસ્થિતિ વિચારવી-

માણસની વિચારધારા બ્યવહારથી અના વાણી અને વર્તન દ્વારા કલ્યાય છે-જીજુયાય છે. બ્યવહારમાં વાણી અને વર્તન દ્વારા માણસ ધર્મ છે કે પાપી છે તે નક્કી કરાય છે. જ્યાં બ્યવહારથી જોઈને ધર્મ-સારા સજ્જન માણસ તરીકે સમજ્યા પછી તે અલ્ય ભવમાં મોક્ષ જ્ઞાન છે, તે યોગ્ય છે વગેરે બુદ્ધિ અને આદર થાય છે તે ગુણ છે.

પરંતુ જે આત્મા બ્યવહારથી વાણી અને વર્તન દ્વારા ધર્મ નથી પામ્યા, અઢાર પાપસ્થાન વિષયક પ્રવૃત્તિ, પ્રશંસા, પ્રેરણા અને પ્રોત્સાહનમાં મશગુલ છે, જેને ભવાનિનંદી અને સંસારરસિક તરીકે સમજ શકાય તેમ છે તેવા આત્માને જોઈને તેમના પરિચયમાં આવનાર સંસારી જીવો જો તેવાથી સ્વાર્થ સિદ્ધ થતો હોય તો સારા ગણે, પ્રેમ-રાખે અને નુકસાન થતું હોય તો દેખ કરે; અને પરિચયમાં ન હોય તો ઉદાસીન રહે, છતાં પણ સુખી માણસ હોય તો તેના ઉપર આદર રહે.

પરંતુ એ જીવોની લૌંડિક-લોકોતરવિરુદ્ધ પાપ પ્રવૃત્તિ જોઈને, આલોક-પરલોક વિરુદ્ધ નિંદ્ય પ્રવૃત્તિ જોઈને ધર્મ આત્મા-સજ્જન આત્મા-સમજદાર આત્માને એના પર દ્યા આવે અને જેમ ડેક્ટર દર્દીને દ્યા દ્વારા રોગથી છોડાવવા ઈચ્છે તેમ પ્રેમ-પ્રેરણા-પ્રોત્સાહન-સમજદાર-સહાયથી સજ્જન આત્મા પાપથી છોડાવવા ઈચ્છે. છતાં તેવા પ્રયત્નમાં નિષ્ફળ જ્યા, સામેથી પ્રતિકૂળ જવાબ મળે-મશકરી થાય ત્યારે સજ્જન આત્માને તેના પર દ્યા આવે અને વિચારે કે એનો કાળ પાક્યો નથી, સંસાર ભ્રમજી હજી વધારે છે, કર્મ ભારે છે. આ રીતે જ્યારે બીજા માટેના પ્રયત્ન કરવા જતા નિષ્ફળતા મળે ત્યારે એના પર દુર્ભાવ ન થાય તે માટે એની ભવસ્થિતિની વિચારણા કરવી.

પ્રત્યક્ષ જ્ઞાની શ્રી ઋઘભદેવ પ્રભુએ મરિયિને દીક્ષા આપી ત્યારે તેઓ જીણતા હતા કે આનાથી અનેક આત્મા ધર્મ પામશે, સાધુ થશે, પરંતુ પાછળથી ત્રિદંડીયાનું કારણ બનશે અને સંસાર વધારશે. છતાં તે ભવસ્થિતિ તેવી હતી તેથી પ્રભુએ દીક્ષા આપતા તે વાત જાહેર ન કરી તેમજ દીક્ષાની ના પણ ન પાડી.

ધર્મગુણોની તેમજ આત્મોગતિની પ્રવૃત્તિમાં આત્માની યોગ્યતા, ધર્મનો પ્રભાવ વગેરે વિચારવાનો હોય છે અને તદનુસાર પ્રવર્તવાનું હોય છે.

પરંતુ જ્યાં એ રીતે ન થાય, સામો ન સ્વીકારે કે વિપરીતં વર્તે તો (આત્મા તો સ્વરૂપે સિદ્ધ સ્વરૂપી છે, છતાં આ વિપરીત કાર્યથી) એ આત્મા પર તિરસ્કાર ન આવે અને અની સાથેના વ્યવહારમાં વિશેષ અસલ્યતા ન આવે તે માટે આ ભવસ્થિતિ વિચારવાની છે.

ભવસ્થિતિ એટલે સંસારમાં રહેવાનું કાળમાપ, ભવ એટલે ઉત્પત્ત થયેલી જીવની અવસ્થા, જે ભવિતવ્યતાંના નામે ઓળખાય છે. આ વિચારવાથી જીવને પોતાનો અહ્મુ નાશ પામે છે. કારણ કે મારા કલ્યા પ્રમાણે-ધારવા પ્રમાણે થવું જ જોઈએ તેવો આગ્રહ-અસદ્ગ્રહ નાશ પામે છે અને એથી જ સામા જીવ પ્રત્યે જે તિરસ્કાર-દ્વેષ વગેરે અસલ્ય ભાવો અને અસલ્ય વર્તન હોય તે પણ નાશ પામે છે.

વિશ્વભૂતિ કાકાથી ઠગાયા અને ઉદ્ઘાનમાંથી બહાર નીકળી પુછ કરવા કાકાને સમજાવી-મનાવીને ગયા. સામો રાજ સહજતાથી વશ થવાથી પોતે ઠગાયો છે નક્કી સમજી ગયા. હવે કાકા અને તેના પુત્રો (ભાઈ) વગેરેની કર્મ પરાધીનતા અને સંસાર સ્વરૂપ વિચારી દીક્ષા માટે તૈયાર થયા. પરંતુ પોતાનું બણ બતાવવાનું પગલું માંડ્યું. કોણ તોડી બતાવ્યું. જેમ કાકાએ છોકરા માટે તેને ઠગ્યો એ ખોઢું પગલું હતું તેમ વિશ્વભૂતિ સંસાર છોડતી વખતે કોણ તોડી બેદ ખુલ્લો કરી અપમાન કરીને નીકળ્યા, આ પણ દીક્ષા લેનાર માટે યોગ્ય ન હતું. પણ ભવસ્થિતિ, ભવિતવ્યતા આગળના નિયાસાના કારણમાં આ નિમિત્ત થયું.


જ્યારે અંતકાળે ગાયે પાડ્યા ત્યારે આ જ સગોભાઈ સહાય કરવાને બદલે હસે છે તેનું કારણ પૂર્વ કરેલ અપમાન છે. નહીંતર સગોભાઈને ઉલ્લો કરવાનું મન ન થાય ? આ તિરસ્કારથી હસવાનું અને એ અપમાન લાગવાથી વિશ્વભૂતિનું ગાય પકડી-ઉછાળી-દાથમાં ઝીલી-મૂકી દઈને નિયાંનું તેમજ અણસણ કરવામાં કારણ કોણ ? ભવસ્થિતિ.

જ્યાં સંસારી જીવોમાં અધટતું બને ત્યાં પણ ભવસ્થિતિ વિચારવી અને ધર્મ આત્મામાં પણ પાપના ઉદ્યથી અયોગ્ય કે અજુગતું બને ત્યારે તિરસ્કાર, અ઱ચિ કે ઉદ્દિગ્રતા ન કરતા, તેની ભવસ્થિતિ તેવી છે તેમ વિચારવું.

આસત્ર મોક્ષગામીની ભવસ્થિતિ ઔચિત્યસભર અને આરાધનાપ્રધાન હોય છે. જેમ જેમ મોક્ષ દૂર જાય છે, દૂર હોય છે તેમ તેમ ઔચિત્યની મંદ્તા અથવા ક્યારેક હોવું, ક્યારેક ન હોવું, આરાધનાના ભાવની સાંતરતા, મંદ્તા, પાપની પ્રવૃત્તિ, રસ વગેરેની વિશેપત્તા વગેરે વધારે દેખાય, ગુણોની સાંતરતા, મંદ્તા, અપ્રધાનતા દેખાય - આ બધા ભાવો અને પ્રવૃત્તિ જોઈને, ભવસ્થિતિ વિચારીને આત્મામાં સમતા કેળવવી.

નિર્બળ વસ્તુ સાચવીને વાપરો તો ઘડી ચાલે અને તોડો તો નકામી થાય. નિર્બળ જીવોને સંભાળો તો થોડી ઘડી આરાધના, વિવેક, ગુણો સાચવતા રહે અને સદગતિ પામે; પણ તિરસ્કાર, ઉપેક્ષાથી અના ભાવને, ઉલ્લાસને તોડી નાખો તો તમો સહાયક ન થાવ, તેઓ પણ ગુણ અને પુણ્યના ભાજન ન થાય અને દુઃખની અને દુર્ગતિની પરંપરાના ભાગી થાય.

માટે પાપી જીવોની ભવસ્થિતિ વિચારવી અને તે પૂર્વક તેની સાથે યોગ્ય વ્યવહાર રાખવો તે સ્વ-પર ઉભય કલ્યાણકારી છે. અન્યથા સ્વ-પર બત્તેને અને અનેકને બાહ્ય-આંતરિક અનેક પ્રકારે હાનિ, દુઃખ, અસમાધિ અને દુર્ગતિની પરંપરા પણ ઉભી થાય.



## ॥ प्रत्यहं प्रत्यवेक्षेत नरः चरितमात्मनः ॥

**આ** જગતમાં જન્મ જોડે મરણ સંકળાયેલ છે તેથી મરણ તો બધાનું થવાનું મરણ કઈ અવસ્થામાં ને ક્યારે થશે તે જાણી શકતું નથી. મરણ વખતની અવસ્થા સામાન્યથી જાણી શકતી નથી. કેટલાક બેભાન અવસ્થામાં જાય છે, કેટલાક છેલ્લા શાસ સુધી શુદ્ધિમાં રહી શકે છે. કેટલાક ઘણી પીડા અનુભવીને જાય છે, તો કેટલાક અલ્ય પીડામાં જાય છે, કેટલાક સમતાપૂર્વક જાય છે, કેટલાક ઘણી વિદ્ધિજીવાથી મૃત્યુ પામે છે. આ બધું કર્મને આધીન છે. આ કર્મ બહુધા જીવન આધીન છે. જે આત્માનું જીવન શાંત, વૈરાગી, સરળ હોય તે આત્મા ઘણા કર્મ ખપાવી અલ્ય કર્મ બાંધે, તેથી તેને અંત વખતે શાંતિ મળે છે. જેનો સ્વભાવ ઉકળાટવાળો, ઉતાવળીઓ હોય તે ધર્મ ગણાવા છતાં, આરાધનાની ઘણી મહેનત કરવા છતાં ઉષ્કેરાટ અને ઉતાવળીયાપણાના કારણે ઉચ્ચા સ્થાનને નથી પામતા અને ઉચ્ચી સમાધિ પણ નથી પામતા.

જીવોની મરણની પરિસ્થિતિ જોઈને આપણે દુઃખી થવું ન જોઈએ, કારણ સર્વ સંસારી જીવો માટે આ એક પરાધીન અવસ્થા છે. પરંતુ તે મરણ બગડવાના અને સુધારવાના જે જે કારણો છે તે આપણે બરાબર સમજવા જોઈએ અને જંદગીમાં સર્વત્ર મરણ બગડવાના કારણો છોડતા આવવું જોઈએ. મરણ સુધારવાના કારણો પ્રત્યેક કણો આચરતા રહેવા જોઈએ તો તે સ્વભાવ સુધરવાના કારણે આપણું મરણ સુખરે.

જેમ શરીરને યોગ્ય રીતે વાપરતાં આવડે તો રંક કે રાજી બત્તેને લાભ કરે, અયોગ્ય રીતે વાપરે તો નુકસાન કરે. ભારે ખોરાક આરોગ્યવાળાને શક્તિ આપનાર થાય છે અને રોગીને તે જ ખોરાક રોગ વધારનાર થાય છે તેથી જેવી રીતે યોગ્ય જીવનચર્યા એ સુખી થવાનો ઉપાય છે, તે રીતે યોગ્ય જીવનચર્યા તે મરણ સુધારવાનો ઉપાય છે, સમાધિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે.

યોગ્ય જીવનચર્યા ત્રણ વિભાગમાં ગોઠવાય :-

(૧) જાતના જીવનવ્યવહારો અને માનસિક વિચારણાઓ.

(૨) બીજાની સાથેના વ્યવહારો અને તમિભિતક માનસિક વલણો,

(૩) પુદ્ગલની સાથેના વ્યવહારો અને તેની સાથેના વલણો.

આ જણામાં જીવને કઈ રીતે સમાધિ મળે, કઈ રીતે અસમાધિ થાય તે વિચારવું જોઈએ. કઈ પ્રવૃત્તિ અને વલણ ઉચિત કહેવાય, કઈ પ્રવૃત્તિ અને વલણ અનુચિત કહેવાય તે સમજવું જોઈએ.

(૧) જેના જીવનવ્યવહારો કાર્યસાપેક્ષ (અનુષ્ઠાનસાપેક્ષ) છે, પણ ભાવસાપેક્ષ (પરિષ્ઠતિ સાપેક્ષ) નથી તે પોતાના ભાવને બગાડીને કાર્ય કરે છે તેથી સર્વત્ર પ્રસત્ત નથી રહી શકતો. આઠમના દિવસે આયંબિલ કરનાર નોમના દિવસે લુખુસાંહ ખાવાના પ્રસંગમાં જો અકળાઈ જાય તો તે ભાવસાપેક્ષ નથી. તેનું આઠમનું આયંબિલ એ ગ્રારંભિક ધર્મ કહેવાય. તપ દ્વારા વૈરાગ્ય અને ભવનિવેદપૂર્વક આહારસંશ્શા તોડવાની પરિષ્ઠતિ જેને ઉભી થાય તેને તપ સિવાયમાં પણ સંજ્ઞા તોડવાનું વલણ રહે. તેથી તે અંત વખતે પણ અનુપાનમાં, દવામાં, યોગ્ય ખોરાકમાં આકર્ષિત થાય નહિ, તિથિમાં લીલોતરીની ઈચ્છા ન કરે. માટે વિવેકપૂર્વક જીવનવ્યવહારમાં સદાચારોની પક્કડ રાખવા પૂર્વક તેના ઉદેશની કાયમી પક્કડ આવે તો અંત વખતે સદ્ભાવનાની એ પક્કડ ટકી રહે.

જીવનના વ્યવહારોમાં, સામાન્ય પરિસ્થિતિઓમાં સદ્ભાચારો પક્કડ રાખવા અને એના ઉદેશ પૂર્વકના વલણ (ભાવ) આચારના સમયે અને આચાર સિવાયના સમયમાં પણ લીલોતરી ખાતા પ્રસત્તા ન લાવવી.

(૨) બીજાની સાથેના વ્યવહારમાં જેમ આચારની પ્રધાનતા છે, તેમ સામી વ્યક્તિની પણ પ્રધાનતા છે. તેથી આપણી પ્રવૃત્તિના કારણે સામેવાળા સાથે મૈત્રી, સ્નેહના બદલે દ્રોષ ઉભો કરીએ, અનુચિત કરીએ (ભિત્ત કાર્યપદ્ધતિ વગેરેના કારણે) તો આપણું મન ધર્મવિરાધક બને. બાબ્ય આચારધર્મ ઉભો રહે પણ ભાવધર્મ નાશ પામે તેથી જીવ આંતરસમાધિ ન સાધે. અને અંત વખતે આંતરિક સમાધિ ન મળે. એ રીતે બાબ્ય નિમિત્તથી આંતરિક પ્રમોદભાવ ગુમાવે તે પણ ધર્મનો અંતરાય બાંધે અને સમાધિ દુર્લભ થાય. ગુણવાન ઉપર પ્રમોદ ન હોવાના કારણે ઈર્ષા થાય અને તેથી ગુણોના અંતરાય બાંધે છે તેવી રીતે જેના હૃદયમાં દુઃખી પ્રત્યે અને કર્મથી, મોહથી, અજ્ઞાનથી કે કોઈપણ દોષથી દુષ્પિત પ્રત્યે કરુણા હોય તો તે એ કરુણા દ્વારા તે તે પાપકર્મ ખપાવીને સમતા સમાધિ મેળવે છે

અને જો કરુણા ન હોય તો તિરસ્કાર અરુચિ કરવા દ્વારા તે તે દોષકારક કર્મ બાંધીને જતે દુઃખી થાય છે, સમતા સમાધિને ગુમાવે છે. માટે બીજા સાથેના વ્યવહારમાં સદ્ગ્રાચારની જેમં પ્રધાનતા છે તેમ સામી વક્તિ પ્રત્યે મૈત્રી વગેરે ભાવની પણ જરૂર છે. તે જો હોય તો અંતે સમાધિ સુલભ થાય અને ન હોય તો સમાધિ દુર્લભ થાય. તેથી ઉપદ્રવ કરનાર પ્રતિકૂળ વર્તનાર પ્રત્યે પણ જો હૃદય કરુણા-માધ્યસ્થ ભાવમાં રહે તો અંત કણે કે બીજા અવસરે સમાધિ મળે, પણ અકળામજુ કે દેખભાવમાં જાય તો પરસ્પર વૈરભાવ વધે, સંકલ્પ વિકલ્પજન્ય અસમાધિ વધે, માટે આપણાથી પ્રતિકૂળ ચાલનાર વક્તિથી ક્યારે પણ અકળાવું નહીં. આ રીતે બીજાની સાથેના વ્યવહારમાં સદ્ગ્રાચાર આદિ કોઈપણ નિમિત્તે જો હૃદયમાં મૈત્ર્યાદિ ભાવનાને બદલે અરુચિ વગેરે આવે તો જીવન અસમાધિમય બને અને મરણ પણ અસમાધિમય બને.

એવી જ રીતે જે આત્મા વિશિષ્ટ ધર્મ કે આચાર સાથે સંકળાયેલા નથી-તેઓ સાંસારિક રાગદેખની આંધિમાં સદા અટવાયેલા રહે છે તે જ તેમની અસમાધિ છે અને તેથી અંત વખતે પણ તે અસમાધિ, રાગદેખની આંધીઓ આવીને ઊભી રહે છે. માટે જીવનમાં રાગદેખની માત્રા ઘટાડતા જવું અને મૈત્રી આદિ ભાવનાથી દરેક પ્રસંગે વાસિત બનતા જવું જેથી અંત વખતે અને ચાલુ જીવનમાં પણ સમાધિ-શાંતિ પ્રાપ્ત થાય.

(3) જેના જીવનમાં પૌદ્રગલીક અનુકૂળતાનું લક્ષ હોય છે તે આત્મા સારું ખોટું કરતા રહે છે. સારું જોઈએ, હલકું ન ચાલે આવા ભાવના કારણે સત્ત્વ હંગાઈ જાય છે. સત્ત્વહીન આત્મા જ્યારે પ્રતિકૂળ સામગ્રી આવે ત્યારે સહન ન કરી શકવાથી આવેશગ્રસ્ત થાય છે, આર્તધ્યાનમાં જોડાય છે. જેમ રોજ ગાળ સાંભળનારને ગાળથી ટેવાયેલ હોવાથી તરત અકળામજુ નથી થતી-પણ જે માનથી સાંભળવાને ટેવાયેલ હોય તેને તરત ઉકળાટ, અકળામજુ અને અવિવેક ઊભો થાય છે. આ ન થાય તે માટે સુખી અવસ્થામાં પણ આત્મા સત્ત્વથી નિર્બળ ન બને તે માટે વૈરાગ્યભાવના, અનિત્યાદિ ભાવનાથી અપ્રતિબદ્ધતા ભાવના ઊભી કરવાની છે. જેમ જીવને જે જ સાંસારિક ભાવો, વાસનાઓ કે સગાદિથી પ્રતિબદ્ધતા હોય તે જ અસમાધિ છે તેથી જેવી સાનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય કે તેવું યાદ આવે કે તરત જીવ સંકલ્પ વિકલ્પમાં ચડે છે માટે જેનું જીવન

બાબુ પ્રતિકૂળતામાં સહનશીલ હોય અને બાબુ અનુકૂળતામાં મમતાવાળું, ગળીયા બળદ જેવું ન હોય, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ ભાવનાથી વ્યામ હોય તેને સમાધિ સુલભ બને છે.

જ્યાં જેને અનુકૂળતા સારી લાગે તેને ત્યાં અસમાધિ જાણવી. આવા પરિણામને રોકવાથી, અટકાવવાથી, સુધારવાથી સમાધિ મળે છે.

જીવનમાં પ્રતિકૂળતા વેઠવાથી, ભાવના દ્વારા અનુકૂળતામાં ન ઠરવાથી સત્ત્વ વિકસિત બને છે.

નિષ્કારણ નિરર્થક પ્રવૃત્તિઓ, વિશેષ ગુણ ન કરનાર પ્રવૃત્તિઓ, કષાયજન્ય પ્રવૃત્તિઓ, વિષય કષાયની વૃત્તિઓ, સ્નેહરાગ-દ્રષ્ટિરાગ વગેરે મોહજન્ય લાગણીઓ, અજ્ઞાનજન્ય લાગણીઓ, વાતવાતમાં ઓછું આવવું, દુઃખ લાગવું, રડવું વગેરે જીવનના દરેક પાસામાં જે સત્ત્વહીનતા, ધર્મની-ધર્મભાવનાની, આત્મબળની ગૌણતા, ઉપેક્ષા, દીનતા વગેરે દેખાય છે તે અસમાધિરૂપ છે અને જેના જીવનમાં આ અસમાધિ હોય તેને અંત વખતે ચિત્ત વ્યાકેપ મ્રાયઃ આવે.

### માટે

જીવનમાં જે ઉપરોક્ત ત્રણ કારણોથી સમાધિ, પ્રસત્તતા, શાંતતા જાળવી રાખે છે તેમને અંત વખતે બહુધા શુદ્ધ અને સમાધિ મળે છે, ક્યાંક શુદ્ધ ન હોય તો પણ સમાધિ અવશ્ય મળે છે. જે પારકી પંચાત, પરચિતા, બહુમમતા વગેરેથી વ્યામ છે તેવા આત્માઓને સમાધિ દુર્લભ છે.

માટે તપ-ત્યાગ-વૈરાગ્ય ભાવના, આચાર નિષ્ઠા, વિવેક, ઉપશમ વગેરેથી સંપર્મ બની સમાધિ સહજ સિદ્ધ મ્રામ થાય એ જ શુભાભિલાઘા.



## ખાણી અણત્યાણ હુ કામભોગ

**જી**મ રહની ખાણ રહો ઉત્પત્ત કરે, હીરાની ખાણ હીરા ઉત્પત્ત કરે, સુવર્ણાની ખાણ સોનું અને કોલસાની ખાણ કોલસા ઉત્પત્ત કરે તેમ જાની પુરુષ કામભોગને અનર્થની ખાણાની ઉપમા આપે છે. પાંચ ઈન્દ્રિયના વિષયો છે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ. તે શબ્દાદિ અને વર્ણાદિ તરીકે પણ ઓળખાય છે. આમાંથી શબ્દ અને રૂપની આકાંક્ષા-ઉપયોગને કામ કહેવાય છે અને ગંધાદિકની આકાંક્ષા તે ભોગ કહેવાય છે.

શબ્દાદિ પાંચે પુદ્ગલરૂપ છે, જ્યારે અને જીવ વિષયરૂપે જંખે છે, સેવે છે ત્યારે જીવમાં રાગાદિ પરિણાતિ જન્મે છે. તેથી રાગાદિ પરિણાતિને જન્મવાનાર આ કામભોગ અર્થાત્ શબ્દાદિ વિષયો છે. રાગાદિ પરિણાતિ જન્મવાથી સારી વસ્તુમાં જીવ તેની રૂચિ-પક્ષપાતવાળો થઈને પુરુષ-પાપ, કર્તવ્ય-અકર્તવ્ય, પોત્ય-અયોગ્ય, પેયાપેય, ભક્ષ્યાભક્ષ્ય, ગમ્યાગમ્ય વગેરે બધું જાણો ભૂલી ગયો હોય, જાણો જાણતો ન હોય તેમ એ સારી માનેલ વસ્તુ માટે વિવેકહીનપણે પ્રવર્તે છે. આ જે વિવેકહીનતા, જાણવા છતાં અનુચિત પ્રવૃત્તિ, અનુચિતતાને ન જાણવા દેનાર રાગાદિ અને તેને ઉત્પત્ત કરનાર જે શબ્દાદિ વિષયો તેને અહીં ખાણ તરીકે બતાવેલ છે. આ કામભોગ કામાંધ, રાગાંધ, નિયાણા કરાવનાર બને છે. સન્માર્ગમાંથી ભટ કરનાર પણ આ કામભોગો જ છે. આને બીજી ભાખામાં પાંચ પ્રકારના પ્રમાદ કહેવાય છે. આ પ્રારંભમાં કખાય કે અનાભોગથી પ્રેરિત હોય છે પણ પછી જો સુધારવામાં ન આવે તો તે પ્રમાદરૂપી વિષયો કખાયોના વિશેષ ઉતેજક બને છે, અને જીવને મિથ્યાત્વમાં ભેંચી જાય છે. આના કારણો જ જીવ અનંત સંસાર પણ બટકે છે, નરકાદિ દુર્ગતિઓમાં બટકે છે, સ્વર્યંદ અને ઉન્મત માણસની જેમ જાની પુરુષોના વચન સાંભળવા, વિચારવાનું, સમજવાનું, સ્વીકારવાનું, આચરવાનું તે જીવ કરી શકતો નથી, કરતો નથી. આના કારણો માટિરા પીધેલ માણસનું મન તેની અસર સુધી જેમ તાત્ત્વિક વાત સાંભળવા, સમજવા અયોગ્ય હોય છે તેમ કામભોગથી મૂઢ બનેલ જીવનું ચૈતન્ય-જ્ઞાન પણ તત્ત્વવિચારણા તરફ રૂચિ ધરાવતું નથી. તેમ તેવા જીવો ગમે તેવા દુઃખી હોય

તો પણ ભૌતિક સુખની ઝંખનામાં રમતા હોય છે. વિષયો ન મળવા છતાં વિષય લંપટ હોય છે, તેથી જ તંદુલીયા મત્સ્યની જેમ પાપ ન કરવા છતાં દુર્ગતિમાં જાય છે, આ કામબોગને બીજી ભાખામાં નવ નોકખાયોમાં ગોઠવેલ છે. તેનાથી ઉત્તેજિત કખાયો દ્વારા જીવ પાપો, દુર્ગતિઓ ઉપાર્જિત કરે છે. જે નોકખાયનો જીવ કરે છે, તે કખાયનો જીવ સહેલાઈથી કરી શકે છે, જે કખાયનો જીવ કરે છે તે દુઃખનો જીવ પણ કરી શકે છે.

કામબોગની ઈચ્છા અને તેની તીવ્ર લાગણીઓના પ્રતાપે આ સંસારમાં એવા કોઈ દુઃખ નથી કે જે જીવે અનંતીવાર પ્રાપ્ત ન કર્યા હોય. એક એક વિષયો, વિષયના વિચારો, રાગદ્વેષથી બાળજીવને આર્તધ્યાન તથા પાપબંધના કારણ અને દુઃખના સર્જક છે. ખાડામાંથી ક્યારે પણ ઉત્પત્તિ અટકતી નથી, તેમ કામબોગની ઝંખના, ઈચ્છા, ભોગવટાની રૂચિ, પ્રતિકૂળતામાં અરૂચિ, દેખ, છૂટવાની કે છોડવાની ઈચ્છા, આ બધી જીવની જે વૃત્તિ અને તદનુસાર શક્ય પ્રવૃત્તિઓ તે કામબોગ કહેવાય, પણ તેમાંથી પેદા થતી અનર્થની ઉત્પત્તિ અટકતી નથી. તે પ્રત્યેક વૃત્તિ અને તેના અનુસાર સાક્ષાત કે પરંપરાની જે પ્રવૃત્તિ તે પણ અનર્થની-દુઃખ-પરંપરાની ખાણ છે.

અર્થ એટલે જીવને ઈષ્ટ. તે બે પ્રકારનું હોય છે-વૈષયિક અને આધ્યાત્મિક. જીવને ઈષ્ટ હોય તે સુખ આવે જ, તેવો નિયમ નથી કારણ જે સુખ આપનાર હોય તે સુખ આપે, દુઃખ આપનાર હોય તે દુઃખ આપે.

કુટુંબ, પરિવાર, ધરણ, ધાન્ય, માનપાન, એશ આરામ, રસ-ત્રણિ-શાતાગારવ વગેરે સુખાભાસ છે, આંશિક સુખનો આભાસ કરાવી પાછળથી બયંકર દુઃખો આપે છે. માટે વિષયોને અર્થ ન કહેતા અનર્થ કહ્યા છે. ઈષ્ટ છે માટે અર્થ અને ઈષ્ટનું કાર્ય સાતા, સુખ અને તેની પરંપરા નથી કરતા, તેથી વિપરીત કરે છે માટે અનર્થ કહ્યા છે, સામાન્ય અનર્થ નહિ પરંતુ અનર્થની ખાણ.

મરિચીને દીક્ષા લીધા બાદ ઘણા વર્ષો સંયમ પાળ્યા પછી ગરમીના કારણે ઠંડકના વિષયે ત્રિદંડી વેષ કરાવી સંયમબ્રાષ્ટ કર્યા, છતાં સંયમરાગ ઊભો હતો. પરંતુ ઠંડકના રાગે આચાર રાગ ઘટાડ્યો. પછી માંદા પડ્યા અને સાધુઓએ સેવા ન કરી ત્યારે સાપુ રાગ ગૌણ થયો, તેથી દીક્ષા આપવાની ઈચ્છા થઈ. પોતાના માર્ગમાં બીજાને પેસાડવા માટે ઉત્સૂત્ર પ્રલૂપણ થયું. આમ શાલરાગ

પણ ઘટ્યો. આ રીતે શરીરની અનુકૂળતા માટે ઉત્સૂત્ર અને શિથિલાચાર આવ્યો અને કોટાકોટી સાગરોપમ કાળ સંસારમાં ભમ્યા. ઉત્તમ કુળ તરીકે પણ કામબોગ પ્રધાન બન્યો. તેથી નીચ ગોત્ર બંધાયું. સારાંશમાં ધર્મવિહીન જીવોની સાંસારિક જે કોઈ શક્તિ, મહત્તમા, પ્રવૃત્તિ, વૃત્તિ આ બધાના કેન્દ્ર તરીકે જે છે તેનું નામ કામબોગ. ‘અમારું કુળ ઉંચુ’-આવી ભાવના પણ કામબોગની પ્રધાનતાના કારણે છે. બીજા નીચા, તુચ્છ, અજ્ઞાન, દરિદ્રી, અનવિકારી વગેરે ભાવ પણ કામબોગરૂપ છે. આ પાપના બંધમાં કારણભૂત છે.

માટે લૌકિક અર્થ પણ અનર્થ છે. તેથી જેમ ધન અનર્થ છે તેમ પૌદ્યગલિક બધી જ શક્તિઓ અને અનુકૂળતાઓ શુદ્ધ ભાવરહિતને, ધર્મભાવનારહિતને માટે અનર્થરૂપ છે. સંસાર આખો અનર્થોથી, અવિવેકથી, પાપોથી, અને દુઃખોથી ભરેલો છે. તેને ઉત્પત્ત કરનાર, રાગાદિને જન્માવનાર કામબોગ છે. માટે અને અનર્થની ખાડા કલ્યાણ અનુકૂળ શબ્દાદિમાં રાગાંખ થનાર આત્મા નરકાદિ દુર્ગતિમાં જાપ છે. ત્રિપૃષ્ઠ વાસુદેવે શય્યાપાલકના કાનમાં સીસુ રેડાવવાનું ઉત્ત્ર પાપ પણ કામબોગના પ્રતાપે કર્યું અને તીર્થકરનો આત્મા હોવા છતાં સાતમી નરકે ગયા.


પ્રતિકૂળ શબ્દાદિમાં ઉશ્કેરાટ પામી મારવા જનાર, મારનાર પણ શબ્દાદિને પરાધીન છે. માટે શબ્દાદિ વિષયોનો શક્યતયા ત્યાગ કરીને અને બાકીનામાં સમભાવ-વિવેકપૂર્વક અનર્થકારક ન બને તે રીતે અનાસક્તપણે પ્રવૃત્તિ કરવાથી જીવ દુર્ગતિમાં જતો નથી. સંસારમાં લાંબો સમય ભટકતો નથી.

શક્ય એટલો ધર્મ સમજુને યોગ્ય રીતે સહન કરવું જોઈએ, એટલે કે જેને જેટલું, જેવું, જ્યારે જે મળે તે ખાવું, પીવું, ભોગવવું, સંઘરવું ન જોઈએ; પરંતુ બધામાં નિયમિતતા, અંકુશપણું, પરિમિતપણું કરવું જોઈએ. આ રીતે સહન કરનારને દુઃખ ઓછા આવે અને આવે તો સહન કરી શકે. સુખી માણસ સુખની સામગ્રીનો સદ્વ્યય અને શક્યતયા ત્યાગ કરીને, ભોગ ઉપભોગમાં અંકુશ અને અલ્યતા કરીને, દુઃખને સહન કરવાની ટેવ પાડીને અંત વખતે સમાધિને સુલભ બનાવે છે. મરણ ટાળી શકતું નથી તેથી સુખની આશંસા છોડવી, અપેક્ષા છોડવી.

જેમ જેમ માણસ આ ભવના સુખ, માન કે ઈયણપૂર્તિ માટે પાપ કરે છે, પ્રયત્ન કરે છે, તેમ માણસ પરલોકના ભૌતિક સુખો માટેની આશંસા, નિદાન વગેરેથી ધર્મને ગૌણ બનાવી દે છે, અને મરણો વધારે છે.

જો પરભવના સુખો ન હોય તો જીવનું સત્ત્વ અને શ્રદ્ધાઓ ધર્મ પ્રત્યે વધે. તેથી વિશુદ્ધ લેશ્યા અને વિશેષ સમાપ્તિ પ્રાપ્ત થાય. માટે બબો ભવના મરણાને જોઈને આલોક કે પરલોકના સુખની હૃદ્યા ન કરવી અને હૃદ્યા થતી જ હોય તો શાન-વૈરાગ્ય દ્વારા તેને ઘટાડવી, ફેરવવી, સુધારવી. તો આત્મા મોક્ષ સુધી પહોંચી મરણારહિત બને છે.

વૈષ્ણવિક હૃદ્યાપૂર્તિ માટે પણ ધર્મ કરનાર આગળ જઈને તે હૃદ્યા છોડીને શુદ્ધ વૈષ્ણવિક સુખના ત્યાગ, વૈરાગ્યમય બની વિશેષ આગળ વધે છે અને તે શુદ્ધ ભાવને અને વિશેષ ધર્મ પામીને શાશ્વત સ્થાન પામે છે.



## સર્વેષ્વરણવાંદત્યાગો વિશેષતો રાજાદિષુ ॥

**બીજી** કોઈ ગર્હણીય પ્રવૃત્તિ કરતા હોય તો જો અટકે તો અટકાવીએ. પણ ન અટકે તો ? આગ લાગે ત્યારે ઓલવાય એમ હોય તો ઓલવીએ, પણ ન ઓલવાય તો ? ત્યાંથી જતા જ રહેવું પડે. આપણી પાપપ્રવૃત્તિને કાબુમાં રાખવી એ આપણા હાથની વાત છે, પણ બીજા માટે જો તે ન અટકે એમ હોય તો આપણે ત્યાંથી ખસી જવું જોઈએ. એવી રીતે અવર્ણવાદનો ત્યાગ કરવો જોઈએ. નિંદનીય વસ્તુમાં આપણે પ્રવર્તન ન કરવું, તેમ નિંદનીય પ્રવૃત્તિવાળી વ્યક્તિ હોય તો અવર્ણવાદનો ત્યાગ કરવો. દોષની જહેરાત કરો એટલે એને આપણા પ્રત્યે દ્રેષ્ય થાય ને આપણને એના પ્રત્યે દ્રેષ્ય થાય. ખુદ કેવળજ્ઞાની ભગવાન પોતાની પર્યદામાં બધાના પાપને જાણતા હોવા છતાં કોઈના પાપની જહેરાત ન કરે. બાપ દીકરાના પાપની જહેરાત કરે કે ઢાંકીને રાખે?

**પ્રશ્ન :-** ભૂલ બતાવવી એમાં તો મિત્રભાવ રહેલો છે ને ?

**જવાબ :-** મિત્રભાવની જહેરાત થાય છે કે દ્રેષ્યભાવની થાય છે ? મિત્રભાવે ખાનગીમાં શિખામણ અપાય. જહેરમાં જહેરાત તો દ્રેષ્યભાવ કરાવે છે.

નીતિશાલ્કમાં આવે છે કે બ્રહ્માનો પણ વિશ્વાસ ન કરવો. આનો અર્થ શું ? કયોપશમભાવમાં રહેલો આત્મા કામ, કોષ, માન, મદ, હર્ષ, લોભનો નિગ્રહ કરનાર હોય છે, પણ ક્યારે નિગ્રહને બદલે તેમાં પ્રવર્તનાર થઈ જાય તેની કંઈ ખબર પડે ? પેલા મુનિ કાયોત્સર્વ ધ્યાને ઊભા હતા. અવધિજ્ઞાનથી ઈન્દ્ર-ઇન્દ્રાણીને મનાવે છે તે જોયું અને તેમને હસવું આવ્યું. વાસના ન જાગી, પણ ઈન્દ્રના મોહ અને મૂર્ખાઈ પર હસવું આવ્યું. કોઈના પાપ પર હસવું આવે તો એ ગુણ કે દોષ ? દોષ. ઉપરની ભૂમિકામાં છે માટે હસવું આવ્યું ન એનાથી નીચેની ભૂમિકામાં હોય તો મેરાઈ જાય. બ્રહ્માનો વિશ્વાસ ન કરવો, આનો અર્થ શું ? વ્યવહારથી શુદ્ધ આચાર પાળનારા બ્રહ્મા જેવા છે. પોતપોતાની રીતે સારા આચારવાળા છે એ પણ બ્રહ્મા જેવા છે. એનો વિશ્વાસ ન કરવો. ભગવાનની આશાને પાળનારો હોય, પણ જો વ્યવહારથી પણ બંગ થાય ત્યાં ગમે તેવા મહામુનિ હોય તો પણ વિશ્વાસ ન મૂકાય. આમ આપણા આત્મગુણોની રક્ષા

માટે કોઈના પર પણ આંધળો વિચાસ ન મૂકવો. હા ! દેવ-ગુરુ-પર્મ પરની અને તેના સાધનો પરની શ્રદ્ધામાં ઓટ ન આવવા દેવી.

આત્મ ગુણોના રક્ષણ માટે બીજાનું જીવંત જોતા રહેવું, જેથી તેનામાં રહેલા ગુણો મેળવવાનો પુરુષાર્થ થઈ શકે અને તેનામાં રહેલા દોષો જેવા દોષો આપણામાં ઘૂસી ન જાય. આમાં એક તકેદારી એ રાખવી કે પંચાત્મિયા ન બની જવાય.

સંસારી આત્મા પ્રત્યે નિંદા કરવાની ? અરુચિ કરવાની ? તિરસ્કાર કરવાનો ? ઉપેક્ષા કરવાની કે પછી સાવધાની રાખવાની ? સારા આચારવાળા હોય તો હળીમળીને રહેવાનું, પણ નબળા આચારવાળા હોય તો ઉપેક્ષા અને સાવધાની રાખવાની.. નિંદા કે અરુચિ નહીં.

જે માણસ પારકી પંચાત જ કર્યા કરે તે દુનિયામાં બધાનો દુશ્મન બને.

પ્રશ્ન :- કોઈ આપણું ખરાબ બોલે તો મૌન રહેવું ?

જવાબ :- તમે સાચો પાંચ હજારનો હીરો પહેર્યા હોય, પણ કોઈ મશકરી કરે ને કહે કે આ તો વીસ રૂપિયાનો છે, તો આપણો ક્યાં જવાબ આપીએ છીએ? વિશિષ્ટ આભરુ બગડતી હોય તો જવાબ આપવો ઉચિત, બાકી મૌન રહેવું. આપણી ભૂલ હોય તો સુધારી લેવી, ભૂલ નથી તો આપણું મન બગાડવાનું કંઈ કારણ ? મન, વચન અને કાયાની શક્તિની કિમત કેટલી ? બીજાની ભૂલ જોવામાં, દેખ કરવામાં, અરુચિના કારણો જવાબ આપવામાં જ આ મહાન શક્તિને ખર્ચવાની ? જો વધારે નુકસાન ન હોય, મોટી વાત ન હોય તો બીજી કોઈપણ વાતનો ખુલાસો કરવો જરૂરી નથી, પ્રતિકાર કરવો જરૂરી નથી. પ્રતિકારમાં એ તમને ગાળો આપે, તમે એને ગાળો આપો; એ તમારું હલકું બોલે, તમે એનું હલકું બોલો. તેનાથી આપણા આત્મામાં કલુષિતતા આવે, પાપ ઉપરની ઘૃણા જતી રહે. માટે બીજાના પાપની પ્રવૃત્તિમાં અવર્ણવાદનો ત્યાગ કરવો. બીજ દ્વારા કરાતા અવર્ણવાદની પ્રશંસા પણ કરવી નહિં.

શ્રી કૃષ્ણ મહારાજાએ મરેલી કુતરી જોઈ અને તેના દાંતની પ્રશંસા કરી. બધા સૈનિકોને તેમાંથી ગંધ આવતી હતી. તેમને પણ ગંધ આવતી હતી છતાં તેને ગૌણ કરી દાંતની પ્રશંસા કરી એમાં કંઈ કારણ ? હા, પાપબંધની ભીરતા. મન બીજાના દોષોને ગ્રહણ કરવા દ્વારા પાપ બાંધે છે. બીજાની હલકી વાતો મનમાં વિચારીએ એટલે પાપ બંધાય. દરિદ્રને જોઈ કરણા ન થાય તો પાપ

બંધાય, બુદ્ધિહીનને જોઈ કરુણા ન આવે તો પાપ બંધાય. જ્યારે લક્ષ્મીવાળાને જોઈ હદ્યમાં આનંદ (ઈર્ઝા, તિરસ્કાર કે પ્રતિસ્પર્ધિભાવ નહીં પણ તેની પુંધાઈનો આનંદ) થાય તો પુષ્ટ બંધાય. લૌકિક વસ્તુમાં પુષ્ટને પ્રધાન કરીને પ્રમોદભાવ આવે તો પુષ્ટ બંધાય. પૌદ્ગલિક વસ્તુમાં કરુણાભાવ આવે તો પણ પુષ્ટ બંધાય. લૌકિક વસ્તુમાં તિરસ્કાર, ઘૃણા થાય તો પાપ બંધાય. પૌદ્ગલિક વસ્તુમાં ઈર્ઝા, દેખભાવ થાય તો પાપ બંધાય. બીજા માણસને જોઈ ક્યો વિચાર આવવો જોઈએ ? કેટલાક પરિસ્થિતિથી દીન હોય, કેટલાક વૃત્તિથી દીન હોય. કેટલાક શરીરથી અશક્ત હોય, કેટલાક મનથી અશક્ત હોય. મનથી અશક્ત એ મોહનીય કર્મ અને શરીરથી અશક્ત એ વીર્યાંતરાય કર્મ. કેટલાકને ઘણું ધન હોવા છતાં દીનતા હોય છે, માન ન મળે એટલે દીન બને. કેટલાક સત્ત્વવાળા હોય છે. કેટલીકવાર સશક્ત માણસ હોવા છતાં દીન હોય છે, અશક્ત માણસ હોય છતાં પણ સત્ત્વ વિકસિત હોય એવું બને. સત્ત્વ મોહનીયકર્મના કથ્યોપશમથી ખીલે. સત્ત્વ એટલે હિંમત. એને મારી નાખનાર, ઊંઘા રવાડે ચડાવનાર મોહનીય કર્મ છે. કોઈ ડોક્ટર કોઈને કહે કે તમે અઠવાઉયું કાઢો એમ નથી, તો આ સાંભળવા માત્રથી જ અડધો મરી જાય. જેને પ્રભુના શાસનની શ્રદ્ધા, આલોક-પરલોકનો હિસાબ ખબર હોય એને તો મરવાનું નક્કી જ છે, તમે મને આ જણાવીને સાધના કરવાની જગૃતતા આપી એમ કહે એને આમ કરતાં એનું સત્ત્વ ખીલે. જે પારકી પંચાત છોડે એનું સત્ત્વ ખીલે. જે પારકી પંચાત કરે એનામાં સત્ત્વહીનતા આવે. પંચાતમાં - નિંદા, બીજાના દોષો જોવાના હોય, આ દોષો જોવાના કારણો એ અજ્ઞાન બાંધે, મોહ બાંધે, અંતરાય બાંધે અને અવિવેકને ઉત્પન્ન કરે છે, અને સત્ત્વહીન બને.

જ્ઞાન ભણેલા આત્મામાં સત્ત્વ ખીલે કે ન ભણેલામાં ? ધી રોટલીમાં ચોપદેલું હોય તો કામનું, (ગરમાગરમ રોટલી એકાદ ચમચી ધી ચૂસી જાય) બાકી ટોયલીમાં રાખેલું ધી કશું કામ આવે નહિ. એજ રીતે રોજિંદા જીવનબ્યવહારમાં વણાયેલું જ્ઞાન કામનું, બાકી બધું પોથીમાંના રીગજા જેવું જ્ઞાન તો અજ્ઞાન જેવું જ બની રહે. આત્માને ગમે તેટલું જ્ઞાન મળે એ ટોયલીનું ધી છે. જ્યાં સુધી એ જ્ઞાન આત્માના અનુભવમાં ન આવે ત્યાં સુધી તે ભાજનમાં પડેલા ધી જેવું છે.

આપણા જ્ઞાનનો લાભ આપજાને ક્યારે થાય ? રસોઈમાં ભળેલું, રોકાયેલું, પાકેલું ધી ક્યારેય જુદું ન પડે. એ રસોઈની સાથે એકમેક થઈને પરિણામે. હંડી

રોટલી પર લગડેલું ધી ઉપર તરે, ગરમ રોટલીમાં બધા અંશમાં ધી પણે, રોટલીની નીચેની બાજુ પણ ભીની થાય. જ્યારે તવી પર નાંખેલી રોટલીમાં ધી નાંખો તો? આપણું જ્ઞાન ઠંડી રોટલી પરના ધી જેવું, ગરમ રોટલી પરના ધી જેવું કે તવી પરની રોટલીના ધી જેવું છે? સુખની અવસ્થામાં થોડો ઘણો ધર્મ કરવો એ ઠંડી રોટલી જેવું છે, સામાન્ય આપત્તિ, સામાન્ય કઠિનાઈ, સામાન્ય અપમાન અને સામાન્ય મનને મારીને જે ધર્મ કરે એ ગરમ રોટલી પરના ધી જેવું. સારી સ્થિતિમાં આત્મા ધર્મ કરતા જેટલું પુષ્ય બાંધે એના કરતાં નબળી સ્થિતિમાં ધર્મ કરે તે પુષ્ય વધારે બાંધે. એક બાજુ વિશિષ્ટ વેદના, વિશિષ્ટ દુઃખની પરિસ્થિતિ, વિશિષ્ટ અપમાનની પરિસ્થિતિ હોવા છતાં આત્મા ધર્મ પકડે તો વિશિષ્ટ ધર્મ થાય તે ચુલા પર ચોપડેલી રોટલી જેવું થાય. કોઈની સાથે બહુ મોટો જગડો થયો હોય, પહેલાં તો આવા સંજોગોમાં સામેવાળો આપણા ધરે આવે જ નહિ, પણ ધારો કે કોઈપણ રીતે આવે તો પછી એક સાધર્મિક તરીકે પણ ચા-પાણી પીવડાવીએ કે જમાડીએ તો દેખભાવને બદલે ક્ષમાભાવ આવે. એ જ વ્યક્તિ કલાક પહેલા ગાળ દઈને જાય અને કલાક પછી ધરે આવી ચેતે તો એને ગાળ આપીએ કે આવકાર? આપણા હૃદયની પરિણાતિ શું? ગરમાગરમ પ્રસંગમાં પણ આત્મા ધર્મ સાથે સંકળાઈને એકમેક થાય તો જ સાચો ધર્મી, એટલે જેની સાથે વિરોધ હોય એના ધર્મના પ્રસંગમાં, વ્યવહારના પ્રસંગમાં જવું એ આપણને ક્ષમાધર્મ શીખવાનો ઉપાય છે.

કષાયોને વોસિરાવવા, સામાને માન આપવું, સામાનું ગૌરવ વધારવું-આ માટે આપણને અપમાન મળતું હોય તો સહન કરીને પણ સામાને માન આપીએ તો આપણા હૃદયમાં નમ્રતા આવે. જેમ આપણા આત્મામાં સારા સંસ્કારો પાડવા માટે તમામ નિંદનીય પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે તેમ આ જગતની તમામ વ્યક્તિમાં રહેલા દોષોની નિંદાનો પણ ત્યાગ કરવાનો છે. શાખમાં કહેવાય છે કે જો બીજાના ગુણ જોઈએ તો ગુણ મેળવવાના કર્મો બંધાય છે અને જો બીજાના દોષ જોઈએ તો દોષ બાંધવાના કર્મો બંધાય છે. કોઈ માણસ બીડી પીતો હોય ને આપણે કહીએ કે આ બીડી પીવે છે તો બીડી પ્રત્યેની સુગ જતી રહે ને બીડી પીવાના સંસ્કાર ઊભા થાય. તો આપણે તેના માટે શું વિચારવાનું? - કર્મ એને સતાવે છે એટલે સુખી, સમજુ હોવા છતાં અયોગ્ય માર્ગ ગયો છે. જો હું સાવધ નહીં રહું તો હું પણ તેવો થઈશ. એટલે એને જોઈ સાવધગીરી વધારવાની.


રોગચાળો થાય એટલે ડૉક્ટર સાવધ બને, તેમ ધર્મી સામાની કંગાળ અવસ્થા જોઈને સાવધ બને. આપણા મનથી કે વચ્ચનથી આપણને બીજા માટે ધૂણા ન હોવી જોઈએ.

હવે આપણી જત માટે આપણામાં જે દોષ હોય તેને માટે ધૂણા થાય તો દોષ તૂટે જો પોતાના દોષો પ્રત્યે ધૂણા ન થાય તો દોષો તૂટે નહિ. બીજાના દોષોમાં કરુણા ભાવવી અને જાતના દોષોની ધૂણા કરવી. હંમેશા અંકુશવાળી પ્રવૃત્તિ કરવી. પેસા વધે એટલે સાધનસામગ્રી વધે કે ધટે ? જો વધે તો ધૂણા ગઈ. સાધનસામગ્રી જેમ વધે તેમ ધૂણા જાય. માટે

(૧) બધે જ નિયંત્રણપણું રાખવું.

(૨) જે કોઈ પાપ પ્રવૃત્તિ થાય છે તે સત્ત્વલીનતાથી જીવ કરે છે, અના નિવારણ માટે ધૂણા જોઈએ. જીવનમાં પાપ પ્રત્યે ધૂણા થાય તો પાપ ઘટતા આવે. પણ પાપમાં ધૂણા ન હોય તો પાપ જીવનમાં વધતા આવે. પાપનો પક્ષપાત વધતો આવે.

માટે સ્વયં નિન્દ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને બીજાની નિન્દ્ય પ્રવૃત્તિને જોઈ આપણામાં એ દોષ ધૂસી ન જાય તેની સાવધાની રાખવી. પણ એની નિંદા તો ન જ કરવી.



## ॥ अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् ॥

**अ**न्तश्चानी परमात्माना शासनने पामवानी योग्यता मोहना छासथी आવे छे. मोहनीय कर्म घटे नहि त्यां सुधी शासन मળे नहि. मोहना शखोने जाणी तेनो क्षय करता ज्वो ते ४ मोहनीयने घटाइवानो उपाय छे.

“हुं” अने “मारु”-आ विचारणा मोहनीय कर्मने वधारे छे. पुद्गलमां, धनमां, कुटुंबमां, मानमां, अपमानमां, “हुं अने मारु”नी बुद्धि रहे तो आत्मा मोहनीय कर्मना क्षयोपशम वगरनो छे.

आत्मानु स्वरूप ज्ञान-दर्शन-चारित्र छे. परमात्मानु शासन पाम्या पछी मोहनीयनो क्षयोपशम जोઈअ. ते माटे “हुं कोशा ?” ऐंवुं विचारवुं जोઈअ.

आत्माना स्वरूपनु भान, गुणोनु भान थाय त्यारे देह “हुं हुं” ऐवी बुद्धि थती नथी.

भोटर यत्वावता होय ने खाडामां भोटर पडती होय अने भारणु खोली उतरी शकाय तेम होय तो उतरो के नहि ? तेम शरीरना पालनमां, शरीरनी संभागमां जो आत्मानो नाश थतो होय तो यत्वावाय नहि.

वात अे छे के जेने आ शरीर पर ममता छे अने ममता पक्षा आंधणी छे तो ते आत्मा शरीर माटे गमे तेवा पाप करवा तैयार छे.

जेने धन, कुटुंब, बंधु, मान, झ्याति पर ममता छे ते क्युं पाप न करे ? बधा पाप करे. एटले बधा पापनु मूण कोशा ? आसक्ति, ममत्व.

बाह्य पौद्गलिक विषयमां अने आंतरिक क्षाय-विषयोमां “हुं अने मारु” माने त्यां सुधी पापथी पाछो न करी शके. पापथी पाछा फरवानो उपाय, ‘आत्मा मोक्ष अपावे छे, आत्मा सद्गतिनुं कारण छे,’ ऐवो विचार जेने आवे ते पाप छोडी दे.

भाईनो दीकरो भार वर्ष्यी धरमां रहे तो पक्ष “मारो” कहेवाय ? ने पोतानो दीकरो १२ दिवस धरमां न रहे तो “परायो” कहेवाय ?

“आ शरीर मारुं नथी, आ कुटुंब मारुं नथी, आ आरोग्य मारुं नथी, आ पुष्य मारुं नथी,” आवुं जे विचारे तेनुं सम्यग्दर्शन निर्भण छे.

प्रतिकूण सामग्रीमां ममता तो नथी, पक्ष तेने बदलाववा माटेना भावो

પણ ન હોવા જોઈએ. પ્રતિકૂળ સામગ્રીની અંદર આર્તધ્યાન ન થવું જોઈએ; અનુકૂળ સામગ્રીની પાછળ મમતા ન હોવી જોઈએ.

જેને મોહનીયનો કષ્યોપશમ કરવો હોય, વૈરાય જોઈતો હોય, દુર્ગાત્મિ ન જોઈતી હોય, વિવેકની આંખ ખુલ્લી રાખવી હોય તો તેણે બધા પર "Lable" મારવું કે "આ મારુ નથી." શરીર પર પણ Lable મારવું કે "આ મારુ નથી."

"તો પછી આપણું શું?" એમ કોઈ પૂછે ત્યારે આત્મામાં રહેલા શુભ ભાવોને ઉત્પસ્ત કરનાર ધર્મસ્થાનો ને ધર્મકિયા આપણા છે. દેરાસરમાં આપણાપણાની બુદ્ધિ એ આત્માને સુધારવાનું કારણ છે, અને એનાથી મોહનીયનો કષ્યોપશમ થાય છે.

ભગવાન આપણા તો પૂજારી કોણો? પૂજારીને દર બેસતા મહિને ૧૦૧/- રૂ. કોણ આપે? ઘરના નોકરને કેટલું આપો? ને પૂજારીને કેટલું આપો?

વાત એ છે કે હંદ્યમાં દેરાસર, ઉપાશ્રય હજુ આપણા લાગ્યા નથી.

ધેર મહેમાન આવ્યા હોય તેમની જમવાની કાળજી કરો ને, મોડા આવે તો રાહ જુઓ તો સાધુ મહારાજને ત્રણ વખત ગોચરી માટે કોણ વિનંતી કરવા આવે? સાધુ પૂજ્ય લાગે છે, પણ પોતાના લાગ્યા નથી. દેરાસર, ઉપાશ્રય પૂજ્ય લાગે ખરાં, પણ હંદ્યમાં આપણું નહિ, પણ સંધનનું હોય તેવું લાગે છે.

આપણા જીવનમાં શું કરવાનું? બીજાનો વિચાર કરવાનો છે કે પછી આંખ આડા કાન કરી બાબ્ધ ભોગોમાં મસ્ત રહેવું છે? ખાલી બેગું જ કરવાનું કે બીજા પ્રત્યે સ્નેહ-કરુણા કરવાની છે? બેગું કરીને ભોગવવું છે કે પરોપકાર કરવો છે? પરોપકાર જીવો પ્રત્યે કરીએ તો તેમના પ્રત્યે આદર-મમતાને સ્નેહભાવ કેળવાય છે. આરોગ્યનું પુણ્ય જેમ તપથી આવે છે તેમ આરોગ્યનું પુણ્ય બીજાને ખવરાવવાથી મળે છે. બીજા પર મમતા-કરુણા-આનંદ ઊભા કરો એટલે સહજ પુણ્ય મળે. બીજાને વાત્સલ્ય આપીએ તો આત્મામાં ધર્મની યોગ્યતા આવે.

તપ-ત્યાગ દેહની મમતા છોડવા માટે છે.

ધર્મના સાધનોને પોતાના માને, ધર્મના સાધનોનું રક્ષણ કરે, ધર્મ આત્માનું ધ્યાન રાખો, રક્ષણ કરે તે ધર્મ કહેવાય.

આપણી વાત એ છે કે સંધ પર મમતા આવે ત્યારે સંધમાં કોઈ દુઃખી ન રહે ને ઘરમાં કોઈ સંસકાર વિનાનું ન રહે.

આવો ભાવ કરીએ તો ઉત્તમ કોટીની આરાપના થાય, ને એ રીતે આગળ વધાય.

## ચિત્તરક્તમસંકિલણમાન્તરં ધનમુચ્યતે

**ચિત્ત** શબ્દ 'મન' અર્થમાં અને 'જ્ઞાન' અર્થમાં વપરાય છે. મનમાં પણ દ્વયચિત્ત પુદ્ગલ આત્મક છે, જ્ઞાન સ્વરૂપ નથી, જ્ઞાનનું કારણ છે. ભાવચિત્ત જ્ઞાનરૂપ છે. આ જ્ઞાન પણ લખિતુપ, ઉપયોગરૂપ કે સંસ્કારરૂપ હોય છે. લોક વ્યવહારમાં ઉપયોગને 'ચિત્ત' કહેવાય છે. ઉપયોગ વખતે એમાં મોહનીયના ઉદ્ય કે ક્ષયોપશમ જેવા હોય કે જેવા ઉત્પત્ત થાય તેવી શુભાશુભતા આવે છે. અશુભ કર્મના (મોહનીયના) ઉદ્યથી અશુભતા ઉપયોગમાં આવે છે. જેમ અવધિજ્ઞાન ઉત્પત્ત થતાં દેવલોક દેખાતા ઠંડ ઈન્દ્રજાળીને મનાવે છે તે જોઈને મુનિને હસવું આવ્યું અને અવધિજ્ઞાન ગયું. આમાં અવધિજ્ઞાનથી જે દેખાયું તેના ઉપર કર્મ પરતંત્રતાની ભાવના, મોહની પ્રધાનતા તેમજ ભાવદ્યારૂપ વિચારણા થઈ હોત તો અવધિજ્ઞાન ન જાત માટે અશુભ કર્મના ઉદ્યથી જીવ કોઈપણ સારા કાર્યમાં-સારી વિચારણામાં પણ અશુભ વિચાર કરનાર બને છે, આ રીતે ઉપયોગ અશુભ-સંકિલણ બને છે.

ऋઘભદેવ ભગવાનના પૂર્વ ભવમાં પ્રાલી-સુંદરીના જીવ પીઠ-મહાપીઠ પાસે તેમના ગુરુદેવે (ऋઘભદેવ ભગવાનના જીવે) ભરત-બાહુભલિના જીવ બાહુ-સુભાહુના વૈયાવચ્ચ ગુજરા અને ઉત્કૃષ્ટ સાખુલક્ષિતની પ્રશંસા કરી. તે વખતે સ્વાધ્યાય તત્પર આ બને જીવોને ખોટું લાગ્યું અને મનમાં વિચાર આવ્યો કે 'કામ કરે એટલે ગમે છે, પણ શરીર તોડી નાખીને, બાધ્યથી વિમુખ બનીને સ્વાધ્યાય કરીએ છીએ તેની કાંઈ કદર નહીં ?' આવા ગુરુનિંદાના વિચારથી બનેએ રીવેદ બાંધ્યું. જો પીઠ-મહાપીઠ-બાહુ સુભાહુની પ્રશંસા સાંભળી ભક્તિના ગુજરાની મહત્ત્વા વિચારી હોત તો આવું કર્મ ન બંધાત. પણ અશુભ કર્મના ઉદ્યથી પોતાની મહત્ત્વા વિચારી અને ચિત્ત, જ્ઞાન, ઉપયોગ અશુભ વિચારવાણા બન્યા.

આ રીતે શુભ કર્મના ઉદ્યથી, મોહનીયના ક્ષયોપશમથી જીવ અશુભમાં ન વળતા શુભ વિચારણા તરફ વળે છે. મરુદેવીમાતા ઋઘભદેવ પુત્રને (ભગવાનને) વંદન કરવા ગયા ત્યારે પ્રભુએ તેમને ન બોલાવ્યા, ઉત્કૃષ્ટ સમૃદ્ધિમાન બનવા છતાં, કરોડો દેવતાઓ સેવામાં હાજર હોવા છતાં સંદેશો પણ ન મોકલાવ્યો. તે

જ રીતે (ગૈતમસ્વામીનું) પોતાનું અતિવિશાળ જ્ઞાન, ૫૦,૦૦૦-કેવળજ્ઞાનીઓનું ગુરુપણું, અનંતલભિનિધાનતા વગેરે બાજુ પર મૂકીને બાળકની જેમ જ્ઞંદગીભર સેવા કરી છીતાં અંતિમ સમયે ભગવાને પોતાને દૂર મોકલ્યા, છૂટા પાડ્યા. આંમ સંકલેશના ઢગલાબંધ નિમિત્તો હાજર હોવા છીતાં આ જ્ઞાનના ઉપયોગને વૈરાગ્યભાવનામાં વાળવાથી, વીતરાગતાયુક્ત બનાવવાથી બનેને કેવળજ્ઞાન મળ્યું. તેથી (૧) શુભકર્મના ઉદ્દ્યથી કે (૨) આત્મપુરુષાર્થથી કે (૩) પૂર્વ નાખેલ શુભ સંસ્કારની તીવ્રતાથી ઉપયોગમાં જે અશુભતા કે અશુભની તીવ્રતા નથી આવતી, તે ઉપયોગ અસંક્ષિપ્ત કહેવાય. તેમાં ઉપરના ત્રણ કારણ જેમ બતાવ્યા છે તેમ અશુભ કર્મના ઉદ્દ્ય, અશુભ આત્મવીર્ય અને અશુભ સંસ્કાર એ સંકલેશ જન્માવે છે. ઉપરના ત્રણ કારણ સંકલેશના પ્રસંગે પણ વિશુદ્ધિ આપે છે અને નીચેના ત્રણ કારણો સારા ઉપયોગમાં પણ અશુભતા જન્માવી સંકલેશ આપે છે. માટે અશુભ કર્માદ્યને રોકવા માટે, અશુભ આત્મવીર્ય ન જાગે - ન પ્રવર્તત તે માટે, અશુભ સંસ્કારો નાશ પામે તે માટે આત્માને એવી રીતે કેળવવો જેથી સારા કાર્યો જોવા ગમે, સારા કાર્યવાળા ગમે, સારા કાર્ય, વિધિ, પદ્ધતિ, આચાર અને ઉપાય ગમે, ભૂતકાળના કે વર્તમાનકાળના સારા કાર્ય કરનારના ચરિત્રો વગેરે સાંભળવા ગમે, ગુણાનુવાદ વિધિનું પ્રલૂપણ સાંભળવું ગમે, એવા કાર્યો જોવા ગમે. આ બધું જે ગમે છે તે પાપને, પાપબુદ્ધિને, પાપની રૂચિને ધોવા માટે કાર સમાન છે. આ ગમવાના પ્રતાપે કાળકમે આવા આચારની ઈચ્છા થાય. આ ઈચ્છા પાપપ્રવૃત્તિને છોડવાની ઈચ્છા જન્માવે છે.

એ રીતે પૂર્વ જે રૂચિ થઈ તે પણ પાપપ્રવૃત્તિની રૂચિની મંદતા અને છેવટે અરુચિ જન્માવનારી છે. આ રૂચિ અને પ્રવૃત્તિની ઈચ્છા તે શુભ પ્રણિધાનનું બીજ છે. આ ઈચ્છા નિર્ણયરૂપે, મજબૂતરૂપે થાય તે પ્રણિધાન છે. આ શુભ અર્થાત् સારું પ્રણિધાન એ આત્મામાં સંસ્કાર નાખે છે જેથી આપણા જ્ઞાનના ઉપયોગમાં એની છાયા રહે છે, તે છાયા પણ સારી છે. આનાથી અશુભતા આવતી નથી. અશુભ સંસ્કાર આ પ્રણિધાનથી દબાય છે, નાશ પામે છે. અશુભ આત્મવીર્ય ઉલ્લસિત થતું નથી. તેથી સારી વસ્તુ-ગુણ-કાર્યની રૂચિ, શુભને પ્રામ કરવાની રૂચિ અને તેના માટેનું પ્રણિધાન-આ ત્રણે શુભભાવના ઉત્તરોત્તર પ્રબળતાવાળી છે અને કથંચિત્તુ શુભભાવ-સંસ્કારરૂપ છે, તેથી અશુભ ભાવના - અશુભ આત્મવીર્યનું પ્રગટન અને અશુભ સંસ્કાર નાશ પામે છે. તેથી ઉપયોગમાં

સારાપણું, અસંકિલણપણું નિરંતર પ્રવર્તે છે. આ પ્રણિધાનની મદ્તા હોય તો અશુભ સંસ્કાર ઉત્તેજિત થાય છે, અશુભ આત્મવીર્ય ઉલ્લસિત થાય છે, અશુભ ઈચ્છાઓ જન્મે છે, એની તીવ્રતા જંને છે અને શુભ પ્રણિધાનને ફેરવીને અશુભ પ્રણિધાનનો પણ જન્માવે છે. માટે પ્રણિધાન પછી જે પ્રવૃત્તિ બતાવી તે શુભ પ્રવૃત્તિ એ પ્રણિધાનને કાર્યાલીમુખ બનાવે. આ પ્રવૃત્તિ પણ સારા ઉપયોગરૂપ છે, અસંકિલણ છે.

આ પ્રવૃત્તિ જો પ્રણિધાનમૂલક અને વિશિષ્ટ હોય તો (૧) અતિચારરહિત, (૨) અપ્રમાદ, (૩) આદર, (૪) અપ્રસમતા, અને (૫) ઉલ્લાસથી સબર હોય છે. આ પાંચે પ્રવૃત્તિના અને ઉપયોગના સારા અંશો છે. અસંકિલણતા, વિશુદ્ધિતાના પ્રેરક-સૂચક તત્ત્વ છે.

આ પાંચના કારણો પ્રવૃત્તિ દ્વારા આત્માનો શાન, દર્શન, ઉપયોગ વિશેષ શુદ્ધ અને વિશિષ્ટ બને છે, સામાન્યથી ડામાડોળતા આવતી નથી.

ઉપરોક્ત પાંચના પ્રતાપે બળવાન સારો ઉપયોગ આવે છે. બળવાન ઉપયોગના કારણો વિભો, પ્રવૃત્તિની પ્રતિકૂળતા, સાંયોગિક પ્રતિકૂળતા કે અનુત્સાહ વગેરે આવતા નથી અને નિકાયિત કર્મ સિવાયના બધા આંતરિક વિભો, કર્મના ઉદ્યો ખસી જાય છે. બાધ્યમાં સહન કરવાનો ઉલ્લાસ-બળ જન્મે છે. તેથી ઉત્તમ પ્રવૃત્તિ દ્વારા સારા ઉપયોગની વિશિષ્ટતા જન્મે છે અને વિઘનજયનું બળ આપે છે. બાધ્ય મામુલી પ્રતિકૂળતામાં જેની વિશુદ્ધિ નાશ પામે તે જધન્ય વિશુદ્ધિ કહેવાય, વિઘનજય પણ જધન્ય કહેવાય.

બાધ્ય વિશિષ્ટ પ્રતિકૂળતામાં જેની વિશુદ્ધિ ઘટે અથવા ટકે તે મધ્યમ વિશુદ્ધિ કહેવાય, વિઘનજય પણ મધ્યમ કહેવાય.

બાધ્ય ગમે તેવી પ્રતિકૂળતા કે આંતરિક વિકલ્પોની પરિસ્થિતિમાં પણ જે ભાવના શાનની વિચારણાથી વિશુદ્ધ ઘટવા ન હે તે વિશિષ્ટ વિશુદ્ધિ કહેવાય. તેને ઉત્કૃષ્ટ વિઘનજય કહેવાય.

વિભોમાં મક્કમતા તે પણ શાન-ઉપયોગને વિશુદ્ધ અને બળવાન બનાવે છે.

આ રીતે બાધ્ય આંતર વિભોનો જય એ પણ એક પ્રકારનું આત્મવીર્ય અને શુભ સંસ્કાર છે, જે શાનને પવિત્ર-વિશુદ્ધ રાખે છે. આ વિશુદ્ધિની સમજ આત્મ સંસ્કારની વૃદ્ધિથી સિદ્ધિ નામનો આત્મગુણ ઉત્પત્ત થાય છે. આ ગુણ એટલે

પોતાને તે ગુણની અપ્રતિપાતી (ક્યારેય પણ ન પડે તેવા) તરીકે કે ક્ષાયિકલાવરૂપે પ્રાપ્તિ. આ પ્રાપ્તિના પ્રતાપે એ ગુણથી વિપરીત ભાવ ક્યારેય પણ ઉપયોગમાં આવતા નથી. ઉદાર માણસને ક્યારે પણ ન આપવાની બુદ્ધિ ન જાગે; સહનશીલ માણસને ક્યારેય સામનો કરવાની બુદ્ધિ ન જાગે તો સમજવું કે સિદ્ધિ છે.

આ પછી વિનિયોગની શક્તિ પણ જન્મે છે - બીજાને પણ ગુણો ઉત્પત્ત થાય તેવી પ્રવૃત્તિ થાય છે અને સફળ થાય છે.

દુંકમાં જ્ઞાનના ઉપયોગને 'ચિત્ત' કહેવાય, તેમ તે જ્ઞાનની લભ્યને પણ જ્ઞાન ઉપયોગમાં હેતુભૂત હોવાથી ચિત્ત કહેવાય અને તેમાં નિર્મળતા આપાદક મોહનીય કર્મના કષ્યોપશમો અને અન્તરાય કર્મના કષ્યોપશમો જે સહકૃત કારણ બને તે અસંક્લિષ્ટ ચિત્તમાં કારણ છે, નિર્મળ જ્ઞાનોપયોગમાં કારણ છે તેથી તેને પણ કારણમાં કાર્યના ઉપયોગથી 'ચિત્ત' કહેવાય.

સંકલેશ એટલે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના ઉદ્યથી ઉત્પત્ત થતા અપ્રશસ્ત અશુભ વિકલ્પો. આ પણ અશુભ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનની અશુભતા એ પાપબંધનું, દુઃખબંધનું, મોહનું અને અજ્ઞાનનું કારણ છે.

મોહનીયના બદલે મોહનીયનો કષ્યોપશમ થવાથી સંકલેશના બદલે જ્ઞાન વિશુદ્ધ અને વિવેકસંપત્ત બને છે, ઉપશમપ્રધાન બને છે, સ્વ-પર ગુણકારી, કલ્યાણકારી બને છે.

મોહનીયના બંધને કષ્યોપશમયુક્ત વિશુદ્ધ જ્ઞાન તે આંતરિક ધન છે, આત્મ ઉત્તીકારક છે, આત્મગુણપ્રાપ્ત છે, શાશ્વત સ્થાન મેળવવાનું કારણ છે, પ્રસન્નતાદિ સાત્ત્વિક ગુણોનું કારણ છે. આ બંધું આત્મિક ધન છે અને એ જ પુણ્યબંધ અને પુણ્યોદય દ્વારા બાબુ સર્વ શક્તિઓ રૂપી બાબુ ધનનું કારણ છે.

માટે જ્ઞાનની, ઉપયોગની વિશુદ્ધિ તે આત્મ ઉત્તીર્ણ આંતરિક ધન છે અને જ્ઞાન, ઉપયોગની મહિનતા તે આંતરિક દરિદ્રતા છે, સંસારરૂપ-દુઃખરૂપ છે. માટે જ્ઞાન અને ઉપયોગની વિશુદ્ધિ માટે એના કારણોમાં સતત આદરવાળા થઈ પ્રયત્નશીલ બનવું.



જહ જઉ અગ્નિણા તપ્યંતં ગલતિ,  
એવં જહુત્તસંજમજોગસ્સ અકરણતો ચરિત્તં ગલતિ ।

જેમ લાખ-જતુ(પૃથ્વીનો રસ) અગ્નિથી તપે તો ઓગળે છે, તેમ પથોક્તા સંપ્રમયોગોને નહિ કરતા, ન આચરતા જીવનું ચારિત્ર ગળે છે, ઓગળે છે, નાશ પામે છે.

શાખમાં અસંયમ યોગની પ્રવૃત્તિને જેમ અગ્નિની ઉપમા આપી છે, એ રીતે સંયમયોગોની પ્રવૃત્તિને પણ અગ્નિની ઉપમા આપી છે. એ જ રીતે વિશિષ્ટપણે ભાવિત આત્મા સિવાય અસંયમ યોગોવાળા ગૃહસ્થો વચ્ચે રહેવું તેને પણ અગ્નિ સાથે સરખાવાયું છે. તેથી સંપ્રમના રક્ષણ અને વૃદ્ધિ માટે-

૧) અસંયમ યોગોની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. અનુચિત પ્રવૃત્તિ અને અજ્યષાવાળી પ્રવૃત્તિઓને પણ આમાં લેવી.

૨) સંયમના દરેક યોગોમાં ઉલ્લાસપૂર્વક, ઔચિત્યપૂર્વક અને જ્યષાપૂર્વક પ્રવૃત્ત થવું.

૩) ગૃહસ્થો અને અનુચિત પ્રવૃત્તિવાળા કે અજ્યષાવાળી પ્રવૃત્તિવાળા સાથે ન રહેવું, વધારે વ્યવહાર ન કરવો.

આ ત્રણ નિયમ જે પાળે છે તેનું સંયમ સ્થિર થાય છે, મજબૂત થાય છે, વધું જાય છે.

જેમ સંયમયોગ અને અસંયમયોગ બસે પરસ્પર વિપરીત હોય છે, ઔચિત્ય અને અનૌચિત્ય બસે પરસ્પર વિરોધી હોય છે, પતના અને અયતના બસે પરસ્પર વિલક્ષણ છે, તેમ સાધુની સાધુતા અને ગૃહસ્થની સંસારિતા બસે પણ પરસ્પર આચાર અને ઉદેશથી લિન હોય છે.

જ્યાં સુધી જીવના ગુણોના પરિણામ, આચારના પરિણામ જતુ જેવા ઢીલા છે ત્યાં સુધી ઉપરની ઉત્તરનો અમલ કરે તે સંયમમાં આગળ વધે, મજબૂત બને અને એકદમ સ્થિર થાય.

જે જીવો વિવક્ષિત ગુણોના જે જે આચાર અને મર્યાદાઓ છે, તેમાં ઢીલા પડે-તે આચાર પાળે-ન પાળે, અર્ધા પાળે, જેવા તેવા પાળે તો તે જીવોના તે તે આચારો ધીરે ધીરે ઘટતા જાય, દોષના આચારો વધતા જાય અને એના કારણો ગુણો બહારથી નાચ પ્રાય: થાય અને અંતરથી પણ પ્રાય: હોય નહિ અને કદાચ હોય તો પણ ઘસાતા જતા હોય અને ધીરે ધીરે નાશ પામે.

જેમ સાચું બોલનારનો આચાર છે કે વિચારીને બોલવું, નકામું ન બોલવું, ખોટી પ્રશંસા ન કરવી, કોઈ વગેરેમાં આવીને ન બોલવું, જુદું બોલનાર જોડે અનિવાર્ય કારણોસર જરૂર પુરતું બોલવું, વાચાળ ન બનવું, મામુલી બાબતોમાં ખ્ય વગેરેથી જુઠ ન આવે તેની કાળજી રાખવી, વિકથાઓ-પાપપોપક વાતો ન કરવી. આ આચારનું જેને લક્ષ હોય તેને દરેક વખતે સત્ય પ્રેમ વધે અને લક્ષ ન હોય તો સત્યપ્રેમ ન વધે-અસત્યની પ્રવૃત્તિ એ જ અસત્યનો પ્રેમ સાબિત કરે છે.

અનાભોગથી પણ વારંવાર સત્ય પ્રવૃત્તિ થાય એ સત્યપ્રેમ સૂચવે છે; એમ વારંવાર અસત્ય પ્રવૃત્તિ કે વિચારણા થાય તે અસત્યપ્રેમ સૂચવે છે.

માટે સ્વાભાવિક આચાર-સ્મૃતિસાધ્ય આચાર-કંઈક કષણસાધ્યાચાર-વિશેષ કષણસાધ્યાચાર અને અસાધ્ય આચાર-આ પાંચ પ્રકારના આચારથી સંયમ વધે છે અને એનાથી વિપરીત આચારથી જો સંયમ હોય તો નાશ પામે છે, અને જો સંયમ ન હોય તો સંયમની યોગ્યતાની ઉત્પત્તિ તો થતી નથી, ઉલટુ અયોગ્યતા જન્મે છે.

જે આચાર અસાધ્ય હોય તેના પ્રત્યે આદર-સ્નેહ-મમતા રાખે તો પુણ્ય અને કષ્યોપશમ દ્વારા એ સાધ્ય બને છે.

સમ્યકૃતના દ્વારા બોલરૂપ વ્યવહાર આચારથી ભાવ સમ્યકૃત પ્રગતે છે, નિર્મળ થાય છે, દઢ થાય છે. તેવી જ રીતે શ્રાવકોના પ્રતો અને ઉત્તરગુણના આચારથી શ્રાવકપણું નિર્મળ થતા ભાવની નિર્મળતા થવાથી સર્વવિરતિની ભાવના જાગે છે, તેમજ તે મેળવવાનો પ્રયત્ન થાય છે.

સાધુપણાના આચારમાં સ્થિતને સાધુપણામાં આનંદ આવે છે, જેનાથી આચારની વૃદ્ધિ થાય છે અને અપ્રમત્તા, વિષયવૈરાગ્ય, સ્વાધ્યાય નિષ્ઠતા, તપ, ત્યાગ, વિનય, વૈયાવચ્ચ વગેરે સર્વતોમુખી ભાવ્ય-અત્યંતર આરાધનામાં પ્રગતિ કરે છે. આચારમાં જે નબળો પડે છે, વારંવાર “થાય છે, થશે” એમ કરીને આચારની પક્કડ ઢીલી કરે છે, તેને આચારનો રસ જ ઊરી જાય છે; અને અનાદિકલીન સંસાર-મોહ-અજ્ઞાન-પ્રમાણની પ્રવૃત્તિનો રસ જીવનમાં સહજપણે પ્રવર્તે છે, જેના કારણે સ્વાધ્યાયથી ભાવિતપણું થતું નથી, જીચી ભાવનાઓ જાગતી નથી, સ્વાધ્યાયરસિકપણું પણ વ્યવહારથી ઘટતું જાય છે અને એની પરિણાતિ પણ આચાર વગર પ્રગતિ નથી.

તેથી આચાર ઘટવાથી આંતરિક પરિણામ, જ્ઞાન, સમ્યકૃત બધું ડ્રાસ પામે છે અને કાલાન્તરે નાશ પામે છે.

માટે આચારમાં સતત ઉદ્ઘમ કરવો,

जं अब्मसेइ जीवो गुणं च दोसं च एत्य जम्ममि ।  
तं पावइ परलोए तेण य अब्मः सजोएण ॥

**ગ**पदेशमालाना आ श्लोकनो स्थूल अर्थ करीએ તો “જીવ આ જન્મમાં જે ગુણ કે દોષનો અભ્યાસ કરે છે તે અભ્યાસના કારણો તે ગુણ કે દોષ પરલોકમાં પામે છે.”

આ લોકમાં જીવોની જે જે સારી કે નરસી પ્રવૃત્તિ અને તેમાં રસ સાહજિક દેખાતો હોય ત્યાં સમજવું કે એ જીવે પૂર્વભવમાં તે આચારો, પ્રવૃત્તિઓ અને ભાવનાઓ જીવનમાં અનેકવાર રસપૂર્વક આચરેલી હશે.

આજ રીતે આ ભવમાં જે સારી કે નરસી પ્રવૃત્તિ જીવ વારંવાર કરે, રસપૂર્વક કરે, તેનાથી સંસ્કાર પડે છે. તે દ્વારા પરભવમાં તે પ્રવૃત્તિ અને તેમાં રસ તેને સાહજિક મળે છે.

જેને શુભપ્રવૃત્તિ અને શુભ પરિણામોની પરલોકમાં જરૂર હોય તેણે આ ભવમાં શુભપ્રવૃત્તિ અને શુભ પરિણામોનો અભ્યાસ કરવો પડે. આ પ્રવૃત્તિથી મોહનીયકર્મના-કથ્યોપશમથી અનુવિદ્ધ=પુક્ત જ્ઞાનાવરણકર્મના કથ્યોપશમથી આત્મામાં શુભ સંસ્કાર પડે છે અને સાથે સાથે શુભપ્રવૃત્તિથી પુણ્યબંધ દ્વારા સારા કાર્યને અનુકૂળ સામગ્રીઓ-અનુકૂળતાઓ મળે છે અને શુભ પરિણામના કારણે આત્મામાં મોહનીયનો કથ્યોપશમ થવાથી ભવાંતરમાં પણ શુભ પરિણામ મળે છે. તેથી શુભ કિયા અને શુભ પરિણામની નિરંતર વૃદ્ધિ થતા જીવ મોક્ષ સુધી પહોંચે છે. શુભકિયા શુભ પરિણામ જન્માવે છે, શુભ પરિણામ શુભ કિયા કરાવે છે. આ રીતે બતેની વૃદ્ધિ અને શુદ્ધિ થવા પૂર્વક પરાકાણા પમાય છે.

માટે જીવનમાં અશુભ પ્રવૃત્તિઓને બને તેટલી છોડતા જવું - ઓછી કરતા જવું, અને શુભ કિયામાં વારંવાર પ્રવર્તતા જવું.

અશુભ કિયાની ઈચ્છાથી-રસથી-વારંવારની પ્રવૃત્તિથી જીવ અશુભ પ્રવૃત્તિના સંસ્કાર નાખે છે, અશુભ કર્મ પણ બાંધે છે. અશુભ સંસ્કારોના પરિણામે જ્ઞાનાવરણનો કથ્યોપશમ મોહનીયના ઉદ્દ્યયપુક્ત બની વિકૃત બનેલો ખોટી બુદ્ધિ-દોષપુક્ત બુદ્ધિ-

પાપબુદ્ધિ પેદા કરે છે અને જીવ પાસે પાપમૃત્તિ કરાવે છે. માટે જે સંસ્કારો તોડવા હોય તેની પ્રવૃત્તિ છોડવી જોઈએ; જે સંસ્કારો છોડવા હોય તેનો રસ અને વિચારણા તોડવા માટે તેના નુકસાનોની વિચારણા વારંવાર કરવી જોઈએ.

વારંવાર પૂજવા-પ્રમાર્જવાની કિયાથી હદ્યમાં જીવદ્યાના પરિણામ જન્મે છે. તેથી બધી પ્રવૃત્તિમાં જીવદ્યા-રક્ષાના પરિણામ આવે તેથી હિંસા થાય તેવી પ્રવૃત્તિમાં જીવને આંચકો લાગે.

વારંવાર વિચારીને જુહું ન બોલાઈ જાય તેની કાળજી રાખનારને સત્ય પરિણામ પ્રગટ થાય; તેથી તે ઊંઘમાં પણ જુહું ન બોલે.

આ રીતે દરેક સારી પ્રવૃત્તિને વારંવાર ચોક્કસરુપે કરવાની ભાવના અને તે પ્રવૃત્તિ કરવાથી તેનાથી વિપરીત અશુભ પરિણામો સ્વપ્રમામાં પણ ન આવે. અજીવતા પણ થાય તો તરત ખ્યાલ આવે. આ જીવને જગાડવાનું કાર્ય શુભ સંસ્કારો કરે છે. શુભપ્રવૃત્તિના અભ્યાસથી રસથી અશુભ પ્રવૃત્તિનો રસ નૂઠે છે- અશુભ પ્રવૃત્તિથી ઊભા થયેલ સંસ્કાર તૂઠે છે, અશુભ પ્રવૃત્તિથી બંધાયેલા પાપકર્મ અને પાપકર્મના અનુબંધ નાશ પામે છે અથવા પાપકર્મની સ્થિતિ-રસ ઘટે છે, એમ અનુકૂમે અશુભ પ્રવૃત્તિ બંધ થઈ જાય છે.

શુભપ્રવૃત્તિના સંસ્કાર પડે છે. મોહનીયનો અને શાનાવરણ વગેરેનો ક્ષયોપશમ થાય છે, શુભ કર્મ બંધાય છે, શુભ અનુબંધ થાય છે, શુભ પ્રણિપાન થાય, અશુભ પરિણામ તૂઠે, શુભકિયા અને પરિણામોના લાભ સમજવાની જીવમાં પોગ્યતા આવે, રૂચિ અને શ્રદ્ધા જન્મે છે. એ જ રીતે અશુભ પરિણામો અને અશુભ કિયાઓના નુકસાન સમજવા માટે જીવ પોગ્ય બને છે. એથી અશુભ કિયાઓની અરૂચિ થાય છે, તેના પ્રત્યે નુકસાનકારિતાની-દુર્ગતિ આપનાર તરીકેની શ્રદ્ધા જાગે છે.

પ્રભુનું શાસન એ શુભકિયાના અભ્યાસરૂપ છે. જે લૌકિક શુભકિયા કરે તે આ શાસનને માટે વિશેષપણે યોગ્ય હોય છે. માટે જીવનમાં (૧) નિરથ્યક સર્વ પાપોનો ત્યાગ કરવા સદા જાગ્રત રહેવું જોઈએ. પાપકિયામાં મનોરંજન એ પાપમાં મનોરંજન છે. પાપમાં મનોરંજન એ પાપરતિ છે. પાપરતિ એ પાપના ભયનો અભાવ સૂચવે છે અને પાપના ભય વગરના જીવ ધર્મને પોગ્ય બનતા નથી. પાપકિયામાં મનોરંજન એ પાપ પક્ષપાતનું બીજું સ્વરૂપ છે, અથવા પાપના પક્ષપાતને જન્માવે છે. માટે નિરથ્યક પાપોનો ત્યાગ એ આત્માને ધર્મ પોગ્ય બનાવે છે.

(૨) શક્ય એટલા પાપો ઘટાડવા. આ વાત તેના જીવનમાં બને કે જે દરેક પ્રવૃત્તિમાં પાપ છે કે નહિ, પાપ છે તો કેટલું છે, કેટલું ઘટે તેમ છે તેની વિચારણા કરે અને શક્ય હોય તેટલું ઓછું કરે. આના પ્રતાપે જીવનમાં જે થાય પ્રવર્ત્ત તેમાં પણ જીવ પાપ તરીકે જોતો થાય. તેથી તેમાં હરે નહિ. તેથી તે કરાતી પાપની પ્રવૃત્તિ પણ પશ્ચાત્તાપ-આલોચના-પ્રાપ્તિશીત વગેરેથી પુક્ત હોવાથી આત્માના અશુભ સંસ્કારની નાશક બને છે. જેમ પાપની પ્રવૃત્તિ ઘટાડનાર ધર્મ હોય, ધર્મ સંસ્કારવાળા હોય તેમ ધર્મની પ્રવૃત્તિમાં આળસ-ઉપેક્ષા-મંદતા-ઉતાવળ-અપ્રસરતા વગેરેવાળા આત્મામાં ધર્મ અપ્રધાન હોય અથવા ધર્મ ન હોય એમ કહેવાય. શુભ સંસ્કાર નથી અથવા અલ્ય છે, અને એથી એના અશુભ સંસ્કાર તીવ્ર છે તેમ સૂચિત થાય. અને તેથી અશુભ સંસ્કારની તીવ્રતાવાળો ધર્મમાં હરી શકે નહીં. માટે આત્માને બળવાન બનાવી મનને સમજાવીને પણ ધર્મની પ્રવૃત્તિમાં બળ કેળવીને મહત્ત્વા-આદર-શાન્તિ-ઉત્સાહથી કામ કરવું.

ચંડકૌશિકના ઉગ્ર કોષના સંસ્કાર પ્રતિબોધ પછી ક્ષમાની નિશ્ચલ પ્રવૃત્તિથી નાશ પામ્યા, મહાક્ષમાધારી બન્યો. ચંડડુદ્રાચાર્ય શિષ્યની ક્ષમાએ કેવળજ્ઞાન પછી પ્રતિબોધ પામી, તીવ્ર પશ્ચાત્તાપથી સંપૂર્ણ કોષરહિત સમતાબંદાર કેવળી બન્યા.

ચાર તપસ્વી કુરગણુ ઉપર તિરસ્કારવાળા અને તપના મદ્યુક્ત છતાં કુરગણુને કેવળજ્ઞાન થતા તિરસ્કાર અને મદને પશ્ચાત્પૂર્વક છોડીને કેવળી થયા.

આનાથી વિપરીત અનેક આરાધનામાં ચેઢલ આત્માઓ અશુભ કિયા-પ્રમાદને પરવશ પડીને ધર્મબ્રાષ્ટ થયા અને દુર્ગતિમાં રખડયા.

જ્યારે મનને મારીને પણ ધર્મકિયામાં પ્રવર્તનાર કાળકમે અંતરાયોને તોડીને ભાવધર્મને અને સદ્ગતિની પરંપરાને પામે છે. કદાચ ભાવધર્મ ન પામે તો પણ દેવગતિની ગ્રામિ સાહજિક રીતે થાય છે.

માટે અશુભ કિયાઓના જે કોઈ અનાદિકાલીન અભ્યાસ છે તે ઘટાડવા અશુભ કિયાઓ સંપૂર્ણ છોડવી જોઈએ. સંપૂર્ણ છોડવાની ન બને તો વચ્ચે વચ્ચે છોડતા રહેવું જોઈએ. આ માટે તો પર્વ તિથિઓની આરાધના સર્વજ્ઞ શાસનમાં છે. આ પર્વતિથિઓ આરાધવાથી અશુભ કિયાઓના પ્રણિધાન-રૂચિ-પક્ષપાત-આદર-ગૌરવ ઘટે, નાશ પામે, પશ્ચાત્તાપ ઊભા થાય અને અશુભ કિયા ઘટતી આવે, કાલાંતરે સંપૂર્ણ છૂટી જાય.

એજ રીતે શુભકિયાઓ પણ જો નિરંતર થાય તો ઉત્તમ છે, પણ જો નિરંતર ન થાય અથવા નિરંતર થાય તો પણ રોજ વિશિષ્ટ ન થાય ત્યારે વચ્ચે વચ્ચે પર્વ દિવસે તેં કરવાથી અને રોજ કરનારે પર્વના દિવસે વિશેષ કરવાથી તે શુભકિયાના સંસ્કારો હઠ થાય, એમાં ઉપાદેયતાનું પ્રણિપાન મજબૂત થાય. આત્મામાં સારા સંસ્કારો અને સાનુબંધતા ઉત્પત્ત થાય છે, અને કયોપશમની વૃદ્ધિ થાય છે. આ રીતે શુભકિયા અને શુભ ગુણોનો અભ્યાસ વધારવાથી અશુભ કિયા અને દોષોનો અભ્યાસ ઘટાડવાથી આત્મા આગળ વધે, ગુણોને યોગ્ય બને, પુણ્યવંત બને, પાપ પરિણામો ઘટે, પાપ પરિણામોથી રહિત બને, કયોપશમ શુભ અને સાનુબંધ થાય, ઔદ્યિક ભાવ પણ કયોપશમ યુક્ત થાય. તેથી ગુણોની અને સંદાચારની વૃદ્ધિ દ્વારા આત્મા ઉચ્ચ ઉચ્ચ સ્થાન, સુખ, સમૃદ્ધિ, ત્યાગ, તપ, સંયમ પામતો જ્ઞાન અને દર્શનને વિશેષ નિર્મલ અને વિકસિત બનાવતો શાશ્વત સ્થાનને પામે છે.

માટે આત્માએ શુભકિયાની પ્રવૃત્તિમાં-અભ્યાસમાં આદર કરવો એ મોક્ષનો સ્થાયી અને પ્રધાનમાર્ગ છે.



## “સ્વભાવલાભસંસ્કારકારણ જ્ઞાનમિષ્યતે”

**દ**િષ્પથમાં આવનારા પદાર્થ વિષે થતું જ્ઞાન વ્યક્તિબેદે બિત્ત બિત્ત હોય છે. તે વ્યક્તિના જ્ઞાન, અનુભવ, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ, મનની પ્રસન્તતા આદિ જેટલા વિકસિત હોય તેમ તેનું જ્ઞાન વધારે ને વધારે સચ્ચોટ બનતું જાય છે, જેમ કે બળીયા પાસેથી પસાર થનાર દરેક વ્યક્તિ ફૂલને જુઓ છે, પણ દરેકનું જ્ઞાન એક સરખું હોતું નથી. કોઈકને ફક્ત ફૂલ દેખાય, કોઈકને ગુલાબ દેખાય, કોઈકને ઉત્તમ દેખાય, કોઈકને તેના વિશિષ્ટ ગુણોનું પણ જ્ઞાન થાય. એ જ રીતે સંસારના દરેક પદાર્થના જ્ઞાન વિષે સમજવું. આધ્યાત્મિક જ્ઞાનના પણ આ રીતે વ્યક્તિબેદે ભેદ પડે છે, જેનું નિરૂપણ ખોડશક, બત્તીશી, અષ્ટક આદિ અનેક ગ્રન્થોમાં થયેલ છે. આ નિરૂપણ આપણા આત્માની અવસ્થા અને પ્રગતિ જ્ઞાનવા માટે અત્યંત ઉપકારી હોવાથી આપણો તેનો વિચાર કરીએ.

### વિષય પ્રતિભાસ જ્ઞાન

- ૧) સારા વિષયોની મહત્તમા,
- ૨) અશુભની જુગુખસા,
- ૩) સારા વિષયોથી પોતાની મહત્તમા,
- ૪) અશુભની જુગુખસાથી પોતાની દીનતા,
- ૫) સારા વિષયોના અભાવમાં દીનતા,
- ૬) અશુભની જુગુખસાના અભાવમાં પ્રસન્તતા.

ભવાભિનંદ તેમજ અપુનર્બન્ધકની નીચેની અવસ્થામાં પ્રણિપાનરૂપે આ જ્ઞાન પ્રુવ-કાયમી હોય છે.

આ લોકોના બધા જ વિચાર-વાણી અને વર્તનમાં વિષયો-આંબર-મોભો-પરિવાર-દેહ-ભૌતિક સુખ એ જ લક્ષ્યબિન્દુ બન્યા હોય છે, એના કારણો પ્રત્યે આદર-પ્રવર્તન-હોશિયારીની ઈચ્છા હોય છે.

ભાસનો અર્થ જ્ઞાન થાય, પણ અહીં ઉપલક જ્ઞાન-અસ્પષ્ટ જ્ઞાન એવો અર્થ થાય છે. ‘પ્રતિ’ શબ્દનો અર્થ દરેક-સર્વ રીતે-સર્વ પ્રકારે-સર્વ પ્રયોજનમાં ગુણરૂપે જ્ઞાન થવું તે. વિષયોનું ગુણરૂપે ઉપાદેયરૂપે સર્વત્ર જે જ્ઞાન તે વિષય પ્રતિભાસ.

આમાં વિષયોના નુકસાનનું-દુર્ગતિનું-દુઃખનું જ્ઞાન નથી. માટે પણ પ્રતિભાસ કહ્યું છે. અપુનર્બન્ધક અવસ્થા ન આવે ત્યાં સુધી આ જ્ઞાન લબ્ધિરૂપે પ્રુવ છે

અને ઉપયોગરૂપે જ્યારે જે શાન પ્રવર્ત્ત તેમાં તે આંશિક વક્ત હોય છે.

'પ્રતિ'નો અર્થ વિપરીત પણ થાય છે. પ્રતિપક્ષ વિષયોનું વિપરીત જ્ઞાન. હેય હોવા છતાં ઉપાદેય માને; દુઃખનું કારણ હોવા છતાં સુખનું કારણ લાગે.

ઉપાધિના બદલે ગૌરવ-આલંબન-શોભા-આંદુરરૂપ લાગે-અનાદિકાલીન સંસ્કારો અને મોહનીયના ઉદ્ય સહિત અજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જીવની આ દર્શા થાય છે.

અપુનર્બન્ધકથી નીચે-અનાભિગ્રહિક મિથ્યાત્વ નથી, અભિનિવેશ મિથ્યાત્વ પણ નથી, સાંશયિક પણ નથી. બે મિથ્યાત્વ છે - અનાભોગિક અને આભિગ્રહિક. તેથી અસમજણ કે મનરહિત અવસ્થામાં અનાભોગિક મિથ્યાત્વ હોય છે, અને ઉપયોગ અવસ્થામાં, જ્ઞાનવાળી અવસ્થામાં સંજીવિમાં આભિગ્રહિક મિથ્યાત્વ હોયછે.

આ આભિગ્રહિક મિથ્યાત્વ એટલે વિષયોમાં ગુણકારિતાનો આગ્રહ. આ આગ્રહથી વિષય પ્રતિભાસજ્ઞાન મિથ્યાત્વીનું જ હોય છે. આ મુખ્ય રીતે અપુનર્બન્ધક સુધી હોય, પછી ઘટતું જાય.

સમકિતીને અનાભોગ=અનુપ્યુક્ત દર્શામાં વૈષ્ણવિકજ્ઞાન અને પ્રવૃત્તિ હોવા છતાં વિષયપ્રતિભાસ જ્ઞાન ન કહેવાય કારણ કે ક્ષયોપશમથી આત્મપરિણાત્મત નામનું બીજું જ્ઞાન હોય છે.

અને 'પ્રતિ' શબ્દ સમકિતીને ઘટતો નથી, વિષય આભાસરૂપ જ્ઞાન હોય છે- સર્વ રીતે જ્ઞાન નથી હોતું.

આ જ્ઞાનના કારણે જીવને પુણ્યાનુબંધ થતો નથી. પુણ્ય કે પાપના કાર્યોમાં ઉપયુક્ત અવસ્થામાં પરિણામની તીવ્રતા-મંદતાનુસાર પાપાનુબંધ થાય. અનુપ્યુક્ત અવસ્થામાં નિરનુબંધ કે આંશિક પાપાનુબંધ થાય. આના કારણે જ દ્વય સંયમ કે સાધના ઉંચી હોય તો પણ તે મોક્ષના અંગભૂત થતી નથી.

વિષયોના કારણે કપાયો છે અને કપાયોના પોપક નોકપાયો છે. તેથી વિષયપ્રતિભાસ કપાયપ્રતિભાસ અને નોકપાયપ્રતિભાસ પણ લઈ લેવાના. છતાં ત્રણોમાં મુખ્ય વિષય હોવાથી તેનું નામ વિષયપ્રતિભાસ છે.

સમકિતીને કપાય, નોકપાય અને વિષયો ત્રણો હોવા છતાં મોહનીયકર્મનો ક્ષયોપશમ અમુક અંશે હોવાથી તેનું જ્ઞાન વિષયપ્રતિભાસરૂપ નથી. આત્મપરિણાત્મતરૂપ છે. અનાભોગ અવસ્થામાં કપાય આદિના ઉપયોગો પણ

વિષ્યપ્રતિભાસ જેવા દેખાય છે, સમકિતીને મિથ્યાત્વનો-અજ્ઞાનનો નાશ અને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, દર્શનમોહનીયનો ક્ષયોપશમ અને ક્ષયાય નોક્ષયાય રૂપ ચારિત્રનો પણ અમૃક જાતનો ક્ષયોપશમ થવાથી લબ્ધિરૂપે તેમજ ઉપયોગરૂપે આત્મપરિણાતિમત્ત જ્ઞાન હોય છે અને અનાભોગ કાળે આ પાપરૂપ વિષ્યપ્રતિભાસ છે. પણ તે પાપાનુંખકારક નથી, કેમ કે ક્ષયોપશમ કાળમાં ઉદ્યોગીતા પકડી શકતા નથી. જાગૃત માણસ વધારે ગાંધેલ બની શકતો નથી.

રૂથ-પમે ગુણસ્થાનકે વિષ્યપ્રતિભાસની (શરૂઆતમાં બતાવેલી) છાંબે બાબતમાં ફેરફાર થાય છે.

અપુનર્બન્ધક અવસ્થામાં આ વિષ્યપ્રતિભાસપણું કર્મના ક્ષયોપશમના કારણે ઘટતું જાય છે. તેથી છાંબે પ્રકારો મંદ થતા જાય છે, વિપરીત માન્યતા ઘટતી જાય છે, આંશિક આત્મપરિણાતિ પ્રગટતી જાય છે, વધતી જાય છે. તેથી પાપાનુંખ ઘટતા જાય છે. પુણ્યનો પાવર વધતો જાય છે અને અલ્ય પ્રમાણમાં પુણ્યાનુંખ શરૂ થાય છે.

આના કારણે અપુનર્બન્ધક અવસ્થાથી ચોથી દ્રષ્ટિમાં આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિની ઉપમાઓ માટે તૃષ્ણા (ધાસ)-ગોમય-કાટ અભિના પ્રકાશની ઉપમા આપી છે.

### જ્ઞાનનો બીજો ભેદ છે આત્મપરિણાતિમત્ત.

આત્મ એટલે વિષ્ય. તેનું હેય-ઉપાદેય સ્વરૂપ જેવું છે તે રૂપે જે જી છે તે જ્ઞાન. બીજો અર્થ છે: આત્મા એટલે શુદ્ધ આત્મા, સિદ્ધ સ્વભાવ, તેને પ્રામુખ્ય કરવામાં અનુકૂળરૂપે પરિણામ પામનાર-પરિણામેલું જ્ઞાન. આ જ્ઞાન જ્ઞાનાવરણના ક્ષયોપશમથી થાય છે, સાથે મિથ્યાત્વનો ક્ષયોપશમ, અનંતાનુંખંધીનો ક્ષયોપશમ અને બીજું પણ ચારિત્ર મોહનીયની મંદતા બળે છે. તેથી મિથ્યાત્વના ક્ષયોપશમથી વિષ્યપ્રતિભાસની એકાંત દ્રષ્ટિ બદલાઈને પ્રજ્ઞાપનીય ભાવયુક્ત અનેકાંત દ્રષ્ટિનો ક્ષયોપશમ થાય છે. અનંતાનુંખંધીના ક્ષયોપશમથી રાગ-દેખની મંદતા થાય છે તેથી જ્ઞાન આત્મપરિણાતિરૂપ બને છે.

આ જ્ઞાનમાં જેમ વિષ્યપ્રતિભાસ નથી હોતો તેમ તત્ત્વસંવેદન પણ નથી. માટે વચ્ચગાળાનું જ્ઞાન છે. આમાં તત્ત્વ સમજાય છે, પરંતુ અવિરતિના ઉદ્યથી, પ્રત્યાખ્યાનાવરણ-અપ્રત્યાખ્યાનાવરણ કુપાયના ઉદ્યથી સંવેદન થતું નથી. હેય

તરીકે જણાય છે, શ્રદ્ધા થાય છે, હેય તરીકેની છોડવાની રૂચિ થાય છે, છતાં હેય તરીકે અનુભવ નથી થતો; જેમ પાણી તરસ છીપાવનાર છે તેવો તરસ્યા માણસને બોધ-શ્રદ્ધા-રૂચિ હોય છે પરંતુ પાણી પીનારને જે સંવેદન બોધ થાય છે તે પાણી નહિ પીનારને હોતો નથી. તેમ આત્મપરિણાતિમત્ત જ્ઞાનવાળો વિષયોને ભુંડા જાણે છે ખરો પણ વિષયો ભુંડા અનુભવાતા નથી. તેથી કર્મના ઉદ્યથી આ અવસ્થામાં વિષયપ્રતિભાસ જ્ઞાન ન હોવા છતાં જીવ વિષયોમાં પ્રવર્તે છે, ખેંચાય છે. તત્ત્વ સંવેદનમાં આ ખેંચાજી નથી રહેતું.

આ જ્ઞાન ક્ષયોપશમદૃપે દરેક સમકિતીને હોય છે તેથી તે વારંવાર વૈરાગ્યવંત બને છે, તેનો ઉપયોગ આત્મસ્વરૂપમાં આવે છે, તેનો અનાભોગ કે આભોગજન્ય વિષયપ્રતિભાસ દઢ અને સ્થાપી નથી કારણ મૂળમાં આત્મપરિણાતપણું છે.

આ જ્ઞાન આવ્યા બાદ તત્ત્વસંવેદનને યોગ્ય બનાય છે. તત્ત્વમાં તત્ત્વપણાનું જ્ઞાન થાય - પછી તે અનુભવમાં આવે તે રાજમાર્ગ છે.

૪-૫ ગુણસ્થાને આ જ્ઞાન મુખ્યત્વા છે.

૩-૨-અને ૧લે અપુનર્બન્ધકમાં ગૌણવૃત્તિએ આ જ્ઞાન છે. એ પહેલા આ જ્ઞાન નથી.

ઉપર ૬-૭મે તત્ત્વસંવેદનજ્ઞાન મુખ્ય બને છે, અને જેને જેટલા જેટલા અંશમાં તત્ત્વસંવેદન ન હોય તેને તેટલા તેટલા અંશમાં આ જ્ઞાન હોય છે. છતાં ૭હે-સાતમે આની ગૌણતા સમજાય છે.

અથવા વચન અનુભાવ સુધી આત્મપરિણાતિમત્ત જ્ઞાન અને અસંગ અનુભાવમાં તત્ત્વસંવેદન જ્ઞાન હોવાનું જણાય છે.

આભોગજન્ય રાગાદિનો અભાવ હોવાથી આઠમેથી તત્ત્વસંવેદન હોય. મોહનીય અભાવજન્ય તત્ત્વસંવેદન ૧૧મેથી અને અજ્ઞાનના નાશજન્ય તત્ત્વસંવેદન ૧૩મેથી હોય.

આત્મપરિણાતિમત્ત જ્ઞાનવાળો વિષયોમાં કરતો નથી, તેથી તે તત્ત્વ ગવેષણપુક્ત બને છે. વ્યવહારથી વિષયો, વિષયોના સાધનો, વિષયોને અનુકૂળ પ્રવૃત્તિ વગેરેથી જેમ અપાયર્દ્શન કરતો પાછો કરે છે, વિષયો ને તેનું ખેંચાજી ઘટાડતો જાય છે તેમ તેના ત્યાગમાં, તપમાં, સંતોષમાં, પ્રભુના માર્ગમાં એ ગુણ જોતો થાય છે, આનંદ પામતો થાય છે, તે તરફની રૂચિ તીવ્ર બને છે. આંશિક

પ્રવૃત્તિ અને આંશિક તત્ત્વ સંવેદક બને છે, જેમ સામાયિક કરનારને સાધુપણાનું આંશિક સંવેદન આવે છે. ઉપધાન કે છ'રી પાલીત સંધમાં વ્યવસ્થિત આરાધના કરનારને પણ આંશિક સંવેદન આવે છે. આ સંવેદન આત્મપરિણાત્મિક પછી આવે છે, માટે આત્મપરિણાત્મણું તે તત્ત્વ સંવેદનનું બીજું છે. આજ વાતથી સમકાળીત વિરતિને ખેંચીને લાવે છે તે સાબિત થાય છે.

જેમ ભવાત્મિનંદી કે અચરમાર્વત્તમાં રહેલા જીવની વિષયોને કેન્દ્રમાં રાખીને બધી વિચાર વાણી વર્તનની પ્રવૃત્તિ હોય છે તેને બાધક કે ભૌતિક રીતે વિશેષ નુકશાનકારી પ્રવૃત્તિ અટકી જાય, ન થાય.

તેવી રીતે આત્મપરિણાત્મણમાં આત્માને કેન્દ્રમાં રાખીને બધી અધ્યાત્મિક કે ભૌતિક પ્રવૃત્તિઓ વાણી વિચાર પ્રવર્તે, તેથી સાંસારિક ભૌતિક વર્તનોમાં પણ અધ્યાત્મિક સાધકતા ન હોવા છતાં આત્મજ્ઞાન સામેલ હોવાથી તેને વિશેષ બાધ કરનાર થતા નથી. તેથી આત્મપરિણાત્મણાને ઘણી પાપ મુકૃતિના બંધ અટકી જાય છે, તેને દેવ મનુષ્ય ગતિ જ ખુલ્લી રહે છે. આ બધાનું કારણ આત્માએ સિદ્ધ આત્માને કેન્દ્રમાં રાખેલ છે તેથી સંસારની પ્રવૃત્તિઓ પણ લાંબી ટકતી નથી.

આત્મપરિણાત્મણ જો વિષય વ્યાખોહીત બને, આત્મપરિણાત્મણ એટલે કે તત્ત્વવિચારણા છોડી દે, સમ્યકૃત્વના આધ્યાત્મિક ગૌણ કરે તો આત્મપરિણાત્મણ જતું રહે અને વિષયપ્રતિભાસ ઊભો થાય. સાકર ચાખેલી હોવા છતાં જ્યારે તીજું ખાધું છે તે વખતે સાકરનું જ્ઞાન આત્મપરિણાત્મણ છે અને સાકર ખાતી વખતે સંવેદનજ્ઞાન છે. તે રીતે સંસાર ખરાબ-સુખ ખરાબ વગેરે માન્યતા વિષયપ્રતિભાસવાળાને નથી હોતી. આ માન્યતા આત્મપરિણાત્મણ અર્થાત् ૪-૫ ગુણર્થાનકવાળા સમકિતીને હોવા છતાં કાયમ સંસાર ખરાબ અનુભવાતો નથી. સુખ ખરાબ અનુભવાતું નથી. તે આગળને ગુણાંગે તત્ત્વસંવેદનમાં અનુભવાશે. “વિષયો બૂંડા” આ માન્યતા પ્રતિભાસ તરફ જતા અટકાવે છે, અને તત્ત્વસંવેદન તરફ લઈ જાય છે.

આ જ્ઞાનથી સાહજિક રીતે હોય, ઉપાદેયતા સમજાતી આવે છે. સાહજિક તત્ત્વરૂપિ-કિયારૂપિ-માર્ગરૂપિ વગેરે પ્રગટે છે. વિષયપ્રતિભાસમાં કિયા વગેરે ઉપર અરૂપિ હોય છે.

વિષયપ્રતિભાસ જ્ઞાનના અપુનર્બન્ધકની ઉત્તરાવસ્થામાં ઘટતા એવા અનેક

બેદો છે. અપુનર્બન્ધક અવસ્થાની પહેલા તરતમભાવે અનેક બેદો હોવા છતાં સ્થૂલદિશાએ એક બેદ જાણવો.

આત્મપરિણાતિમત્ત શાનના પણ ચડ-ઉત્તરરૂપે કયોપશમભાવરૂપે અનેક બેદો છે. આ આત્મપરિણાતિમત્ત શાન અને તેને યોગ્ય કયોપશમ તે સર્વ ગુણોનું મૂળ છે અને સર્વ દોષના સંપૂર્ણ ખાસનું કારણ છે.

તત્ત્વસંવેદન શાનના પણ તરતમ માત્રાએ અનેક બેદો છે. તેથી તત્ત્વસંવેદન વધતું જાય ત્યારે વૈરાગ્યની વૃદ્ધિ થતા વીતરાગતા આવે.

સારું ખાવું-પીવું, મોજમજા, આનંદમંગળ કરવા, મનફાવે તેમ વર્તવું, વિષયોની મસ્તિ, કખાય-નોકખાયની પ્રબળતા, શક્તિમાં ગર્વ, શક્તિની હાનિમાં હીનતા, આ બધી સંસારરસિક જીવોની જે પ્રવૃત્તિ તે વિષયપ્રતિભાસ શાન, અજ્ઞાન, વિપરીત શાનને ટકાવી રાખે છે તેને ઘટાડવા માટે :-

- ★ જીવન નિર્વાહના સાધનમાં પણ વિષયોની અપ્રધાનતા,
- ★ ઉચ્ચા સાધનનો અસંગ્રહ-અનુપયોગ,
- ★ વિષયોની ભયંકરતાના દ્રષ્ટાંતો-શાલ્વવચનથી પરિણામ વિચારવા,
- ★ બાર ભાવના ભાવવી, પાપ પ્રવૃત્તિ ઘટાડવી,
- ★ વ્યવહારથી પણ આચારશુદ્ધિ પાળવી.

આત્મપરિણાતિમત્ત શાન પણ આ જ ઉપાયોથી વધતું આવે, નિર્મળ બને અને વિપરીત ઉપાયોથી નાશ પામે.

તેથી સદ્ આચાર એ આત્મશુદ્ધિ અને શાનનિર્મળતાનો ઉપાય છે, અને અસદ્ આચાર એ આત્માની મહિનતા અને અસદ્ શાનનો માર્ગ છે.

આ શાન કયોપશમથી થાય છે. ઉપયોગથી એ વૈરાગ્ય અને આત્મભાવનાથી પુત્તા હોય છે. ક્યારેક અભ્યાસ અવસ્થામાં આંશિક તત્ત્વ સંવેદન હોય છે. અને પૂર્વ અભ્યાસના કારણે વિષયપ્રતિભાસનો પણ આંશિક ઉપયોગ આવે.

### તત્ત્વસંવેદન શાન

આમાં શાન અને આચારનો સુમેળ હોય છે. આમાં શાન અને ભાવનાનો પણ ઘણો ગાઢ મેળ છે. તેથી જેવું શાન તેવી પરિણાતિનો અનુભવ આ શાનમાં થાય. આની પ્રારંભિક અવસ્થામાં હેયતતત્ત્વના સંવેદન અને ત્યાગ બને સાથે હોય છે, આ ઉત્સર્ગ માર્ગ છે અને અપવાદિક રીતે જેટલા અંશમાં ભાવ્ય

ત्याग ન હોય ત્યાં પણ આંતરિક પતના, હેય પ્રત્યે તિરસ્કાર, બિનજરૂરીનો અનુપયોગ, તેમાં ઉદાસીનતા વગેરે દ્વારા તત્ત્વસંવેદન ટકે છે, ક્યારેક આત્માની યોંંયતા અનુસાર વિકસિત પણ થાય છે. પણ સામાન્યથી અપવાદ કરે સાવધાની ન હોય તો તત્ત્વસંવેદન જાંખું થાય છે. એ જ રીતે ઉપાદેય તત્ત્વમાં=સન્માર્ગના આચારોમાં ભાવથી પ્રવર્તે છે આ પણ તત્ત્વસંવેદન છે. આ તત્ત્વસંવેદનમાં આંશિક રીતે આત્માનું અને સાધનરૂપે ભાવ્ય હેય ઉપાદેય તત્ત્વનું તે તે રૂપે સંવેદન થાય છે, પરંતુ જેમ જેમ ચારિત્ર પરિણામ સ્થિર થાય છે, વૃદ્ધિ પામે છે તેમ આ સંવેદન છઢી દસ્તિમાં હેયના શક્ય ત્યાગ સહિત હેયથી ભયરહિત બને છે. જેમ નિર્બળ માણસથી બળવાનને ભય નથી તેમ સમજણાની-શ્રદ્ધાની-આત્મપરિણાતિની તીપ્રતાથી આત્મા બળવાન બળવાથી જો કે હેયમાં પ્રવર્તતો તો નથી. ઉપરાંત સ્વાભાવિક રીતે પણ તેને હેયને જોઈને ભય કે કંપારી પણ થતી નથી કારણ મોર સાપને જોઈને, ગભરાતો નથી તેવી આ તત્ત્વસંવેદનની સ્થિતિ છે. તે પછી આગળની સ્થિતિમાં ઉપાદેયમાં સાહજિક પ્રવૃત્તિ અને નિરતિચારપણું હોય છે. ત્યાં અતિચાર વર્જવાનો વિચાર પણ કરવાનો હોતો નથી. મન સદા સ્વભાવથી તત્ત્વરૂપ હોય છે. તે પછી ઉપર ઉપેક્ષા, માધ્યસ્થ્ય અને ઉદાસીન દશારૂપ તત્ત્વ ભાવ પ્રગટ થાય છે તે રૂપે તત્ત્વસંવેદન હોય છે. માટે ભૂમિકા ભેદથી તત્ત્વની ભિત્તતા છે પરંતુ તે તત્ત્વ જ્યાં જે દેખાય છે તે રૂપે સંવેદન થાય છે.

સાધ્ય તત્ત્વ સિદ્ધ સ્વરૂપ અને સાધન તત્ત્વ જ્ઞાન-દર્શન-ચારિત્રના પંચાચાર અને તેની પરિણાતિ-ભાવનાઓની પરિણાતિ-આ બધું તત્ત્વસંવેદન આચારોથી, શાલ અધ્યયન અને ગુરુકુળવાસથી થાય છે. માટે આચાર-શાલ અધ્યયન-ભાવન અને ગુરુકુળવાસ તે તત્ત્વસંવેદનના પ્રધાન અસાધારણ ઉપાય છે, અને પરાકાશમાં ઉપેક્ષા, ઉદાસીનતા, માધ્યસ્થ્ય અને શુદ્ધ આત્મ તત્ત્વનું સંવેદન તે વીતરાળીને છે, અપ્રમત્ત પ્રાયને તે વ્યવહારથી છે.

તત્ત્વસંવેદનમાં સર્વત્ર તત્ત્વદ્રષ્ટિ, એમાં પણ સિદ્ધસ્વભાવપણું પરમતત્ત્વ છે તેનું સંવેદન તે પૂર્ણ તત્ત્વસંવેદન અને તે ગ્રામ ન થાય ત્યાં સુધી જીવોના વિપ્યમાં મૈત્રી, પ્રમોદ, કાળજી અને કવચિત્ ભાવ્ય વ્યવહાર પૂરતું માધ્યસ્થ્ય એ અપૂર્ણ તત્ત્વસંવેદન છે.

આ તત્ત્વસંવેદન ચોથે ગુણસ્થાનકે આંશિક હોય છે, પણ આત્મપરિણાતિ સાથે શાખબોધ, ભાવના અને આચારનો સહયોગ બળે તેમ તે તત્ત્વસંવેદન વધતું જાય. નિર્મણ પાણી અસ્થિર હોય તો પણ પ્રતિબિંબ ન પડે. મેલું પાણી સ્થિર હોય તો થોડું પ્રતિબિંબ પડે, બરાબર નિર્મણ ન પડે.

૬-જે ગુણસ્થાનકે પરિણાતિ વધતા વધતા સંવેદન ઉભું થાય છે, કષપક શ્રેષ્ઠી વગર આ તત્ત્વસંવેદન જ્ઞાન આત્મપરિણાતિમત્ત જોડે વારાફરતું આવ જાવ કરે છે. કષપક શ્રેષ્ઠીથી તે સ્થિર બને છે.

એક અપેક્ષાએ વિચાર કરીએ તો જેમ કેવળીને જ્ઞાનમાં સંવેદન નથી, સમભાવ છે. નારકના દુઃખનું વેદન નથી કરતા, દેવલોકના સુખનું વેદન નથી તેમ કષપક શ્રેષ્ઠીમાં પણ આવું વેદન નથી તેથી તત્ત્વસંવેદન એટલે તાત્ત્વિક-વાસ્તવિક-મૂળભૂત બોધ. જે અભ્રામક, સંશયાતીત, વિપર્યાસરહિત હોય છે. આત્મ-પરિણાતિમાં બોધ શાખાનુસારી હોય છે અને અનુભૂતિ આંશિકરૂપે હોય છે, આંશિક વિપરીત હોય છે. તત્ત્વસંવેદનમાં આ અનુભૂતિ વાસ્તવિકરૂપ હોય છે.



## ॥ ઉવસમસાર ખુ સામણં ॥

**જીમ દાદશાંગીના બીજભૂત ત્રિપદી છે તે જ રીતે અધ્યાત્મમાર્ગના બીજભૂત એક ત્રિપદી છે - 'ઉપશમ' 'વિવેક' 'સંવર'.**

વેરની આગમાં સણગતા ચિલાતીપુત્રે હાથમાં રક્તટપકતી તલવારનો બય બતાવી ચારણમુનિને ધર્મતત્વનું રહસ્ય પૂછ્યું - તેના જવાબમાં ઉપરોક્ત ત્રિપદી બતાવી, જેના પરના ચિંતને એક હત્યારાને નિકટ ભવમુક્તિગામી બનાવ્યો. આવી અદ્ભૂત ત્રિપદીને આપણા જીવનમાં આત્મસાતું કરીએ તો પણ અધ્યાત્મમાર્ગમાં આપણી પ્રગતિ દિનપ્રતિદિન સરળ બની રહે.

ઉપશમપણું ઓળખવા માટે આવેશ અને સ્વરૂપ બે ઓળખવા પડે છે. 'આવેશ' એટલે પરભાવને ધારણ કરવો, 'સ્વ'ભાવની પરભાવ દ્વારા થતી વિકૃતિ. આવેશને શાન્ત કરે અથવા આવેશની યોગ્યતા હોવા છતાં આવેશ ન આવવા દે તે 'ઉપશમ' કહેવાય. જીવ પુદ્ગલમાં પોતાનો ચેતનભાવ આપી શકતો નથી અને પુદ્ગલ પોતાનામાં ચેતનભાવને સ્વીકારતું નથી. માટે પુદ્ગલ પોતાના સ્વભાવથી વિકૃત થતું નથી-સદા સ્વભાવરૂપ રહે છે. માટે એમાં ઉપશમભાવ પણ નથી આવતો.

આવેશ આંશિક હોય અને આંશિક ન હોય તે ક્ષયોપશમ કહેવાય અથવા આંશિક ક્ષય-આંશિક ઉપશમ અથવા કંઈક સ્વભાવ અને કંઈક પરભાવ તે 'ક્ષયોપશમ' કહેવાય.

જેમાંથી પરભાવ સંપૂર્ણ પણે જતો રહે તેવા સ્વભાવને ક્ષાયિકભાવ કહેવાય, પરંતુ જે સ્વભાવ પરભાવથી વિકૃત થતો નથી તે સ્વભાવને પારિણામિક ભાવ કહેવાય છે. માટે પુદ્ગલમાં પારિણામિક ભાવ છે અને જીવમાં ક્ષાયિકભાવ છે, તે વસ્તવમાં પારિણામિક ભાવ છે.

જીવને જે કર્માનો ઉદ્ય રસરૂપે થાય છે તે જીવને વિકૃત કરે છે. તે પરભાવ જીવમાં પ્રતિબંધિત થાય છે, તેથી તેને ઔદ્યિકભાવ કહેવાય છે. આ જીવનું વિકૃત સ્વરૂપ છે. જીવનું મૂળ સ્વરૂપ વીતરાગતા સહિત અધિકૃત ચૈતન્ય છે. માટે રાગદ્રોષની વિકૃતતાયુક્ત ચૈતન્યપણું અને રાગદ્રોષરૂપે જે કર્મના ઉદ્યયુક્ત જીવની અવસ્થા તે મુખ્ય આવેશ છે. એટલે મોહનીયનો ઉદ્ય તે આવેશ

પ્રધાનતથા કહેવાય અને તેનો ઉપશમ કે ક્ષયોપશમ તે ઉપશમ કહેવાય.

આમાં સર્વાંગે ઉપશમ અવસ્થા ફક્ત મોહનીયની હોય છે, જ્યારે આંશિક ઉપશમ અવસ્થા ચાર ઘાતિકમણી હોય છે. ક્ષાય, નોક્ષાયના ક્ષયોપશમનુંપી ઉપશમથી વિવેકને ઉત્પત્ત કરનાર મિથ્યાત્વમોહનીયનો ઉપશમ છે.

પુદ્ગલમાં ઔદ્યિકભાવ મુખ્યત: ન હોવા છતાં, કર્મના ઉદ્યની મુખ્ય અસર જીવમાં થવા છતાં પોતાના જ સ્વરૂપ રૂપ વર્ણાદિ જીવમાં કર્માદય દ્વારા જીવશક્તિથી નિર્માણ થતા હોવાથી ઔપચારિક રીતે આંશિક ઔદ્યિકભાવ માન્યો છે.

એ રીતે કર્મના ઉદ્યનો ઉપશમ જીવની શક્તિથી થાય છે, પરંતુ ઉપશમ પુદ્ગલનો થાય છે. તે અપેક્ષાએ ઉપશમ પુદ્ગલનો કહેવાય અને ઉપશમ નિર્ધન ગુણ જીવનો કહેવાય; એમ બે બેદ પડે છે. એ રીતે ઉદ્ય એ પૌદ્ગલિકભાવ છે અને ઉદ્યનિર્ધન નરકગતિ વગેરે જીવભાવ છે. એ રીતે ક્ષયોપશમ એ પૌદ્ગલિક ભાવ છે અને ક્ષયનિર્ધન ગુણ એ જીવભાવ છે. ક્ષય એ પૌદ્ગલિક ભાવ છે અને ક્ષયનિર્ધન ગુણ એ જીવભાવ છે.

આ પરભાવરૂપ મોહનીયના દ્વારાસ્થી ઉપશમ દ્વારા વિવેક આવે છે. વિવેક એ વાસ્તવિક જ્ઞાન=ઉપશમપ્રધાન જ્ઞાન છે. તેનાથી ઉપશમ ભાવ વધે છે, ઉપશમથી વિવેક વધે છે, બસે આંતરિક મિથ્યાત્વના ઉદ્ય અને મિથ્યાત્વના આશ્રવને ઘટાડે છે, અટકાવે છે અને સંપૂર્ણ નાશ કરે છે. તે પછી ક્ષાય-નોક્ષાયના આશ્રવોનો ઘટાડો ચાલુ જ રહે છે અને તેથી અવિરતિરૂપ આશ્રવ કરે કરીને ઘટતા ઘટતા સંપૂર્ણ નાશ પામે છે. તે પછી પણ ક્ષાય-નોક્ષાયના આશ્રવો ઘટતા જ જાય છે, પ્રમાદ પણ ઉપશમ અને વિવેકના બળથી ક્ષાય નોક્ષાય ઘટવાથી ઘટે છે. ઉપશમ અને વિવેકના બળથી ક્ષાય નોક્ષાય સંપૂર્ણપણે શાન્ત થાય છે, અને કાળકરે નાશ પામે છે. જેમ જેમ અવિરતિ ઘટે કે નાશ પામે; જેમ જેમ ક્ષાય-નોક્ષાય ઘટે, શાન્ત થાય કે નાશ પામે, તેમ તેમ ઉપશમ અને વિવેક પણ પ્રભળ થાય છે. આમ બસેના બળથી દેશ સંવર વધતો જાય છે અને છેવટે સર્વ સંવર રૂપે બસે પરિણામે છે.

ઉપશમ એ વિવેકને જન્માવીને સંવરની પરાકાણા સુધી પહોંચાડે છે. તેથી ઉપશમ દ્વારા સમ્યગ્દર્શન; વિવેક દ્વારા સમ્યગ્જ્ઞાન અને બસે દ્વારા સમ્યક્ ચારિત્રરૂપ સંવર પામીને આત્મશુદ્ધિની પરાકાણા પમાય છે. દ્વય ઉપશમ, દ્વય

વિવેક અને દ્રવ્ય સંવર એ ત્રણે ભાવ ઉપશમ વગેરેને ઉત્પત્ત કરવામાં, વધારવામાં અને પરાકાણાએ પહોંચાડવામાં કારણ બને છે.

ભાવ ઉપશમ વગેરે ઓળખાતા નથી. માટે દ્રવ્ય ઉપશમ વગેરે અપનાવતા અપનાવતા ભાવની-પ્રાર્થિ થાય છે.

**ઉપશમના પ્રકાર :-** સામી વ્યક્તિ સ્વસ્થ, શાન્ત ન હોય ત્યારે સ્પષ્ટ ભૂલ બતાવવી, સ્પષ્ટ રીતે રોકવો, ટકોર કરવી કે કડક કહેવું તે એના કષાયોના ઉત્તેજન દ્વારા એના ઉપશમનો નાશ કરે છે. આવા અવસરે ન કહેતા સ્વસ્થ થયા પછી, થાક વગરની અવસ્થામાં, ખાઈ-ધીને ઠંડો થયો હોય ત્યારે આવેશના કારણો, નુકશાન તેમજ ક્ષમાના લાભ વગેરે બતાવવાપૂર્વક મીઠા શાંદોમાં જે ભૂલ બતાવાય તે દ્રવ્ય ઉપશમ છે. આ બીજા માટેની વાતમાં વિચારણા થઈ.

પોતાને પોતાની બિમારી, લાચારી, કે દરિદ્રતા વગેરે ગમે તે પરિસ્થિતિમાં ગમે તેવી ભાષામાં બીજા જે કાંઈ ટકોર કે સુચન કરે તે વખતે આપણું મન ધર્ષણું ઉકળાટ કરે અને વચનથી અસલ્ય વચનો બોલવા તત્પર બને તેવા અવસરે ભાવ વગર પણ આલોકના નુકશાનને લક્ષમાં રાખીને શાન્ત બેસે, આબરુના કારણે પણ મૌન રાખી સહન કરે, સત્ત્વહીનતાના કારણે સહન કરે.

પ્રેમ-વાત્સલ્યના કારણે પણ આવેશ દબાઈ જાય. વિશિષ્ટ ઘરાક વગેરેથી થતા લાભના પ્રલોભનથી પણ ગમ ખાઈને સહન કરી લે.

એ જ રીતે ઉપશમ ભાવનાથી ભાવિત બનતા બનતા જીવમાં એક દસ્તિ ઉભી થાય છે, જેના કારણે

a) પાપના ભયથી એ આવેશ ન કરતા શાન્ત બને. b) દુર્ગતિના ભયથી પણ શાન્ત બને. c) ગુણના નાશના ભયથી શાન્ત રહે. d) ગુણોના વિકાસ માટે સહન કરે. e) પુણ્ય માટે, સદગતિ માટે, સ્વભાવ માટે સહન કરે.

કેટલાકમાં દ્રવ્ય ઉપશમપણું હોય, કેટલાકમાં ભાવ ઉપશમપણું હોય.

પ્રતિકૂળ સંયોગોમાં સહન કરવું, પ્રસત્ત રહેવું એ જેમ ઉપશમ છે, એમ અનુકૂળતામાં લેવાઈ ન જવું, અનુકૂળતાને હુંક ન માનવી, એમાં પોતાનું પુણ્ય, ગૌરવ, મહાતા ન દેખાવી તે પણ ઉપશમ છે. જ્યારે અનુકૂળતાની ઈચ્છા કરવી, અનુકૂળતા ન મળો તો અકળાવું, પ્રતિકૂળ વર્તનાર સાથે જઘડવું તે અનુપશમ છે. માન-અપમાનમાં પણ ઉપશાંત બનવું, માન ઈચ્છાવું નહિ, અપમાનમાં અકળાવું નહિ.

જ્યારે કોઈના સ્વમાનનો બંગ કરવો તે અનુપશાંતપણું છે, માન અને કોષનો પ્રકાર છે. બીજાને માન આપવું તે પણ જતના અપમાનનો ઉપશમભાવ છે. એ જ રીતે બીજા ગુસ્સે થાય તેમ બોલવું, વર્તવું, અને વિચારવું તે પોતાના કોષનો અનુપશમભાવ છે. એમ બીજાને સાનુકૂળ વર્તવું, યોગ્ય મીઠારાસ્નેહ, વાતસલ્ય વગેરે યુક્ત બની બીજા જોડનો વ્યવહાર, વર્તન, વાણી, વિચાર ગોઠવવા તે પોતાના કોષ કપાયના ઉપશમનું સ્વરૂપ છે.

આ જ રીતે માયા, લોબ, હાસ્યાદિ અને કામ વગેરેના ઉપશમ ભાવ રીતે કરવા અને આભ્યંતર રીતે પણ મનને ભાવનાઓથી કેળવતા જવું.

મોહનીયના ભાવ ઉપશમથી આંતરિક મોહનીય વિશેષ તીવ્ર બનતા નથી. તેથી પૃથ્વેબંધ, શાતા, સમૃદ્ધિ અને દેવ-મનુષ્ય ભવરૂપ સદ્ગતિઓ મળે છે અને આંતર ઉપશમ એ ધર્મ છે અને એ વધતા વધતા ક્ષાયિક ઉપશમને પ્રાપ્ત કરાવે છે.

સ્રીંગ દાબી રાખવાથી વધારે ઉછળે છે તેવા દ્રાષ્ટાંત આપીને ભાવ ઉપશમ અને એના કારણોની પ્રવૃત્તિને વખોડવી તે વ્યાજભી અને વાસ્તવિક નથી. દાબેલી સ્રીંગ ઉછળે તો પણ તે સ્વાભાવિકપણે જેટલી પહોળી હોય છે તેથી વધારે પહોળી થતી નથી. પરંતુ સ્રીંગને ખેંચીને પહોળી કરવામાં આવે તો તે સ્વાભાવિક કરતા વધારે પહોળી થાય છે. તેવી જ રીતે કપાયો-વિષયોને દબાવનાર ક્યારેક સત્ત્વહીનતા વગેરેના કારણે કપાય પરવશ કે વિષય પરવશ બને તો પણ તે લંપટ અને નિરંકૃત જેવા નથી બનતા, અમુક મર્યાદામાં પ્રવર્તે છે. જ્યારે જેઓ અંકુશને ઈચ્છતા જ નથી તેઓ ભાવથી સામગ્રી અનુસાર પહોળા થાય છે પરંતુ આંતરિક રીતે એમની તૃષ્ણા, આશંકા અપરિમિત બની જાય છે. માટે પ્રભુશાસન જ્યાાવે છે કે મનને કેળવવાનું પછી રાખો-પહેલા ભાવ ત્યાગથી મારણ કરો, પછી શાલુ અભ્યાસ અને ભાવનાથી મનનું વારણ કરો. પછી આત્મભાવમાં મનને ધારણ કરો, જેથી સ્વાભાવિકપણે મન વિષયકપાયરહિત બને. માટે શમ એટલે

i) મોહનીયની બધી પ્રકૃતિઓના ઉતેજક નિમિત્તોથી દૂર રહેવું. તેના માટે મોટા નિમિત્તોથી દૂર રહેવું અને નાના નિમિત્તોથી સાવધ રહેવું.

ii) શાલ અધ્યયન દ્વારા એટલે કે ઉપમિતિભવપ્રપંચા કથા જેવા શાલો કે જેમાં મોહનીયની બધી પ્રકૃતિઓના નાના મોટા બધા જ રૂપકો બતાવેલ છે તેનું એક ઉપયોગી શાલરૂપે અધ્યયન કરવું અને તેની વારંવાર વિચારણાથી આત્માને ભાવિત બનાવવો. સાથે વિષયો-કપાયોથી મનને પાછું વાળતા રહેવું.

જેનાથી મન સદ્ગ સ્વસ્થ અને પ્રસન્ન રહેતા રહેતા સ્વાભાવિક શાંત બનાયા.

માટે ગ્રારંભમાં અભિયોગ (જબરજસ્તી) દ્વારા, પછી સમજાવટ દ્વારા, પછી ઉલ્લાસ દ્વારા ઉપશમનો ગુણ કેળવતા જઈએ તો છેલ્લે તે સ્વાભાવગત ચાય છે. માટે કોઈપણ સંન્માર્ગકારક-પ્રેરક સંસ્થાના નેતા કે સંચાલકો અભિયોજક (કડક-દબાણપૂર્વક પણ શિસ્તપાલન કરનાર) હોવા જોઈએ અને સમજાવટપૂર્વક કામ લેનારા પણ હોવા જોઈએ. જે સમજાવટ ન કરી શકે તે (લોકપ્રિય) નેતા ન બની શકે. જે જાણકાર હોય અને સમજાવટ કરી શકે તેવા નેતા બની શકે, જો સાથે સાથે અભિયોગ કરનાર હોય. કેવળજ્ઞાની ભગવંતો જાણકાર છે, સમજાવનાર છે, પણ અભિયોગ કરનાર નથી, માટે તેઓ નેતા નથી બનતા. માટે નેતા એટલે બધાને બધા કાર્યમાં સંયોગ, યોગ્યતાનુસાર અભિયોગ કરીને પણ જોડનાર હોય. તેઓનું પણ અપૂર્વ પુણ્ય હોય છે.

આવી જ રીતે આત્મા આત્માને પ્રથમ શમ વગેરેમાં પરાણે, બલાત્કારે જોડે, પછી શાખો દ્વારા, ભાવના દ્વારા સમજાવે. ટુંકમાં દરેક ધર્મ, ગુણ કે શુભકાર્ય સ્વમાં કે પરમાં પ્રથમ અભિયોજન-દબાણદ્વારા, પછી શાખજ્ઞાન દ્વારા, પછી ભાવના દ્વારા ઉત્પત્ત ચાય છે. વિવેકને ઉત્પત્ત કરનાર આ અભિયોગ અને શાખ-અધ્યયનપૂર્વકની ભાવના છે.

અભિયોગ વગરનો એટલે કે નિરંકુશ એવો શાખ બનેલો ભાવનાદીન અને વિવેકદીન હોય છે. અભિયોગને સ્વીકારનાર એટલે અંકુશમાં રહેનાર શાખ ન પણ ભણોલ હોય તો પણ કથંચિત્ ભાવનાયુક્ત બનેલો હોવાથી વિવેકસંપત્ત બને છે.

માટે સમજાણ હોવા છતાં પણ જાનને પ્રવૃત્તિમાં ન આવવા હેનાર અસ્તુ પ્રવૃત્તિ અને અસ્તુ રૂચિમાં ઝેંચી જનાર અનાભિયોગ-નિરંકુશ વૃત્તિ, સુખશીલતા, સ્વેચ્છાચારીપણું છે. તે અભિયોગને સ્વીકારતું નથી. તેથી શમ અને વિવેક પૂર્વના ઉત્પત્ત થયેલ પરિણામે પણ નાશ પામે છે. માટે શાખમાં કહું છે કે પરતંત્રતા વગરની સારી પણ વૃત્તિ પરિણામે હાનિકારક છે. વિવેક અને શમનું મૂળ પરતંત્રતા-અભિયોગ-નિયમનો-શાસન-નિયંત્રણા-વ્યવહારબદ્ધતા છે, માટે પ્રભુ શાસન સ્થાપે છે, વ્યવહારબદ્ધ કરે છે. સામાચારીઓ ગણાદેવો પ્રવર્તાવે છે. તે પાળનાર શાસનને આગળ ચલાવે છે. માટે નિયંત્રણા અપનાવવી તે શમ અને વિવેકનો ઉપાય છે.

## અવરાહેસુ ગુણેસુ ય નિમિત્તમિત્ત પરો હોડ ।

**નુ**કશાન અને લાભમાં, ગુણ અને દોષમાં, બીજી વ્યક્તિ નિમિત્તમાત્ર હોય છે.

જીવની કર્મપરવર્તનાના કારણો સુખ, દુઃખ, અનુકૂળતા, પ્રતિકૂળતા સર્જીય છે. આ કર્મના ઉદ્યો પણ સુખ-દુઃખના, માત્ર વ્યવહારિક કારણો છે. પરંતુ એનાથી પણ આગળ દ્રષ્ટિ કરીએ તો એ કર્મને ઉપાર્જન કરનાર જીવની પોતાની પ્રવૃત્તિ અને અધ્યવસાય એ મુખ્ય કારણ છે. કર્મના ઉદ્યમાં દવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના નિમિત્તો કારણ બને છે અને તે જ રીતે કર્મના કાયોપશમમાં પણ તેઓ કારણ બને છે.

માણસ દારુ પીએ તો જ્ઞાનશક્તિ આવરાય છે, તેથી જ્ઞાનશક્તિ આવરવામાં દારુ નિમિત્ત છે. એ જ રીતે બ્રાહ્મી એ જ્ઞાનશક્તિ વધારવામાં નિમિત્ત છે.

જગતમાં બે પ્રકારના દવ્ય છે - ભાવુક અને અભાવુક, અભાવુક દવ્યને બીજા દવ્યો કોઈ અસર કરતા નથી. જેવી રીતે વજરણ કોઈનાથી વાસિત થતું નથી - વાસિત થવાની દ્રષ્ટિએ એ અભાવુક છે, તેમ કેવળજ્ઞાની એ અભાવુક છે, તેમને રાગદેખના નિમિત્તો કોઈ અસર કરતા નથી.

નિમિત્ત ભાવુક દવ્યને અસર કરે છે. જીવમાં પ્રકૃષ્ટપણાને પામેલા સ્વાભાવિક ગુણો અભાવુક છે. તેમાં કોઈ વધ્યઘટ કે વિકૃતિ થતી નથી. પરંતુ જ્યાં સુધી તે સંપૂર્ણ પ્રગટ થયા નથી તેવી ઔદ્યિક અને કાયોપશમિક ભાવની અવસ્થાઓ કેટલીક ભાવુક છે અને કેટલીક અભાવુક છે.

જીવ અચરમાવર્તમાં ધર્મ માટે અભાવુક છે કેમકે ત્યાં કાળ પરિપાક થયો નથી, સહજમળનો ઝ્રાસ નથી, અમુક રીતે કર્મની મંદ્તાની કે કાયોપશમની યોગ્યતા નથી. તેથી ધર્મ આત્માઓની વચ્ચે રહેવા છતાં મોહનીયની મંદ્તા કે કાયોપશમ થતા નથી, ગુણો પ્રગટ થતા નથી.

એવી જ રીતે ધર્મ અને પુણ્યની સાનુબંધ અવસ્થામાં, અપ્રતિપાતી અવસ્થામાં જીવ આવે ત્યારે પાપ માટે, અધર્મ માટે, મિથ્યાત્વ માટે, અભાવુક બને છે. તેથી પાપી જીવો વચ્ચે પણ તે પોતાનો ધર્મ ટકાવી રાખે છે. અને એ પાપી જીવોના સહવાસની અસર થતી નથી.

અચરમાવર્તમાં પણ અમુક રીતે કર્મના ઉદ્ય માટે આત્મા ભાવુક છે, અમુક રીતે કર્મની મંદ્તા પણ ભાવુક છે તેથી કર્મના ઉદ્યો નિમિત્તોથી વધે છે, નિમિત્તોથી ખસે છે. તેથી યુગલિક કાળમાં જીવ મંદ કષાયી થાય છે, સિંહ-વાઘના જવોમાં કષાયી થાય છે. સાધુના સાનિધ્યમાં અભવ્યને સાધના કાળમાં રાગાદિ ઉપલક દ્રષ્ટિએ મંદ થાય છે, અને માખીની પાંખ જેવું નિર્મળ ચારિત્ર પાલન થાય છે અને નવમા ગ્રેવેયક જેવા યોગ્ય અધ્યવસાયો આવે છે. આ બધા નિમિત્તોથી થતા કર્મના ફેરફાર છે.

આ વાત અશુભ નિમિત્તોને શક્યતયા ટાળવા માટે અને શુભ નિમિત્તોને શક્યતયા ગ્રહણ કરવા માટે છે. પરંતુ અશક્ય પરિહાર જેવા સ્થળમાં નિમિત્તોથી આત્મા ઉપર થતા ગુણ-દોપને અટકાવવા માટે, આત્મસત્ત્વ પ્રગટ કરવા માટે અને નિમિત્તોને દોષ ન આપવા માટે આ ભાવના છે કે બીજો દોપમાં નિમિત માત્ર છે, અર્થાત् મારામાં જો દોપની યોગ્યતારૂપ કર્મ ન હોત તો બીજાથી દોષ ન થાત. માટે દોષ તો મારા કારણે જ છે. બ્યવહારમાં બીજા દારા નુકશાન થાય ત્યાં બીજો નિમિત માત્ર છે, આપણા અંતરાયકર્મ જ મુખ્ય છે, આ ભાવનાથી બીજા ઉપરનો દ્રેષ્ટ વિલીન થાય છે.

બીજા તો ગુણમાં નિમિત માત્ર છે, આમ કહીને પર ઉપકારની મહત્ત્વા ઘટાડી નાખીએ તે શી રીતે ચાલે ? આવો મશ્ર મનમાં ઉઠે, ત્યારે વિચારવાનું કે આપણે બીજાને સુધ્યારવા ઘણી મહેનત કરતા હોવા છતાં તે ન સુધરે ત્યારે આપણને એના ઉપર દ્રેષ્ટ ન થાય, માટે આપણે વિચારવાનું કે ગુણો પણ બીજામાં ઉત્પન્ત કરવામાં નિમિત માત્ર બની શકે છે, જ્યારે તેના આત્માની યોગ્યતા જ મુખ્ય છે. સામાની પરીક્ષા કરીને ગુણ આપવા પ્રવર્તણું, પાત્રાપાત્રની પરીક્ષા વગર ગુણ આપવાથી લાભના બદલે નુકશાન થવાની સંભાવના રહે છે. બીજું આપણી સામાન્ય મહેનતથી કે સાહજક સાનિધ્યથી એનામાં ગુણારોપ થયો અને એ આપણા ગુણ ગાય ત્યાં ગુણાની ઉત્પત્તિ આપણાથી નથી, પણ એની યોગ્યતાથી છે એ રીતે વિચારતા આપણા ગર્વનું પણ નિરાકરણ થાય છે.

બીજાથી થયેલ નુકશાનમાં તેના ઉપર દ્રેષ્ટ ન કરીએ તે માટે બીજો નિમિત માત્ર છે, એમ વિચારવું એ પોતાની સમાપ્તિનું કારણ છે.

એ રીતે બીજા આપણા માટે મહેનત ઘણી કરે, પણ આપણી જાગૃતિ અને પુરુષાર્થ ન હોય તો વિશેષ લાભ ન થાય, માટે બીજાના પ્રયત્નમાં ફળ આપણા પુરુષાર્થને આધિન છે એમ વિચારી જીવ પ્રયત્ન વધારે. માટે પણ ગુણમાં પણ

બીજ નિમિત માત્ર છે, તેમ વિચારવું કેરીમાં મીઠાશ ખેડુતના કારણે નથી, પણ પોતાના કારણે છે, તેમ વિચારી આંતરિક ગુણોના વિકાસમાં અને દોપના નાશમાં પણ પ્રયત્ન, યોગ્યતા વગેરેને પ્રધાનતા આપવી.

પરંતુ તે જ રીતે અશુભ નિમિતોથી આત્માના ગુણો નાશ પામે છે અને દોપો આવે છે, એ વાત પણ એટલી જ સત્ય અને સિદ્ધ છે. માટે અશુભ નિમિતોથી સદા દૂર રહેવું અને અશક્ય પરિહારમાં સાવધ રહેવું, એ જ રીતે શુભ નિમિતોથી દોપો નાશ પામે છે અથવા ઘટે છે અને ગુણો આવે છે. માટે શુભ નિમિતોને છુફનમાં અપનાવવા અને આ શુભનિમિતાના અશક્ય સંયોગમાં આત્માએ બળવાન બની ખરાબ નિમિતોની અસર ન લેવી અને એનાથી દોપ ઉત્પન ન થાય તેની કાળજી રાખવી.

આત્મા ગુણાનુરાગથી બીજાના ગુણો જોઈ આનંદ પામે તો પોતાના આત્માને ગુણને યોગ્ય બનાવે છે. અને ગુણની, ગુણોની નિંદા, જુગુપ્સા કે ઉપેક્ષા કરે તો આત્મા પોતે સ્વમાં ગુણની યોગ્યતા નાચ કરે છે, અંતરાય બાંધે છે; ગુણ હોય તો નાશ પામે છે અને નવા ગુણો જટ આવતા નથી.

આત્મા પોતે દોપ આચરે, દોપમાં રૂચિ ધરાવે તો જેમ આત્મામાં દોપની વૃદ્ધિ થાય છે, તેમ દોષિત ઉપર સ્નેહરાગની તીવ્રતાથી પણ દોપની વૃદ્ધિ થાય છે. દોપવાળાની નિંદા, તિરસ્કારથી પણ આત્મામાં દોપો આવે છે.

માટે સારા નિમિતો હોવા છતાં આત્માની રૂચિ, પ્રવૃત્તિ અને યોગ્યતા હોય તો જ લાભ થાય છે. ખરાબ નિમિતો હોવા છતાં સાવધાની, અરૂચિ અને નિવૃત્તિની ઈચ્છારૂપી યોગ્યતાથી આત્મા બચે છે.

માટે આ કથનથી સારા નિમિતમાં ન જવાનું વિધાન નથી, પરંતુ તે નિમિતમાં પણ આત્મવીર્ય, આત્મશક્તિ અને ઉપયોગ, લક્ષ અનુકૂળ બનાવવાના છે. એ જ રીતે ખોટા નિમિતોમાંથી નિવૃત થવું જ જોઈએ પરંતુ નિવૃત થઈને કે નિવૃત ન થવાય ત્યારે પણ આત્મબળથી, સાવધાનીથી એની અસર ન થવા દેવી.

મરીચિના ભવમાં ભગવાનનો જીવ ગરમીના તેમજ અસ્નાનના કારણે સંપર્મથી નીચે ઉત્થો, અને ત્રિંદી થયો; જ્યારે નનદનક્ષપિના ભવમાં ગરમી તો હતી જ, છતાં આત્મબળથી નિમિતને ગોણા કરી, ઉગ્ર સાધના કરી. એક ભવમાં આત્મશક્તિ ન કોરવવાથી નિમિત દોપનું કારણ બન્યું, બીજા ભવમાં આત્મશક્તિ કોરવવાથી દોપનું કારણ ન બન્યું.

પ્રભુના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સિંહને કાડી નાખ્યો, ત્યારે પ્રભુને શય્યાપાલક જેવા વિશેષ કર્મ ન બંધાણા, કારણ કે એના પ્રત્યે દ્વેષ વગેરે વિશેષ

ન હતા-પોતાનું કર્તવ્ય બજાવવા રૂપે કાર્ય થયું હતું, તેથી નિમિત વિશેષ દોષરૂપ ન થયું; જ્યારે શય્યાપાલકના કાનમાં સીસું રેડાવ્યું તેમાં સામાની ભૂલ કરતાં પોતાની આંશાની મહત્તમા અને માનકપાપની વિશેષતાના કારણે જે આદેશ થયો, તેમાં પોતે જ પોતાના દુઃખ, પાપકર્મમાં કારણ થયા. શય્યાપાલક નિમિત બન્યો, સિંહ નિમિત ન બન્યો.

મરીચિના ભવમાં ભરતની સ્પષ્ટતાપૂર્વકની પ્રશંસા પણ ગર્વનું કારણ બની, કારણ કે આત્માએ અને પ્રધાનતા આપી, જ્યારે ચરમ ભવમાં હન્દોની સ્તવના છતાં મહત્તમ નથી લાગતી, કારણ આત્મા માનરહિત થયો છે; તો દોષકારક સ્તવના નથી, પણ માનદશા છે, અને એ માનદશા નાચ થાય પછી સ્તવના દોષકારક નથી બનતી. માટે આત્મામાં જે ગુણો કે દોષો થાય છે તેમાં બીજા બાબુ નિમિત હોવા છતાં આત્મવીર્ય બદલાય તો તે ગુણ કે દોષરૂપ થઈ શકતા નથી.

અગ્રિશર્માના ત્રણ પારણા ચુકાયા બાદ ગુણસેનરાજાની જાહીને ભૂલ ન હોવા છતાં કષાય પરવશ બનેલ અગ્રિશર્માએ વૈરાનુબંધનું નિયાળું કર્યું અને અણસણ કરી પોતે પોતાના આત્માને દોષિત કર્યો. જ્યારે ગુણસેને તે પછી તરત ધર્મ પામીને નજીકમાં સંયમ લેવાની તીવ્ર ભાવના અને નિર્ણય કર્યો, જેમાં અગ્રિશર્માએ દેવ થઈને મરણાના ઉપસર્ગ કર્યો અને ગુણસેન મર્યાદ, પરંતુ આત્મવીર્ય ઉચિતરૂપે વિકસિત થયેલ હોવાથી દોષરૂપ ન થયું. આત્માના વિવેક ગુણ કર્યો.

માટે બાબુ સારા કે ખરાબ નિમિતો આત્માને ગુણદોષનું નિમિત જરૂર થાય છે, પરંતુ તેમાં આત્મા જેવી રીતે બળે તે રીતે ફળ આવે છે. દોષનું નિમિત ગુણ પણ કરે છે અને ગુણનું નિમિત દોષ પણ કરે છે. આત્માની વિપરીત બુદ્ધિ તે ગુણના નિમિતને દોષરૂપ કરે છે, જેમકે વરદાત આચાર્ય પાસે સુવાના સમયે કોઈ સાધુ શંકાનું સમાધાન પૂછ્યવા આવ્યા તો તેમની જ્ઞાનની પગશની અનુમોદના થવી જોઈએ, તેના બદલે ઉંઘમાં અંતરાયની બુદ્ધિ થવાથી તે દોષ અને અંતરાયનું નિમિત થયું. માટે બાબુ નિમિત ગુણદોષમાં નિમિત માત્ર છે. ક્યારેક ગુણના સ્થાને દોષ થાય, ક્યારેક દોષના સ્થાને ગુણ થાય, ક્યારેક ગુણ કે દોષ એકે ન થાય કે મંદ થાય - આ બધું અનિશ્ચિત છે, પરંતુ મુખ્યત્વયા આત્મા પોતે જ્ઞાન, વિવેક, સંયમ, સમતા, ઔચિત્ય વગેરે દ્વારા ગુણનું કારણ થાય છે, અને એથી વિપરીત અજ્ઞાન અવિવેક વગેરેથી દોષનું કારણ બનતો હોવાથી આત્મા ગુણદોષનું કારણ છે, એમ કહી શકાય.

## જો જાણે ન મરિસ્સામિ, સો હુ કંખે સુહેસિયા ॥

**મ**રણ એક અદેવી અવસ્થા છે કે જ્યાં જીવનું કશું ચાલતું નથી, અતેની બધી જ પરિસ્થિતિ છોડીને પાવત્ત દેહને પણ છોડીને જવાનું હોય છે.

જીવ ગર્ભમાં આવે ત્યારથી આ મરણ ક્યારેય પણ, ક્યાંય પણ ગમે તે રીતે આવે તેનું કશું નક્કી જાણી શકતું નથી. પણ બધા સંસારી અવશ્ય મોત આવશે તે જાણી શકે છે, બધા જ જાણે છે. મરણના કારણે બધાની બધી જ અવસ્થા સંસારમાં નાશવંત બને છે. અનુત્તર સુધીના દેવોના સુખો પણ ત્યાંથી અવવાથી નાશ પામે છે અને જીવ પાછો ગર્ભાવાસના દુઃખમાં પડે છે.

શ્રી તીર્થકર પરમાત્મા પણ અંતે નિર્વાણ પામતાં, પોતે શાશ્વત સ્થાન પામવા છતાં, સર્વાંગે સુખી થવા છતાં અતેની અતિશય વગેરેની ઋદ્ધિઓ નાશ પામે છે, એઓ પણ મનુષ્યલોકમાં તીર્થકરદેવ તરીકે કાયમી રહી શકતા નથી. હંદ્રો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બલદેવો, પ્રતિવાસુદેવો, રાજા-મહારાજાઓ વગેરે કોઈ પણ કાયમી નથી.

મહાશક્તિઓ, ક્ષાયોપશમિક લબ્ધિઓ, પુષ્પયના ઉદ્યો, સારા સંયોગો, સુખી અવસ્થા, સુખની સામગ્રી વગેરે જે જે ભાવો સંસારી જીવોમાં દેખાય છે તે બધાને શૂન્યમાં ફેરવનાર, નાશ કરનાર, પોતે નાશ ન પામવા છતાં ત્યાંથી માલિક સુધીના બધાને દેશનિકાલની સજા કરનાર મૃત્યુ છે - આ મૃત્યુ બધાને માથે હોવા છતાં ભૌતિક અનુકૂળતામાં, સુખમાં મગ્ર બનેલ, આસક્ત બનેલ, અથવા તેની અભિલાષાયુક્ત થયેલ જીવ મરણને જોતો નથી. કુતરો રોટલાને જુવે પણ લાકડીને ન જુવે તેવી બધા જીવની સ્થિતિ છે.

મરણ દેખાય કે ન દેખાય તો પણ કોઈની કોઈ પણ સ્થિતિ કાયમી નથી, તે સુખની હોય કે દુઃખની હોય. છતાં દુઃખથી જીવ અકળાય છે, જીંદગીભર આવતા સાધ્ય કે અસાધ્ય દુઃખો પણ મરણ બાદ છુટે છે. માટે મરણને જોવાથી જીવ સમતાથી દુઃખો સહન કરી શકે છે, આર્તધ્યાન છોડી શકે છે. સમતાથી સહન કરનારને ભવાંતરમાં દુઃખો આવતા નથી, કારણ કે સમતાથી સહન કરનારને

દુઃખના અનુભંગો નાશ પામે છે, દુઃખોને આપનાર ઘણા પાપકર્મ નાશ પામે છે,  
દુઃખને લાવનાર, નિમિત્ત આપનાર કર્મો પણ નાશ પામે છે, સુખને પ્રામ કરાવનાર  
કર્મ બંધાય છે, સુખની સામગ્રી મળે છે, અનુકૂળ સંયોગો મળે, કદાચ ગાડ કર્મના  
કારણે દુઃખ મળે છતાં દુઃખ સહન કરવાની ધીરતા, સહનશીલતા મળે છે, સુખ  
મળવા છતાં સુખની તમના, આનંદ, આસક્તિ, તેનું પ્રલોભન, તેમાં ઘમંડ, દુઃખીનો  
તિરસ્કાર વગેરે આવતા નથી. વળી સુખમાં ગંભીરતા, ઉદારતા વગેરે બધું મળે  
છે. અવસ્થભાવી મરણ જોવાથી દુઃખી આત્મા પણ સુખી થાય છે, દુઃખને શાંતિથી  
સહન કરી શકે છે, સમતા જાળવી શકે છે. તેવી જ રીતે મરણને અને મરણના  
કાર્યને જોવાથી મનમાં વસેલી સુખની મહત્તા, વિષયોની મહત્તા, રસ-ઋદ્ધિ-  
સાતાગારવની ગૃહ્ણિઓ વગેરે નીકળી જાય છે, તેના પ્રત્યેનું જીવનું અંતર વિરક્ત  
બને છે, માટે મરણને વારંવાર યાદ કરવું જોઈએ. મરણ જોવાથી બૌતિક ઉમતિ  
અને બૌતિક સુખની ઈચ્છા સાહજીક રીતે નિવૃત થાય છે.

બૌતિક સુખની ઈચ્છા વ્યક્ત થાય ત્યારે મરણ આંખ સામેથી જતું રહે છે.

મરણને જાણીને તેનાથી આપણો છુટી નથી શકતા, પરંતુ મરણ સુધારવાથી  
ધીમે ધીમે બીજા મરણો પણ સુધરે છે અને એના કારણે ૨-૫-૭ ભવમાં  
મરણને સુધારી કાયમી રીતે મરણથી રહિત બનાય છે.

દુઃખી માણસ ધર્મભાવના દ્વારા મરણને સમાધિમય બનાવીને સદ્ગતિની  
પરંપરા પામે છે. દુઃખી માણસ મરણને જોવાથી મરણના દુઃખમાં સમાધિને ઈચ્છતો  
આ દુઃખને આત્મભળ કેળવીને સમાધિથી સહન કરે છે. સમાધિ ન રહે ને હાયવોય  
થાય તો પણ સમાધિને મેળવવાની દ્રષ્ટિ હોવાથી સમાધિ તરત યાદ આવે છે  
અને તેથી પ્રતિક્ષણ મોહનીયકર્મનો કષ્યોપશમ થાય છે અને સમાધિ સુલભ થાય  
છે. માટે દુઃખમાં મરણ યાદ કરવાથી સમાધિ સુલભ બને છે.

સુખી અવસ્થામાં મરણને યાદ કરનાર સુખમાં અંધ બનતા નથી, સુખમાં  
મગ્ન બનતા થથી, સુખી અવસ્થામાં વિશેષ ધર્મ બધી રીતે કરાય તે યાદ કરીને  
સુખને ધર્મની સામગ્રીઝપ બનાવી બધી જાતના ધર્મ જાતે કરે છે, બીજાને પણ  
પેસા દ્વારા, ઐશ્વર્ય દ્વારા, સત્તા દ્વારા, અને શ્રીસંઘને સાધર્મિકભક્તિ, તપ કરાવવા  
દ્વારા આરાધના કરાવે છે.

મરણને વારંવાર જોવાના કારણો જાગેલ ધર્મભાવનાથી જીવ ધર્મને કરે છે,  
કરાવે છે, તે કારણો ઉત્ત્ર પુષ્પપ્રભાવે મરણકાળે બધું છોડવા છતાં મનથી છોડે  
છે, પ્રસરતાથી નવંકાર ગણતાં મરે છે. તેથી જે મરણ યાદ કરે તે સુખમાં ધર્મ  
કરે, પણ સુખ બોગવવાની ઈચ્છા ન કરે. સુખ મેળવવાની ઈચ્છા થાય,  
બોગવવાની ઈચ્છા થાય તેનાથી જેમ મરણ ભૂલાય તેમ મરણની પરંપરા ભૂલાય,  
તેથી આશંસા અને નિયાસા થાય અને આ ભવમાં સામગ્રી હોય તો ધર્મ ન  
કરતાં જીવ આંધળો બની સુખ મેળવવા-બોગવવા દોડે.

માણસ પોતાની બુદ્ધિથી સુખ અને દુઃખને જુઓ છે, માપે છે. તેથી ત્યાગ,  
તપ, વિનય, નાત્રતા, ક્ષાપજ્ય, ઈન્દ્રિયદમન, સંઘલક્ષિત, સ્વાધ્યાય, ધ્યાન, કિયા,  
સાધ્યમિકભક્તિ, આવશ્યક કિયા, વૈરાગ્ય, ઉપરામ, ગંભીરતા, ઉદારતા,  
સહનશીલતા, ધર્મિ-ધર્મ અને ધર્મના સાધનો ઉપર આદર, ભક્તિ, પ્રશંસા, રક્ષણ,  
વર્ધન; આ બધામાં જેને મમતા છે, પોતાનાપણું જુઓ છે, એમાં એને આનંદ  
થાય છે, તે માણસ અનુકૂળતા અને વૈખયિક સુખોને વિરોધરૂપે ઈચ્છતો નથી,  
તેથી તે પોતાના મનને સહેલાઈથી પાછું વાળી શકે છે.

જીવ દુઃખમાંથી અકળામણ ઘટાડવા માટે જીવનમાં શક્ય એ રીતે વૈખયિક  
પદાર્થો પરની આસક્તિ ઘટાડવા સાથે આ દુઃખ ચાલ્યું જ જવાનું છે અને છેવટે  
મૃત્યુ સમયે તો બધા દુઃખોનો અંત આવી જ જવાનો છે આ વિચારસરક્ષણે  
આત્મસાત્ય કરતા જવી. એક મોટો બધ બાકીના નાના ભયોને ગૌણ બનાવી હે  
છે, મોટું દુઃખ નાના દુઃખોને ગૌણ બનાવી હે છે તેમ મૃત્યુની વિચારણા જીવનમાં  
આવતા બીજા દુઃખોને ગૌણ કરાવી દઈ સુંદર સમાચિ પ્રદાન કરે છે.



## વિષયગણ: કાપુરુષ કરોતિ વશવર્તિનં, ન સત્યુરુષમ् ॥

**પાં**ચે ઈન્દ્રિયના વિષયો અને તેનો સમુહ કાયર માણસને, - પોતાને આધીન કરે છે પરંતુ વિષયોનો સમુહ સત્યુરુષને પોતાના આધીન કરી શકતો નથી. સત્યુરુષ એટલે સત્ત્વપ્રધાન પુરુષ... વૈરાગ્ય પ્રધાન, મોહનીયના કષ્યોપશમ પુક્ત પુરુષને સત્યુરુષ કહેવાય.

વિષય ગણ એટલે શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ. આ પાંચે અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે પ્રકારે છે. અનુકૂળ વસ્તુ મેળવવી-ભોગવવી અને એનો સંગ્રહ કરવો એ જેના મનમાં રમ્યા કરે છે અને પ્રતિકૂળ વસ્તુઓથી જે દૂર ભાગે છે, કંટાળે છે, છોડી દે છે અને ન છૂટે ત્યારે ચિંતામાં, ઉદ્ઘેગમાં ડૂબી જાય છે તે વિષયગણને પ્રધાન કરનાર પુરુષને કાયર પુરુષ કહેવાય.

પુરુષપણું એટલે પુરુષાર્થપણું. જીવ માત્ર જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે પુરુષાર્થ છે. તેમાં કર્મના ઉદ્યથી અનુકૂળતાઓ મળવાથી આનંદથી લેવાઈ જાય, વ્યામ બને તેનું સત્ત્વ રાજ્યસ્તું અને તામસભાવથી હણાપેલું છે તેથી તેને કાપુરુષ કહેવાય છે. તે રીતે પ્રતિકૂળતામાં પણ દીનતાથી જેનું સત્ત્વ હણાઈ જાય અને હતાશ-ઉદ્દિગ્ન બને તો તે પણ કાયરપુરુષ કહેવાય. જો આત્મા વિશિષ્ટ સત્ત્વશાલી ન બન્યો હોય તો વિષયગણ આત્માની સદ્બાવના અને સત્ત પુરુષાર્થનો નાશ કરવા સમર્થ થઈ શકે છે. અને વિશિષ્ટ સત્ત્વ વિકસિત થયા બાદ વિષયો આત્માના સત્તવનો નાશ ન કરે તે બને, પરંતુ તે ભૂમિકામાં નહિ પહોંચેલ આત્માઓને વિષયગણનો સંપર્ક સત્યુરુષાર્થથી ભાટ કરે છે અને એ આત્મા વિષયવશ થાય છે. માટે જેમ જેમ જીવ વિષયોના સંપર્કમાં પ્રવર્તે છે તેમ તેમ જીવનું સત્ત્વ ઘટતું જાય છે, જીવ એને પ્રધાન તરીકે જોતો થાય છે. પોતાની પ્રધાનતા મન ઉપરથી ઘટતી જાય છે. હજાર વર્ષ નિર્મળ સંયમ પાળનાર કંડરિક દવાના કારણે પુષ્ટિદાયક અત્ત્વપાન ખાવામાં પરવશ થઈને વિષયના ગુલામ બન્યા, અખાડાભૂતિ લાડવા ખાવાની લાલચે વિષયવશ બન્યા, અરણિકમુનિ કષથી કંટાળ્યા અને રીના આમંત્રણથી કાયર બન્યા..

જે જે આત્મા સમ્યકૃત્વ અને સંયમથી ભ્રષ્ટ થાય છે તેમાંના મોટાભાગના જીવો અનુકૂળતામાં બેંચાઈને અથવા પ્રતિકૂળતાથી અકળાઈને સત્ત્વ ગુમાવી બેઠા હોય છે... જેમકે મરિયિ ગરમીથી કંટાળી સાંપુપણું હારી ગયા...

સંયમ કે ધર્મથી ભ્રષ્ટ થનાર લગભગ બધામાં વિપ્યગણથી કાયર થવાનું જોવા મળશે. માટે વિપ્યગણોમાં વશ ન થવા માટે (૧) અનુકૂળ વિષયોમાં ત્યાગ (૨) તેની અલ્ઘતા કરવી અને (૩) ભાવના ભાવવી એમ ત્રણ માર્ગ બતાવ્યા છે. ત્રણોનો જે અમલ કરે તેનું મન વિષયોને પરવશ બનતું નથી.. આજ કારણે સર્વજ્ઞપ્રભુના શાસનમાં તપ-ત્યાગ અને ભાવનાને મોક્ષમાર્ગ બતાવ્યો છે.

(૧) સામાન્યથી ધર્મી આત્મા, ધર્મ પામનાર આત્મા, ધર્મમાં આગળ વધનાર આત્મા, ધર્મમાં સ્થિર રહેનાર આત્માએ બને ત્યાં સુધી સારી વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ, કારણ કે અનાદિકાળથી જીવ સારી વસ્તુમાં આનંદ પામતો આવ્યો છે, એની હિંદ્રા કરતો આવ્યો છે, એ ન મળે કે જતી રહે તો અકળાય છે, વિદ્ધિ બને છે માટે સારી વસ્તુઓનો સામે ચડીને જે સંપૂર્ણ ત્યાગ કરે છે તે એ વસ્તુઓના નિમિત્ત થતાં રાગદેખના સંક્લેશથી સહજ રીતે બચી શકે છે. વિષયોમાં આસક્ત થવાને બદલે એ જીવ વિષયો માત્રે નફરત કરે છે તેથી એમાં બેંચાતો નથી. વિષયોમાં-અનુકૂળતામાં ડૂબેલા આત્માને પણ એ દ્યાની દિદ્ધિથી જુએ છે. આ ત્યાગ જેના જીવનમાં જેટલો આવે તેટલો લાવવો..

(૨) ત્યાગ સંપૂર્ણ ન આવે તો જેમ ઉપવાસ ન થાય તો ટંકોની અલ્ઘતા અને પ્રમાણની અલ્ઘતા કરવાનું બતાવ્યું છે. તેમ વિષયોના પ્રકારોની અને પ્રમાણની સંગ્રહમાં અને ઉપયોગમાં અલ્ઘતા કરવી. આ અલ્ઘતા કરવાનો ઉદ્દેશ એ છે કે, એ વિષયો અને વિષયોના સાધનભૂત વસ્તુઓ આત્માના પરિણામને બગાડનાર છે માટે સંપૂર્ણ ત્યાગ યોગ્ય છે છતાં નિર્વાહ માટે કે સત્ત્વના ઉલ્લાસના અભાવમાં જે કાંઈ ઉત્તમ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે તો તેમાં બને તેટલી ઓછી વાર ઉપયોગ કરવો એ ટંક ઘટાડ્યા કહેવાય અને પ્રમાણ પણ ઓછું કરવું. આ રીતે ટુંકમાં પતાવવાની બુદ્ધિ એ વિષયોમાં થતી રતિની તીવ્રતા અટકાવે છે. રતિની તીવ્રતા વિષયોને પરવશ થવાની ભૂમિકા છે. આ રીતે બને તેટલી વસ્તુઓમાં સાદાઈ રાખવી અને વિશિષ્ટતામાં અલ્ઘતા રાખવી.

(૩) આ કરવા છતાં જીવ અનિત્યતાદિ ભાવનાથી ભાવિત ન બને તો બીજાના વિષયો-બીજાની સામગ્રી જોઈને તેને મેળવવા-ભોગવવાનું-સંગ્રહ કરવાનું

તેને મન થાય છે. માટે પુદ્ગલના સારા વર્ણાદિમાં અનિત્ય વગેરે ભાવનાથી ભાવિત બની જીવ એના પ્રત્યેનું આકર્ષણ નાશ કરે અથવા ઘટાડી નાખે જેથી એમાં ન જેંચાય. “જે જેમાં મહત્ત્વ-વિશિષ્ટતા જુઓ તે તેમાં જેંચાય” આ કાયદો છે માટે ભાવના દ્વારા મહત્ત્વાના પરિણામને તોડવા જેથી સત્ત્વ વિકસે અને સત્પુરુષ બની શકાય. આ ગ્રંથ પ્રકારના માર્ગ ન અપનાવે તેનું સત્ત્વ નાશ પામે, ઘટતું જાય તેથી તે સત્પુરુષમાંથી કાયર પુરુષ થાય. જો શક્ય સંયોગ હોય તો ભાવનાવાળા આત્મા અલ્યતાના કે ત્યાગના માર્ગ ગયા વગર રહેતા નથી. ભાવનાથી પહેલા અલ્યતા અને પછી ત્યાગ આવે છે, ત્યાગ અને અલ્યતામાં ભાવના હોય તો ટકે છે અને ભાવના ન હોય તો ત્યાગ અને અલ્યતા નાશ પામે છે. માટે ભાવના એ પાયો છે, બીજ છે તે ત્યાગ અને અલ્યતા લાવે છે અને વધારે છે. ત્યાગ અને અલ્યતાથી જો ભાવના દઢ થાય તો ત્યાગ અને અલ્યતા સાનુંબંધ થયા કહેવાય. ભાવના વગરના ત્યાગ અને અલ્યતા નિરનુંબંધ કહેવાય.

ભાવના એ સત્ત્વ વિકસાવનાર છે, સદ્ભાવનાથી રહિતનું સત્ત્વ નાશ પામે છે. આ અનુકૂળ વિષયની વાત થઈ.

પ્રતિકૂળ વિષયમાં ભાવના-ધૈર્ય અને સહિષ્ણુતા કેળવવી. આ ગ્રંથથી જીવ સત્ત્વને વિકસિત કરે છે. આ ન હોય તો સત્ત્વ હણાઈ જાય અને આર્ત-રૌદ્ર ધ્યાનને પરવશ થાય છે. જેમ જેમ સુખી અને સ્વસ્થ અવસ્થામાં સહન કરતા જઈએ, ખડતલ-મજબૂત બનીએ તેમ તેમ સહિષ્ણુતા વિકસે અને એ સહિષ્ણુતા ધૈર્ય આપે છે, એવી રીતે ધૈર્ય રાખે તેમ સહિષ્ણુતા આવે છે. ભાવનાસંપત્ત આત્મા ધૈર્ય રાખીને તપ-ત્યાગ-સંયમકાણ વગેરે આરાધે છે, સહિષ્ણુ બને છે. સહિષ્ણુ બનવામાં ધૈર્ય કારણ છે, ધૈર્ય વિકસાવવામાં સહિષ્ણુતા કારણ છે પરંતુ આંતરિક દસ્તિ વિકસિત થાય, શાન અને ભાવના સંપત્ત આત્મા બને ત્યારે ધૈર્ય અને સહિષ્ણુતા સ્થાયી બને છે માટે વિષય પરવશ જેમને ન થવું હોય તેમણે ભાવના દ્વારા ધૈર્ય અને સહિષ્ણુતા સંપત્ત બનવું જોઈએ.

વરદાત આચાર્ય નિદ્રાની સહિષ્ણુતા ગુમાવવાથી સત્ત્વ ગુમાવી બેઠા. કુલેટ-ઉત્કુરુટ આકોશ પરિષહમાં સત્ત્વ ગુમાવી બેઠા અને શ્રાપ આપી સાતમી નરકે ગયા. વિશ્વભૂતિ અપમાન અને મશકરી સહન ન કરી શક્યા અને નિપાણુ કર્યું. માટે સત્ત્વશાળી આત્મા અનુકૂળતાઓને છોડીને અને ગૌણ કરીને જેમ જીવે તેમ પ્રતિકૂળતામાં પડા અકળાયા વગર અને ઉપેક્ષાથી, પ્રસત્તતાથી સહન કરીને

આરાવના કરે તો સત્તુરૂપ બને છે. ભાલી-સુંદરીએ ઈર્ધાથી પરવશ થઈ લી વેદ બાંધ્યો. મહિનાથ ભગવાનના પૂર્વભવમાં છાંએ રાજાએ ઉગ્રતપ સરખો કર્યો હોત તો શું વાંધો આવત ? જણાવી કરવામાં ક્યાં નાનમ હતી ? બધા સરખુ પુન્ય બાંધત તો જુદા જુદા કેત્રમાં જુદા જુદા તીર્થકર થાત અથવા બધાના પરિણામો કાંઈ સરખા ઓછા થવાના હતા ? બાધ સમાનતા રહે તો શું હરકત ? પરંતુ મહાના રૂપી માન, બીજા મારી સમાન ન થાય તે રૂપી ઈર્ધા થવાથી માયા આવી, શુદ્ધ સત્ત્વ દૂષિત થયું... માટે અનુકૂળ અને પ્રતિકૂળ બંને વિષયો જીવના સત્ત્વને હણે છે અને જીવને સંકલ્પ વિકલ્પને પરવશ બનાવે છે. માટે સત્ત્વશાળી પુરૂષ અનુકૂળતાને મહાના આપતો નથી, અને પ્રતિકૂળતાને ગણકારતો નથી. આ વિષયો વિદ્યમાન હોય તો પરિણામ બગાડવા દ્વારા સત્ત્વને ઘટાડે છે. વિદ્યમાન ન હોય તો પણ અનિષ્ટના આવવાની કલ્યના, ઈષ્ટના જતા રહેવાની કલ્યનાથી પણ મન રાગ દ્વેષ વિદ્ધળ બની સત્ત્વહીન બને છે. જેમ ડોક્ટર પાસેથી મરણની આગાહી સાંભળી રોગની શંકાવાળો માણસ મરવા જેવો થાય છે તેમ આ વિષયોની પરવશતા માણસને પાંગળો બનાવે છે માટે બાધ અને અભ્યંતરથી વિષયોને પરવશ ન બનતા સદા સત્ત્વ વિકસાવવા પ્રયત્ન કરવો..



## વવહारनयउच्छेए तित्युच्छेओ अवसंस ॥

**ભ**વालिनंदी જીવના શાસ્ત્રોમાં આઈ દોષ બતાવ્યા છે. તે આ પ્રમાણે :-  
 (૧) કુદ્ર, (૨) લાભરતિ, (૩) દીન, (૪) મત્સરી, (૫) ભયવાન, (૬) શઠ, (૭) અજા,  
 અને (૮) નિષ્ફળઆરંભયુક્ત. આ લક્ષણોથી ભવાલિનંદી જીવ ઓળખાય છે.

આ દોષો બરાબર નિમજ્જવા જોઈએ અને જીવનમાંથી તે ઘટાડવા અને દૂર  
 કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ દોષો બે પ્રકારના છે - (૧) કર્માદ્યજન્ય અને  
 (૨) સહજમલ (આત્માની સ્વાભાવિક અયોગ્યતા) જન્ય. અચરમાવર્તમાં આ  
 દોષો સહજમલજન્ય હોય છે, અને એમાં દેખીતો વિશેષ વધારો-ઘટાડો  
 કર્માદ્યજન્ય પણ હોય છે.

અચરમાવર્તમાં અપુનર્બન્ધક વગેરે અવસ્થા પામ્યા બાદ સમ્યકૃત્વ પામીને  
 પડેલામાં આ સહજમલજન્ય દોષો નથી હોતા, કારણ સહજમલ ઘણો ખપી ગયો  
 છે, અન્તિ અભ્ય છે, પરંતુ ત્યાં પણ કર્માદ્યકૃત દોષો અવારનવાર આવજાવ કરે.

અચરમાવર્તમાં કોઈપણ નિમિત્ત-અપેક્ષા વગેરેથી અમુક રૂપે, અમુક રીતે,  
 આત્મવીર્ય ઉલ્લસિત થવાથી સહજમલ હોવા છતાં કર્માદ્ય કૃત દોષોનો છ્રાસ  
 થવાથી કુલની ખાનદાની વગેરેથી કુદ્રતા વગેરે દોષો શાંત થાય છે, પરંતુ નાશ  
 પામતા નથી. માટે અચરમાવર્તમાં જે ગુણો દેખાય, તે ક્ષયોપશમકૃત નથી, પણ  
 નિમિત્તના અભાવમાં કે સારા નિમિત્તની બલવત્તામાં દોષો દબાઈ જતા કેદીક  
 ગુણાભાસરૂપે ગુણો પ્રગટ થાય છે. જેવી રીતે અભ્ય કે દુર્ભિયને પણ દ્વાર  
 આચારપાલન અને શ્રુત પરાવર્તન-ભાવનના પ્રતાપે શ્રુત સામાયિકનો લાભ અને  
 નવમા ગ્રૈવેયક સુધીની પ્રાપ્તિ થાય છે.

આનો અર્થ એ થયો કે ખરાબ નિમિત્તો અને ખરાબ પ્રવૃત્તિ જેમ જેમ  
 છોડવામાં આવે અને સારા નિમિત્તો અને સારી પ્રવૃત્તિ જેમ જેમ સેવવામાં  
 આવે તેમ તેમ યોગ્ય આત્માને કર્મના ક્ષયોપશમ અને ભાવગુણો પ્રાપ્ત થાય  
 છે, અને કાળ પરિપાક ન થયેલાને પણ અશુભ કર્મો શાન્ત થઈને ગુણની જાંખી  
 મળે છે, પણ આ જાંખી સંયોગ આધીન હોવાથી આચાર સંપત્તા વગેરે સત્ત  
 સંયોગ હોય ત્યાં સુધી રહે, પછી જતી રહે છે. તે મોકના કારણરૂપ ન બને અને  
 લાંબા ભવો સુધી ન રહે.

શ્રુતના પરિશીલન-ભાવન દ્વારા અભિવ્ય આત્માને પણ કેટલીક આગંતુક શાંતિ થાય છે, પણ પછી પાછા કૃત્તુતાદિ દોષો સ્વરૂપ દેખાડે છે.

ચરમાર્વાત્માં સહજમલનો છાસ થયો હોવાથી, આત્માની યોગ્યતા પ્રગટાયેલ હોવાથી જીવ અસદ્ નિમિત્તાથી દૂર રહે, અસદ્ પ્રવૃત્તિથી દૂર રહે, સદ્ નિમિત અને સત્ત્વ પ્રવૃત્તિ આદરે અને શ્રુતશાનમાં પ્રવર્તે, તેમ આત્મ ગુણો પ્રગટ થાય છે. પરંતુ આ પ્રગટ થતા આત્મગુણો જો પરાકાણાએ ન પહોંચે, અથવા સાનુબંધ બનીને અપ્રતિપાતી ન બને તો પાપ નિમિત કે પ્રવૃત્તિના કારણે પાપકર્મોના ઉદ્ય થાય અને ગુણો નાશ પામે. માટે ગુણોને પ્રગટ કરવા, ટકાવવા કે વધારવા માટે તેને સાનુક્ષી આચાર-વિચાર રાખવા પડે છે.

માટે વ્યવહાર ધર્મનો સાર આ છે કે જે આચારોને પાળે છે, ધર્મને આચરે છે અને શ્રુતને ભણે છે-વિચારે છે, તે આત્માની યોગ્યતા પ્રગટી હોય, કાળ પરિપાક થયો હોય તો ગુણો પામતા, આગળ વધતા યાવત્ મોક્ષે પહોંચે છે, અને અનેકને ધર્મના આલંબનભૂત બને છે. ભવસ્થિતિ લાંબી હોય અને જો વચ્ચે ભૂલ કરે તો પડે, પાછો ચેડે; આમ ચડ-ઉત્તર કરતાં કરતાં અન્તે આત્માની યોગ્યતાના કારણે અને આચાર ભાવનાના બળે શાશ્વત સ્થાન પામે છે.

અભિવ્ય વગેરે જીવો વ્યવહાર ધર્મથી આંતરિક શુદ્ધિ નથી પામતા, પરંતુ અલ્યકાલીન શાંતિ-સમતા પામે છે, દોષનો ઉધમાત શાંત થાય છે. માટે આચાર, શ્રુત અને ભાવનારૂપ વ્યવહાર ધર્મ નિશ્ચય પામેલાને સ્વભાવસ્થ રાખે છે એટલે કે આચારવંત બનાવે છે. શુભચિંતન અને ભાવનાયુક્ત બનાવે છે. નિશ્ચય આંશિકપણે પામનારને તે વિકસિત મજબૂત બનતો જાય છે, અન્તે પ્રભુશાસનની વ્યવહારની પ્રવૃત્તિ પરાકાણાએ પહોંચાડે છે.

યોગ્ય આત્મા કાળ પરિપાક થયા બાદ અનુકૂળ નિમિત્તો તેમજ આચાર, જ્ઞાન અને ભાવના દ્વારા નિશ્ચય ધર્મ પામે છે.

કાળ પરિપાક નથી તેવાને પણ વ્યવહાર ધર્મ દ્વારા વારંવાર ગુણ મ્રાદિ, ધર્મ મ્રાદિ અને સ્વર્ગાદિ મ્રાદિ થાય છે. આ રીતે કાળ પસાર કરતા વિશેષ કાળ પરિપાક થયે સંપૂર્ણપણે આત્મગુણો વિકસે છે.

માટે નિશ્ચય પામેલામાં વ્યવહાર અવશ્ય હોય છે, તેમજ નિશ્ચય પામવા માટે પણ વ્યવહાર અવશ્ય હોવો જોઈએ.

પ્રભુએ પણ કેવળજ્ઞાન પામ્યા બાદ વ્યવહાર ધર્મ જ સ્થાયો છે, કારણ વ્યવહાર ધર્મરૂપ આચાર એ નિશ્ચય ધર્મનો ઉપાય છે.

## ॥ મૂલં સુખાનાં સમતૈવ વિદ્ધિ ॥

**સુખ** ચાર પ્રકારના છે :- (૧) અજ્ઞાનનું સુખ, (૨) વિષયનું સુખ, (૩) શાતાવેદનીયનું સુખ અને (૪) પ્રશમનનું સુખ.

(૧) અજ્ઞાનનું સુખ :- નાના બાળકો અજ્ઞાનના કારણે સુખી છે. એકેન્દ્રિય જીવને વિશેષ દુઃખ નથી. સામાન્ય સુખ છે, તે અજ્ઞાનના કારણે. એ અવસ્થામાં વિષયકપાયની મંદ્તા છે. પરંતુ સંયોગ મળે, ભવ બદલાય એટલે વિષયકપાયો વધી જાય છે.

જ્યારે વસ્તુ કે પરિસ્થિતિનું જ્ઞાન થાય ત્યારે દુઃખ થાય. અમેરિકામાં આજે ઘણી વસ્તુ છે. આપણે જોઈ નથી, જાગ્રત્તા નથી, તેથી મેળવવાની હશ્ચા થતી નથી, તે અજ્ઞાનજન્ય સુખ છે. અજ્ઞાનજન્ય સુખ જ્ઞાન આવે એટલે નાશ પામે. જ્ઞાન સાથે વિષયકપાય ભેગાં ભળે તો દુઃખી બનાવે.

(૨) વિષયજન્ય સુખ :- સારી વસ્તુ ખાવાનું સુખ ૧૦ મિનિટ, પણ આરોગ્ય બગડે તેવું ખાખું, દુર્ગતિદાયક ખાખું તો અસંખ્ય વર્ષના દુઃખ મળે છે.

વિષયોમાં જ્યારે કપાય ભળે ત્યારે અજ્ઞાનજન્ય સુખ કરતાં આ સુખ અસંખ્ય વર્ષના દુઃખ આપે.

(૩) શાતાજન્ય સુખ :- ગ્રેવેયક દેવલોકમાં સમકિતી દેવો શાતાવેદનીયના સુખને અનુભવે છે. તે દેવોને મન : પ્રવિચાર નથી, ખાવાપીવાની હશ્ચા નથી. યુગલિકોને પણ શાતાવેદનીયનું સુખ છે. વિષયોની હશ્ચા યત્કંચિત્ છે, અજ્ઞાન થોડું છે. શાતાના ઉદ્યમાં વિષયો ઓછા, કપાયો ઓછા હોય અને અમુક પ્રકારના શાતાના ઉદ્યમાં સંકલેશ ઓછા હોય.

શાતાનું સુખ કેવું છે ? શાતાનું સુખ પરાધીન છે. કર્મનો ઉદ્ય હોય ત્યાં સુધી સારું, ઉદ્ય જાય એટલે પાછી ધમાયકડી અને દુઃખના ઉદ્યો ચાલુ.

(૪) પ્રશમનું સુખ :- અનુત્તરવાસી દેવ પ્રશમ સુખ અનુભવે છે. ગ્રેવેયકમાં શાતાના સુખે વિષયોને ભૂલાયા છે, ગયા નથી, જ્યારે અનુત્તરમાં વિષયસુખ ભૂલાય છે સાથે જાય પણ છે.....

શમ સુખ ક્યારે આવે? અહમના પહેલા દિવસે, બીજા દિવસે ભૂખનું દુઃખ છે પણ પછી ભૂખ લાગતી નથી. ભૂખનું દુઃખ શમસુખમાં પરિષ્ઠમે છે. ભૂખ એ દુઃખ છે. ભૂખના દુઃખનો નાશ જેમ ખાવાથી થાય છે, તેમ સમતાથી પણ થાય છે.

વિષયોનો ત્યાગ કરી, વિષયોનો તિરસ્કાર કરી, વિષયો દુર્ગતિદાયક છે એવું વિચારીને, ક્યાયોથી ભવમાં ભ્રમજી થાય છે એવી વિચારણાથી શાંતિ મળે તે શમસુખ છે.

ગુસ્સામાં સમતાસુખનો અનુભવ ક્યારે થાય ? સંકલ્પપૂર્વક નિર્ણય કરો કે મારે બોલવું નથી અને છતાં થોડુંક બોલાઈ જાય તેનો પશ્ચાત્તાપ થાય ત્યારે માનસિક ક્ષમાનો નિર્ણય પણ કયોપશમ કરાવે. સમતાનું પ્રણિધાન નથી માટે ગુસ્સો આવે છે. ઘાસતેલમાં સળગવાની યોગ્યતા છે. ન સળગવું હોય તો ડબ્બાને પેક કરવો પડે, ચિનગારીથી દૂર રાખવો પડે. તેમ નિમિત્ત મળતાં ક્યાયો ઊભા થાય તે પહેલાં જ નિર્ણય કરો કે જવાબ આપવો જ નથી. ક્યારેક નિમિત્ત વિના ક્યાયો આવવા માડે ત્યાં જ ભાવનાથી ભાવિત થાઓ કે માનસિક દુર્ધીન પણ થશે તો દુર્ગતિ મળશે. માટે બધારનું નુકશાન વેઠી લઈશ, પણ મારે દુર્ભાવ કે અનુચ્ચ કરવા નથી. આપણો સ્વસ્થતા જાળવવી હોય તો પણ ક્યાય ન કરો. ક્યાપથી દુઃખ જ વધે છે, સુખ નહિ.

શમસુખવાળાને તપ હોય કે પારણા, બધે જ આનંદ હોય. શમસુખ નથી તેને બધે જ વાંધા ઊભા થાય.

સમતાનું સુખ ક્યું ? સંસારની દરેક ચીજ વસ્તુમાં, સારી કે ખોટી પરિસ્થિતિમાં દુર્ગતિદાયકતા, વિષમતા, પરાધીનતા, અનિત્યતા, દુઃખદાયિતા છે, એવી બુદ્ધિ ઉત્પત્ત કરી દરેકમાં નિરાળો રહે તો સમતાસુખનો અનુભવ થાય. નિરાળાપણાનો ભાવ તે સમતા. માન અને અપમાન બત્તેમાં સમતા જોઈએ.

આપણે સરળ છીએ. સામો આપણાને માયાકપટ કરી છેતરવા આવે ત્યારે મારે મારા સ્વભાવમાં રહેવું છે તેમ વિચારી સામે આપણે માયાકપટ ન કરીએ તો સમતા સુખનો અનુભવ થાય.

આ જગતની કોઈપણ, વસ્તુમાં જે મહત્વ દેખાય છે તે વિષયનું સુખ છે. હું બધું તો મને માનપાન મળશે, મારી સારી સરબરા થશે; તો તે વિષયનું સુખ છે. પણ શાન ભણવાથી મારા આત્માને કર્મા ઠગી ન જાય એવો વિચાર આવે

તે શમસુખ છે. આપણા કણમાં સમતાસુખનો જ ઉદેશ જોઈએ. સમતા સુખના લક્ષ વિના કરાતી સારી પણ પ્રવૃત્તિ તે દ્રવ્યક્રિયા બને છે, પુણ્યબંધ કરાવે છે.

પંચપરમેણિને નમસ્કાર કરવા દ્વારા મારે સમતામય બનવું છે તે ભાવ હોય તો સમતા આવે, સમતાના ઉદેશથી કાર્ય થાય તો આત્મપરિણાતિ આવે.

સમતાનો ઉદેશ નથી તો યોગનો પ્રારંભ નથી. ભાવનાથી, જ્ઞાનથી, આચાર-સંપત્તાથી જ્ઞાન આવે.

જે આચારમાં જ્ઞાન અને ભાવના ન ભળે તેમાં મામુલી પુણ્ય મળે. જ્ઞાન અને ભાવનાથી ભાવિત બનેલા આરાધનાને મુખ્ય કરે, વિષયોને નહિ.

વિષયોના દરેક સુખ અલ્યકાલીન છે, વિનશ્ચર છે. જેને નિદ્રા, અભિમાન કે ખાવાપીવામાં સુખ હેખાય, તે એની સામે લડે કેવી રીતે ? જેને આમાંથી એકમાં પણ આનંદ આવે તેને શમસુખનો અનુભવ થાય નહિ. જેને શમસુખનો અનુભવ થયો નથી તે યોગી નથી, પ્રારંભનો કિયાયોગી છે.

વર્ણાની ધર્મક્રિયા પછી પણ સામાન્ય પ્રસંગોમાં સમતા ન આવે ? કાયાના ધર્મ પકડાય વિના મનના ધર્મ ન મળે, પરંતુ કેવળજ્ઞાન કાયાના કર્મથી નહી મનના ધર્મથી મળે. માટે મનના ધર્મ ન પકડાય તે પણ ન ચાલે.

આપણે શાન્ત, સ્વસ્થ, ઉપરામવાળા, વિવેકી, વૈરાગ્યભાવવાળા નહિ બનીએ તો શમસુખનો અનુભવ ક્યારે થશે ? દરેક પરિસ્થિતિમાંથી પસાર થતા આપણે આપણા આત્માની પ્રધાનતા ગુમાવવાની નહિ.

આપણે આપણા સ્વરૂપમાં રહીએ તે મુખ્યતા. સ્વરૂપને છોડીએ તો મુખ્યતા જાય.

ગમે તે વસ્તુ જોતાં લેવાની ઈચ્છા થઈ જાય તો સમતા ક્યાં રહી ? ભગવાને છ મહિનાના ઉપવાસ કર્યા તેમાં જ નિર્જરા થઈ તેના કરતાં છ મહિના અભિગ્રહ કરીને ગોચરી ગયા, તેમાં લાભ અને નિર્જરા વધારે થઈ.

તરસ લાગે તરત પાણી ન વાપરો, ન રહેવાય તો જ વાપરો. થોડીવાર જરમી સહન કરો, પછી બારી ખોલો, "દેહદુઃখં મહાફલં" આ સૂત્ર સમતા મેળવવા માટે છે. સમતાનો ત્યાગ કરાવે છે; દેહની મમતા, અનુકૂળતાનો પ્રેમ.

જ્યારે સારી સ્વસ્થ અવસ્થા છે ત્યારે સહન કરતાં શીખો તો ગમે તેવી પરિસ્થિતિમાં વિદ્ધિતા નહિ આવે. જીવનમાં નાની નાની પીડામાં જગ્યુમે તો જ

સમતા આવે. પ્રતિકૂળતા એ મનની પીડા છે. એને સહન કરવાની પાછળ આત્મપરિણાતિ વધે છે.

આપણી બુદ્ધિ સ્થિર જોઈએ, સ્થિત જોઈએ. આપણી પાસે ગુણની કમાણી નથી. ગૃહસ્થ સમજે છે કે પાઈ પાઈ ભેગી કરી રૂપિયા બનાવો, રૂપિયા કરશો તો લખપતિ બનાશે. તેમ આગળ વધવું છે તો ધીમે ધીમે આગળ ચાલો.

બાબુ આપજિમાં ડેલાયમાન ન થાપ તે સ્થિતપ્રકાશ છે. બાબુ અનુકૂળતામાં લેવાઈ ન જાય તે સ્થિતપ્રકાશ છે. આરોગ્ય મળ્યું છે તો સાખના કરી લો; રોગ આવ્યો છે તો દીન ન બનો. આપજિ, સંપત્તિ બનેમાં ડેલાયમાન ન બને તે સ્થિતપ્રકાશ છે. આરાધનાને ક્યે માર્ગ લઈ જવો, કેવી રીતે વધારવી તે સ્થિતપ્રકાશ વિચારી શકે. ક્યાંક સહન કરવાનું, છોડવાનું પણ હોય છે. જ્યાં છીએ ત્યાંથી ઉપરની ભૂમિકાની ઈચ્છા કરો તો ગુણી વધે.

આખી રાત કાઉસરગમાં રહેનાર ધીમે ધીમે આગળ વધે છે ત્યારે સિદ્ધ કરી શકે છે.

ગુરુનું કષ્ટું કેમ કરવાનું ? ગુરુ સ્થિતપ્રકાશ છે, તે લાભ-નુકશાન જોઈ શકે છે; જ્ઞાનીને-વિચારીને જવાબ આપે છે, તેથી ગુરુવચન તહેજ કરવાનું.

જે પાંદડું ડાળે બંધાયેલું છે તે પવન આવતાં કેટલું હાલે ? અને જે છૂટું પડેલું છે, તેને પવન ક્યાં કેટલે ઉડાડે ? ઘણો દૂર ઉડાડી શકે. તેથી મનને સંકલ્પ-વિકલ્પોમાંથી બચાવવા ગુરુના નિયંત્રણમાં બાંધો-શાનધ્યાનમાં બાંધો.

જ્યાં નિયંત્રણ છે ત્યાં મન ખોટા વિચારો કરતું નથી; નિયંત્રણ નથી ત્યાં નાના કાણામાંથી બકોલેં બની જાય છે. નિયંત્રણ ઈચ્છે એટલે સમતા આવે, જેનામાં સમતા, સ્થિરતા છે તો નિયંત્રણ ઈચ્છે છે. જે નિયંત્રણ નથી ઈચ્છતા, તેનામાં યોગનો વિકાસ થતો નથી.

બીજને પાણી મળે ત્યારે ફણગા નીકળે છે, ધરતી ફોડાને બહાર આવે છે, પછી અંકુરા પ્રગટે છે. તેવી જ રીતે આપણા આત્મામાં રહેલા યોગ્યતારૂપ બીજમાંથી સમતારૂપી પાણી ફણગા, અંકુર પ્રગટાવવાનું કામ કરે છે.

સમતા આવે તો આરાધનાની રૂચિ જાગે. જે ધર્મમાં સ્વાદ આવે તેમાં મનની રૂચિ, પ્રવૃત્તિ વધે. જે ધર્મમાં આસ્વાદ ન આવે તેમાં પ્રવૃત્તિ ઘટે

પ્રવૃત્તિ બાહ્યયોગ છે પ્રવૃત્તિનો આનંદ એ આંતરયોગ છે. શમસુખને બાહ્યયોગ દ્વારા પકડી શકાય છે. તેમાં આનંદ તે આભ્યંતર યોગ છે.

શમસુખ શેન્નાથી મળે ? કૃપાયના દોષો, ઈર્ધ્વા આદિ ઓછા થાય તો પ્રશમનું સુખ આવે. પુદ્ગલમાં દુઃખની બુદ્ધિ, આત્મામાં સુખની બુદ્ધિ થાય તો જ પ્રશમ સુખનો ખ્યાલ આવે. સાકરમાં, અમૃતમાં અને લીલોળીમાં મીઠાશ છે, છતાં વધારે મીઠાશ શેમાં ? જેણે સાકરની મીઠાશ ચાખી હોય તેને લીલોળીનું ખેચાણ ન હોય.

ખાવામાં, નિદ્રામાં, ઠંડા પાણી પીવામાં શાતાનો ઉપયોગ કીથો છે, છતાં શાની અને દુઃખદાયી કહે છે. કારણ તે સુખ સ્થાયી નથી, રાગાદિથી દુર્ગતિ આપે છે, આત્માની સ્વરૂપરમણતા બૂલાવે છે. ઔપચારિક સુખ હોવા છતાં પરંપરાને દુઃખનું કારણ છે. ભર ઉનાળામાં બપોરે ઠંડા પાણી પીતી વખતે ઠંડકનો અનુભવ થતા હાશ થાય તે વખતે આયુ બંધાય તો શાનું બંધાય ?

વિષય સુખની ઈચ્છાવાળાને જ્યાં ત્યાં, ઓછામાં ઉકળાટ થાય. શમસુખની ઈચ્છાવાળાને કાંઈ જ અસર ન થાય. જ્યાં પૌદ્ગલિક સુખ અનુભવી આનંદ માણે ત્યાં યોગની અસ્થિતા છે. જ્યાં અનુકૂળતા આવે ત્યાં વિશેષ જાગૃતિ, સાવધાની રાખે તો પ્રશમનું સુખ આવે.

જ્યાં નુકશાન થતું ન હોય ત્યાં પ્રતિકૂળતા સહન કરો, પણ વારણ ન કરો. મામુલી પરિસ્થિતિમાં સમતામાં જીલતા શીખો. નાની નાની બાબતમાં અનુકૂળતા છોડે, પ્રતિકૂળતા વેઠે તો ધીરતા, ગંભીરતા, ઉદારતા આદિ ગુણો પ્રગટ થાય.

સમતાના સુખને મેળવવા સ્થિરતા, ધૈર્ય કેળવો. સહન કરતા જાઓ. જેના હદ્યમાં આત્માનો નિગ્રહ કરવાનું ધ્યેય નથી, પૌદ્ગલિક વસ્તુનો રાગ છે તે સાધક નથી. અનુકૂળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં તિરસ્કાર જાગે છે કારણ કે આત્મામાં સહનશીલતા નથી, ભાગેડુ વૃત્તિ હોય તો યોગની વૃદ્ધિ ન થાય.

વધારે કષ્ટથી વધારે યોગસિદ્ધિ તેવું એકાંતે નથી. યોગસિદ્ધિ માટે કૃપાયોથી વિમુખ થવું અને વિષયથી વિરામ પામવું જરૂરી છે.

વનસ્પતિના બવમાં ટકાના ત્રણ શેર વેચાયા હતા ત્યારે માન ક્યાં હતું ? અત્યારે જરા અપમાનમાં ઉચ્ચાનીચા કેમ થઈએ છીએ ? અપમાનને મન ઉપર લો જ નહિ, મનમાં દુભાઓ નહિ. બીજા સાથેના વ્યવહારમાં આત્માને-ગુણોને પ્રધાન બનાવીએ તો ધર્મમય બનાય.

સંસારી આત્મા અને ધર્મ આત્માના વ્યવહાર એક કે જુદા ? સંસારી સારુ

લે, ખરાબ આપે; ધર્મી ખરાબ લે, સારું આપે. સંસારી માન સ્વીકારે, અપમાન કરે; ધર્મી બીજાને માન આપે, પોતાના અપમાનને ગળી ખાય. ધર્મી ગરમી સહન કરે, બીજાને ઠંડક આપે; સંસારી દરેક કાર્યમાં પોતાનું કાર્ય પહેલું કરે, બીજાના પછી, ધર્મી પહેલાં બીજાના કરે, પોતાના પછી કરે.

પોતાના આત્માને સમજાવો કે મારા વ્યવહાર સારા જ હોવા જોઈએ અને બીજાને સારા જ માનવાની દષ્ટિ જોઈએ.

જીવ દુઃખમાંથી સુખમાં ભાગવાની મહેનત કરે છે, પણ સુખ ક્યાંય નથી. આત્માને વિવેક, વૈરાગ્ય, કષાયના જ્ય, ઠંડિયના દમન વિના ક્યાંય સુખ નથી. બીજામાં સુખ દેખાય તે આંધળા થઈને અથડાવા જેવું છે.

જરૂર પડે તો પુદ્ગલ લઈએ પણ તેની અસર નહિ. દરેક ઠેકાણો જઘડા નાની બાબતના થાય છે. વસ્તુઓ જ તુચ્છ છે, તેના માટે જઘડા શા ? વસ્તુ ન મળે તેનું દુઃખ વધારે કે જઘડાથી થતા સંતાપનું દુઃખ વધારે? અને તેથી થતી દુર્ગતિનું દુઃખ કેટલું ? તુચ્છ વસ્તુ ખાતર મોટા દુઃખો શા માટે સ્વીકારીએ?

શમસુખના અભાવથી આવેશ ઉભા થાય છે. પાંચ પચીશ લાખ જતા કરે તો નરક ન મળે, પણ તેના ખાતર જઘડા કરે, આર્તિધ્યાન કરે અને રૌદ્રધ્યાનમાં મરે તો નરકના દુઃખ મળે.

સમતાના સુખવાળા વાતોને, વસ્તુને ગૌણ કરે છે, વિવેકને પકડે છે.

જેની પાસે સમતા નથી તે વિવેકરહિત બને છે, વસ્તુને પકડે છે.

જેનો સ્વભાવ લેટ ગો (Let go) કરવાનો છે, તેને કોઈ દુઃખી કરતું નથી. સહન કરતા શીખીને, મનને મારતા શીખીને યોગની સાધના કરો. વસ્તુનો ત્યાગ એ ધર્મ છે, તેમ સમતા એ વિશેષ ધર્મ છે.

કુરગુઝુએ સમતા રાખી તો કેવળજ્ઞાન મળ્યું જ્યારે તપસ્વીએ સમતા ગુમાવી તો શરમિંદા થવું પડ્યું.

માટે પ્રત્યેક પ્રવૃત્તિમાં સમતા કેળવવા પ્રયત્ન કરવો.



## અન્યથા શરણ નાસ્તિ...

**જ**વની સંસારી અવસ્થા દોપોવાળી, કર્મપરાધીનતાવાળી, અજ્ઞાન-મોહથી ઘેરાયેલી, દુઃખથી અને વિપમતાથી વ્યામ છે અને તેથી જીવ સંસારમાં બટક્યા કરે છે. તેને ક્યાંય લાંબો સમય સ્વર્ણતા, શાન્તિ, સુખ, પ્રસન્નતા મળતી નથી. આવા જીવની આ દુઃખી અવસ્થા સુધારવાનો જો કોઈ પણ માર્ગ હોય તો પરમાત્મભાવને જાગ્રવા, પૂજવા, ગૌરવ કરવું, બાબુ જામ વસ્તુઓ ધરવા દ્વારા એ ચીજોના ત્યાળી બનવું, આત્મગુણો મેળવવા યોગ્ય બનવું તે છે. આ જે સંસારી જીવનો પરમાત્મા પ્રત્યેનો તરણતારણહાર, મહારક્ષક વગેરે રૂપે જે સર્વોત્તમ-પણાનો, પૂજ્યતમપણાનો ભાવ અને એ ભાવપૂર્વક જે એમની પૂજન, સ્તવન, સ્મરણ વગેરે રૂપ ઉપાસના કે હદ્યનો સમર્પણભાવ તે જ સાચી પૂજા છે.

સમર્પણભાવ એટલે શું ?

અનર્પણ, અર્પણ અને સમર્પણ ત્રણ શબ્દના અર્થો વિચારીએ... અનર્પણ=ન આપવું; અર્પણ એટલે આપવું અને સમર્પણ એટલે સમ્યક રીતે - સર્વ રીતે આપવું. પરમાત્મને સમર્પણ કરવું છે તો શું સમર્પણ કરવું ?

૧) શું આપવું ? અહોભાવ, પૂજ્યભાવ, સર્વશ્રેષ્ઠ તરીકે ઉપાસ્ય ભાવ.

(i) અહોભાવ એટલે જગતમાં વિશિષ્ટ વ્યક્તિ તરીકેનો આદરભાવ ધરાવવો.

(ii) પૂજ્યભાવ એટલે જગતમાં વિશિષ્ટ વ્યક્તિ તરીકેનો નમ્રભાવ રાખવો.

(iii) સર્વશ્રેષ્ઠ ઉપાસ્યભાવ =

(A) જગતમાં જે વિશિષ્ટ વસ્તુઓ છે એમાં સર્વશ્રેષ્ઠ માનવા.

(B) જગતમાં જે ગુણી વ્યક્તિઓ છે, એમાં સર્વશ્રેષ્ઠ માનવા.

(C) જગતમાં જે ઉપકારી છે, એમાં સર્વશ્રેષ્ઠ માનવા. આ ત્રણના કરણે પરમાત્મા સર્વશ્રેષ્ઠ ઉપાસ્ય એટલે ઉપાસના કરવા યોગ્ય છે. આવા પ્રકારનો હદ્યનો જે ભાવ તે પરમાત્મા વિષયક હોવાથી પરમાત્માને અર્પણરૂપ છે.

૨) શાનાથી આપવું ? :- આ સમર્પણભાવ હદ્યગત વસ્તુ હોવા છતાં જે સાધનોથી ઉપાસ્યની ઉપાસના થાય એ સાધનોથી એ ઉપાસના દ્વારા હદ્યમાં

રહેલા ઉપાસ્યભાવને વવહારમાં પ્રવર્તાવી શકાય છે. તો ઉપાસનાના કારણભૂત ઉત્તમ દવ્યોનું અર્પણ, એમની અનિચ્છિત (નિષિદ્ધ) વસ્તુઓનો ત્યાગ, એમની કોચિત વસ્તુઓનું આચરણ આ બધા ઉપાસનાના પ્રકારો છે. એ ઉપાસ્ય છે અને આના વડે એમની ઉપાસના થાય છે, એવું આપણને અને બીજાને સંવેદન થાય છે. માટે ઉપાસનાના સાધનો વડે ઉપાસના કરવી.

૩) શા માટે આપવું ? :- પરમાત્મા અને આત્મા વચ્ચે રહેલ વિપમત્તાને દૂર કરીને સમતા-તુલ્યતા મેળવવા માટે, પરમાત્માના જેવા બનવા માટે..... કોઈપણ વ્યક્તિની ઉપાસના (સેવા) શા માટે કરવી ? (૧) પોતાની કોઈપણ હંઘાની તૃપ્તિ માટે, (૨) પોતાની માની લીધેલી આપણિના નિવારણ માટે, (૩) ઉપાસ્યની તુલ્ય બનવા માટે.

પહેલા બે કારણો અલ્યકાલીન છે એટલે કાર્ય સિદ્ધ થયા બાદ ઉપાસ્ય છૂટી જાય છે અને ત્રીજા કારણમાં આપણો પોતે જ સર્વગુણસંપત્ત ઉપાસ્યરૂપ બની જઈએ છોએ. માટે મુખ્યત્વે ત્રીજા કારણ માટે ઉપાસના કરવી જોઈએ.

૪) કેવી રીતે આપવું ? :- અવિધિ ટાળીને, અપાતી વસ્તુની પ્રધાનતા અને આપનારની પ્રધાનતા ન થતા જેને આપવું છે તેની પ્રધાનતા થાય તે રીતે. સાંસારિક સર્વ ભાવોથી જે પર છે એમને સાંસારિક સર્વભાવોથી પથાશક્તિ પર (નિવૃત્ત) થતાં કે પર થવા માટે જે કંઈ આપવું તે ઉપાસના.

કોઈપણ ઉત્તમ પુરુષને-પૂરુષ પુરુષને અપાતી વસ્તુની મહત્ત્વ કરતા કોણી મહત્ત્વાથી, કેવી રીતે-શા માટે અપાય છે, એ વધારે મહત્વનું અંગ છે. અવિધિથી આપવું એ પૂરુષતાની અવગારના છે... વસ્તુની પ્રધાનતા કરતા વસ્તુ લેનારની પ્રધાનતા ઘટે એ પણ વસ્તુ લેનારનું અપમાન છે... એ રીતે વસ્તુ લેનાર કરતા આપનારની પ્રધાનતા વધે એ પણ વસ્તુ લેનારનું અપમાન છે. જે અર્પણ કરનાર છે અને જે અર્પણ કરવું છે તેમાં અર્પણ જેને કરવાનું છે તેની અનુકૂળતા જોવી જોઈએ. જે વ્યક્તિ જેને હંઘતી હોય એ વ્યક્તિ સાથે આપણી મિત્રતા તે મૂળ વ્યક્તિને અનુકૂળ થવા બસોબર છે... એ રીતે મૂળ વ્યક્તિની વિરોધી વ્યક્તિઓ પ્રત્યે આપણી ઉપેક્ષા કે વિરોધ એ મૂળ વ્યક્તિ પ્રત્યે મુખ્ય સમર્પણ ભાવ છે. અને વિરોધી વ્યક્તિની મિત્રતા સહિત અર્પણ એ અપ્રધાન અર્પણા અથવા અવજ્ઞા છે.

એથી પરમાત્મા સર્વ પૌરુષિક ભાવોથી રહિત છે. સર્વ પૌરુષિક ભાવો એમના વિરોધી છે. માટે જે વ્યક્તિ પૌરુષિક ભાવોથી રહિત થવા માટે ઉપાસના કરે તે વિધિ ઉપાસનાં છે. ક્યારેક અલ્ય સામર્થ્યમાં પૌરુષિક ભાવોનું આલંબન લેવાનું પણ હોય છતાં મૂળમાં અને છોડવાની દ્રષ્ટિ અને તમના આવે ત્યારે પ્રધાન ઉપાસના બને છે..

૫) શામાં આપવું ? :- પરમાત્માના પરમાત્મ ભાવમાં કે પરમ સામર્થ્યમય આત્મસ્વરૂપમાં આત્માના બહુમાન આદર ભાવોનું સ્થાપવું-આપવું.

### પરમાત્માના બે ભાવો હોય છે

આધ્યાત્મિક-સામર્થ્યવાળા (આત્મસ્વરૂપ)      બૌતિક શક્તિરૂપ (બાધ્યશક્તિરૂપ)

આમાં બાધ્યસ્વરૂપ એ આત્મસ્વરૂપને ન ઓળખી શક્નાર માટે ધર્મની ભૂમિકા સર્જવામાં નિમિત્તભૂત છે અને ધર્મને ઓળખનાર જીવને ધર્મની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિમાં નિમિત્ત છે.

પરમાત્માનું આંતરસ્વરૂપ આંતરિક=આભિક શુદ્ધિના પ્રકર્ષમાં પરમ આલંબન-સહાયક અને રક્ષક છે, એટલે યોગીઓ પરમાત્માના આત્મિક સ્વરૂપનું ધ્યાન કરે છે, સામર્થ્યની સ્તરના કરે છે. બાળજીવો પરમાત્માના બાધ્ય સ્વરૂપની સ્તરના-આલંબન-ધ્યાન કરે છે. આ સર્વ સમર્પણ પરમાત્માને હોય છે.

જે જે જીવને જે જે વસ્તુ વિશેપત્રપે ગમતી હોય, જે જે ચીજો મેળવવા જેવી, વાપરવા જેવી, રાખવા જેવી, આપવા જેવી લાગતી હોય તે તે ચીજોની તે તે પ્રવૃત્તિમાં અને એ રીતે તે તે ગુણોની તે તે વૃત્તિઓમાં હૃદયને આકર્ષણ-આનંદ-ઉત્સાહ અને બહુમાન હોય છે.

સામાન્યથી નાના છોકરાને મિત્રો જોડે રમવામાં, મોટા છોકરાઓને કરવામાં, પુવાનોને ઠડા મશકરીમાં અને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં, વેપારીઓને ધંધામાં, પ્રોફેને માનપાનમાં, નિવૃત્તને પારકી પંચાત્માં રસ હોય છે, એટલે એ વાતમાં પોતાનું ખાવાપીવા વગેરેનું કાર્ય અને બીજા કાર્યોને એ ગૌણ-તુચ્છ સમજીને જતા કરે છે, અને તે જ કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે. એવી રીતે આત્માને પરમાત્માના ગુણોમાં જો રસ હોય તો એ ગુણોને જાળવા, એ ગુણોને વિચારવા, એ ગુણોની સ્તરના કરવી, એ નિમિત્ત એમની સેવા કરવી, એ ગુણોનો અભ્યાસ કરવો, એ ગુણોમાં બીજાને સહાય કરવી, એ ગુણોથી વિરુદ્ધ દોષોમાંથી બચવું, એ દોષોની

ભયંકરતા વિચારવી, એ દોષોની ભયંકરતા બીજાને બતાવવી, એ દોષોની ભયંકરતા સમજવીને બીજાને એ દોષોમાંથી નિવૃત્ત કરવા, પોતે એ દોષોમાંથી નિવૃત્ત થવું, નિવૃત્ત થવા માટે બીજાને સહાય કરવી, આ બધું શક્ય બને.

આ બધું પરમાત્માના બહુમાનનું કાર્ય છે. એથી આ ગુણોમાં આત્માનું જે વલણ એ પરમાત્મભાવમાં આત્માનું આત્મગુણોનું સ્થાપન છે.

(૧) પરમાત્મા (૨) પરમાત્મશક્તિ... (૩) પરમાત્મ સામર્થ્ય-આ ત્રણ વસ્તુને આપણે આપણા અનુભવથી સમજવી જોઈએ... શબ્દમાત્રથી સમજેલી વસ્તુઓનો વ્યવસ્થિત-સચોટ બોધ-અનુભવ જેવો થતો નથી દાત. જન્મથી આંધળાને રૂપનું વર્ણન કે પર્વતનું વર્ણન કરવામાં આવે તો એનો બોધ કરી શકે નહિ અને જે થાય એ કેવળ શબ્દરૂપ હોય છે. વ્યક્ત અનુભવરૂપ હોતો નથી.

એવી જ રીતે પરમાત્માની ઓળખ શાખના શબ્દો દ્વારા શ્રદ્ધાપૂર્વક આપણે કરવા છતાં જેનો જેટલો બોધ વિકસિત થયો હોય, જેનો જેટલો અનુભવ હોય એના બળથી એ પરમાત્માના ગુણોનું કંઈક અનુભવરૂપે, કંઈક પથાસ્થિત કલ્પના રૂપે પીઠાણ જ્ઞાન કરી શકે.

જેવી રીતે છરી આકારથી-ધારના દેખાવથી અને છેદવાના સામર્થ્યથી ભિન્નભિન્ન સ્વરૂપવાળી હોય છે અને તે તે કાર્યના અર્થી તે તે ગુણને અવલંબી તેને અહંકાર કરે છે. નાના છોકરાને રમવા આપવાની છરી આકર્ષક દેખાતી, ધારવાળી છતાં કાપવાના સામર્થ્યરહિત હોય છે. શોકેસમાં મૂકવાની છરી પણ આવા જ મકારની હોય છે, જ્યારે ઉપયોગમાં લેવાનું ચઘ્પુ કદાચ તેવા મકારનું આકર્ષક ન હોય, કદાચ તેવા મકારની ચકચકાટ ધાર ન હોય છતાં પણ કાર્યનો અર્થી એની તીક્ષ્ણતાને જુઓ છે.

એવી રીતે (૧) પરમાત્માનું સ્વરૂપ (૨) બાધ અભ્યંતર બને રીતે પરમાત્માની શક્તિ અને (૩) પરમાત્માનું એ શક્તિના અર્પણનું સામર્થ્ય આ ત્રણે અનુભવવા જોઈએ.

કોઈપણ જીવની આગળ જે વસ્તુનું વર્ણન કરવામાં આવે એ વસ્તુના સ્વરૂપને જો એ અનુભવ દ્વારા પકડે તો જ એનો બોધ વાસ્તવિક થાય.



## ધન્યોડહં કૃતપુણ્યોડહં યત્રાત્મ જિનશાસનમ् ॥

**અ**નંત ઉપકારી અરિહંત પરમાત્માનું તારક શાસન પ્રચંડ પુષ્પોદયે આપણને પ્રાત થયું, જેમાં રહેલી સર્વ આરાધનાઓ, આરાધનાની સામગ્રીઓ અને શાસનના પ્રત્યેક અંગો તારક છે. જરૂર છે એના પ્રત્યે બહુમાન અને શ્રદ્ધા જગ્ગાવવાની. આ બસે તત્વો કોઈપણ આરાધનાના પ્રાણભૂત છે. તે બસે આવતા આરાધનાની તાકાત અને આત્માનો કયોપશમભાવ કંઈક ગણા વધી જતા હોય છે.

શ્રાવક કુળમાં જન્મેલા એક ભાઈ રસ્તા પરથી પસાર થતા હતા ત્યાં અચાનક ચક્કર આવતા ઓટલા પર બેસી ગયા, બેભાન થઈ ગયા. જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવ દેખાયો. કૂકડાના વેપારીને ત્યાં પાંજરામાં પૂરાયેલા પુષ્કાય કૂકડા તરીકે પોતાની જાત દેખાઈ. બીજા કૂકડાઓની હાંસી કરવામાં સમય વીત્યો, ત્યાં એક ઘરાકે ભાવતાલ કરી તેને ખરીદી લઈ થેલોમાં નાખ્યો. મોતના પંજાથી છૂટવા ધમપણાડા કરતા તે કૂકડાએ આજુભાજુ નજર નાખતા એક મહાત્મા દેખાયા. ‘આ સારા માણસ છે, મને બચાવશે’ એમ માની ચીસાચીસ કરી મૂકી. તેથી કંટાળીને માલિકે ગળુ મરડી નાંખ્યું. અંતિમ સમયના સાહુર્દ્ધન અને સાહુ પ્રત્યેના ‘આ સારા માણસ છે’ આવા અભ્યક્ત આદર ભાવના કારણે તે કૂકડો મરીને માણસ થયો, શ્રાવક કુળમાં જન્મ મળ્યો.

કુવલયમાળામાં પણ એક દ્રષ્ટાંત આવે છે. એક જુગારી દુઃખી થઈને મરવા પડ્યો છે. અંતિમ ઘડીઓ ગણતા એને તાપસોએ ઉઠાવી લાવી પ્રભુના મંદિરમાં પ્રભુની દ્રષ્ટિ સન્મુખ મૂક્યો. તે વિચારે છે કે મેં પુષ્પ કાંઈ કર્યું નથી અને પાપો પાર વિનાના કર્યા છે અને તેથી જ આજ સુધી પ્રભુના દર્શન પામ્યો નથી. આજ અંતિમ ઘડીએ પ્રભુના દર્શન પામ્યો છું તો તેનું જે ફળ હોય તે મને મળો. આમ વિચારતાં મૃત્યુ પામી મહાર્દીક વંતર દેવ થયો.

આ રીતે મન, વચન, કાયાથી પ્રભુર્દ્શન-જાપ, પંચપરમેષ્ઠિના દર્શન, જાપ, ધર્મકિયા વગેરે જે કાંઈ ઓધ-આદરથી કરવામાં આવે તો તેનું ફળ સંપ્રતિ મહારાજની જેમ અબજોથી પણ આંકી ન શકાય તેટલું મળે છે, તે નિશ્ચિત

સમજવું. અને એથી પ્રમાદને છોડી બીજા બધા કાર્યો ગૌકા કરીને પણ ધર્મક્રિયા-પ્રભુદર્શન-ભક્તિ વગેરે ખૂબ કરવી. જેનાથી આગળ ભૌતિક ઉત્તુલિ અને ધર્મની મોચ્યતા પ્રાપ્ત થાય છે.

પ્રભુશાસનના કોઈ પણ ધર્મ ઉપર વ્યક્ત આદર ધરાવનાર અને ઉત્તમ ઉપાસના કરનારને દેવલોકથી ઓછું ફળ ન મળે. અવ્યક્ત આદર-ઉપાસનાવાળાને દેવ અથવા મનુષ્યમાં મહાન સમૃદ્ધિવાળું અને ધર્મ પ્રમાય તેવું સ્થાન મળે. માટે શ્રદ્ધા, ઉત્પન્ન કરી, ટકાવી શક્ય-પ્રભુદર્શન-પૂજા-જાપ-ભક્તિ સાથું ઉપાસના-વંદન-સેવા-આદર વગેરેમાં પ્રવર્તનું.

કેવલ પ્રજ્ઞામ કોઈપણ ધર્મ પ્રત્યે અરુચિ-ઉપેક્ષા કે અનાદર કરનારને ઘોર અંતરાય, દુર્ગતિની પરંપરા, રોળીપણું, દુર્ભાગીપણું, દુઃખી દીનપણું અને કમોતે અનેક ભવોમાં મરવાનું મળે છે. માટે ગમે તેવી નુકસાની, આપત્તિ કે વિપરીત સંયોગોમાં પણ ધર્મ, ધર્મ, ધર્મસ્થાન કે ધર્મક્રિયાને અનાદર દ્રષ્ટિથી ન જોવા, તેની અવજ્ઞા ન કરવી, આશાતના ન કરવી, પરંતુ આરાધના ઉતૃષ્ટભાવે કરવી, જેથી સદગતિની પરંપરા દારા અન્તે મોકા સુધી પહોંચી શકાય.



## अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः ।

**“क**पाय अने ईन्द्रियथी छताएलो आ आत्मा ए ज संसार छे” आ सूक्तिमां आंतरिक संसारनु स्वरूप बताववाभां आव्युं. छवि सिवायना बाकीना द्रव्योभां संसार के मोक्ष जेवा कोई अवस्था बेद ज नथी. इक्क पुद्गलद्रव्य संपूर्ण लोकाशमां प्रयोगथी, विलसाथी अने भिन्न, अम त्रिष्ठ रीते गमनागमन करे छे, छतां पुद्गलने संसार कहेवातो नथी कारण के ए संसरणाभांथी क्यारे पश्च कोईपश्च पुद्गलनी मुक्ति-छटकारो ऐटले के कायमी संसरण बंध थवानी अवस्था ज नथी.

जेम छवनी पुद्गलथी मुक्त अवस्थाने मुक्ति कहेवाय छे, अने ए पछी ए छवि कायम भाटे पुद्गलना बंधनथी मुक्त ज रहे छे, तेम पुद्गलो छवथी छुटा पञ्चा पछी क्यारे पश्च कोईपश्च छव जोडे न जोडाय तेवा जनी शक्ता नथी. तेथी पुद्गलोनी मुक्त अवस्था पश्च नथी. आत्मा पुद्गल साथे बंधाय छे तेम पुद्गल आत्मा साथे बंधाय छे, छतां आत्मानी ज बंध अवस्था कहेवाय छे, पुद्गलनी बंध अवस्था नथी कहेवाती. कारण आ संयोग थवाना कारणे आत्माना गुणो विकृत थाय छे के नाश पामे छे, परंतु पुद्गलना गुणो विकृत के नाश नथी थता. भाटे आत्माने बद्ध कहेवाय छे, आत्माने ज मुक्ति कहेवाय छे, अने आत्माने ज संसार कहेवाय छे.

आत्मा ज्यां सुधी पुद्गलथी बंधायेलो छे त्यां सुधी ते संसारी कहेवाय छे, अने ते अनादिकाण्ठी बंधायेलो छे. परंतु कोईपश्च आत्मा पुद्गलथी संपूर्ण मुक्त थया बाट क्यारे पश्च फरी बंधातो नथी अने मुक्त थया वगरनो अनादिकाण्ठी कायमनो मुक्ति कोईपश्च आत्मा होतो नथी.

अनादिकाण्ठी बंधायेल आत्माने बे प्रकारना बंधन छे-(१) ते ते भव पुरता ज शरीरना बंधन अने (२) भवांतरो सुधी साथे रहे तेवा शरीरना बंधन. आमां ग्रथम बंधन स्थुल रीते औदारिक, वैकिय के आहारक शरीरनु होय छे अने बीज्ञु बंधन तैजस अने कार्मण शरीरनु होय छे. आ तैजस शरीर भेवोभव साथे आवे छे. कार्मण शरीरनी जेम आ तैजस शरीर पश्च अनादि छे अने

ઘોદારિક, વૈકિય, આહારક શરીર પર અનુગ્રહ કરે છે. આ ચારે શરીરનો આધાર અને સંસારની સર્વ અવસ્થાઓનો આધાર કાર્મણ શરીર છે.

કાર્મણ શરીરના બે બેદ છે-(૧) આત્મા પર લાગેલ બધા જ કર્માનો સમુહ એટલે કે આત્મા ઉપર કર્મરૂપે પરિણમીને રહેલ કાર્મણ વર્ગણા તે કાર્મણ શરીર (૨) નામકર્મના અવાંતર બેદરૂપ કાર્મણ શરીર નામકર્મ. આ કાર્મણ શરીર નામકર્મ ઉદ્યમાં આવે એટલે જીવ તે કાળે પ્રવર્તમાન યોગના કારણે કાર્મણ વર્ગણાઓ (QUANTITY) જથ્થામાં ગ્રહણ કરે અને પદ્ધી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના કારણો અનુસાર અમાં (QUANTITY) રસબંધના બેદોનું નિર્માણ થાય. કાર્મણ વર્ગણામાં QUALITY નથી હોતી, છતાં મિથ્યાત્વ આદિ બંધ હેતુઓના કારણે ગ્રહણ કરતી કાર્મણ વર્ગણામાં એટલે કે બંધાતા કર્મમાં QUALITY ઉત્પન્ન થાય છે. એટલે કે કાર્મણ શરીર નામકર્મના ઉદ્યથી જીવ કર્મરૂપ શરીર=૧૫૮ પ્રકૃતિરૂપ શરીર બનાવે છે.

કાર્મણ શરીરરૂપે રહેલ કર્માના ૧૫૮ બેદો છે. તેમાંના કેટલાક કર્મો જીવને નિત્ય બંધાય છે, નિત્ય ઉદ્યમાં હોય છે; કેટલાક વિકલ્પે બંધાય, નિત્ય ઉદ્ય હોય; કેટલાક નિત્ય બંધાય પડ્ય ઉદ્ય વિકલ્પે હોય; કેટલાક વિકલ્પે બંધાય, વિકલ્પે ઉદ્યમાં આવે. આ કર્માના ઉદ્યથી જીવોમાં અનેક વિકૃતિ-અવસ્થાનાર આવે છે.

આ કર્મના આઠ બેદ છે, તેમાં સંસારમાં જીવને ભમાઇનાર મુખ્ય મોહનીય કર્મ છે, પરંતુ મોહનીય કર્મને બળવાન બનાવનાર જ્ઞાનાવરણ કર્મ છે. અજ્ઞાનથી મિથ્યાત્વ આવે છે, મિથ્યાત્વથી કષાય અને નોકષાય જોર પકડે છે અને નોકષાયોથી વિષયો અને ઈન્દ્રિય જોર પકડે છે. માટે સંસારનું મૂળ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. આ બનેથી ઉભા થતા કષાય, નોકષાય અને ઈન્દ્રિયો દ્વારા બધો સંસાર ઉત્પન્ન થાય છે. તેમનો નાશ કરવા માટે-શાલજ્ઞાન દ્વારા જ્ઞાનાભાવ અને અનાદિકલીન મોહવાસના મિશ્રિત વિપરીત જ્ઞાનના સ્વરૂપને જાણી, તેના નુકશાનો જાણી તે છોડવું જોઈએ. આ શાલજ્ઞાનમાં બતાવેલી ભાવનાઓના ચિંતન-મનન દ્વારા વિષય-કષાયોની ઉપાદેયતાની બુદ્ધિ, તેમાં સુખની બુદ્ધિ ઘટે છે, આ ઘટે તેમ મિથ્યાત્વ મોળું પડે, અને બીજી બાજુ ઈન્દ્રિયના વિષયોના શક્ય લાગ દ્વારા વિષયાસક્તિના નુકશાનો વિચારવાથી અને ઈન્દ્રિયનિગ્રહના લાભ

વિચારવાથી ઈન્દ્રિયજ્ય દ્વારા કૃપાય-નોકૃપાય ઉપર જ્ય મેળવવાય છે. આ રીતે જ્ય મેળવનાર આત્મા મોક્ષ જ્ય છે. માટે તે જ મુક્તિ છે, અને કૃપાય અને ઈન્દ્રિયથી જીતાપેલા આત્મા એટલે કે કૃપાય અને ઈન્દ્રિયને પરવશં આત્મા અજ્ઞાન અને મિથ્યાત્ત્વને પરવશ બને છે, અને સંસારમાં સુદીર્ઘ કાળ રખે છે. માટે પરવશ બનનાર આત્મા એ જ સંસાર છે.

જે કૃપાય-ઈન્દ્રિય પરવશ હોય તે પ્રાય: મિથ્યાત્ત્વ તેમજ અજ્ઞાન પરવશ હોય ને સંસારમાં ભટકનાર બને. જે કૃપાય-ઈન્દ્રિય પરવશ ન હોય તેનામાં અજ્ઞાન અને મિથ્યાત્ત્વ પ્રાય: ન હોય, કદાચ હોય તો પણ ઘટતા જતા હોય અને તેના કારણે જ્ઞાન-દર્શન-ચારિત્રકૃપ મોક્ષમાર્ગને સન્મુખ બનેલો હોય છે.

માટે જ અચરમાવર્તમાં કૃપાય તેમજ ઈન્દ્રિયની પરવશતા બતાવી છે, અને અપુનર્બન્ધકથી કૃપાય-ઈન્દ્રિય ઉપરનો કમિક જ્ય કહેલ છે. માટે કૃપાય અને ઈન્દ્રિયનો જ્ય એ મોક્ષમાર્ગ છે. ઈન્દ્રિય પર જ્ય મેળવવા વિષયોનો ત્યાગ અને વૈરાગ્યની ભાવના કરવી. વિષયોના ત્યાગ અને ભાવનાથી નોકૃપાયનો પણ જ્ય થાય. જેમ જેમ નોકૃપાયનો જ્ય થાય તેમ તેમ કૃપાયો પણ મંદ થાય છે. આમ શાલે અધ્યયન અને ભાવનારૂપી જ્ઞાનથી તેમજ આચારની ચીવટથી મિથ્યાત્ત્વ, અજ્ઞાન, કૃપાય અને નોકૃપાયનો છ્ણાસ થાય છે. તેથી જ શાલેમાં જ્ઞાનયોગ અને કિયાયોગથી મોક્ષ કલ્યો છે. કૃપાય જ્ય તે જ્ઞાનયોગ છે, ઈન્દ્રિય જ્ય તે કિયાયોગા છે. સંસાર અસત્ત્જ્ઞાન અને અસત્તકિયાથી ઊભો થાય છે. અને તેનો નાશ સત્તજ્ઞાન અને સત્તકિયાથી થાય છે.

માટે આચાર, અભ્યાસ અને ભાવનામાં પ્રયત્ન કરવો, જેથી સિદ્ધિગતિ શીધ્ર પ્રાપ્ત થાય.



## મહિંમાગવતી વીજ પરમાનંદસંપદામ्

**“શ્રી** પરમાત્માની ભક્તિ એ પરમ આનંદરૂપ લક્ષ્મીનું બીજ છે.” આમાં તરફ વાત જતાવી છે-(૧) ભક્તિ ભગવાનની, પણ બીજાનો નહિ, (૨) બીજ પરમાનંદ લક્ષ્મીનું, પણ બીજ લક્ષ્મીનું કે બીજ વસ્તુનું નહિ, અને (૩) બીજ ભક્તિને જતાવ્યું છે, પણ બીજ વાતને બીજ નથી જતાવ્યું. આ ત્રણેનો વિચાર કરવાનો છે.

શ્રી પરમાત્મા ભૌતિક અને આધ્યાત્મિક સર્વ શક્તિઓના મૃકૃષ્ટ સ્થાને છે, તેથી તેઓ બધી જ શક્તિઓના બીજ છે, છતાં બધી શક્તિઓમાં ચદિપાતી શક્તિ પરમાનંદ છે. માટે લક્ષ્ય તરીકે તે જતાવ્યો છે. પરમાનંદ વીતરાગપણા વગર અને કેવળજ્ઞાન વગર નથી હોતો, માટે પરમાનંદમાં વીતરાગપણું અને કેવળજ્ઞાન પણ આવી જાય.

વળી પરમાત્માની ઉપાસનાથી મળતી ભૌતિક શક્તિ પણ સ્થાયી નથી. અનુસ્વરૂપ નાશવંત છે. તેથી એ તુચ્છ-અલ્યકાલીન છે અને ક્યારેક દુર્ગતિનું કારણ બને છે. તેથી ભૌતિક કોઈ શક્તિ ઈચ્છવા જેવી નથી.

આધ્યાત્મિક શક્તિઓનાં તરતમલેદે અને સ્વરૂપલેદે અનંત પ્રકારો છે. પરંતુ બધી જ શક્તિઓ પરાકાશાએ પરમાનંદની સાથે સંકળાયેલ છે. તેથી પરમાનંદ સંપદામાં કોઈપણ આધ્યાત્મિક શક્તિ બાકી નથી. તે બધામાં પરમાનંદને જ મુખ્યતા આપેલ છે કારણ સંસારી જીવો આનંદ-સુખ માટે જ બધી પ્રવૃત્તિ કરે છે. તેમને આત્મિક પરમાનંદ જતાવવાથી તેઓ તે તરફ ખેંચાય.

વીતરાગતા વગર પરમાનંદ આવતો નથી. રાગ, દ્રેષ્ટ, કપાય, વિષયોનું ખેંચાડા-આ આનંદનો અનુભવ થવા દેતા નથી.

પરમાત્મા પાસે પરમાનંદ મેળવવા અસંખ્ય યોગોથી, અસંખ્ય પ્રકારોથી પરમાત્માની અને એમની આજ્ઞાની ઉપાસના થતી હોવા છતાં અહીં ભક્તિને જ જતાવી છે, કારણ પરમાત્માની ભક્તિ જો બધા જ યોગોમાં વણાય તો તે યોગ મોક્ષનો યોગ બને છે.

પરમાત્માની ભક્તિ જ કેમ? યોગની ભક્તિ ચાલે કે નહિ? એ એક પ્રશ્ન છે. પણ આ પ્રશ્ન મહાન અજ્ઞાનતા સૂચક છે, કારણ કે ડોક્ટરની શ્રદ્ધા વગર કે દવા બનાવનાર કંપનીની શ્રદ્ધા વગર દવા કંઈ કામ ન કરે. માટે બધે

લોકવ્યવહારમાં અજ્ઞાનને એના જાગ્રત્તારના વચન ઉપર વિશ્વાસ રાખવાનો હોય છે, અને એના કલ્યા મુજબ કરવાનું હોય છે. જેને નિયત કાર્યની જરૂર હોય અને તેના જાગ્રત્તારને પૂછવા જાય ત્યારે તે માર્ગ-ઉપાય બતાવે. આ જરૂરિયાત, જાગ્રત્તારને પૂછવું અને તેના કલ્યા મુજબ વર્તવાની તૈયારી-તે ભક્તિ છે.

પરમાત્મા મોક્ષના અસંખ્ય યોગોના માલિક છે. એમની ઉપરના શ્રદ્ધા-સમર્પણથી એટલે કે સ્મરણ-શરણ-સમર્પણ અને સમાપત્તિના કમથી ભક્તિ કરવાથી પોતાના આલંબન દ્વારા પરમાત્મા ઉપાસક જીવને આગળ વખતા માટેના ક્ષયોપશમ-પુષ્ટય-ઉત્સાહ અને પુરુષાર્થ આપે છે.

પરમાત્માની મૂર્તિની પૂજા-સ્મરણ-જાપ-સ્તવના તથા આજ્ઞાને જાગ્રત્તારની, સમજવાની, યાદ રાખવાની અને આચરવાની ભાવના, શક્ય આચરવું વગેરે અનેક પ્રકારે ભક્તિ છે. બધામાં પ્રભુચિંધ્યા માર્ગ જવાનું હોય છે. પરમાત્માના માર્ગ ઉપરની અનન્ય શ્રદ્ધા ભક્ત જીવને પરમાત્મા બનાવે છે. દેવની શ્રદ્ધા વગર ગુરુ અને ધર્મની શ્રદ્ધા સફળ બનતી નથી. ગુરુ કે ધર્મની શ્રદ્ધા પછી પણ દેવની શ્રદ્ધા આવે તો જ પૂર્ણ બને છે. કારણ કે છભસ્થનો કરાતો ધર્મ ખોડખાપશવાળો અને અપૂર્ણ હોય છે. ગુરુ પણ છભસ્થ, શક્તિથી અધુરા અને દોષથી યુક્ત છે, છતાં કેવળજ્ઞાની પરમાત્માએ કહેલા ધર્મને લક્ષમાં રાખી શક્યતા મુજબ જે છભસ્થો ધર્મ કરે છે તે કરણીય, પ્રશંસનીય અને અનુમોદનીય છે. માટે પરમાત્માની શ્રદ્ધાથી જ ધર્મની શ્રદ્ધા વાસ્તવિક છે. એવી જ રીતે પરમાત્માના વચનાનુસાર વર્તવા મથતા મહાત્રતધારી ગુરુવર્યો જ સાચા ગુરુ છે. જો પરમાત્મા અને પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા ન હોય તો ગુરુ ઉપરની શ્રદ્ધા પણ વાસ્તવિક નથી. ભગવાન ઉપરની શ્રદ્ધા તેમના શાસનના દરેક અંશ ઉપર શ્રદ્ધા લાવે છે તેથી પરમાત્મા ઉપરની ભક્તિથી પરમાત્માના શાસનના દરેક અંગની ભક્તિ આવે છે. તેથી પરમાત્માની ભક્તિમાં શાસનના બધા જ અંગની ભક્તિ સમાયેલી છે, ફક્ત જો તે તે અંગોમાંથી કોઈપણ અંગ પ્રત્યે અરુચિ કે ઉપેક્ષા ન હોય તો...

માટે શાસનના કોઈપણ અંગની આરાધના જો પરમાત્માના વચનની ઉપેક્ષા કે અરુચિ વગરની હોય, રૂચિપૂર્વકની હોય તો તે પણ પરમાત્મ ભક્તિ છે. ફક્ત શાસનના તે તે અંશની ભક્તિમાં પ્રથમ તે અંશ વિકસે, પછી બીજા બધા વિકસે; જ્યારે પરમાત્મ ભક્તિમાં, સંયમ પાલનમાં, પંચાચારમાં બધા જ અંગો એક સાથે વિકસે છે. માટે પરમાત્મ ભક્તિ એ સર્વ ગૃહો અને સર્વોત્કૃષ્ટ સુખનું બીજ બતાવ્યું છે.

## ‘‘તદેવ હિ તપ: કાર્ય’’

**ડ**પના બે પ્રકાર બતાવ્યા છે... (૧) સત્તતપ અને (૨) અસત્તતપ... આ જ રીતે કહેવાતા દરેક ગુણો અને શુભ પ્રવૃત્તિના બે બેદ પડે-સત્ત અને અસત્ત જેમ પાપ પ્રવૃત્તિમાં-દોપોમાં દુઃખદાયકપણું અને દુર્ગતિદાયકપણું છે, માટે અસત્ત કહેવાય, તેમ શુભ પ્રવૃત્તિ કે ગુણોમાં પણ વાસ્તવિક વિશિષ્ટ ગુણપ્રામિપણું ન થાય, મામુલી ફળથી અટકી જાય ત્યારે તેને પણ અસત્ત કહેવાય છે.

શુદ્ધ શાનયુક્ત બાર પ્રકારનો તપ તે સત્તતપ છે, અને એનું ફળ કપાયોનો રોધ અને છ્રાસ છે. ઉદ્યમાં આવતા કપાયોને જે અટકાવે તે રોધ કહેવાય અને કપાયો ઉદ્યમાં આવે જ નહિ કે અતિ મામુલી આવીને ચાલ્યા જાય તે છ્રાસ કહેવાય. જે તપમાં તેના પૂર્વ ઉત્તર કાળમાં પણ બ્રહ્મધ્યાન અને શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન હોય, અર્થાત્ શુદ્ધ આત્મા સિદ્ધાત્મા તેનું ધ્યાન, ભાવના અને લક્ષ હોય તે બ્રહ્મધ્યાન કહેવાય અને ઉપચારથી સિદ્ધ સ્વરૂપના કારણભૂત સંયમ, સ્વાધ્યાય વગેરેને પણ બ્રહ્મ કહેવાય. તેથી તે સંયમ સ્વાધ્યાયના લક્ષ સાથે જે તપ કરવામાં આવે તેને સત્તતપ કહેવાય. વળી આમાં શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન અને પૂજા હોય અર્થાત્ ગૃહસ્થોને શ્રી તીર્થકર પરમાત્માની દ્રવ્યપૂજાપૂર્વક આજ્ઞા આપાવા, સમજવા અને શક્ય પાળવા દ્વારા આંશિક ભાવપૂજા પણ હોય, અને સાધુને દ્રવ્યપૂજા સામાન્યથી ન હોવા છતાં નામસ્મરણ, જાપ વગેરે સાથે આજ્ઞાપાલન-સ્વાધ્યાય-સંયમ વગેરે હોય તો તે જિનેશ્વર દેવોની ભાવપૂજા છે.

આ રીતે કપાયોનો રોધ, અટકાવ અને જિનાજ્ઞાનું લક્ષ જ્યાં હોય ત્યાં તપ શુદ્ધ છે, તથા કોઈપણ સત્ત કિયાઓમાં જ્યાં કપાયોનો નિગ્રહ અને સિદ્ધ સ્વરૂપના કે એના સાધનના લક્ષ સાથે આજ્ઞા પારતંત્ર-આજ્ઞાપાલનનું લક્ષ હોય તો તે કિયા પ્રધાનત્યા શુદ્ધ કહેવાય. બાકી વ્યવહારથી શુદ્ધ હોવા છતાં વાસ્તવમાં શુદ્ધિની ગૌહાતા હોય અથવા અશુદ્ધપણું હોય. આ શુદ્ધ ન હોય તેવા ઉપવાસ આદિ તપને લાંઘણ કહેવાય છે. અહીં લાંઘણનો અર્થ વિશિષ્ટ ફળનો અભાવ લેવો. સામાન્ય પુણ્યબંધ થાય. વિશિષ્ટ પુણ્યબંધ કે આત્મગુણો પ્રગત ન થાય.

તપ આત્મશક્તિઓનું સમ્યકું ઉત્થાન અને ચિત્તવૃત્તિનો નિરોધ કરનાર છે. ચિત્તની જે વૃત્તિઓ ક્રપાય-નોક્રપાય-ચાંચલ્ય-માનપાન-અશારામ-ક્રદ્રિ-ગૃદ્રિ-ગારવો વળેરેથી તથા મનમાં ઉઠતા તરંગો-અનુકૂળતાના બેંચાણથી દૂધિંત થાય છે અને તેનાથી સંસારી જીવને જે જે ઈચ્છાઓ જન્મે છે, તેનો નિરોધ થાય છે.

શુદ્ધ જ્ઞાનયુક્ત તપથી આત્મામાં એક વિશિષ્ટ પ્રસમતાની અનુભૂતિની શક્તિ ઉત્પત્ત થાય છે, જેના કારણે અશુદ્ધ ચિત્તવૃત્તિઓ રોકાય છે. જીવ સહેજે મનને રોકી શકે છે. બહુધા મનમાં વૃત્તિઓ-ઈચ્છાઓ જન્મતી જ નથી. મનની જે અનેક પ્રકારની કાષાયિક-વૈષયિક અને પરચુરણ ચંચલવૃત્તિ છે તે રોકવાની શક્તિ શુદ્ધ-જ્ઞાનયુક્ત બારે પ્રકારના તપની પ્રવૃત્તિથી ઉત્પત્ત થાય છે. આ આત્મશક્તિનું ઉત્થાન એ તપનું વાસ્તવિક આંતરિક કાર્ય છે અને ચિત્તવૃત્તિ નિરોધ એ બાબુ કાર્ય છે.

(૧) તિતિક્ષા એટલે પ્રસમતા અને સમતાપૂર્વક સહન કરવું, (૨) બ્રહ્મચર્ય=આત્મભાવના અને (૩) ગુરુ; આ બધા આંતરિક ગુણોનું સ્વાન શુદ્ધજ્ઞાનયુક્ત બારે પ્રકારનો તપ છે. માટે તપનું લક્ષણ ભૂખ સહન કરવી કે કૃશપણું નથી, પરંતુ ઉપરોક્ત તિતિક્ષા-બ્રહ્મ અને ગુરુ છે.

ચન્દ્રન જેમ ગંધ સાથે એકમેક હોય છે, તેવી રીતે શુદ્ધજ્ઞાનથી એકમેક થયેલ બારે પ્રકારનો તપ એ આત્માને વિશિષ્ટ નિર્જરા કરાવે છે.

આ ભૂમિકાએ ન પહોંચેલા જીવો પણ જો પ્રભુ ઉપરની ભક્તિથી અને શાસન પ્રભાવનાની ઈચ્છાથી તપ કરે તો એ તપસ્વી ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે અને પછી કાળકમે તેને વિશિષ્ટ શુદ્ધ તપ પ્રામ થાય છે. અને સ્પૃહારહિત શુદ્ધ તપ કરીને શીંગ કર્મથી છૂટીને મોક્ષ પામે છે. જે જીવ કર્મને તપાવનાર જ્ઞાનરૂપી તપને નથી જાડાતો તે તપના મર્મને નહિ જાણનાર જડ બુદ્ધિવાળો અત્યંત નિર્જરા શી રીતે પ્રામ કરે ? અર્થાત् વિપુલ નિર્જરા પ્રામ ન જ કરે.


અજ્ઞાની કરોડો ભવોના તપથી જે કર્મ ખપાવે છે તે કર્મ જ્ઞાનરૂપી તપવાળો-જ્ઞાનયુક્ત તપવાળો કલાવારમાં ખપાવે છે. માટે જ્ઞાનયોગ એ શુદ્ધ તપ છે, એમ મુનિપુંગવો કહે છે. જ્ઞાનયોગથી નિકાચિત કર્મ પણ કષય પામે છે. માટે જ્ઞાનમય તપસ્વી એ શુદ્ધ તપસ્વી છે, અને બાબુ નિર્જરાયુક્ત છે.

બાબુ અને અભ્યંતર બસે પ્રકારના તપના બાર પ્રસિદ્ધ બેદો અને બોજા પણ અવાંતર બેદો સ્થૂલદ્રાષ્ટ્રથી અભવ્ય જીવને અને અચરમાવર્તમાં પણ છે.

છતાં વિશિષ્ટ નિર્જરા અને વિશિષ્ટ ગુણ માહુર્માં કરાવનાર નથી, કારણ તે તપ શુદ્ધ નથી, વિશિષ્ટ જ્ઞાનથી યુક્ત નથી.

તપથી થતી નિર્જરામાં જ્ઞાનને મુખ્ય કારણ બતાવ્યું છે, તેમાં જ્ઞાનનું શુદ્ધપણું એ મહત્વનું છે. જેમ જ્ઞાન વગરનો તપ વિશેષ નિર્જરા કરતો નથી, તેમ અશુદ્ધ જ્ઞાન પણ વિશિષ્ટ નિર્જરાનું કારણ બનતું નથી. બાબુ-અભ્યંતર તપથી બાળજીવોને કર્મધ્રાસ થાય છે અને કાંઈક શુદ્ધ અને વિશેષ પુષ્ય મળે છે. તપની શ્રદ્ધાથી પરમાત્મા ઉપર શ્રદ્ધા અને તપના લાભના અનુભવથી પરમાત્માની આજ્ઞાના પાલનમાં લાભની શ્રદ્ધા ઉત્પત્ત થાય છે, અને તે શ્રદ્ધા વિશેષ પુષ્ય અને પરમાત્મા જેવી વિશિષ્ટ પુષ્યપુરુષની પ્રાપ્તિ કરાવે છે. જેનાથી શુદ્ધ યુક્ત જ્ઞાન પ્રગટ થતા વિશિષ્ટ નિર્જરાનું કાર્ય તરત થાય છે. માટે શુદ્ધ જ્ઞાનની શક્તિ-સામગ્રીવાળાએ શુદ્ધ જ્ઞાનપૂર્વક તપ-ત્યાગ-સંયમ વગેરે ગુણોની સાધના કરવી, અને જ્ઞાન વગરના કે જ્ઞાનની શુદ્ધ વિનાનાએ પણ પ્રભુભક્તિ-શાસનપ્રભાવના-સંજ્ઞાજ્ય, કર્મધ્રાસ - ગુણઅભ્યાસ વગેરે લક્ષ્યથી પણ તપ અને સંયમ પાળવા. તેનાથી શુદ્ધ અને જ્ઞાન કાળકમે મળે છે અને સર્વ નિર્જરા પામે છે. માટે પહેલા બતાવેલ તપનું સ્વરૂપ વાસ્તવિક હોવા છતાં તે ભૂમિકા સુધી ન પહોંચનાર. પણ વર્તમાનકાલીન તપ વગેરે અલ્ય નિર્જરા દ્વારા પ્રધાન નિર્જરા અને મોક્ષનું અંગ બને છે. માટે બાબુ તપ અને તપસ્વીની કોઈએ કયારે પણ નિંદા ન કરવો.

બાબુ તપ એ પણ મોક્ષમાર્ગ છે, જેમ શ્રીપરાજર્ખ અજ્ઞાર્થના કારણે તપ ઉપર ચઢ્યા, પછી ધ્યાન ઉપર ચઢ્યા, પછી વિભંગજ્ઞાન થયું, અને પરમાત્મા મહાવીરદેવ મળ્યા અને સંયમ પામી મોક્ષ ગયા. તેથી તપ-ત્યાગ અને બાબુ સંયમ એ પણ આંતર ગુણોના કારણરૂપ છે. માટે એમાં પ્રયત્ન કરવો.



॥ અસુહકિરિયાણ ચાઓ,  
સુહાસુ કિરિયાસુ જો ય અપ્પમાઓ ॥

**ન**વપદના દરેક પદમાં નવપદ વણાયેલા છે. છતાં બાળજીઓને એક-એક પદની મહત્તમ સમજાવવા માટે એક-એક પદની આરાધના કહી છે.

ગણિત આમ એક; પણ ગુણાકાર, ભાગાકાર, બાદબાડી, સરવાળા જુદા-જુદા બતાવ્યા. ભાગાકાર બતાવે ત્યારે ગુણાકાર ન બતાવે, ને બાદબાડીની વાત ચાલતી હોય ત્યારે ભાગાકારની વાત ન હોય. તેમ આપણા હૃદયમાં મહત્તમ વધે માટે દરેક પદની વાત જુદી જુદી બતાવી છે.

પરંતુ, તત્ત્વદાસિએ નવપદના પ્રત્યેક પદમાં નવપદની આરાધના છે. સામાયિક કરીએ, નવકાર ગણીએ તો પણ નવપદની આરાધના છે. વિવક્ષા તરીકે જુદી કહી છે. અર્થાતું અમુકને શાનની, અમુકને દર્શનની, અમુકને ચારિત્રની આરાધના કહેવાય, તેમ વિભાગ પાડ્યા છે.

ચારિત્ર પદની આરાધના એટલે કઈ આરાધના ? આશ્રવની કે સંવરની પ્રવૃત્તિ? સંવરની પ્રવૃત્તિ.

ચય = એકઠાં કરેલાં કર્માને ખાલી કરે તે ચારિત્ર.... બાબ્દ પાપપ્રવૃત્તિથી નિવૃત્ત થઈને અંતરના પાપ પરિણામોને નિવૃત્ત કરવા તે ચારિત્ર.

પ્રથમ બહારથી નિવૃત્ત થવું, બહારથી નિવૃત્ત થાય નહિ તો અંદરના પરિણામો નિવૃત્ત થાય નહિ અને ત્યાં સુધી ચારિત્ર આવે નહિ. બહારથી નિવૃત્ત થયા પછી અંદરથી અરુચિ રાખે તો અંદરની નિવૃત્તિ કહેવાય.

મનમાં પાપપ્રવૃત્તિનું ખેંચાણ હોય તો ચારિત્ર દૂર છે. મનમાં ધર્મપ્રવૃત્તિનું ખેંચાણ છે, સંવરની પ્રવૃત્તિ છે તો ચારિત્ર નજીક છે.

ભગવાનની પૂજા ચારિત્રની નજીક કે દૂર ? ભગવાનની ભક્તિ, ગુણગાન, તે બધાં કાર્યનું કણ સંવરની પ્રામિ, આશ્રવની નિવૃત્તિ છે, માટે તે ચારિત્રની નજીક લઈ જાય છે.

ટી.વી.ની, સમાચાર પત્રોની, રેડિયોની પ્રવૃત્તિ ચારિત્રથી દૂર ખસેડનાર છે.

જેને બાધ્ય મોજશોખની પ્રવૃત્તિમાં રસ છે તે પ્રવૃત્તિ આત્માને શું કરે ? બાધ્ય સાંસારિક પ્રવૃત્તિનો રસ ચારિત્રના રસને, વૈરાગ્યના રસને તથા તપના રસને મોળી પાડે.

એટલે ચારિત્રની પ્રામિ ભૂમિકા વગર થતી નથી, ભૂમિકા વગર ટકી નથી. ચારિત્રની પ્રામિ થયા પછી તેને ટકાવવા માટે નીચેના પગથિયાના ટેકા વિના ઉપરની ભૂમિકા રહી ન શકે.

વિશિષ્ટ અધ્યવસાય, વિશિષ્ટ પ્રવૃત્તિ, વિશિષ્ટ ભાવોલ્લાસ ઓછાવતા કેમ દેખાય છે ? નીચેના પાયા મજબૂત કર્યા વિના ઉપરનું ચણતર કર્યે જઈએ તો ચાલે નહીં.

તો આશ્રવની નિવૃત્તિ વગર સંવરની પ્રવૃત્તિ આવે નહિ, આશ્રવની નિવૃત્તિ માટે આશ્રવનો ભય જોઈએ. આશ્રવનો ભય તે સમ્યગ્દર્શન છે ને આશ્રવની નિવૃત્તિ તે ચારિત્ર છે. દોષનો ભય અને દોષની નિવૃત્તિ જોઈએ; દોષનો ભય તે સમ્યગ્દર્શન છે, ને દોષની નિવૃત્તિ તે ચારિત્ર છે. પાપનો ભય એ નીચેની ભૂમિકા છ.... ને પાપની નિવૃત્તિ ઉપરની ભૂમિકા છે.

ખાવાનો ભય જેને ન આવે તેને આહારસંશ્શા પર તિરસ્કાર ન આવે... “ખાવું એ મારો સ્વભાવ નથી, આવી વિચારણા જેની ન હોય તેને તપ આવે તો ખરો, પણ પુષ્પના આલંબનથી આવે; ગતાનુગતિકતાથી આવે... તેને તપના પારણા ને અત્તરપારણામાં જ આનંદ આવે.

દીક્ષા લીધા પછી આત્મા ગુણો કેળવવા યોગ્ય બને છે. ભાવધર્મની દીક્ષા પછી વ્યવહાર ધર્મની દીક્ષા અપાય તેવું નથી. વ્યવહાર દીક્ષા પછી ભાવ દીક્ષા આવે.

ચારિત્ર બહાર હોય તો અંતરમાં આવે. બહારમાં લાવવું નથી, અંતરમાં ઈચ્છા કરવી નથી, અંતરમાં આશ્રવ પ્રત્યે તિરસ્કાર પેદા કરવો નથી, પછી ચારિત્ર ક્યાંથી મળે ?

કો'કટિવસ પેસા ગણતી વખતે વિચાર આવે કે “આ પેસો મને સંસારમાં ભટકાવનાર છે?” અંતરમાં સમ્યકૃત હોય તો આવો વિચાર આવ્યા વિના ન રહે.

જેને આશ્રવ પ્રત્યે અસુધી નથી, જેને આશ્રવ પ્રત્યે ભય નથી, જેને આશ્રવ પ્રત્યે હદ્યમાં હંડક છે, તેને સમ્યકૃત ન હોય.

બાધ્ય રીતે આચારમાં જેટલી ચુસ્તતા, મક્કમતા આવે તેટલી અંતરમાં ચારિત્રની ઈચ્છા પ્રબલ થાય.

માટીને દાબી દઈએ તો અનાજ ન ઉગે. માટીને ખોદીએ તો અનાજ થાય...  
માટી એકની એક છે, પણ કેટલો ફરક ? એક કઠોરને એક પોચી... તેમ જેને  
પાપનો ભય થાય તે પોચો થાય છે, તેમાં ધર્મ ઉગે છે. જેને પાપનો ભય  
નથી, આશ્રવ પ્રત્યે મીઠાશ છે, તે કઠોર થાય છે, તેમાં ધર્મ ઉગતો નથી.

કઠોર કોણ ? પાપનો ભય જેનામાંથી નીકળી જાય તે...

જે આત્મામાં પાપ પ્રત્યે અરુચિ આવે અને પાપનો ભય આવે તે આત્મામાં  
કોમળતા આવે... ઉપાશ્રયમાં કીડી નીકળે ને ઘરમાં કીડી નીકળે- તો બસેની  
કાળજીમાં ફરક પડે છે. જ્યથાં બધા કાર્યની અંદર જોઈએ...

જમવા બેસો તો નીચે દાઢો પડે તો ચલાવાય નહિ. વસ્તુ એંઠી મૂકો તો  
ચલાવાય નહિ. આજે થાળી ધોઈને પીવાની એવો દરેક ઘરમાં કાયદો નથી.  
અમે એકેય પાતરાં ધોયાનું પાણી પરછવીએ નહિ, પી જઈએ. અને તમારે ત્યાં  
થાળીનો એઠવાડ ગટરમાં નંખાય. ગટરમાં નાંખો તો મસ્ઝર થાય, સંમૂચીંમ  
જીવો થાય. પાછળ આશ્રવો કેટલા ?

આશ્રવનો ભય ગયો એટલે આવું થાય... ઘરમાં વાસણ કેટલાં જોઈએ ? બે  
થાળી હોય તો ચાલે... કરકસરથી વપરાય... વધારે વાસણ હોય તો વધારે બગડે.  
રાખવા પડે તે વાત જુદી; પણ બને તેટલા ઓછા રાખવા. જ્યથાંથી કામ કરવું  
આવી વાતો પાપનો ભય હોય તેના જીવનમાં આવે. જેના જીવનમાં પાપનો  
ભય નથી તેનું “બારદાન હાજર, માલ ગેરહાજર” જીવો ઘાટ થાય.

બારદાન સારુ બનાવવા કોણ મહેનત કરે ? માલ વહેંચવો હોય તે.

બહાર આબરુ જોઈએ તો બારદાન સારુ. આજે લોકોને ધર્મકિયા,  
ધર્મસ્થાનોમાં જવાથી આબરુ વપશે આવી વિચારણા નથી, નહીંતર આબરુ  
જમાવવા ખાતર પણ ધર્મકિયા કરે.

જૂનાકાળમાં ચાંદલો જોઈને વ્યવહાર કરતાં હતાં, અત્યારે ચાંદલો જોઈને  
દૂર ભાગે. જેને ધર્મ નથી ગમતો તેવાની સાથે વ્યવહાર જેને ગમે તે વ્યવહારથી  
પણ ધર્મ ન કહેવાય, પણ જેને ધર્મ નથી ગમતો તેવાની જોડે જેને વ્યવહાર  
નથી ગમતો તે વ્યવહારથી ધર્મ કહેવાય છે. જે વ્યવહારથી ધર્મરહિત છે તેની  
જોડે વ્યવહાર રાખે તો તેને વ્યવહારથી ધર્મબ્રાષ્ટ થવું પડે.

દીકરીના લગ્ન હોય, સામા પક્ષવાળા કહે, “રાતે ખવડાવવું પડશો, કંદમૂળ  
કરવું પડશો,” તો સામે પક્ષે જો ધર્મરુચિ વિનાના હોય અને તેવાની સાથે સંબંધ

માંડવો હોય તો ધર્મથી ભાષ થવું જ પડે. જે ધર્માન હોય, પાપી હોય, ધર્મ પ્રત્યે તિરસ્કારવાળા હોય, અરુચિવાળા હોય તેની સાથે વ્યવહાર કાપી નાંખે તેના આત્મામાં જ ધર્મ રહે.

આપણો ત્યાં એટલે જ કલું છે કે સમકિતી આત્મા ઈતર જોડે પરિચય ન રાખે-વ્યવહાર ન કરે.

પ્રશ્ન :- સમ્યગ્રદર્શન વિનાના હોય તેની જ સંખ્યા કેમ વધારે હોય ?

ઉત્તર :- અસલ હીરાની સંખ્યા વધારે કે નકલી (ઈમીટેશન) હીરાની સંખ્યા વધારે ?

પ્રશ્ન :- સંસારમાં રદ્ધા હોઈએ તો વ્યવહાર કેવી રીતે ચલાવવો ?

ઉત્તર :- પહેલી વાત એ છે કે વ્યવહાર ધર્મ પાળવો હોય તો વ્યવહાર ધર્મ જે ન પાળતાં હોય તો તેની સાથેનો વ્યવહાર કાપી નાંખો. જે ધર્મને શિરોધાર્ય કરે તેની સાથે જ વ્યવહાર રાખવો, અને જે ધર્મની "Non Sense" કહે તેની સાથે બોલવું તે પણ અધર્મ છે.

પ્રશ્ન :- ફક્ત બોલવાથી પણ અધર્મ થાય ?

ઉત્તર :- હા ! ગાંડા સાથે વાત કરે તે પણ ગાંડા કહેવાય. વ્યવહાર ધર્મ જેને પાળવો હોય તેને વ્યવહારથી જે ધર્મ વિમુખ હોય તેની સાથે વ્યવહાર બંધ કરી દેવો જોઈએ.

જે ધર્મને, ગુરુને, ધર્મના વ્યવહારને માથે ન રાખે તેની સાથે વ્યવહાર રાખવાથી વ્યવહારથી ધર્મભાષ થાય છે. સંસારી સાથેનો વ્યવહાર જેટલો વધારે એટલો ધર્મ જોડેનો વ્યવહાર મોળો પડે.

નોકરી કરવી પડે તો ધર્મનિ ત્યાં કરવી... ત્યાં નોકરી કરવાથી ધર્મ વધે છે... પર્વો આવે ત્યારે રજા પણ આપે. ધર્મમાં સહાય કરે.


સાધુને શ્રાવક સાથે સંબંધ કે શ્રાવકને સાધુ જોડે (સંબંધ) ? વિશિષ્ટ કોટિના શ્રાવકને બાજુ પર મૂકીને બાકીના શ્રાવકો સાધુ ધર્મને નહિ જાળનારા, પોતાના સ્વાર્થ માટે સાધુ પાસે મંત્ર, મુહૂર્ત, રાખડી માંગતા હોય, જેમને સાધુ ધર્મની કદર ન હોય તેની સાથે સાધુ વધારે વ્યવહાર રાખે તો વ્યવહારથી સાધુ ધર્મભાષ થાય છે.

શ્રાવકોએ સાધુ જોડે પરિચય રાખવાનો ખરો, પણ જ્ઞાન માટે, આંતરિક ધર્મ માટે, આચાર માટે, સમજણ માટે, શ્રદ્ધા માટે, ધર્મ માટે, ધર્મમાં આગળ

વધવા માટે રાખવાનો છે. અને સાહુએ શ્રાવકો સાથે પરિચય તેમને ઉંચે ચડાવવા માટે રાખવાનો છે.

ભાવચારિત્ર માટે વ્યવહાર ચારિત્ર ઉત્તમ પાળવાનું... ભાવચારિત્ર જોઈતું હોય તો દેશવિરલિ ધર્મને વધારવાનો. આ રીતે ચારિત્ર ધર્મની આરાધના કરીએ તો આગળ જઈને ભાવચારિત્રની પ્રાપ્તિ થાય.

માટે સંસારના વ્યવહાર, સામગ્રી, કાર્યો, પ્રવૃત્તિ ઘટાડવા તે પણ ચારિત્ર છે. આવા ચારિત્રમાં આગળ વધનારો ભાવચારિત્ર પામે, સદ્ગતિની પરંપરા દ્વારા સિદ્ધિગતિ સુધી પણ પહોંચે.



## આણા હિ મોહવિસપરમમંતો

**મો**હને વિષની ઉપમા આપી છે. આજાને વિષ ઉતારનાર પરમમંત્રની ઉપમા આપી છે.

વિષ એ આત્માને મુચ્છિત બનાવે છે, ચૈતન્યરહિત બનાવે છે તેમ દર્શન-મોહનીય અને ચારિત્રમોહનીયના ઉદ્યથી આશ્રવો, હેય, પરભાવ, પુદ્ગલ પરિણાતિ વગેરે તરફ ક્યાંક ગુણકારિતાના, કર્તવ્યતાના, ઉપાદેયતાના, સારા તરીકેના, લાભકારક તરીકેના ભાવો જન્મે છે, ક્યાંક ઉપરોક્ત ભાવો ખોટા લાગવા છતાં તેના તરફ ખેંચાણના ભાવો, સુખબુદ્ધિના ભાવો રહે છે. આ છે મોહના વિષની અસર. બીજી રીતે મોહને મહિરાની ઉપમા આપી છે તેથી તેનાથી ઉન્મત્તતા આવે છે.

આ વિષને ઉતારવા માટે પરમમંત્રના જાપ તરીકે છે આજા. આજા એટલે જિનવયન કે તદનુસાર કરાતી પ્રવૃત્તિ. શ્રી જિનવયનને વારંવાર વિચારીએ, ભાવિત કરીએ, શક્યતા મુજબ જિનવયનાનુસાર વર્તાએ તો વિષની અમણા, વિપરીત સંસ્કાર અને વિપરીત શાનની અસર ઉત્તરતી જાય.

મોહવિષના અનેક પ્રકાર છે, તેમ તેના વારણારૂપ આજાના પણ અનેક પ્રકાર છે. શાખમાં કહું છે કે જેને જે દોષ વધારે પીડિ તેના વારણા માટે તે દોષ સંબંધી ઉપદેશક શ્લોકો, શાખપાઠો મુખ્યપાઠ કરીને વારંવાર પાઠ કરવો, તેમજ તેને વિચારવા.

મોહનું કાર્ય છે જીવને સ્વરૂપમાં ન આવવા દેવો, તેને પરભાવમાં રચિ-ખેંચાણ કરાવવું અને પક્ષપાતરૂપે દ્રષ્ટિ વિકૃત કરાવવી. આના કારણો પ્રમત્ત ગુણસ્થાનક સુધીના જીવો બ્યક્ત રીતે આંશિક વિપરીત ખેંચાણવાણા છે તેની ઉપરના જીવો અબ્યક્તતરૂપે મોહના ઉદ્યવાળા છે. શાખ ભાવનાથી દર્શનમોહનીય એટલે અશ્રદ્ધા પણ નાશ પામે છે.

પ્રભુશાસનની આરાધનાના ચાર પ્રકારો છે.

(૧) જિનઆજા-જિનવયનનો અભ્યાસ કરવો, વારંવાર પૂર્વાપર સંબંધી વિચારવું અને આત્મસાતું થયા પછી પણ વારંવાર પાઠનું પુનરાવર્તન કરવું.

તत્વો, આચારો વગેરે વારેવાર યાદ કરવાથી પાપના પક્ષપાતનુ-પાપસ્થાનોમાં ગુરુદાસિનું મોહવિષ નાશ પામે છે, સમ્યગ્દર્શન ન હોય તો પ્રગટ થાય છે, હોય તો નિર્મળ થાય છે. માટે સમ્યકૃત્વ નહિ પામેલ અપુનબંધકથી માંડી બધાનું અને સમ્યકૃત્વ પામેલાનું મિથ્યાત્વ વિષ શાખ સ્વાધ્યાયથી ઉત્તરનું જાય છે, એટલે કે મિથ્યા માન્યતાઓમાં મિથ્યાપણું દેખાય છે, એના ઉપર આદર નાશ પામી અનાદર થાય છે.

તથા શાખાશ્રવણ, પઠન, ચિંતન, પરાવર્તનથી આચારો અને અનાચારો વારેવાર ધૂટાય છે અને એથી આચારો પ્રત્યે આદર થાય છે, જે ચારિત્રમોહનીયનો કષ્પોપશમ કરે છે, અનાચાર પ્રત્યે જે અરુચિ અને જુગુંસા છે તે શાખપઠનથી વધતા જાય છે અને તે પણ ચારિત્રમોહનીય કર્મનો કષ્પોપશમ કરે છે.

જૈનાચાર્યો સાથે વારેવાર વાદમાં પરાસ્ત થયા બાદ બીજો કોઈ ઉપાય ન દેખાવાથી કહુર દેખી એવા પણ ગોવિંદ બ્રાહ્મણે નભળી કરીએ જાણવાના દઢ નિર્ધાર સાથે ચારિત્ર લીધું. ગુરુદેવનો વિનય કરવા પૂર્વક અધ્યયન પણ ચાલુ કર્યું. પોતાને ક્ષ્યાંક નભળી કરી દેખાય તે એક કાગળમાં ઉત્તરવાનું ચાલુ કર્યું. ચક્રોર ગુરુદેવશ્રીના હાથમાં તે કાગળ આવી જતાં જરાય વિચલિત થયા વિના અધ્યાપન ચાલુ રહ્યાવ્યું અને આચારાગના શાખપરિજ્ઞા અધ્યયનનો અભ્યાસ ચાલુ કરાવ્યો. તેમાં પદ્જીવનિકાયની સિદ્ધ માટે આપેલી સચોટ યુક્તિએ જોઈ હૈયુ ગૂડી ગયું. પશ્ચાત્તાપ થયો. “અહા ! શાખને મેં શાખ બનાવ્યું !” ગુરુદેવ પાસે આલોગના કરી શુદ્ધિ કરી માર્ગમાં સ્થિર થયા.

૨) શક્ય એટલા આચારનું પાલન, તેની ચોક્કસાઈ પણ પ્રતિક્ષાણ દર્શન-મોહનીય અને ચારિત્રમોહનીય કર્મ ખપાવે છે અને મોહ વિષનો નાશ કરે છે.

તીવ્ર જ્ઞાનાવરણીયના ઉદ્યથી શ્રુત ચડતું નથી, શાખનો જરૂરી અભ્યાસ થતો નથી, પણ અભ્યાસ કરવાનો સતત તીવ્ર પુરુષાર્થ, ગુરુદેવના વચનનું પાલન, પોતાની ભૂલ બતાવનાર પ્રસ્તે અહો ભાવના કરણે માપત્રુપ મુનિને વીતરાગતાની પ્રાપ્તિ થઈ.

૩) બીજાઓના આચાર જોઈને આનંદ પામવો, બીજાને આચાર બતાવવો, શાખ ભાગુાવવા, આચારપાલનમાં સહાયક થવું, આચારની તેમજ આચારપાલનની મશંસા કરવી, અનાચારથી પાછા વાળવા વગેરે આપણી વાચિક, કાયિક પ્રવૃત્તિ

દ્વારા બીજાને આજ્ઞા બતાવવા, પળાવવા વગેરેમાં બીજા તો આજ્ઞામય બને જ છે,  
જોતે પણ આજ્ઞામય બનાય છે. માટે એ સ્વના પણ મોહવિપનો નાશ કરે છે.

૪) અશક્ય આચારો-અશક્ય પરિસ્થિતિઓમાં પણ શક્ય આચરણનું  
લક્ષ્યબિનદુ રાખીને જે નથી પળાતું, નથી કરાતું તેમાં પશ્ચાત્તાપ કરવો, પોતાના  
દોષોનું સદ્ગુરુને કથન કરવું, પાળનાર પ્રત્યે અહોભાવ, સેવા કરવી વગેરે પણ  
દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો કષ્યોપશમ કરવા દ્વારા મોહ વિપનો નાશ  
કરતા જાય છે.

અહીં એક વાત સમજવી કે મોક્ષની પ્રામિના કારણભૂત આરાધનાના યોગો  
અસંખ્ય છે - જેવી રીતે જિનનામકર્મ નિકાયના કરનાર કોઈ એક સ્થાનક આરાધે,  
કોઈ બે આરાધે, કોઈ બધા (૨૦ સ્થાનક) પણ આરાધે, છતાં ફળરૂપે શ્રી  
તીર્થકરપણું બધાને મળે, એકસ્થાનવાળાને પણ મળે, બે સ્થાનવાળાને પણ મળે  
અને બધા સ્થાનકના આરાધકને પણ મળે. તેવી રીતે અસંખ્ય યોગમાંથી એક,  
બે કે અનેક યોગ જે આરાધે તે મોક્ષ પામે. તેથી તે તે યોગની જે ભાવપૂર્વકની  
આદર, ગૌરવ સાથેની આરાધનાની તમના તે ભાવ આજ્ઞા છે, તે આત્માના  
મોહવિપનો નાશ કરે છે. માટે ફક્ત શાલ અભ્યાસ અને તેનું પરાવર્તન કરવારૂપ  
આજ્ઞા જ અહીં ન લેવી. જો કે પ્રધાનતથા રાજમાર્ગથી શાલ વગર શાસન નથી,  
પરંતુ આત્માના મોહને નાશ કરવા માટે અનેક નિમિત્તકારણો દ્વારા પ્રવૃત્ત થતો  
જીવ અનાચારને અનાચારરૂપે ઓળખતો થાય, આચારને આચારરૂપે ઓળખતો  
થાય. જીવનું આ જે સદ્યોગ અને સદ્વિચારણા પ્રત્યેનું ઢળાડી તે આજ્ઞા છે.  
તેથી સદ્વિચારણા અને સદ્યોગથી મોહવિપ નાશ પામે.

માટે ગૌણ વૃત્તિએ વૈરાગ્યયુક્ત જૈનેતરમાર્ગમાં જેટલા અંશમાં દયા, દાનાદિ  
પ્રવૃત્તિમાં સદ્યોગતા છે અને વૈરાગ્યભાવના, કપાયનિગ્રહ, ઈન્દ્રિયદમન  
ઈત્યાદિની જે સદ્વિચારણાઓ છે તે બતે એ લોકોના આત્મમાંથી મોહવિપ  
ઘટાડે છે અને જૈનધર્મ તેમજ વિચરતા પરમાત્માને પામવા સુધીનું પુષ્પ ઉપાર્જન  
કરાવે છે અને તેમનો સમાગમ તેમજ ઉત્તમ આરાધનાની સામગ્રી પ્રાપ્ત કરાવે  
છે. માટે મોહવિપને ઉત્તારવા માટે નીચેના ઉપાયોનો અમલ કરવો.

(૧) મોહવિપ ચડવાના જે જે ઉપાયો છે, તેનાથી વિપરીત વિપ ઉત્તારવાના  
ઉપાય છે. તેને આચરવા.

(૨) ધર્મના આચારો, ધર્મ આચારના લાભો, પાપની જુગુસા, પાપ આચારના નુકસાનો, આત્માનું સ્વરૂપ, આત્માના ગુણો-બનેના સુચક દ્રષ્ટાંતો વાંચવા, પાઠ રાખવા, તેનો વારંવાર પાઠ કરવો.

(૩) જાપથી મોહવિષ નાશ પામે, તેમ અનિત્યાદિ ભાવનાઓ અને ઉપરોક્ત અર્થસુચક ગ્રન્થો, શ્લોકો વાંચવા, વિચારવાથી મોહવિષ નાશ પામે.

(૪) પાપની પ્રવૃત્તિઓ જેટલી ઘટાડાય તેટલી ઘટાડવી, જે કરવી પડે તેમાં જ્યલ્લા રખાય, તેના ઉપર અરુચિ, તિરસ્કાર રહે તો મોહવિષ ઉતારે. આનંદ, પ્રસંગતા એ મોહવિષ વધારે. પવન ગમે, સારું ખાવાનું ગમે, માનપાન ગમે તો મોહવિષ વધે.

(૫) આથી વિપરીત, ધર્મ આચારોમાં પ્રવર્તન, આનંદ, આદર, અનુમોદના, વિશેષ-પ્રવર્તન વગેરે પણ મોહવિષ ઉતારે.

(૬) ભાવનાઓ યુક્ત જે કાંઈ પ્રાસંગિક વિચારણા, પ્રવૃત્તિઓ તે પણ મોહવિષ ઉતારે.

આ બધી વાતો આજ્ઞા સ્વરૂપ છે, આજ્ઞા છે.

આજ્ઞા એ ઉત્સર્ગરૂપ-અપવાદરૂપ ભિન્નભિન્ન દ્રવ્યાદિકમાં જરૂરી ફેરફારવાળી હોય છે. જેમ આધ્યાકર્મી વગેરે વ્યવહારો પ્રથમ, અંતિમ અને મધ્યમ જિનોમાં ફેરફારવાળા હોય છે તેમ એક જ શાસનમાં અનેક સંયોગથી આગંતુક ફેરફાર વગેરે જે માર્ગરક્ષક, રાગદેષહાનિકારક ગીતાર્થદેશિત આચાર હોય તે બધું આજ્ઞામાં સમાવિષ્ટ થાય છે.



## ઉચિત છસુ કાર્યક્રમ સંવાદ સથા નેણ બુદ્ધિમત્ત્વ ॥

**બુદ્ધિશાળી માણસે સર્વ કાર્યમાં ઉચિત જ કરવું જોઈએ...**

ઉચિત કરે તે બુદ્ધિશાળી કે બુદ્ધિશાળી હોય તે ઉચિત કરે ?

આ એક માર્મિક પ્રશ્ન છે.

માલ વેચવાનો અવસર અને ખરીદવાનો અવસર ધન હોય એટલાથી જાડી શકતો નથી.. નિપુણ-શુભવિચારક શક્તિ વગર માલ વેચે તો અનવસરે સામાન્ય લાભ થાય અને જો લીપીલ ભાવ કરતા સસ્તો વેચે તો નુકશાન થાય. કાર્ય કરવા માટે શક્તિ-સંયોગ જોઈએ છે પણ યોગ્ય કરવા માટે બુદ્ધિ જોઈએ.

શિયાળાની ઠંડીમાં ઠંડું પાણી પીવા માટે પૂછીએ તો તે પૂછનારાની અણાઆવડત છે અને જેને પૂછું છે તેની મશકરી છે જ્યારે ઉનાળામાં ઠંડું પાણી આપનાર વખણાય છે. શ્રીમંતને હજાર રૂપિયાની બેટ આપવામાં આવે તો કાંઈ વિશેષ કિમત નથી પણ અતિ વિશેષ દરિદ્રતામાં અપાતી એ બેટ વિશેષ આદર-ગુણ-લાભ કરનારી છે. આ અવસરને ઓળખવો તે બુદ્ધિનું વિશેષ લક્ષ્ણ છે. અવસરે જે કાર્ય સુધરે તેવું કરવું તે કર્તવ્ય છે. માટે ત્યાગ-તપ-દાન-ઉપદેશ વગેરે માટે પણ અવસરને ઓળખવો જોઈએ.

દુનિયામાં દવાઓ અનેક હોય છે અને અનેક પાવરની હોય છે પણ વૈદ્ય કે ડૉક્ટર તે દવા દર્દીની સ્થિતિ જોઈને આપે છે.

એ જ રીતે બે પુત્રો સાથે જમવા બેઠા હોય, એક પાંચ વર્ષનો હોય અને બીજો ૨૦/૨૫ વર્ષનો હોય તો બંનેને મા સરખો ખોરાક નથી પીરસતી જેને જેટલું પચે તેટલું અપાય...

નમ્ર માણસને ઠપકો થોડો અપાય, ખાનગીમાં અપાય, જાહેરમાં ઠપકો ન અપાય, જ્યારે નઠોર માણસને ઠપકો આપવાની પદ્ધતિ જુદી હોય. દરિદ્ર દેવાદાર પાસે દેવું વસુલ કરવાની-માંગવાની પદ્ધતિ જુદી હોય અને શ્રીમંત દેવાદાર પાસે દેવાની રકમ માંગવાની પ્રક્રિયા જુદી હોય. એમ સશક્ત જોડનો વ્યવહાર જુદો, અશક્ત જોડનો વ્યવહાર જુદો. બિમાર અવસ્થામાં વ્યક્તિ

જોડેનો વ્યવહાર જુદો, સ્વસ્થ અવસ્થામાં એ જ વક્તિ સાથેનો વ્યવહાર જુદો. એમ બુદ્ધિશાળી જોડેનો વ્યવહાર લિન્ન, બુદ્ધિ વગરના જોડેનો વ્યવહાર લિન્ન, શ્રીમંત જોડેનો વ્યવહાર જુદો, ગરીબ જોડેનો વ્યવહાર જુદો; અને મજબૂત પક્ષવાળા જોડેનો વ્યવહાર જુદો, પક્ષહીન જોડેનો વ્યવહાર જુદો. આવી રીતે પોતાની પરિસ્થિતિ કઈ છે તે સમજને વ્યવહાર થાય છે. આમાં પોતાનું કે સામાનું ધૈર્ય કે અધૈર્ય વગેરે પણ જોવું પડે. આ બધું વિચારી-જોઈને બુદ્ધિશાળીએ ઉચિત વ્યવહાર કરવો જોઈએ...

આ ઉચિત વ્યવહારપૂર્વકનું ધર્મ અનુષ્ઠાન એ મુખ્ય-પ્રધાન ધર્મ છે. આ ઔચિત્યના વિભાજન વગરનો વ્યવહાર એ વ્યવહારધર્મ-ગૌણધર્મ છે. તેથી પૂર્વના કાળમાં ‘ઘરડાઓ ગાડા વાળે’ એ ન્યાયે વૃદ્ધ-પીઠના હાથમાં બધા વ્યવહાર રહેતા હતા અને “આયરિયા પચ્ચવાયં જાણંતિ” આચાર્ય-વડીલો નુકશાન અને ઉપલક્ષણથી લાભને જાણો છે. આ કારણો ગીતાર્થ નિશા બતાવી છે. ક્યારે શું કરવું, શું ન કરવું વગેરે વિચારીને જણાવે તેમ કરવું.. માટે કોઈપણ પ્રસંગે ઔચિત્યનો બંગ ન કરવો, ઔચિત્યનો બંગ એ વસ્તુનો નાશ કરવા તુલ્ય છે.

આવી બુદ્ધિ શાખથી, વિચારણાથી અને પીઠ બુદ્ધિશાળીના સંપર્ક-પરિચય-નિશાથી એટલે કે ગુરુગમથી આવે છે.

માટે ભણ્ણા વગરના વિચારક ન હોય તેવા અને ગુરુગમ ન સ્વીકારનાર, વડીલોને ન ગણકારનારની બુદ્ધિ ઉપર જરા પણ ચાલવું નહિ.

શાખમાં મેધાવી બે પ્રકારના બતાવ્યા છે.

એક ગ્રહણ મેધાવી-યાદ રાખવાથી બુદ્ધિશાળી અને બીજા મર્યાદા મેધાવી-મર્યાદા સાચવવાથી બુદ્ધિશાળી. આ બેમાંથી બીજા પ્રકારના ઉત્તમ છે. કારણ કે શાખના દરેક વાક્યો વિધાન-નિષેધના એક નયથી-એક દસ્તિથી હોય છે જ્યારે વિચારણા અને ગુરુપારતાંયથી પુક્ત મર્યાદા દ્વારા સર્વ રીતે સ્પર્શના થાય છે માટે મર્યાદા મેધાવી એ બુદ્ધિશાળી છે અને એ ઉચિત કરવાને સમર્થ છે માટે બુદ્ધિનું ફળ ઔચિત્ય પાલન છે એટલે બુદ્ધિશાળીએ એ તરફ પ્રયત્ન કરવો...



## વિનિવૃત્તપરાશાનામિહૈવ મોક્ષ: સુવિહિતાનામ् ।

**પરાશાથી નિવૃત થયેલા સુવિહિત મુનિવરોને અહીં જ મોક્ષ છે.**

પરની આશા બે પ્રકારની, (૧) પૌદ્રગલિક અને (૨) સહવર્તી વગેરેની. બજે આશા, અપેક્ષા, પરવશતા, સત્ત્વહાનિ અને આર્ત-રૌદ્રધ્યાનકારક બને છે. સારી વસ્તુની અપેક્ષા એ પણ પરાશા છે. તે મળે એટલે અનુકૂળતાજન્ય આનંદ થાય, અને ન મળે, પ્રતિકૂળ મળેણેએટલે અરતિ થાય. આ રીતે રતિ-અરતિમાં ફંગોળાતો જીવ સમતા-સુખને મેળવી શકતો નથી. એવી જ રીતે કોઈપણ વ્યક્તિ પાસેથી સારા વર્તન-વચન-સેવા-સહાનુભૂતિ-વાત્સલ્ય કે પ્રેમની અપેક્ષા હોય અને તે જો મળે તો જીવ સંતોષ પામે, અને ન મળે તો જીવ ઉદ્દિગ્ય બને. આ રીતે રતિ-અરતિમાં જીવ ભમ્યા કરે છે. માટે ક્યાંય શાંતિ-સુખ-સમતા-પ્રસતતા નથી હોતી.

સારાની આશા રાખ્યા પછી નરસી વસ્તુની પ્રાપ્તિથી અણગમો આવે છે. આ પણ પરાશા છે. માટે નરસી વસ્તુ તેમજ વિપરીત કરનાર કે ન માનનાર વ્યક્તિ પાસેથી અનુકૂળ વર્તનની આશા ન રાખવી.

શ્રી સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારની દુઃખશાયા અને ચાર પ્રકારની સુખશાયા બતાવી છે. (૧) મોક્ષમાર્ગમાં અશ્રદ્ધા, (૨) કામલોગની સ્પૃહા, (૩) પર લાભની ઈચ્છા અને (૪) સ્નાનની ઈચ્છા. આ ચાર દુઃખશાયા છે, અને આ ચારથી પ્રતિપક્ષ ચાર સુખશાયા છે.

પ્રથમ સિવાયની ત્રણ પરાશારૂપ છે અર્થાત્ જે પર વ્યક્તિ અને પર પુદ્રગલની આશા-સ્પૃહા-અપેક્ષાભાવ રાખે છે તે દુઃખના કારણમાં વર્તે છે, માટે દુઃખરૂપ શાયામાં સૂવે છે. જે એ પર અપેક્ષાનો ત્યાગ કરે છે તે સુખરૂપ શાયામાં સૂવે છે, સુખના કારણમાં રહે છે, સુખમળ બને છે.

પર લાભની વાંચ્છા એ જેમ દુઃખનું કારણ છે તેમ પોતાના કોઈપણ કાર્ય માટે પરની અપેક્ષા-પોતાની સાથેના પરના વ્યવહારમાં અનુકૂળ વ્યવહારની અપેક્ષા અને પોતાને નહીં ગમતા વ્યવહારના ત્યાગની અપેક્ષા, બીજાના તમામ વ્યવહારમાં અમુક રીતે ન વર્તવાની અપેક્ષા, અમુક રીતે વર્તવાની અપેક્ષા, આ

બધી પરાપેક્ષા છે. પર વ્યક્તિ પર કોઈપણ મકારના નિયંત્રણની અપેક્ષા તે પરાપેક્ષા. તેનાથી મુક્ત એટલે તેવી અપેક્ષારહિત જીવો એ ભાવમુક્ત છે. માટે તે સુવિહિત અગ્રણીઓને અહીં જ મોક્ષ બતાવ્યો છે.

પરંતુ આ અવસ્થા લાવવા માટે જેમ જીવની અપેક્ષા છોડવાની તેમ પુદ્ગલની અપેક્ષાનો મોક્ષ પણ લાવવો પડે. પુદ્ગલ અપેક્ષા મોક્ષના બે વિભાગ પડ્યા, (૧) કામભોગ અને (૨) સ્વચ્છતા. અનુકૂળતા સ્વીકારવી-પ્રતિકૂળતા છોડવી, અનુકૂળતામાં ઠંડક, પ્રતિકૂળતામાં ઉકળાટ, અનુકૂળ વસ્તુ સંઘરવી-વાપરવી, પ્રતિકૂળ વસ્તુથી દૂર ભાગવું, વારંવાર સ્નાન-ધોવું-સાફસુફ કરવું આ બધી પુદ્ગલ આશા છે.

આ જીવ-આશા અને પુદ્ગલ-આશા છોડવા માટે તત્ત્વની સચોટ શ્રદ્ધા જોઈએ. જેને મોક્ષની, આત્મસ્વરૂપની, તેના કારણરૂપે વૈરાગ્ય-ત્યાગ-જ્ઞાન-સંયમ-સહનશીલતાની શ્રદ્ધા છે તે જ પુદ્ગલ-આશાને નુકસાનકારી-દુઃખરૂપ માને. જેને આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા નથી તે ભવાભિનંદી જીવ પુદ્ગલ-આશા અને જીવ-આશામાં સદા ગળાખુડ દૂબેલો હોય છે. માટે પ્રથમ અશ્રદ્ધારૂપી દુઃખશાયા જાય ત્યારે પુદ્ગલ-આશા, કામભોગ-આશા ઘટતી જાય-છાસ પામે. તે જેમ છાસ પામે તેમ અન્ય જીવો તરફની આશા પણ છાસ પામે. આમ જીવ, આશા છોડનારે બાકીની આશા છોડેલી છે તેથી તે મુક્ત ન હોવા છતાં મોક્ષની જેમ અહીં પણ સ્વસ્થ છે. માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નિરપેક્ષવૃત્તિવાળાને અહીં જ મોક્ષ છે. સંયમમાં આ અપ્રતિબદ્ધતા મેળવવાની-ભાવવાની-આત્મસાત્ત કરવાની છે.

મહાત્મા વગર આ સ્થિતિ આવતી નથી. પરાશામાં પકડાએલા મહાત્માઓને પણ મોક્ષ જેવું સુખ મળતું નથી. પરાશામાંથી છૂટવાનો-આત્માને છોડવવાનો પ્રયત્ન પણ મહાત્માઓએ મુખ્યત્વા કરવાનો છે. તેથી આ ઉક્તિના સારરૂપે આરાધક આત્માઓએ આંતરસુખ અને આંતરિક સાધનામાં આગળ વધવા પરાશા છોડવા સદા તત્પર બનવું જરૂરી છે. મોક્ષનું સ્વરૂપ સમજવા માટે પણ પરાશા અમુક રીતે તોડવી જ પડે. જ્યાં પર એજ સ્વ અને સ્વીયરૂપે સમજાય ત્યાં તેનાથી ભિન્ન સ્વ અને સ્વીય શી રીતે સમજાય ? આવી દ્રષ્ટિ સુવિહિત સાધુ મહાત્માની હોય છે.

સુવિહિતનો અર્થ (૧) સારી રીતે તત્ત્વને જ્ઞાનનાર, હેય-જ્ઞેય-ઉપાદેય-આશ્રવ-સંવર વગેરેના દ્રવ્ય-ભાવ-ભેદો જ્ઞાનનાર. તેથી સહજ રીતે પરાશા છૂટી જાય

છે..-(ર) સારા આચારવાળા, જેને સારા આચારની ઊંચી ભૂમિકાએ જવું હોય એને બીજાની અપેક્ષા-આશા છોડવી જોઈએ. તેથી જે વ્યક્તિ કે પુદ્ગલની આશા છોડે છે તેને રતિ-અરતિ છૂટે છે, અપેક્ષા-પ્રતિબંધ-મમતા છૂટે છે. તેથી તેવા આચારવાળાને અને દ્રષ્ટિવાળાને અહીં જ મોક્ષ છે. મોક્ષની જેમ ક્યાંય રોકાણ કે પક્કડ નથી. તેથી તે સ્વાત્મરમણતા અને સાધનામાં સદા મગ્ના હોય છે.

શિયાળામાં ઠંડી ન પડે, ઉનાળામાં ગરમી ન પડે તેવી ઈચ્છા જેવી ઈચ્છાઓમાં જ જીવ દુઃખથી ભાગતો અને સુખને ગોતતો-તપાસતો અથડાયા કરે છે. ટુંકમાં જેટલી જેટલી ખાવા-પીવાની, કપડા-લતાની, ગરમી-ઠંડીની, માન-પાનની, એશાઓરામની, સ્નેહ-મમતાની, બીજાના દ્વારા કામકાજની અપેક્ષાઓ જીવ ઘટાડતો જાય છે તેમ તેમ એ મોક્ષની નિકટ થાય છે.

વૈરાગ્ય વધે તેમ સદ્ગુરુષી વધે, સદ્ગુરુષી વધે તેમ સદ્ગુરુચાર વધવાની યોગ્યતા અને સદ્ગુરુચાર વધે છે, અને તેનાથી સુખ-સંતોષ વધે છે. જેમ જેમ પરાશા-પરાવલંબીપણું તેમ તેમ સંસાર દુઃખ અને ભ્રમણ; જેમ જેમ તત્ત્વદ્રષ્ટાપણું, વૈરાગ્યપણું અને સ્વાવલંબીપણું તેમ તેમ સંવેગપણું-મોક્ષ નિકટપણું છે. માટે રત્નત્રયના પ્રામિના કારણભૂત દેવ-ગુરુ-સાધ્યમિકના અવલંબન સિવાયના અવલંબનમાં આસ્થા ન બાંધવી. પરભાવોની અપેક્ષા જેમ છોડવા જેવી છે તેમ ઔદ્ઘિકભાવોની આશા પણ છોડવી. સારું શરીર, સારું રૂપ, સૌભાગ્ય, આદેય નામકર્મ, સુસ્વર, વ્યાખ્યાન શક્તિ વગેરે-આ બધા કર્મોદ્ઘયકૃત ભાવો પણ જીવથી પર છે. તેની આશા રાખ્યા પછી જો મળે તો ગર્વ અને બીજાનો તિરસ્કાર આવે, અને ન મળે તો દીનતા આવે.

માટે પર એટલે પુદ્ગલ અપેક્ષા છોડવી, પર એટલે બીજી વ્યક્તિ તેની અપેક્ષા ઘટાડવી, પર એટલે ઔદ્ઘિક અને કથંચિત ક્ષયોપશમ ભાવો પણ સાધનરૂપ હોવા છતાં સાધ્યરૂપ નથી તેમ સમજું મળે તો સદૃપ્યોગ કરવો, ન મળે તો દીનતા ન કરતાં અપેક્ષા છોડવી-સમતા રાખવી.

આ દ્રષ્ટિ વિકસાવનાર સદા આનંદમગ્ન બને છે, સ્વરૂપમણતાનો આનંદ જીલે છે અને શીଘ્ર મોક્ષગામી બને છે.



## થોડા પણ ગર્વથી ગુણસમુદ્દર પણ અસાર કરાય છે....

ગુણ હોય કે ગુણસમુદ્દર હોય તેને નિર્બલ-નિર્ઝળ બનાવનાર કોઈક આચાર કે ભાવ હોય છે.

દોષને જન્માવનાર, વધારનાર અમુક પ્રવૃત્તિ અને અમુક ભાવો છે, તે રીતે દોષોનો નાશ કરનાર પણ અમુક પ્રકારની પ્રવૃત્તિ અને અમુક પ્રકારના ભાવો છે. એજ રીતે ગુણોને જન્માવનાર અને વધારનાર પણ પ્રવૃત્તિ અને ભાવો છે તેમ ગુણોને ઘટાડનાર-નાશ કરનાર પણ પ્રવૃત્તિ અને ભાવો છે.

વિનય એ ધર્મનું મૂળ બતાવ્યું છે તેમ વિનય એ ગુણોનું પણ મૂળ છે. વિનય એટલે નઅતા.. નઅતા એટલે કોઈપણ ભૌતિક કે આધ્યાત્મિક શક્તિઓથી બીજા કરતા પોતાની મહત્ત્વા ન આંકવી, ન માનવી, બીજાની હીનતા ન માનવી. જેમ એક પારસમણી કાચની ડબ્બીમાં છે, એક કપડાના ટુકડામાં બાંધ્યો છે, બંનેની કિમતમાં કંઈ ફેર નથી પડતો તેમ શુદ્ધ અને સિદ્ધ સ્વરૂપી અનંત શક્તિના માલિક આત્મા બધા સરખા છે તેમાં વર્તમાન પરિસ્થિતિમાં સામાન્ય ફેરફારથી પોતાની વડાઈ માનવી તે ગર્વ છે. બીજાનો તિરસ્કાર તે અનું ફળ છે.

નઅતાથી આત્મા ગુણોને યોગ્ય બને છે, પોતાની બડાઈ ન મારતા ન્યૂનતા દેખાય છે, અને એ ન્યૂનતાને કાઢવાના ઉપાયોને આચરે છે અને કમશા: ગુણો પામતો જાય છે.

જે વ્યક્તિ પોતાની ઔદ્યોગિક ભાવની કે કષ્યોપશમ ભાવની જે શક્તિ છે તેની વડાઈ કરે, એનાથી પોતાની મહત્ત્વા આંકે, બીજાને હીન દસ્તિથી, તુચ્છ દસ્તિથી, તિરસ્કાર દસ્તિથી, અપમાન દસ્તિથી જુવે તેની તે શક્તિ નાશ પામે અને વિપરીત અવસ્થા ઊભી થાય. રૂપના ગર્વથી રૂપ નાશ પામે, શક્તિના ગર્વથી શક્તિ નાશ પામે, ઐશ્વર્યના ગર્વથી ઐશ્વર્ય નાશ પામે, કુલના ગર્વથી હીનકુલ મળે, ઉત્તમગોત્ર-જાતિના ગર્વથી હીન ગોત્ર-જાતિ મળે, શાનના મદથી શાનહીન થાય, બુદ્ધિના ગર્વથી મૂર્ખ પાકે. અહીં જ્ઞાનથી શ્રુતજ્ઞાન લેવું અને બુદ્ધિથી

મતિજ્ઞાન લેવું. લાભ વગેરેની લબ્ધિના મદથી લાભ રહિત બને, ભોગના ગર્વથી ભોગહીન બને, જે જે વસ્તુનો ગર્વ કરે તે તે વસ્તુને શક્તિને અયોગ્ય બને એટલું જ નહિ પરંતુ જો એ સુધરે નહિ, પશ્ચાતાપં થાય નહિ, કોઈ સમજાવનાર મળે નહિ તો કમે કરી બધી શક્તિઓ અને ગુણોથી રહિત થાય, ગુણો નાશ પામે, આવરાઈ જાય, અંતરાયોનો ઉદ્ય થાય. માટે વિનય જેમ ગુણોની ખાણ છે તેમ ગર્વ એ દોષોનું સ્થાન છે, ગુણોના નાશનું કારણ છે. ગુણી આત્મામાં ગર્વ છે કે નહિ તે જાણવાના ઉપાયો છે. શક્તિવાળા પાસે હીન શક્તિવાળો જાય તો શક્તિવાળો તેના ઉપર ઉપકારની દાખિલાણો, સહાયની દાખિલાણો, કંઈક કરી છુટવાની ઈચ્છાવાળો થાય અને એ જાતની પ્રવૃત્તિ હોય તો સહાનુભૂતિ-કરુણા-સહાયપણું દેખાય. પોતાની પ્રશંસા-મોટાઈ-આવડત ન દેખાડે કે બીજાની નિંદા-હીનતા કે અનાવડતપણું ન જણાવે.

શિક્ષકની પાસે વિદ્યાર્થી આવે, એમાં જે વિદ્યાર્થી કાંઈક પૂછવા આવ્યો હોય તેને જવાબ આપે, બરાબર સમજે તેમ કહે, બીજુ પૂછવાનું મન થાય તેમ વાત કરે, ચાલીઓ બતાવે, વ્યાપિઓ-મર્મ બતાવે. એમ જ આવ્યો હોય તો પણ નકામી વાતો ન કરતાં તત્ત્વની રૂચિ જન્મે, વસ્તુ સમજે, સમજવાની-જાણવાની ઈચ્છા થાય તેવી વાતો કરે, આ રીતે શિક્ષકના પરિચયમાં આવનાર વિદ્યાર્થી જે જ્ઞાન પામે, નિઃશંક બને, ઊંડાણ પામે, ભણવાની ઈચ્છાવાળો થાય તો ભણવનાર બને તેવો મોનીટર થાય. આવી પ્રવૃત્તિની ઈચ્છા જન્માવે તે શિક્ષકની કરુણા છે. આ કરુણા સ્વ-પરના ગુણની વૃદ્ધિ કરે છે.

શિક્ષક-શિક્ષક બેગા થાય ત્યારે બીજાને શું નથી આવડતું તે ન જુએ. તે જુએ તે ઈર્ધા છે પરંતુ પોતાને જે ન આવડે, જેમાં શંકા હોય તે પરસ્પર વિચારીને શંકા રહિત થાય. શિક્ષક શિક્ષક મલે તો પરસ્પર પ્રેમ રાખે, મેળ રાખે, એક બીજાના કાર્યના પૂરક થાય, એક બીજા બેગા થઈ વિચારકા કરી વિદ્યાર્થીઓની જ્ઞાનશક્તિ-જ્ઞાનરૂપી-હુંશિયારી-આવડત કઈ રીતે વધે, એના અવરોધક તત્ત્વો દૂર કરવા પરસ્પર શિક્ષકો એક થઈને કાર્ય કરે તો આ શિક્ષકોમાં પરસ્પર મૈત્રી થઈ વિદ્યાર્થી પ્રત્યે કરુણા થાય. પરંતુ જો શિક્ષકો પરસ્પર મળી ન શકે, પરસ્પર પ્રશ્નોનો વિચાર-વિનિમય કરી ન શકે, એના ઉકેલો અને વ્યવહાર રસ્તા ન કાઢી શકે તો શિક્ષકો પરસ્પર અભિમાની અને મેળ વગરના છે. જેમ કરુણા વગરના

શિક્ષકો વિદ્યાર્થી ઉપર ઉપકાર ન કરી શકે તેમ મેળ વગરના શિક્ષકો પણ વિદ્યાર્થીઓ ઉપર વિશેષ ઉપકાર ન કરી શકે, વિદ્યાર્થીઓને ગુણસંપત્ત બનાવી ન શકે. શિક્ષકોએ વિદ્યમાન મોટા શિક્ષકો કે પ્રિન્સિપાલ કે સારા ઊંચાં શિક્ષકોના ગુણ ગાવા, એમની મહત્ત્વા રાખવી. આવું કરનાર શિક્ષક પ્રમોદભાવવાળા કહેવાય, આવું ન કરવાવાળા ગર્વથી ગ્રસિત કહેવાય. તેથી ઊંચા સારા શિક્ષકોના જે દૂષણો કાઢે, એમના માટે જેમ તેમ બોલે તેમનો પોતાના સ્થાન રૂપી ગુણ ગુણાભાસ છે.

ગુણાભાસ એટલે ગર્વ વગેરે દોષથી અસાર થયેલ ગુણ અથવા ગુણનો આભાસ એટલે ગુણરૂપ જણાતો જે વાસ્તવમાં દોષ છે. આ રીતે ગર્વ ન હોય તો દરેક ગુણવાળાના ગુણો વધતા જાય છે.

ગુણવાળા જીવો ગુણને અયોગ્ય જીવની અને ગુણાભાસ જીવોની ઉપેક્ષા કરી શકે છે તેને બદલે અરુચિ-ઉદ્ઘેગ-તિરસ્કાર-અવજ્ઞા કરે તો સમજવું કે આ પણ ગુણનો આંશિક ગર્વ છે, આ રીતે વિનયવાળા-નમ્ર રહેનારા જીવોમાં ગુણો વાસ કરે છે, વિસ્તાર પામે છે, ગર્વવાળા ફદ્યમાં ગુણો તુચ્છ-અલ્ય-અપ્રધાન હોય. પથરાળ જમીનમાં વૃક્ષાનું મૂળ ઉંડું જતું નથી તેમ ગર્વ-આંબર પ્રિય આત્માઓમાં ગુણો ઊડા જતા નથી કે વિસ્તાર પામતા નથી. માટે કોઈએ ક્યારેય કોઈપણ બાધ કે અત્યંતર શક્તિ-ગુણોમાં ગર્વ ન કરવો... “થોડા પણ ગર્વથી ગુણ સમુદ્દરાય પણ અસાર કરાય છે.” આમાં પણ શબ્દ બે છે, પ્રથમ ‘પણ’થી એ સમજવું કે વધારે ગર્વ હોય તો સુતરામ્બ અસાર થાય-નાશ પામે અને દુર્ગતિ પણ મળે. બીજા ‘પણ’થી એ વિચારવાનું છે કે ગુણ સમુદ્દરાય જેમ અસાર થાય છે તેમ પુણ્યોદયજન્ય શક્તિઓ પણ અસાર થાય છે, નાશ પામે છે.

નમ્રતાથી બીજા ગુણોના નાશક દોષો પણ નાશ પામે છે.

વિનયથી નમ્રતા આવે છે, નમ્રતાથી સમર્પણ આવે, સમર્પણથી બીજા દોષોને તોડવાની રૂચિ અને પ્રવૃત્તિ આવે છે. માટે દોષોની પ્રધાનતામાં માન-કોષ-માયા-લોભનો કમ કેટલીક વસ્તુઓમાં બતાવેલ છે. મનુષ્યમાં માન પ્રધાન છે, માટે ગર્વ જાય, માન જાય તો બાકીના કાઢવા અનુકૂળ પડે છે.

ગર્વથી કોઈ વસ્તુ-ગુણ સારભૂત થતા નથી તે પણ ધ્યાનમાં રાખવું.



## ન હુ સુજ્ઞાડ સસલ્લો

**આ**લોચન એ તર યોગસંગ્રહમાંથી પહેલો બેદ છે. આલોચન શર્ષણ અનેક અર્થમાં વપરાય છે.

પ્રથમ અર્થ-વિચારણા કરવી.

બીજો અર્થ-કાર્ય પૂર્વ પૂછવું, કાર્ય પછી હકીકતનું ગુરુને કહેવું.

ત્રીજો અર્થમાં ગુરુને દોખોનું કહેવું.

(૧) દરેક કાર્યોનો અનેક રીતે-ચારે બાજુથી લાભ-નુકસાનથી વિચાર કરવો. આ વિચારણા જો વાસ્તવિક થાય તો ઘણા પાપો, પોતાના અને પોતાના દ્વારા બીજાને થતા ઘણા નુકસાનો અટકી જાય છે. આ વિચારણા શાનપૂર્વકની, રાગ-દેખના વલણ વગરની વિવેકયુક્ત હોવી જોઈએ. કોઈપણ વિચારણામાં જો શાનાભાવ કે વિપરીત શાન ભળે તો વાસ્તવિક વિચારણા ન થવાથી જીવ પાપ અને નુકસાનમાં ઉત્તરે છે.

દરેક પ્રવૃત્તિમાં-જીવન પદ્ધતિમાં વિચારણા કરવાથી શું છોડવું, શું આચરવું તે નક્કી થાય છે. માટે દરેક સ્થળે મોટા ભાગે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વિચારણા કરવાની બતાવી છે. જેમ દરિદ્ર માણસો વચ્ચે વિશેષ આંદંબર-ભપકો-મોજશોખ એ લોકોને દેખ-ઈર્ધા, ઉત્પત્ત કરે. માટે અતિ શ્રીમંત માણસે પણ આવી પરિસ્થિતિમાં આંદંબર, ભપકો, મોજશોખ ઓછા કરવા જોઈએ. નહિતર બીજાની ઈર્ધા દ્વારા પોતાના ખૂન સુધીના નુકસાન વેઠવા પડે.

એ જ રીતે સામાની મહત્વની મોટી ભૂલમાં પણ જો આપણે આવેશમાં-કોષમાં આવીને વત્તાએ તો તેનાથી સામે લાભ થાય અથવા ન પણ થાય; પરંતુ તે વખતે જો નરકાયુ બંધાઈ જાય તો આપણાને દુર્ગતિનું જે નુકસાન થાય તે અબજો રૂપિયાના નુકસાન કરતા મોટું છે. ઉતાવળીયા માણસો ઉતાવળથી ક્યારેક કામની સફળતા પામે છે, પણ મોટે ભાગે વિશેષ નુકસાનમાં ઉત્તરે છે.

જીવનના દરેક બ્યવહારોમાં વિચાર કરવો કે આમાં લાભ કેટલો ? આનાથી નુકસાન કેટલું ? આના વિના લાભ કેટલો ? આના વિના નુકસાન કેટલું ? આ

વિચારણા કરવા માટે વ્યવહારિક જ્ઞાન જોઈએ અને શાખીય જ્ઞાન પણ જોઈએ. જેટલું જ્ઞાન-ચિંતન-અનુભવ વિકસે તેટલી વિચારણા વિશેદ-ચોક્કસ-કાર્યસિદ્ધિવાળી બને.

તેથી જ ઉપદેશ પણ આ વિચારણા માટે છે, કથાઓ પણ હેયોપાદેય, કર્તવ્ય-કર્તવ્ય વગેરે વિચારણાઓનો સ્પષ્ટ અને સંગીન બોધ કરાવવા માટે છે, શાખજ્ઞાન પણ વિચારણા-ચિંતન દ્વારા અનાદિકાલીન અશુભ, વિપરીત સંસ્કાર અને વિપરીત બોધયુક્ત વિચારણાઓથી વાસિત અંતઃકરણને સુધારવા માટે છે. આમાં પ્રજ્ઞાપનીયતા ગુણ સહાયક છે તેથી અજ્ઞાનજન્ય, મોહજન્ય, રાગ-દ્રેષ્ણની વૃત્તિજન્ય વિચારણાઓ એક સાઈડની (બાજુની) હોવાથી સર્વ પાસાને જોનારી નથી. આવી વિચારસરણી ધરાવનારને સાચી વિચારસરણી આપનાર મળે તો તે વાત સમજું શકે, પોતાની ભૂલ પકડી શકે અને સુધારી શકે.

જેવી રીતે ગણિતજ્ઞ જો કદાગ્રહી હોય તો પોતાની ભૂલ ન સ્વીકારે, અને જો સરળ હોય તો જાતે ઘ્યાલ આવે તો પણ સુધારે, અને બીજા બતાવે તો પણ સ્વીકારે-કબુલ કરે. એ જ રીતે દરેક બાબતમાં જે સારા વિચારક છે, આગળ પડતા છે તે અને જે ચાલુ મધ્યમ કક્ષાના છે તે જે કાંઈ મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ સાહજિકપણે કે વિચારપૂર્વક કરે છે, તેમાં વિચારકતાના કારણે વિચારણાઓ અને પ્રવૃત્તિઓ સુધરે છે, તેમાં પણ પ્રજ્ઞાપનીયતાના કારણે વિશેષ દ્રષ્ટિ વિકસિત થાય છે. દરેક બાબતોમાં અસદ્ગ્રહના ત્યાગપૂર્વક જે તત્વગવેષણરૂપ વિચારણા, તે પણ યોગના સંગ્રહરૂપ છે.

આ પ્રકારમાં આત્મ જાગરિકા પણ આવે. “આત્મ જાગરિકા” એટલે આત્મા જાગે-તે માટેની વિચારણા. રાત્રે સૂતા અથવા સવારે ઉઠતા અથવા રાત્રે ઉધુ ઉડી જાય ત્યારે, અથવા અનુકૂળ કોઈ પણ સમયે વિચારણા કરવી કે (૧) મેં શું કર્યું ? (૨) મારું શું કાર્ય બાકી છે ? (૩) હું શક્ય પણ શું નથી કરતો ? (૪) બીજા મને કઈ રીતે જુએ છે ? (૫) હું મારી જાતને કઈ રીતે જોઉં છું ? (૬) કઈ ભૂલો-કુટેવો હું નથી છોડતો ? આ અને આવું બીજું પણ વિચારવું. આ વિચારણાને આત્મચિંતા-આત્મ જાગરિકા કહેવાય. તે કરવાથી આત્મા જાગૃત બને, મોહ, અજ્ઞાન, રાગ-દ્રેષ્ણ, પ્રમાદ વગેરે ઘટે, ધર્મથી ભાષ કરે તેવા ઘણા કર્મો આ વિચારણાથી નાશ પામે છે, આત્માનો આરાધનામાં ઉલ્લાસ જાગે છે,

વીરોલ્લાસ વધે છે, ક્ષયોપશમ વધે છે, સત્પુરુષાર્થમાં-સદ્ભાવનામાં નિરંતર વૃદ્ધિ થાય છે. માટે આ આત્મજાગરણરૂપ-આત્મચિંતનરૂપ આત્મજાગરિકા કરવી તે બધા જ ધર્મી આંત્માઓનું કર્તવ્ય છે.

આ જ રીતે અનિત્યાદિ ૧૨ (બાર) ભાવનાઓ બરાબર સમજવી, વિચારવી, યાદ રાખવી અને સંસારરસિક જીવોની વિચારણાની સામે બાર ભાવના યુક્ત વિચારણાઓ કરવી. આ વિચારણા-ભાવના એ શાખણાનપૂર્વકની આલોચના છે. શાખોમાં “ભાવના ભવનાશિની” બતાવી છે, તે આ આલોચનાનો વિચારણરૂપ પ્રથમ પ્રકાર છે, જે વિવેકયુક્ત અને શાખસાપેક્ષ હોવાથી ભવનાશક બને છે. તેથી યોગનો સંગ્રહ કરે છે. આ વિચારણા પણ સ્વયં યોગરૂપ અને યોગની પરાકાણાએ પહોંચાડનાર છે.

આ જ વિચારણાના પ્રકારમાં પોતાના દોષો ગુરુ પાસે કહેવા માટે પણ યાદ કરી સંકલન કરવા પડે તે માટે સાંજે પ્રતિક્રમણમાં અતિચારની ૮(આઠ) ગાથાનો કાયોત્સર્ગ શ્રાવક માટે છે, અને સાધુ માટે “સયણાસણન્નપાણો.....” ગાથાની વિચારણરૂપ કાયોત્સર્ગ છે અહીં ૮ ગાથા પંચાચારની છે, પરંતુ અતિચારને યાદ કરવા માટે છે. તેથી અતિચારની ગાથા એમ કહેવાય છે. એમ સાધુ માટે પણ આચારની ગાથા છે. આ દોષોની વિચારણા બાદ આલોચના વ્યવસ્થિત થાય છે. દોષોની તપાસ-જાંય-નોંધ-ઉપસ્થિતિ એ પણ આ પ્રકારમાં લઈ શકાય.

(૨) વિચારક માણસ પોતાની વિચારણાની પક્કડ ન રાખતા યોગ્ય અને ઉચ્ચક્ષાવાળા પાસે સલાહ માગે છે. જે પોતાના કાર્યમાં, માર્ગમાં, વિચારણામાં કે પ્રવૃત્તિમાં તેવી વિશિષ્ટ યોગ્ય વ્યક્તિની સલાહ, માર્ગદર્શન કે પોતાના કાર્યમાં અનુમતિ હશે તે પણ વિચારક છે. કદાગ્રહી, ધારેલું કરનાર, બીજા ચિંતકને મહત્વ ન આપનાર-પોતાની વિચારણાને જ સર્વાંશે સત્ય સમજનાર એ હકીકતમાં આલોચક (વિચારક) જ નથી. માટે પોતે વિચારેલ માર્ગમાં વડીલોની સલાહ લેવી અનિવાર્ય છે. તેથી જ દરેક બાબતમાં ગુરુને, વડીલને, જવાબદાર વ્યક્તિને પૂછીને કરવું. આ રીતે યોગ્યને પૂછવું-કરેલ જણાવવું તે પણ આલોચન છે. સાધુને ગોચરી આલોચવાની (ગુરુને બતાવવાની) શાખમાં જે વિધિ છે તેમાં લઘું છે કે જ્યાં, જે રીતે લીધું હોય તે બધું વર્ણન કરે. કોઈ પણ દોષ પોતાને ન જણાય કે ન હોય તો પણ આ આલોચન જીવને અસદ્ગ્રહમાંથી, છુપાવવામાંથી,

અહંકારમાંથી મુક્ત કરે છે. હું અજ્ઞાન છું-ઇજસ્થ છું-ભૂલ થવાની શક્યતાવાળો છું તેથી મારી બધી વૃત્તિ અને પ્રવૃત્તિ બીજા યોગ્યને જણાવવી જરૂરી-અનિવાર્ય છે. એવા ભાવવાળા સાચું-સર્વ કથનં કરે. આવા ભાવ વિનાનું જે કથન તે જરૂરી, અલ્ય અને સામાને વિશ્વાસ પમાડવા પૂરતું અથવા ગતાનુગતિક હોય.

તેથી પોતાના જીવનના બધા પાસામાં બીજા યોગ્ય-દીર્ઘદ્રષ્ટા-સાચો માર્ગ બતાવતા ગુરુ કે ગુરુતુલ્ય વડીલ [ક્યારેક તેવા સંયોગોમાં વડીલના અભાવે પર્યાયમાં સમાન અથવા નાના પણ] ગીતાર્થ (બુદ્ધિશાળી) ગંભીરને સાક્ષી બનાવવાનું, પૂછવાનું, જણાવવાનું-બતાવવાનું રાખવું.

આ આલોચન એટલે જીવન વ્યવહારનું કથન, પૃથ્વી, નિર્દ્દશ અનુસાર વર્તન. તે કરવાથી જીવ આરાધનાના યોગોને મેળવે છે.

જેને વડીલ નથી, ગુરુ નથી, કલ્યાણમિત્ર નથી, બીજાને જણાવવાનું કે પૂછવાનું નથી, ગીતાર્થની નિશ્ચા નથી, સ્વયં ગીતાર્થ હોવા છતાં બીજા ગીતાર્થનો સહયોગ કે સહકાર નથી, તે આ યોગની વિરાધના કરે છે.


પોતાના વડીલો કે મિત્રો કે ઓળખીતા મળે ત્યારે એક બીજા પોતાના જીવન વ્યવહારની, પર્યાટનની, અનુભવોની બેગા મળીને વાતો જણાવે, દેશદેશના રિવાજો, પદ્ધતિઓ અને એમાં પોતાને લાભ-નુકસાન વગેરેની પ્રક્રિયાં વગેરે જણાવે.

જેમ એક વિષયના અનેક નિષ્ણાતો બેગા થઈને તે વિષયોના અનુભવો અને વિચારણા કરે, તેમ આ વિચારણાને શાખીય પરિભાષામાં વિહાર આલોચના કહેવાય છે. જેમ ડોક્ટરોની, વૈધોની, વકીલોની, વેપારીઓની કોન્ફરન્સ બેગી થાય છે તેવી રીતે યોગ્ય વ્યક્તિ યોગ્ય વ્યક્તિઓ પાસે અનુભવ મેળવવા, ભૂલો સુધારવા, ભૂલોને સમજવા જે નિખાલસતાથી વાતો કરે, તેને અનુભવેલી વાતોરૂપે આલોચના બતાવાઈ છે.

(3) ત્રીજા નંબરની આલોચનામાં પોતાના દોષો પશ્ચાત્તાપ સાથે ફરી ન કરવા પડે તે પરિણામપૂર્વક જે પરિસ્થિતિમાં જે ભાવથી આચર્યા હોય તે જણાવવાપૂર્વક ગુરુ જે તપ વગેરે આપે કે કહે, તે રીતે દોષના નાશ માટે કરી આપવું, કારણ કે દોષસેવનથી આત્મા ઉપર બંધાયેલ કર્મ પશ્ચાત્તાપ આલોચન અને પ્રાયશ્ચિત્ત આચરવાથી નાશ પામે છે. સાથે બીજા પણ અનેક કર્મો નાશ પામે છે. આ આલોચનાની વિશેષતા એ છે કે લોક વ્યવહારમાં ડોક્ટર વગેરે

દવાના જાણકાર મામુલી રોગમાં દવા જાતે જ કરે, બીજાને જણાવવાની કે પુછવાની જરૂર અને રહેતી નથી. પરંતુ રોગ ન પકડાય, દવા લાગુ ન પડે, ભયસ્થાન લાગે ત્યારે બીજા ડોક્ટરના આશ્રય, સંલાઘ કે દવા લે. પરંતુ અને પ્રભુશાસનમાં તો ગમે તેવા ઉચ્ચસ્થાને બેઠેલા આત્માને જ્યારે દોષ જણાય અને આલોચના લે, તે નાના કે મોટા દોષનું જાતે જાણવા છતાં પ્રાયશ્ચિત ન લઈ શકે, ગુરુ કે વડીલ ગીતાર્થ પાસે લેવું પડે. તે ન મળે તો નાના પર્યાપ્તવાળા ગીતાર્થ પાસે આલોચના=દોષનું કથન કરે, અને જે શુદ્ધિ બતાવે તે સ્વીકારે-આયરે.

આ રીતે પોતાના દોષોના કથનરૂપ આલોચના એ ગીજો પ્રકાર છે. આવી આલોચના કરવાથી કર્મનો ભાર હળવો કરી જીવ શીખ સિદ્ધિગતિમાં પહોંચે છે.



## ધીર વિહૂરે વિ ન કાયરા

**આ**પત્તિમાં દઢ ધર્મતા = અવિચલિતપણું, ધર્મયુક્તતા એ યોગસંગ્રહ છે અને વિશેષ કરીને પ્રધાનરૂપે યોગસંગ્રહ દઢધર્મપણામાં છે. દઢધર્મપણું એ પ્રધાન-મુખ્ય યોગસંગ્રહનું કારણ છે. અને એમાં પણ દ્વય-ક્ષેત્ર-કાળ-ભાવની આપત્તિમાં-પ્રતિકૂળતામાં મજબૂત રીતે ધર્મને વળગી રહે તે વિશેષ અને શીଘ્ર યોગસંગ્રહરૂપ બને છે. આપત્તિમાં ધર્મને પકડી રાખનારના ભાવ વિશેષ વૃદ્ધિ પામે છે. તે પુષ્ય અને જ્યોતિર્યમથી અનેક રીતે ધર્મમાં આગળ વધે છે.

આપત્તિ એટલે પ્રતિકૂળતા. તે ચાર પ્રકારની છે. (૧) આયંબિલ કરવા હોય ને આયંબિલ ખાતું ન હોય, સખત ગરમી હોય, તપ કરવો હોય પણ કોઈ સંભાળનાર ન હોય, પારણા-અત્તરપારણા બરાબર ન થાય, જે જે સામગ્રી આરાધનાની પોષક છે તે બરાબર ન મળે તે દ્વય આપત્તિ કહેવાય (૨) ક્ષેત્રમાં જંગલ-અટવી, રૂક્ષ ક્ષેત્ર, વિરોધી ક્ષેત્ર, અતિ ગરમીનું ક્ષેત્ર, જે કાર્ય કરવું હોય તે કાર્યને અનુકૂળ દ્વયો પણ તે ક્ષેત્રમાં ન મળે તેવું ક્ષેત્ર. (૩) દુર્લિક્ષ કાળ અર્થાત્ આહાર પાણી બરાબર ન મળે તેવો કાળ અને (૪) આપણો ઉત્સાહ ન જાગે, શરીર બરાબર ન હોય, બીજા બીમાર હોય, અનુકૂળ વર્તનાર ન હોય, કુટુંબનો વિરોધ હોય આ ભાવ આપત્તિ કહેવાય.

આ કે આવા કોઈ પણ ભાવ પરિસ્થિતિજન્ય સંયોગો કે ભાવને ઘટાડનાર નિમિત્તો વગેરે આપત્તિ કહેવાય.

મોડા ઉઠ્યા કે મહેમાન આવી ચઢ્યા, બહાર જવાનું થયું કે બીજું કામ આવી ગયું, શરીર અસ્વસ્થ થયું વગેરે અનેક કારણો પૂજા, પ્રતિકમણ ચૂકે, ઉકાળેલું પાણી છોડે, તપ છોડે, એકાસણા-બેસણા-રત્રિભોજનત્યાગ છોડે તે અદઢધર્મતા કહેવાય. આ બધા પ્રતિકૂળ સંયોગોમાં પણ આરાધનાને-ચાલુ કરેલ ધર્મને મજબૂત રીતે પકડી રાખવો જોઈએ. સહન કરીને, પરિસ્થિતિનો સામનો કરીને, સત્ત્વ ફોરવીને પણ ધર્મમાં ડામાડોળ ન થવું. તેથી ધર્મ પ્રત્યેની રૂચિ-પક્ષપાત-પ્રધાનતા વધે છે અને ધર્મ આત્મસાત્ થાય છે.

દેઢતા એટલે શરૂ કરેલ કાર્યમાં હીનતા-અવ્યતા-ઓછાશ ન કરવી, કંટાળો ન લાવવો, પ્રસતતા ન ગુમાવવી, પુરું કરવાની ઉતાવળ ન કરવી, આપત્તિ સમયે હવે અનુકૂળતા કંયારે આવે તેવું ન વિચારવું.

સામાન્ય પરિસ્થિતિમાં અને સામાન્ય આપત્તિમાં તપ-ત્યાગ-જપ-ધ્યાન-શમા-સહનશીલતા વગેરે પકડી રાખવાથી જીવનમાં ધર્મની મહત્ત્વ વધે છે.

નાની નાની મુશ્કેલીમાં જે ધર્મમાં મજબૂત બને તે પછી મોટી મુશ્કેલીમાં પ્રાણાંતે પણ ધર્મ પકડી રાખવા સમર્થ બને. સામાન્યથી આપત્તિ વગર જે દફખમાં નથી તે કરે, ન કરે, ઈચ્છા થાય ત્યારે કરે, ઈચ્છા ન થાય તો ન કરે. તેને પ્રારંભિક ધર્મ-વ્યવહારધર્મ કહેવાય. આવા જીવો કદાચ રોજ ધર્મ કરતા પણ હોય છીતાં પરિસ્થિતિમાં સામાન્ય કેરફાર થતા છોડી દે-તેને છોડી દેતા વાર ન લાગે, તેથી તે-તે ધર્મની ભાવથી સિદ્ધિ ન થાય.

કોઈ પણ કાર્યમાં પ્રથમ રૂચિ આવે, પછી પદ્ધતિપાત આવે, પછી પ્રધાનતા આવે, પછી દેઢતા આવે છે.

રૂચિમાં સારુ લાગે, કરવા જેવું લાગે, ઉપાદેય લાગે.

પદ્ધતિપાતમાં મને મળે તો સારુ, મારે મેળવવું છે મને કયારે મળે ? આ વિચાર મનમાં ચાલે.


પ્રધાનતામાં આના વિના ન જ ચાલે, ગમે તે રીતે મેળવવું છે, તે મેળવવા પ્રવૃત્ત થાય.

દેઢતામાં સહન કરવા-આરાધના કરવા તૈયાર થાય.

ધર્મમાં મજબૂતાઈ એટલે આચારમાં મજબૂતાઈ. ભાવને મજબૂત કરવા માટે આચારને મજબૂત કરવો જોઈએ. મજબૂત ભાવવાળા આચાર સહજપણે પકડી રાખે છે, અને આચાર પકડી રાખનારાના ભાવ મજબૂત થાય છે.

ભાવ મજબૂત નથી અને આચારની પકડ નથી તો ભાવ નાશ પામશે ત્યારે પામશે, પણ આચાર નાશ પામતા વાર નહીં લાગે. અને આચાર નાશ પામ્યા બાદ ભાવ શેના ઉપર રહેશે ? માટે પ્રથમ ધર્મ છે-આચારસંપત્ત બનવું. આચારમાં દેઢતાવાળા બનવું, એ પછી સામાન્ય પ્રતિકૂળતા આવે ત્યારે પ્રતિકૂળતાનો સામનો કરી સત્ત્વ વિકસાવી આચાર પકડી રાખવા, અને છેલ્લે વિશેષ પ્રતિકૂળતામાં પણ સત્ત્વ ફોરવવું. આ બધું વ્યક્તિગત અપેક્ષાએ સમજવું,

સંઘ અને સમુદ્ધાયની મર્યાદા વગરે અંગે ગુર્વાદેશ પ્રમાણ કરવો.  
આચારની મજબૂતાઈથી વિચાર મજબૂત બને, એમ વિચારની મજબૂતાઈથી  
પણ આચાર મજબૂત બને તેથી સત્ત્વ વિકસે-વ્યવહાર શુદ્ધ અને દદ થાય.  
કષોપશમ તીવ્ર બને, પર્મ પ્રત્યે ભક્તિ-અનુરોગ તીવ્ર થાય, બીજાને આલંબન  
મળે, એનાથી ઉપરની ભૂમિકાના આચારની શક્તિ અને યોગ્યતા આવે છે.



## મહિં ર્માગવતી વીજં પરમાનંદસંપદામુ

**‘પરમાત્માની ભક્તિ એ પરમાનંદ સંપત્તિનું બીજ છે.’** એમ આ વાક્યમાં શાલ્કારશીએ બતાવ્યું છે. અહીં આપણે પરમાત્માનું સ્વરૂપ, ભક્તિનું સ્વરૂપ અને પરમાનંદ સંપત્તિનું સ્વરૂપ, આ ત્રણે સમજવા જોઈએ.

પરમ આત્મા=શૈખ આત્મા. એ આધ્યાત્મિક રીતે સિદ્ધ પરમાત્મા છે અને બીજા નંબરમાં શ્રી તીર્થકર પરમાત્મા છે. ભૌતિક રીતે પરમ આત્મા શ્રી તીર્થકર દેવો છે.

સંસારી આત્માઓ યોગ્યતારૂપે પરમાત્મા છે, મ્રગટરૂપે તાત્કાલિક નથી. એમાંના કેટલાક વિશિષ્ટ આત્માઓ આધ્યાત્મિક પરાકાણાએ પહોંચતા વચ્ચે ભૌતિક પરાકાણા પામીને શ્રી તીર્થકર પરમાત્મા બને છે. એ સિવાય પણ જ્યાં સુધી પરાકાણા ન પમાય ત્યાં સુધી સંસારી આત્માઓને જે આધ્યાત્મિક અને ભૌતિક શક્તિઓની ઉત્તરોત્તર વિશેષરૂપે પ્રાપ્તિ થાય છે, તેમાં પોતાની યોગ્યતા કારણ છે, પરંતુ સાથે ભાવ્ય આલંબન-સામર્થ્ય પરમાત્મા અને પરમાત્માના શાસનનું છે.

પરમાત્માના ઉત્કૃષ્ટ પૂજ્યના અનુરાગ, ગુણોના અનુરાગ, અને ઉપકારીપણાના અનુરાગ દ્વારા જીવને પરમાત્મા ઉપર ભક્તિ જન્મે છે. વ્યક્તિ ઉપર જેટલો સ્નેહ, આદર, ગૌરવ, પૂજ્યતાની બુદ્ધિ વધારે તેટલું જ તે વ્યક્તિના દરેક કાર્ય, દરેક પ્રસંગ, દરેક વચ્ચન, દરેક કરણી, તે વ્યક્તિને માન્ય દરેક વસ્તુ અને માન્ય દરેક વ્યક્તિ ઉપર પણ પૂજ્યતા, ગૌરવ, આદર, સ્નેહ વગેરે આવે છે. તેથી પરમાત્મા ઉપરનો સ્નેહ પરમાત્માના શાસનના દરેક અંગ ઉપરના સ્નેહરૂપે પરિણામે છે.

ભજન કરાવે તે ભક્તિ. ભજન એટલે કે સેવા, ગુણગાન કરાવે. પોતાનામાં સેવકપણાની બુદ્ધિ અને તે-તે આરાધ્ય અને આરાધનાના સ્થાનોમાં પૂજ્યપણાની બુદ્ધિ તે ભજન છે-ભક્તિ છે. પરમાત્માની ભક્તિથી સમગ્ર શાસનની ભક્તિ પ્રાપ્ત થાય છે. પરમાત્માની ભક્તિથી આધ્યાત્મિક દ્રષ્ટિ આવે છે, આરાધનાના અંગની દ્રષ્ટિ આવે છે. પાપકર્મના નાશથી પાપદ્રષ્ટિ, કદાગ્રહ દ્રષ્ટિ, અવિવેક દ્રષ્ટિ, આવેશ દ્રષ્ટિ બધી ધીમે ધીમે કે એક સાથે નાશ પામે છે અને સર્વ ગુણોના બીજ આત્મામાં વવાય છે.

સંસારી જીવોના મુકૃતિ, ગુણો, પ્રવૃત્તિ, વલખ વગેરેથી અત્યંત વિલક્ષણ પરમાત્માની મુકૃતિ વગેરે સ્વરૂપ છે. સંસારી આત્મા બધી રીતે દોષ-મોદ-અજ્ઞાન પુકૃત છે, પરમાત્મા બધા ગુણો-શાનથી ચુકૃત હોનાથી સદા પ્રસર, સર્વ રીતે સર્વ કાર્ય કરવામાં સમર્થ છે. તેમની ભક્તિ એટલે તેમની આદર-ઔચિત્યપૂર્વક સેવા કરવી, તેમના નામ અને ગુણોનું રટશ્શ કરવું, તેમના વચનો સાંભળવા, વાંચવા, યાદ રાખવા, પોતાના જીવનમાં આચરણરૂપે પાળવા, એમના ગુણો જીવનમાં મેળવવા પ્રયત્ન કરવો, એમના શાસનના આરાધનાના સર્વ અંગોને ગૌરવભરી દ્રષ્ટિથી જોવા, શક્ય રીતે આરાધવા, બીજા આરાધકોની પ્રશંસા=સહાય કરવી. આ બધી ભક્તિથી જીવ પાપના જુના અનુભંધોનો નાશ કરે છે, નવા અનુભંધ પડતા નથી, પુણ્યના અનુભંધ પડે છે. સાનુભંધ ક્ષયોપશમ થાય છે તેથી તે યાવત્ કેવળજ્ઞાન સુધી જીવને પહોંચાડે છે. આ બધા ઇણ ભક્તિના છે. તેથી પરમાત્માના દર્શન, વંદન, મૂજન, સ્તવન અને આજ્ઞાપાલનમાં જેને આનંદ છે તે પરમાનંદરૂપ કેવલ લક્ષ્મીની સંપદાને પ્રાપ્ત કરે છે.

તેથી જ શાઅ અધ્યયન, વાંચન, ઉપદેશ, પાઠન, આચારપાલન, તપ, ત્યાગ, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ વગેરે બધા ગુણોમાં જો પરમાત્માની ઉપર આદર ભળેલો હોય તો તે બધા પરમાનંદના કરશ્શ છે. પરંતુ પરમાત્માની ભક્તિમાં જેને હંડક લાગતી નથી, જેનું મન હરતું નથી, તેને બીજા અનુષ્ઠાનો પુણ્ય આપી કદાચ જતા રહે, ચિરસ્થાયી ન બને. માટે બીજુ આરાધના કરનારે પણ પરમાત્મભક્તિ, જ્ઞાપ, ધ્યાન અને એમના ઐદ્યપર્ય વચનને યાદ કરવા રૂપે હદ્યમાં સમર્પણ ભાવ પ્રાપ્ત કરવો જોઈએ.

જેના હદ્યમાં પરમાત્મા આવે છે તે આત્મા પરમ આનંદ પામે છે. માટે સર્વ આપત્તિઓમાં પરમાત્માને યાદ કરવા, નવરાશમાં પરમાત્માને યાદ કરવા, સર્વ સારા કાર્યમાં પરમાત્માને યાદ કરવા. માટે વારંવાર નવકાર ગણવા. જરૂર નવકારરૂપ નંદિ પણ બતાવી છે. સારા કાર્યમાં યાદ કરવાથી સારા કાર્યોના વિના દૂર થઈને શીઘ્ર સિદ્ધ થાય છે. મંગળરૂપે આરાધનાના બીજા યોગો કે બીજા આરાધકો ન બતાવતા પરમાત્માને કે પંચ પરમેષ્ઠિને યાદ કરવામાં આવે છે કારણ કે પરમાત્માની આરાધના તે સર્વ આરાધનાનું બીજ છે.

પાપ કાર્યમાં પણ પરમાત્માને યાદ કરવાથી પાપ કાર્યથી જીવ છુટે છે. જ્યાં પણ પાપ કરવું પડે ત્યાં પણ પરમાત્માની યાદગીરીને પસારે એ પાપના પ્રત્યે

મન ઠરતું નથી તેથી વિશિષ્ટ પાપ બંધાતું નથી. જીવ પરમાત્માના પ્રભાવે સદા મસત રહે છે. માટે સદા મસતતા, સાત્ત્વિકતા, વીલપાવર (ઈંદ્રજાશક્તિ), વિવેકસંપત્તતા, ધર્મસંપત્તતા અને આનંદધ્યુક્તાંતા જોઈએ. તે બધાના બીજું રૂપ શ્રી તીર્થકરદેવ પ્રત્યે આદરભાવ, ગૌરવભાવ, ભક્તિભાવ, પૂજા, જાપ, સ્તવનો-સ્તોત્રોનો નિત્ય પાઠ અને શાખાધ્યયન, આચારપાલન વગેરે રૂપ ભક્તિમાં સજ્જ બનવું જોઈએ. આ બધી ભક્તિથી જીવ તદ્દ્બવે પણ મોક્ષ પામે અથવા ૨-૪-૬ ભવે અલ્ફકાળમાં મોક્ષ પામે.

શ્રેષ્ઠિક મહારાજાએ પરમાત્માના ધ્યાન, જાપ એકતાનતાથી કર્યા તો તુભુમાં મોક્ષ પામશે અને શ્રી પરમાત્મા થશે. માટે પરમાત્મા ભક્તિ જીવનમાં વધારવી.



વરં મે અપ્પા દંતો, સંજમેણ તવેણ ય ।  
મા હુ પરેહિ દમેજા, બંધણેહિ વહેહિ ય ॥

**આ** શ્લોકમાં મોક્ષપ્રાપ્તિનો ઉપાય, સંસારમાં પણ સ્વાધીન રહેવાની પ્રક્રિયા, સંસારમાં પરાધીનપણું શાથી આવે અને એની શી સ્થિતિ છે આમ ચાર વાત જતાવી છે. જેમ વાહન જો ચલાવનારના અંકુશમાં ન હોય અને ચલાવનાર જો સ્વસ્થ-સ્વાધીન ન હોય, નિદ્રાવ્યાસ-ચિંતાવ્યાસ કે પીષેલ હોય અથવા શૂન્યમનસ્ક હોય તો વાહન આહુઅવળું જતું રહે અને ગતિ હોવા છતાં તે ગતિ જ અક્ષમાતનું કારણ બને. એ રીતે ઘોડા-હાથી વગેરેની સવારીમાં તે સ્વયં શાંત-સ્વસ્થ હોય તો સીધા માર્ગ વ્યવસ્થિત ચાલે, પરને પીડા ન કરે અને પોતે પણ પીડા ન પામે. પણ મદોન્મત બને, ગાંડો બને, તોણાની બને કે વિપરીત શિક્ષિત હોય તો તે સ્વ-પર બનેનો નાશ કરનાર, નુકશાનમાં ઉતારનાર થાય છે, તેવી જ રીતે આપણે જેના આધારે પ્રવર્તિઓ તે જો સ્વયં વ્યવસ્થિત હોય અથવા આપણા દ્વારા કાયમ અંકુશમાં હોય તો આપણે અને એ નિર્ભય રહીએ. જો એવું ન હોય તો આપણે તેને સ્વસ્થ બનાવવા પડે અને અંકુશમાં રાખવા પડે. સ્વસ્થ બનાવવા અને અંકુશમાં રાખવા એ બેમાંથી સારુ અને સહેલું શું એ વિચાર કરીએ તો- જે જાતે શાંત-વિચારક-સ્વસ્થ-અવિપરીત ન હોય એના પર ક્યારેક આપત્તિકાલીન આચાર રૂપે અંકુશ મુકી કામ લઈએ એ વાત જુદી; બાકી એનાથી સ્વ-પર અનેકના જીવન જોખમમાં આવે. તેથી કાર્યને પાર ઉતારવા માટે યોગ્ય વ્યક્તિ-વસ્તુ જોઈએ, સાથે એ ચલાવનારને આધીન જોઈએ. ચલાવનારે લગામ વાળવા-હલાવવા કડક કે ઢીલી મુકવા જેવી ઈશારા પુરતી જ પ્રક્રિયા કરવાની રહે. માટે વાહન-સવારી-આશ્રય આપવા માટે પાત્રતા અને નિયંત્રણ-યોગ્યતા જોવી પડે છે.

એ નિયંત્રણ એટલે યોગ્ય માર્ગ યોગ્ય રીતે ચાલવું; યોગ્ય માર્ગ અયોગ્ય રીતે ચાલે તો પણ ન ચાલે અને યોગ્ય રીતે અયોગ્ય માર્ગ ચાલે તે પણ ન ચાલે. બને ન હોય તે વિશેષ જોખમી છે. યોગ્ય માર્ગ એટલે સંયમ અને યોગ્ય રીત એટલે તપ. સ્વ અને અન્ય અનેકના રક્ષણ માટે આશ્રય વ્યક્તિ કે સાખનોનું

નિયંત્રણ અને વ્યવસ્થિતતા અનિવાર્ય છે. તે નિયંત્રણ લોકોમાં અનેક રીતે જોવાય છે. ઠપકો આપીને, તિરસ્કારથી-મારથી-વસ્તુ છીનવી લઈને-લોકમાં હલકો પાડીને- જે જે રીતે એનું બળ હોય તે બળને ઘટાડવાથી નિયંત્રિત થાય છે. તેથી લોકમાં કહેવત છે કે “નાક દ્વારાવાથી મોઢું ખોલે” આ રીતે લૌંગક માર્ગમાં યોગ્ય કાર્ય અને યોગ્ય પદ્ધતિ બધે જોઈએ છે; એ કરવી-કરાવવી પડે છે. એ રીતે લોકોની માર્ગમાં પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા નથી ચાલતી.

સ્વતંત્રતા એટલે અનિયંત્રિતતા, અસંયમ, અને સ્વચ્છંદતા એટલે અનિયંત્રિતતા. આને માટે શાસ્ત્રો-સામાચારી અને આચાર્ય વગેરે પાંચના નિયંત્રણ મુકેલા છે. શાસ્ત્રો ભણાવીને પ્રથમ બુદ્ધિમાં નિયંત્રણ અને પદ્ધતિ વસાવવી, સામાચારીના શાન અને પાલન કરવા-કરાવવા દ્વારા યોગ્ય રીતે વર્તવું. ગમે તે રીતે ન વર્તવું. આ નિયંત્રણ એક સુગ્રથિત સંસ્થા-સમાજની જેમ બતાવ્યું. અને એની ઉપર પ્રમુખ-ઉપાધ્યાય, મંત્રીની જેમ વ્યવસ્થિત કાર્ય ચલાવવા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક બતાવ્યા, જે જુદી જુદી રીતે નિયંત્રણ કરે છે, સ્વયં નિયંત્રિત રહે છે, આ પાંચને પણ એક બીજા નિયંત્રિત રાખે છે. જે સ્વયં નિયંત્રિત ન હોય તે બીજાને નિયંત્રિત રાખે તે લાભનું ચાલે નહિ. જે જીતે લાંચ લે અને બીજાને લાંચ લેતા અટકાવે તે દેખાવ પુરતું હોય છે.

માટે વળ, પાત્ર, અન, પાન વગેરેના વપરાશમાં ઉત્પાદન સંભાળ, પરિકર્મ, વિસર્જન બધામાં યોગ્ય રીત અને પ્રમાણ અંકુશ જોઈએ. એ જે રીતે આચિત-શિષ્ય-પુત્ર વગેરેને શિક્ષા, વ્યવહાર, સત્યતા, સાત્ત્વિકતા, વિનય, શાંતતા, ગંભીરતા, અવસર ઉચ્ચિતતા, ચતુરાઈ, પ્રાજ્ઞતા વગેરે ગુણો સમજાવવા, કેળવવા, પળાવવા. આવું નિયંત્રણ હોય એ ઘર કહેવાય. એ નિયંત્રણ ન હોય તે માળો કહેવાય.

આ નિયંત્રણ માટે પૂર્વ ઉપાધ્યાય, દાદા, દાદીમા, પિતાજી સંભાળ લેતા હતા. આજે સ્કુલ-કોલેજ એ માટે હોવી ઘટે. સાથુ માટે આચાર્ય, ઉપાધ્યાય, સાધ્વી માટે એમના વડીલ સાધ્યીજી હોય. જે ભજાવે, વ્યવહારકુશળ અને આચારકુશળ બનાવે. જે નિયમન અને નિયમિતપણું ન શીખડાવે, ન આપે તેને નિયંત્રણ કરનાર ન કહેવાય.

આ બધી વાત બીજી વસ્તુની અને બીજી વ્યક્તિની થઈ.


હવે જાતની વાત. સંસારમાં નિયંત્રણ અને નિયમિતપણું કોને કેટલું ગમે છે? છતાં લોકવ્યવહારમાં બહારથી જો અંકુશ વગર પ્રવર્તે તો તિર્યંગ જેવી સ્થિતિ

થાય તેથી લોકમાં મર્યાદારુપે અમૃત નિયમિતતા-નિયંત્રિતતા જરૂરી-અનિવાર્ય હોય છે. આનાથી લોકમાં શિસ્ત અને સદાચાર પ્રવર્ત છે. જો લોકમાં મર્યાદાઓ અને સારા આચારો ન હોય તો ગુંડા-લુઘ્યાઓનો અહો થાય. એ જ રીતે જો જીવ પોતાના ઉપર સંયમ અને તપનું નિયંત્રણ મુકે તો તેનાથી ઉદ્યમાં આવતા અશુભ કર્મો અટકે, અસત્ત પ્રવૃત્તિઓ અટકે, ઘટે, શુભકર્મ બંધાય, શુભ વિચારણા-પ્રવૃત્તિને અવકાશ મળે. જેમ દારુ પીવાનું બંધ કરવાથી અનો કેફ ઉત્તરે, સ્વયં સ્વસ્થ થાય, તેની પરાધીનતા જાય તેમ જીવન સંયમ-તપમાં નિયંત્રિત કરવાથી સ્વયં સ્વસ્થ થાય છે. પછી અસંયમની, ઈચ્છાની, પરાધીનતાની બયંકરતા સમજાય છે. આ નિયંત્રણ મુકવાથી જીવ સદા શાંત-વિવેકી બને છે. તેથી અંગભાજુ સંયમ, તપ સદા માટે સ્વાભાવિક બને છે, બીજી ભાજુ પુષ્પની પરાકાશાથી, પાપના દ્વારાસથી અને કષ્યોપશમની વૃદ્ધિથી બધા પ્રકારે ઊચી સ્થિતિ, શક્તિ, પ્રતિભા, સામર્થ્ય મળે છે, જે સ્વ-પરને વધારે અંકુશમાં, નિયંત્રણમાં લેવા-સ્વસ્થ બનાવવા કરી લાગે. તેને ક્યારે પણ બીજા દારા નિયંત્રણ, વધ, બંધન આદિનો અનુભવ કરવો પડતો નથી કરણ બીજા જેટલું નિયંત્રણ ઈચ્છા હોય તેના કરતા કેઠ ગળાનું નિયંત્રણ જાતે જ કરે છે.

સંસારી જીવો આ બવમાં વ્યવહારથી ભલે આંશિક નિયંત્રિત હોય, પરંતુ અજ્ઞાન, પાપની રૂચિ, વિષયોની અનુકૂળતા, માન-અપમાન, કષાય વગેરેથી માનસિક અને વ્યવહારિક જે અનિયંત્રિતતા-અસંયમ, ભોગ, કષાય થાય તેના કારણે પાપ અને પાપના કારણે પરભવમાં મતિવિભમ અને બીજાઓ દારા નિયંત્રણ ભોગવવાનું રહે છે.

જીયારે શાલ અધ્યયન, સામાચારી રૂપ આચારમાં દઢતા અને આચાર્ય વગેરે શ્રી સંધની આધીનતા, ઈન્દ્રિય-મનોનિગ્રહ, કષાય-દમનરૂપ તપસંપત્તતાથી જીવ જાતે જ જાતનું દમન કરતો રહે તો સંસારમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી આ સંસારમાં એને દમન કરનાર, વધ બંધન કરનાર કોઈ રહેતું નથી. માટે આવો જીવ વ્યવહારથી સ્વતંત્રતાની ગરિમાને ધારણ કરે છે.

આ બધાનો સાર એ છે કે જીવે દરેક વાતમાં સંયમ અને તપને જીવનમાં પ્રધાનતા આપીને જીવવું અને જાતનું દમન કરવું જોઈએ.



## ઇચ્છા હુ આગાસસમા અણંતિઆ ।

**જીમ** કેવળજ્ઞાની ભગવંતને સર્વ વસ્તુનું, સર્વ કાળનું, સર્વ અવસ્થાનું, સર્વ પર્યાપ્તનું જ્ઞાન હોય છે તેમ છઘસ્થને પૂર્વી જ્ઞાન નથી હોતું, પરંતુ તરતમ માત્રાએ અનંત બેદવાળું જ્ઞાન હોય છે. શ્રુતજ્ઞાનમાં પણ ચૌદ્ધપૂર્વાઓમાં પદ્ધસ્થાનપતિત જ્ઞાન છે, મતિજ્ઞાનમાં પણ પદ્ધસ્થાન પતિત છે.

છઘસ્થના ગુણોમાં વિપ્યબેદથી-કાળબેદથી-પર્યાપ્તબેદથી અનંત બેદ પડે છે. કાળ અને કેત્ર બેદથી ક્યાંક અસંખ્ય બેદ અને ક્યાંક અનંત બેદ પડે છે.

ઈચ્છા એ મોહનીયના ઉદ્યરૂપ જ્ઞાનયુક્ત-આશંસાયુક્ત આત્માની અવસ્થા છે. ઈચ્છાના અનેક પ્રકારો પડે છે. (૧) પોતાને ઈષ વસ્તુ-વ્યક્તિ-અવસ્થા-સંયોગની પ્રામિની અભિલાષા... આના પણ વસ્તુબેદથી, વ્યક્તિબેદથી, કાળબેદથી, અનુકૂળ સંયોગોના બેદથી અનંતા બેદો પડે છે, ક્યાંક અસંખ્ય બેદ પડે.

આ જ રીતે પોતાના મુત્રાદિ-સ્વર્ધાદિ વ્યક્તિઓ માટેની ઈચ્છાઓના પણ બેદ પાડવા. (૨) પોતાને અનિષ્ટ વસ્તુ-વ્યક્તિ-અવસ્થા-સંયોગાદિ આવી ન પડે તેની અભિલાષા-આના પણ અનંતા બેદ પડે આ જ રીતે (૩) પ્રામ ઈષના અવિયોગની અભિલાષા અને (૪) અનિષ્ટના વિયોગની, અશાતાવેદનીયજન્ય વેદનાની વિયોગાભિલાષા, અપ્રામ વેદના ન આવે તેની ઈચ્છા. શાતાવેદનીયમાં આથી વિપરીત કરવું.

વિપ્યબેદથી નિયાષાના પણ અનેક બેદ પડે છે. આમ ઈચ્છાના બેદ અનંતા છે.

અવિવેકી-અનિયંત્રિતવિચારાધીન-મોહાધીન-આવેશ આધીન તંદુલિયો મત્સ્ય જેમ જીવનમાં એક પણ મસ્ત્યનો આહાર કરી શકે તેમ નથી પણ વિરાટ સંકલ્પ-ઈચ્છાથી વ્યામ છે તો નરકગામી થાય છે. કપિલ કેવલીને પૂર્વ અવસ્થામાં બે કોડી સુવર્ણાની જરૂર હતી છતાં સંકલ્પમાં ઈચ્છાથી ય લાખો ટનથી સંતોષ ન થયો. જેમ ક્ષિતિજ જ્યાં ઊભા હોઈએ ત્યાંથી ૫-૧૫ માઈલે દેખાય છે, ત્યાં પહોંચીએ એટલે એટલી ફરી આગળ વખતી દેખાય, વળી આગળ દેખાય. એ

રીત ક્ષિતિજનો અંત વ્યવહારથી નથી, તેમ સંકલ્પથી પણ ઈચ્છાનો અંત નથી અને પ્રામિથી પણ ઉત્તરોત્તર ભૂમિકાની પ્રામિની ઈચ્છા અને શક્યતાનુસાર પ્રયત્નો થાય છે, તેનો પણ અંત આવતો નથી. આકાશનો જેમ અંત નથી તેમ સારી નરસી કોઈપણ ઈચ્છાનો અંત નથી હોતો.

વિશેષ અશુભ ઈચ્છાને ઉદેશીને આ વાત છે. જેમ કામ, કોષ, આળસ, આહાર અને નિદ્રા આ પાંચ જેમ આચરીએ તેમ વધે. મહાભારતમાં કહું છે-

વર્ધને પંચ કૌન્તેય! સેવ્યમાનાનિ નિત્યશ : ।

આલસ્ય મૈથું નિદ્રા કુધા ક્રોધશ્વ પંચમ ॥

તેમ ઈચ્છા પણ વધારીએ તેમ વધે છે. માટે ઈચ્છારોધને તપ અને સંવર બતાવ્યો છે. સુભૂત છખંડનો માલિક હોવા છતાં લોભથી બીજા છ ખંડ જતવા ગયો અને સમુદ્રમાં મર્યાદ.

પાપની-આશ્રવની-સંસારની-અર્થકામની ઈચ્છાઓ તો રોકવાની-અટકાવવાની હોય છે અને એ માટે એની પ્રવૃત્તિઓ પણ અટકાવવાની હોય છે. સાથે સાથે શુભ ઈચ્છાઓ શુભ દેખાતી હોવા છતાં મોહ, અવિવેક અને આસક્તિથી પુરુત હોય તો એ ઈચ્છાના કારણો બીજા યોગો આરાધી શકતા નથી.

જેમ સ્વાધ્યાયાસક્ત ગ્લાન કે આચાર્યની ભક્તિની જવાબદારી માટે અયોગ્ય છે. તેથી જ કિયામાં અન્યમુદ્ર (એક કિયા વખતે બીજો વિચાર, તેમાં આનંદ પામવો)ની જેમ આસંગ (કોઈ એક કિયામાં અતિ આસક્ત બનવું) દોષ પણ બતાવ્યો છે. તેને તે કિયા સિવાય બીજામાં આનંદ ન આવે, તેથી બાકીની કિયાઓ સિદ્ધાય. માટે મનને અંકુશમાં રાખી જેમ અશુભ પ્રવૃત્તિઓની નિવૃત્તિ કરવાની છે તેમ અશુભ ઈચ્છાઓનો પણ ત્યાગ કરવાનો છે. સંપૂર્ણપણે ઈચ્છારહિત ન થવાય ત્યાં સુધી તેને ઘટાડતા જવું જોઈએ.

પ્રવૃત્તિના વધારા કે ઘટાડામાં શક્તિ-સંયોગ-ભાવના વગેરે અનેક ચીજો આવશ્યક છે તેથી પ્રવૃત્તિનો વધારો કે ઘટાડો સહેલો નથી, પરંતુ ઈચ્છાની વૃદ્ધિને બાધ્ય કોઈ વસ્તુની જરૂર નથી. તેથી સિનેમાના પડદા પર ચાલતા દ્રશ્યની જેમ જીવ મનના પડદા પર સંકલ્પ-વિકલ્પ-હિસા વગેરે તાંડવ કરે છે અને આર્ત-રોદ્ર ધ્યાન દ્વારા દુર્ગતિની પરંપરા સર્જે છે.

મરીચિએ નીચ્યગોત્ર કર્મ કેમ બાંધ્યું ? ભરત મહારાજાએ ‘પરમાત્માએ

તીંથેકર-ચક્વતી અને વાસુદેવપણું મળવાનું બતાવ્યું છે' એમ કહ્યા બાદ આજે તાત્કાલિક કશું મળવાનું નથી, જ્યારે મળવાનું છે ત્યારે તેને કોઈ લઈ લેવાનું નથી, તો આટલા આનંદથી નાચવાની રી જરૂર ? તરફ પદવીની ઋદ્ધિમાં જીવને આનંદ આવે છે. તેથી જેમ મેળવવાની ઈચ્છા કરે તે મહાઆશ્રવ છે, તેમ તે મળવાનું નિશ્ચિત જાણી જીવ આનંદ પામે આ પણ મહાઆશ્રવ છે. હિસાના સંકલ્પથી-ઈચ્છાથી દ્રમક સાતમી નરકે જાય, તંહુલિયો મત્ત્ય આહારના સંકલ્પથી-ઈચ્છાથી સાતમી નરકે જાય આ બધામાં પોતાની શક્તિ નથી, કાર્ય કરી શકતો નથી, તેનું જે દુઃખ છે તે પણ ઈચ્છારૂપ મહાઆશ્રવનું જ બીજું સ્વરૂપ છે. ઈચ્છાના કારણે સ્વયં પ્રવર્તયું, બીજા પ્રવર્તે તેમાં આનંદ થયો, પોતે ન પ્રવર્તી શકે ત્યારે દુઃખ થયું, બીજાની અનુમોદના કરવી, બીજાને પ્રવર્તાવવા-આ બધા ઈચ્છાના જ રૂપકો છે.

સારુ ખાઈને-પીને-ભોગવીને-જોઈને-હરીકરીને જીવ જ્યારે ધરાયો ? આ ઈચ્છાઓ સદા અતૃપુ જ છે. અબદિત ચક્વતી ઉમાં દેવલોકમાં જિંચી સામગ્રી ભોગવીને અહીં આવ્યો. મનુષ્ય યાં બાદ જાતિસ્મરણ જાન થયા પછી પણ, ચક્વતીપણાના ભોગથી પણ ધરાતો નથી. સતત અતૃપિની લ્હાયમાં આજે પણ સાતમી નરકમાં રીબાઈ રહ્યો છે. ઈચ્છાનું બધાર કદી બરાનું નથી. તેથી જ ઈચ્છાને આકાશ સમાન બતાવી છે. માટે ઈચ્છાપૂર્તિ એ શાંતિનો, આરાધનાનો કે મોકાનો ઉપાય નથી પરંતુ શાલજ્ઞાન અને ગુર્વાધીનાં દારા અશુભ ઈચ્છાઓને સમજવી, એને ઘટાડવી અને શુભમાં વળાંક આપવો, તે જ જીવનું સાચું કર્તવ્ય છે.

શુભના કાર્યોની રૂચિ જન્માવવી. બાવનાનો દારા બીજા કાર્યને ટેકો આપવા દારા એની પ્રશંસા કરવા દારા, પોતે કાર્ય કરવા દારા એ શુભરૂચિને વિકસાવવી જોઈએ. જો કે શુભ રૂચિ પણ શાલજ્ઞાનથી અને ગુરુથી નિયંત્રિત જોઈએ, વિવેકયુક્ત જોઈએ. માટે જેમાં ગુરુની સંમતિ ન મળે તેમાં પોતાની રૂચિ હોવા છતાં એ ગૌણ કરવી, તે રૂચિને રોડવી. આ રીતે રૂચિને યોગ્યસ્થાને નિયંત્રિત કરવાથી સ્થાનનું માહાત્મ્ય ફટ્યમાં વસે છે અને રૂચિનું (ઈચ્છાનું) પ્રધાનપણું નાશ પામે છે. અનિયંત્રિત રૂચિ લગામ વગરના ધોડા જેવી છે જે ગમે ત્યાં ગમે તે રીતે દોડી જાય, જ્યારે વિવેકથી નિયંત્રિત રૂચિ, ગુર્વાદ્વાપરતંત્ર રૂચિ, શાલસાપેક્ષ રૂચિ લગામથી નિયંત્રિત ધોડેસ્વરાની ઈચ્છાનુસાર ઈદ સ્થળે પહોંચાડતા ધોડા જેવી છે.

માટે હયણને નિરંકુશ વધવા ન દેવો, કલ્પનાઓના શેખચલ્લી ન બનવું,  
હયણને આખીન ન બનવું, ધારેલું કોઈ પણ ભોગે કરવાનો કદાગ્રહ ન રાખવો,  
પરંતુ હયણને રોકવી, યોગ્ય વળાંક આપવો અને યોગ્ય કાળે યોગ્ય રીતે યોગ્ય  
કાર્ય કરવું, બાકી શક્તિ-સંયોગ અને સામગ્રીના અભાવમાં સારા કાર્યની પણ  
ઉતાવળને આર્તધ્યાન કર્યું છે.

એથી સંસારના માન, ખાનપાન, કુટુંબ વ્યવહાર વગેરેમાં મનને સ્વસ્થ, શાંત  
અને સંતોષી બનાવવું એ જ આત્મસંયમ અને મોક્ષપ્રાપ્તિનો સાચો માર્ગ છે.



## સંતોષ: પરમં સૌખ્યમ्, આકાંક્ષા દુઃખમુત્તમમ् ।

**જી**ગત છ દ્વયમય છે. તેમાં પાંચ દ્વયો અજીવ છે. જીવદ્વય ચેતન છે તેથી સુખ અને દુઃખ જીવને હોય છે. બાકીના ધર્માસ્તિકાયાદિ પાંચ દ્વયમાં તે નથી.

દુઃખ જેમ કોઈ પણ જીવને ગમતું નથી, તેમ દુઃખ કોઈ પણ જીવના મૂળભૂત સ્વભાવમાં નથી.

સુખ-દુઃખ જ્ઞાનથી લિપ્ત છે, પરંતુ જ્ઞાન તે બંનેની અભિવ્યક્તિ કરે છે. તેને પ્રગટ-વ્યક્તા-સ્પષ્ટ અનુભવ કરાવે છે. બીજાને પણ કાંઈક બોધ કરાવે છે જેમકે આ સુખી છે, આ દુઃખી છે, આ રિબાય છે, આ સમતાથી સહન કરે છે.

દુઃખ એ અશુભ કર્મના ઉદ્યનું કાર્ય છે, વ્યવહારમાં તે અશાંતા વેદનીયથી ઉત્પત્ત થાય છે, એમ કહેવાય છે. અપેક્ષાએ એ વાત સાચી છે, પરંતુ મોહનીયકર્મ, અજ્ઞાન, અને વિપરીત જ્ઞાન પણ જીવને માનસિક દુઃખ ઉત્પત્ત કરવામાં મુખ્ય કારણ છે. ક્ષારેક કાંઈક શારીરિક દુઃખમાં પણ કારણ બને છે. માનસિક દુઃખ જીવને ભ્રમથી, અસદ્દ વિકલ્પોથી, મોહથી અને અપેક્ષાથી ઉત્પત્ત થાય છે.

જેમ ચાંદી અને છીપ સમાન વર્ણવાળા હોવાથી જીવને ભ્રમ થાય છે તેથી છીપમાં ચાંદી સમજ લે તો તેનાથી ધન મળતું નથી, તેમ સાંસારિક અનુકૂળતાઓ છીપ જેવી છે. તે સુખના કારણનો દેખાવ કરે છે, પણ તેમાં સુખ નથી. સંસારી જીવો છીપને ચાંદી સમજ લે છે અને પરિણામે દુઃખી થાય છે. અપેક્ષાએ ધર્મ એ ચાંદી જીવો કહેવાય. તે ગ્રહણ કરનાર જીવ ધર્મ અને પુણ્યની ઉત્તરોત્તર વૃદ્ધિ દારા આંતરિક અને બાહ્ય બને રીતે સુખી થાય છે. પરંતુ ભ્રમજ્ઞાથી જીવ નકામું સમજ અને લેતો નથી અને લાભથી ઠગાય છે.

સંસારી જીવોને દેહ-પન-પરિવારમાં સુખની ભ્રમજ્ઞા છે, તેના કારણો એ એને સંભાળવામાં-રક્ષણ કરવામાં રચ્યો પચ્યો રહી કાપમ દુઃખી થાય છે.

ધર્મ જીવો આત્મિક સુખ અને એના કારણરૂપે તપ-ત્યાગ-શીલ-દાન-અનિત્યાદિ ભાવનાઓ અને એના સંસકારથી ભાવિત મનને જાળતા હોવાથી તથા દુઃખના કારણોમાંથી સુખની ભ્રમજ્ઞારહિત હોવાથી અને સુખના કારણોમાં દુઃખની ભ્રમજ્ઞારહિત હોવાથી સંસારમાં આંપળા પણ બનતા નથી અને સાવધાન-

જાગ્રત હોવાથી વિશેષ દુઃખી પણ બનતા નથી અને ધર્મમાં દેખીતું અલ્ય દુઃખ કોઈને જણાતું હોવા છતાં આંતરિક સુખના અને પરમ સુખના કારણનું પર્મને વિવેક અને જ્ઞાનથી જાણવાથી એમાં જીવ ઉલ્લાસપૂર્વક સર્વસર્વા બનીને પ્રવર્તે છે. માટે વિવેક અને જ્ઞાન એ મોહ, અજ્ઞાન, અમ અને અવિવેકના નાશક હોવાથી સર્વત્ર પરમ સુખનું કારણ છે.

એવી જ રીતે અસદ્વ વિકલ્પો પણ જીવના રાગાદિ અને ભય વગેરેના પરિણામથી ઉત્પન્ન થાય છે. કોણિક છોડવવા આવ્યો ત્યારે શ્રેણિક અસદ્વ વિકલ્પથી હીરો ચુસીને મરી ગયા. સંસારી જીવો ડગલે પગલે આવા અસદ્વ વિકલ્પોથી આવેશથી અસત્ત પ્રવૃત્તિ કરી દુઃખી થાય છે. ધર્મ જીવો ભવિતવ્યતા-પ્રીત્ય અને કર્મને લક્ષમાં રાખી ધર્મના શરદો જાય છે. તેથી ચિન્તવિલ્ગનતા નાશ પામે છે. તેથી માનસિક દુઃખ લગતભગ નાશ થાય છે અને કાયિક દુઃખ પણ અલ્ય થાય છે.

કુટુંબ-માન-ધન-શક્તિ-બુદ્ધિ વગેરે જીવનવ્યવહારના સાધન છે, અને ધર્મ આરાધનાના સાધન પણ બની શકે છે, પરંતુ જીવ તેના ઉપર મોહિત બને, મળે તો સંગ્રહ-રક્ષણ કરે, ન મળે તો દીન બને તો તે મોહ એ દુઃખનું કારણ બને છે. મેળવવા, સંભાળવા વગેરેની કાળજી રાખવી અને મળે ત્યારે પણ દુઃખ, ન મળે તો પણ દુઃખ.

જેના પર મોહ ન હોય તે વસ્તુ મળે તો ઉપયોગ કરી લે, ન મળે તો નભાવી લે. અને વિશેષ આનંદ નથી અને દુઃખ પણ વિશેષ નથી. જેને જે વાતની અપેક્ષા હોય તે મળે ત્યારે આનંદ, સુખ અને ન મળે કે મળ્યા પછી નાશ પામે ત્યારે દુઃખ. અપેક્ષાવાળા જીવો વસ્તુને ભાવથી વળગેલા છે, એટલે વસ્તુ-સંયોગથી પકડાપેલાને જે રીતે જ્યારે હેરાન કરવા હોય તે રીતે કરી શકાય, એમ અપેક્ષાવાળા કલ્યનાથી અને સંયોગથી કાયમ હેરાન થતા રહે છે. જે વસ્તુ-સંયોગની અપેક્ષાને પકડાપેલા નથી, તે વસ્તુનો ઉપયોગ કરી શકે છે, અને તણાખલાની જેમ છોડી પણ શકે છે તેને કોઈ દુઃખી કરી શકતું નથી. માટે અમ, અસદ્વ વિકલ્પો, મોહ અને અપેક્ષા એ જગતમાં સર્વાકૃષ્ટ દુઃખનું કારણ છે. અનાથી ચઢીયાતું કોઈ દુઃખ નથી.

બાબ્દ દુઃખ દવાથી, ખોરાકથી, હવાફેરથી, વ્યાપામથી, આસનોથી, શરીર છુટવાથી કે પુષ્પોદયથી સ્વયં નાશ પામે છે તેવી રીતે માનસ દુઃખ નાશ કરવા

ભાવના અને વૈરાગ્ય, શાળ અભ્યાસ, સ્વાધ્યાય અને પરાવર્તન, પાપ નિવૃત્તિ અને ધર્મ પ્રવૃત્તિ, ગીતાર્થ અને આચાર સંપત્તિ સહચારિતા (આચારસંપત્તિ સાથે રહેવું તે) જોઈએ. આ બધા ધર્મો પંસુ આકાંક્ષાદિને, તેના સંસ્કારને ઘટાડી માનસ દુઃખનો નાશ કરે છે, તેમ વૈરાગ્ય, સ્વાધ્યાય, આચાર અને સાધ્યમિક સહચાસ એ માનસ સુખને ઉત્પત્ત કરે છે.

સુખ બે પ્રકારે છે (૧) આત્મિક અને (૨) વ્યવહારિક. એમાં આત્મિક સુખ વેદનીયકર્મના કષયથી મળતું અવ્યાભાષૃતપ છે, અને તેમાં પણ મુખ્ય ભાગ ભજવનાર સાથી કારણ જ્ઞાનાવરકા અને મોહનીયનો નાશ છે. માટે આત્મ-સ્વરૂપના, સિદ્ધ સ્વરૂપના જ્ઞાનથી અને વીતરાગતાર્થી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે.

“જં ચ કામ સુહં લોએ જં ચ દિવ્ય મહાસુહં।

વિયરાયસુહસ્સ ય અણંતભાગંપિ નગઘઙ ॥”

જેમ અહીં વીતરાગ સુખનો અનંતમો ભાગ પણ પ્રાપ્ત નથી થતો તેમ વૈરાગ્યના સુખનો પણ અનંતમો ભાગ નથી આવતો, માટે વૈરાગ્યનું સુખ એ પરમસુખ છે. લોભના નિગ્રહથી સંતોષ થાય છે. એ ઉપલબ્ધાઙ્કાથી બધા મોહનીયના ભેદના નિગ્રહરૂપ લેવાનું છે.

સુખ એ તોષ=આનંદરૂપ છે, દુઃખ એ અતોપરૂપ છે. તોષ બે પ્રકારે :-  
(૧) આરોપિત અને (૨) વાસ્તવિક. જે તોષ પૌદ્રજલિક છે, જે તોષ કાલ્પનિક છે, જે તોષની પાછળ અતોષ અને દુઃખ પરંપરા છે, જે નાશવંત છે, તે ઔદ્યિક ભાવરૂપ તોષ કહેવાય. એ પરાધીન અને નાશવંત હોવાથી વસ્તુ સ્વરૂપે તોષના અમમાત્ર છે. જ્યારે વૈરાગ્યથી, જગત્સ્વરૂપના ચિંતનથી, ભાવનાઓથી-આત્મસ્વરૂપની વારંવાર વિચારણાથી અને એના કારણભૂત ત્યાગ, તપ, શીલ, દાન, ગુર્વાશાપાલન, સ્વાધ્યાય, સાધુસેવા વગેરેથી ધર્મ આરાધનામાં કહેવાતા કાઢ હોવા છતાં તેમાં ધર્મત્માને પરમ સંતોષ, આનંદ, ઉલ્લાસ હોય છે, માટે મોહનીયનો કષયોપશમ અને ભાવથી ક્ષમાદિ ગુણયુક્ત જે દશવિધ્યતિધર્મ એ મુખ્ય સંતોષ છે. ગૌણ રીતે દેશવિરણિ, અવિરણિ, માર્ગાનુસારી, અપુનર્બધક વગેરે જે વિષયવિરાગ અને કષાયત્યાગ ધરાવે છે, અને તે મેળવવાના ઉપાયોમાં આનંદ પામે તેને પરમ સુખ મળે છે. તેઓ કાયમ સ્વસ્થ છે, આનંદિત છે અને જ્યાં સુધી વૈરાગી છે, સંતોષી છે ત્યાં સુધી તેમના માટે દુર્ગતિના દરવાજા બંધ રહે

છે, અશાતા નહિવતું બંધાય, શાતા વિશેષ બંધાય. કાયોપશમિક ધર્મ સાનુભેદ બને અને વધતો વધતો મોકે પદ્દોચાડે છે. દેવલોકમાં શાતાવેદનીયજ્ઞન્ય સુખની સાથે સંતોષ ઉપર ઉપરના દેવલોકમાં હોય છે. પરંતુ ભવ પૂરો થતા તે સુખ-સંતોષ નાશ પામે છે. વળી ત્યાં પણ અસંતોષવાળા, ઈર્પા, દેખ વગેરે યુક્ત કોઈક હોય છે, તે દુઃખી થાય છે. સામાન્ય સંતોષવાળા દુનિયામાં જથે સુખી દેખાય છે, પરંતુ તે સુખ પણ નાશવંત છે. જ્યારે કાયોપશમજ્ઞન્ય, વૈરાયજ્ઞન્ય સંતોષવાળા ધર્મી હોય છે, અને ઉત્તરોત્તર વૈરાય વધારવાના કારણોમાં પ્રવર્તતા હોય છે, તેમની તમજાવાળા હોય છે તેથી તે પરમ સુખી હોય છે.

એક ઉપવાસ કર્યા બાદ પારણું કરવાની વિચારણા કરનાર કરતા બીજો દિવસે બીજો ઉપવાસ કરવાની વિચારણામાં રમનાર વિશેષ આનંદિત દેખાય છે.

નિયમો લીધા હોય અને તે પૂર્વી થવા આવે ત્યારે નિયમોને આગળ વધારનાર, નિયમો પૂર્ણ કરીને છુટા થનાર કરતા વધારે સુખી, આનંદિત, આંતરિક આનંદવાળા હોય છે. આને પરમ સુખ કહેવાય, માટે ધર્મ ઈચ્છનારે વૈરાય-ભાવરૂપ સંતોષમાં સતત પ્રથત કરવો.



## ન મોહોદ્રિત્કતાભાવે સ્વાગ્રહો જાયતે કચિત् ।

**મો**હની તીવ્રતા વગર ક્યાંય પણ જીવને પોતાનો આગ્રહ થતો નથી. આ વાત-અંમ સૂચવે છે કે દુનિયા કાર્યકરણભાવ ઉપર ચાલે છે આપણા આગ્રહથી ક્યાંય કશું બનતું નથી.

દૂધપાક કઢી ન બને, કઢી દૂધપાક ન બને; રોટલો મહેસુર ન બને, મહેસુર રોટલો ન બને. માટે જીવને મોહ, અજ્ઞાન, કાયાયનો આવેશ ન હોય તો કર્તવ્ય-અકર્તવ્ય, ઉચિત-અનુચિત, શક્ય-અશક્યનો વિચાર કરી શકે. આવેશ હોય તો એ વિચારને અવકાશ જ નથી રહેતો.

પુગલિકના પહેલા, બીજા અને ત્રીજા આરાના અંત સિવાયના કાળમાં પુગલિયાને સાખુપણું મળે ? જો સુખી માણસ, ઉપાધિ વગરના માણસ ધર્મ કરી શકતા હોય તો પુગલિકો સુખી છે, ઉપાધિ વગરના છે છતાં કરી શકતા નથી માટે સુખી અને ઉપાધિમુક્ત વ્યક્તિ જ ધર્મ કરી શકે, આવો આગ્રહ કરનાર કલ્યાનાની દુનિયામાં જ રાચે છે.

સુખના કારણભૂત ક્ષેત્ર અને કાળના પ્રભાવના કારણે સર્વવિરતિની ત્યાં અયોગ્યતા છે. મહાવિદેહમાંથી જંચાચારણ મુનિ આવીને પણ સર્વવિરતિ ન આપી શકે.

એ રીતે છઢા આરામાં-અતિ દુઃખમાં પણ ધર્મ ન થાય.

ઉગ્ર સંયમ-તપવાળા સ્વચ્છંદ જ્ઞાનવાળાને પણ ધર્મ નથી, કેમકે જ્ઞાનીને પરતંત્રને જ ધર્મ હોય. માટે પરમાત્મા કે લભ્યધારીઓ પણ અભિવને, દુર્ભિવને, કાળ પરિપાક ન થયો હોય તેને ધર્મ આપી શકતા નથી.

ચોથા આરામાં પણ ભગવાન કે બીજા મહાપુરૂષો આગ્રહથી કશું કરાવતા નથી.

આગ્રહ અનેક રીતનો હોય. શક્ય-અશક્ય, સાધ્ય-અસાધ્ય, ઉચિત-અનુચિત.

નિશ્ચય નયના હિસાબે કોઈ પણ આગ્રહ એ મોહનો ઉદ્ય છે.

જે ઈચ્છામાં-આગ્રહમાં મોહનો ઉદ્ય ભળવા છતાં કષ્યોપશમ, વિવેક પ્રધાન રહે, ભળેલા રહે તો તેને વ્યવહાર નય મોહનો ઉદ્ય માનવા છતાં મોહનો ઉદ્ય નથી માનતો. તેવી ઈચ્છા કે આગ્રહ કર્તવ્ય બને છે માટે મોક્ષના યોગાંગ

તર બતાવ્યાં છે, તેમાં ધર્મ દઢતા “આપતિસુ હદ્ધમ્મયા” બતાવી છે. આ પણ જાત માટે એક આગ્રહરૂપ છે, છતાં ઉપાદેય છે અને પ્રશસ્ત ઈચ્છારૂપ મોહનીયના કથોપશમ મિશ્રિત ઉદ્યરૂપ છે.

જેમાં અજ્ઞાન, અવિવેક, અપ્રશસ્ત ભાવની તીવ્રતા બળે અને જે નિયાળા કરાય, દઢ નિર્ણય કરાય અને સ્વાગ્રહ કહેવાય. ગુણ આગ્રહ, આચાર આગ્રહ, ધર્મ આગ્રહ આ બધા આગ્રહમાં જ્યારે કથોપશમ અને વિવેક પ્રધાન બને છે ત્યારે તે ગુણ-આચારાગ્રહ છે; જ્યારે મોહ, માન્યતા, સ્વપ્ન, સ્વરૂપ્ય વગેરે પ્રધાન થાય ત્યારે સ્વાગ્રહ કહેવાય. આ સ્વ આગ્રહ મોહનીયના વિશેષ ઉદ્યની તીવ્રતા વિના નથી થતો.

જેવી રીતે મરિયિએ કામ ચલાઉ ગરમીનો ઉપચાર ન કરતા નવો વેશ કલ્યો, તે સ્વ આગ્રહ કહેવાય. જ્યારે જીવ પોતાની બુદ્ધિ-આગ્રહવશ કાયમી છુટછાટ કે નવા ચીલા પાડે, નવા માર્ગ કાઢે, ફાંટા પાડે તે સ્વાગ્રહ કહેવાય. જેમ જમાલી, ચૈત્યવાસી કે એવા બીજા કોઈ પણ મોહની તીવ્રતા વગર ઉત્પત્ત નથી થતા. એટલે આ દર્શન મોહનીયના ઉદ્યનો ઉદ્રેક કહેવાય.

જેનામાં પ્રજ્ઞાપનીયતા (બીજાની સાચી વાત સ્વીકારવાની-સમજવાની તૈયારી) છે, જેનામાં સ્વાગ્રહ નથી, તેનામાં સમ્યકૃત્વની યોગ્યતા હોય. જેનામાં સ્વાગ્રહ છે તેનામાં પ્રજ્ઞાપનીયતા નથી તેથી સમ્યકૃત્વ કે સમ્યકૃત્વની યોગ્યતા નથી.

જીવ પોતાની ભૂલને ગુણ માની બેસે ત્યારે આ સ્થિતિ આવે. જ્યાં બીજાના ગુણને દોષ માની બેસે ત્યારે પણ આ અવસ્થા આવે.

કુરગુના પાત્રમાં થુંકનાર કે કુરગડુ ઉપર અરૂપ્ય કરનાર તપસ્વીને આવા મોહ ઉદ્રેકના દાખાંતરૂપ જણાવી શકાય. અનુચિત અર્થ, વાક્ય કે કાર્ય વિપે આગ્રહને સ્વાગ્રહ તરીકે સમજવો. તેના અનેક બાધ્ય કારણો છે.

- (૧) અભિમાનનથી, “મારી ભૂલ કેમ કાઢે ?” માટે મારે ભૂલ ન સ્વીકારવી.
- (૨) અનુચિત અર્થનો - વાતનો - વ્યવહારનો પક્ષપાત થાય, તેથી સાચી વાત, સાચો અર્થ, સાચો વ્યવહાર ન સ્વીકારે.
- (૩) અનુચિત વાત કરનાર પક્ષનો રાગ થાય તો પણ સાચી વાત ન વિચારી શકે, ન સમજી શકે, ન સ્વીકારી શકે.
- (૪) અનુચિત હોવા છતાં અનુચિત તરીકે બતાવનાર વ્યક્તિ પર દેષ હોય.

- (૪) વિચારશૂન્યપણે “પકડ્યું ન છોડવું” આવો કદાગ્રહ.
- (૫) અનુચિત રીતે વાત કહેવાઈ હોવાથી દ્રેષ્ટ અને અનુચિતની પકડ થાય.
- (૬) અનુચિતમાં અપાય ન દેખાવાથી અનુચિતની પકડ થાય.
- (૭) સંયોગ, પરિસ્થિતિ, અવસ્થા કણ વગેરે કારણે ઉચિત પણ અનુચિત થાય, અનુચિત ઉચિત થાય, તેનું જીન ન હોય, તેથી પકડ થાય.

માટે સ્વાગ્રહ અને તેના કારણભૂત મોહની તીવ્રતાને ઘટાડવી-છોડવી, માર્ગ, જગત્, સ્વભાવ, શાસન મર્યાદાને વારંવાર વિચારી, તાત્ત્વિક દણી કેળવવી, વિવેક જગ્ગાવવો. તત્ત્વદણી અને વિવેક દ્વારા ગંભીર પ્રકૃતિવાળો બની જીવ સમતા અને સમાધિને પ્રાપ્ત કરી છેવટે સિદ્ધિગતિ સુધી પહોંચી જાય છે.



## ॥ મન એવ મનુષ્યાણાં કારણ વન્ધ્ય-મોક્ષયો: ॥

**આ**નંતરશાની તીર્થેકર પરમાત્માનું શાસન મનની આંટીઘૂંઠીઓ અને અવનવા ખેલો પર સુંદર પ્રકાશ પાડે છે. સદગતિનું અને દુર્ગતિનું કારણ મન જ છે, સંસાર કે મોક્ષ બનેનું કર્તા મન જ છે. સમાધિમય મન સદગતિ અને પરંપરાએ મોક્ષનું કારણ; અસમાધિમય મન તે જ દુર્ગતિ અને સંસાર પરિભ્રમણનું કારણ. મનને સમાધિમય કેવી રીતે બનાવી શકાય, અસમાધિમાંથી કેવી રીતે ઉગારી શકાય તેની કેટલીક ચાવીઓ શાખના પાનાઓમાં મળી આવે છે. તેનો વિચાર કરીએ.

(૧) જો મન સમાધિથી ઘડાએલું હોય તો અલ્પજ્ઞાનીને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે છે, અને મન સમાધિથી ભાવિત-વાસિત ન હોય તો ભાવ્ય રીતે ઘણું જ્ઞાન હોવા છતાં જીવ કર્મ બાંધે છે, અને દુર્ગતિમાં રખડે છે.

(૨) ઉપાધિ એટલે ભાવ્ય સાંયોગિક અનુકૂળતાઓ-પ્રતિકૂળતાઓ. તે સામાન્ય આત્માને અસમાધિ દ્વારા સંસારમાં ભટકાવે, દુર્ગતિમાં રખડાવે. પરંતુ સમાધિથી ભાવિત-વાસિત આત્માને ભટકાવી શકતી નથી. ભાવ્ય સાધન સામગ્રી હોય તે દુર્ગતિમાં જાય અને ભાવ્ય સાધન સામગ્રી ન હોય તે દુર્ગતિમાં ન જાય તેવું નથી. મન સાધન-સામગ્રીમાં કે તેની મમતામાં અટવાયું હોય તો જીવ સંસારમાં ભટકે અને મમતા મુક્ત બને તો આરિસાભુવનમાં પણ કેવળજ્ઞાન મળે. છતાં મનની મમતા તોડવા અને છોડવા માટે શક્ય અનુકૂળતાનો ત્યાગ, શક્ય પ્રતિકૂળતાને વેઠવાનું અને ભાવના દ્વારા જ્ઞાનયોગનો આશ્રય કરવો જરૂરી છે. એથી આત્માને સમાધિનું બળ મળે છે. અને બાકી રહેલ ઉપાધિઓ આત્માને જરૂરી શકતી નથી, અસમાધિનું કે ભવભ્રમણાનું, દુર્ધ્યાન કે દુર્ગતિનું કારણ બનતી નથી.

(૩) પ્રતિકૂળ અવસ્થામાં માનસિક વિચારણા કલેશવાળી થાય તો જીવને દુર્ગતિ મળે છે, પાપબંધ થાય છે. મનની આ કલેશવાળી એટલે કે રાગદ્રોષના આવેશવાળી વિચારણા તે અસમાધિ છે. કૃષ્ણ, શ્રેણિક વગેરે અનેક જીવો દુઃખમાં દુર્ધ્યાન કરતા દેખાય છે. યુગભાઇને પ્રતિકૂળ અવસ્થામાં મદનરેખાની પ્રેરણાથી મનની સ્વસ્થતા-સમાધિ-ક્ષમાપના મળી તો પાંચમાં દેવલોકે ગયા.

રાજગૃહીનો દ્રમક મનના કલેશો નરકે ગયો તેમ તંડુલીઓ મત્ત્ય પણ કલેશો સાતમી નરકે ગયો.

(૪) સુખની અસ્વસ્થામાં પણ જીવ રાગાંધી-કામાંધ થઈને દુર્ગતિના કર્મ બાંધે છે. આ રાગાંધતા કે કામાંધતા પણ અસમાધિ છે. સુખની અવસ્થામાં પણ મન તીવ્ર વૈરાગ્યમાં રહેવા પ્રયત્ન કરે તો બાર ટેવલોક સુધીનું આયુષ્ય ગૃહસ્થ અવસ્થામાં બાંધી શકે અને ભાવનામાં ચેતે તો પૃથ્વીચન્દ્ર-ગુણસાગરની જેમ કેવળજ્ઞાન પણ પામે છે. તેથી બાધ અનુકૂળતા હોવા છતાં મનની સમાધિ સદ્ગતિ, પુણ્ય અને ધર્મ આપે છે યાવત્તુ મોક્ષ પણ આપે છે, અને મનની અસમાધિ પાપ અને દુર્ગતિ આપે છે.

(૫) દુઃખમાં સુખની ઈચ્છા કે દુઃખની અકળામણ પણ અસમાધિ છે, તેવીજ રીતે સુખમાં આનંદ-સંતોષ એ પણ અસમાધિનું જ રૂપક છે.

(૬) વ્યાધિ એટલે શરીરના રોગો. તે સુધરે કે ન સુધરે, ઘટે કે વધે તે આપણા હાથમાં નથી. અનુકૂળ પ્રતિકૂળ સંયોગો સુધરે, ન સુધરે તે પણ આપણા હાથમાં નથી. આ વ્યાધિ કે ઉપાધિ સદ્ગતિ કે દુર્ગતિ પણ આપી શકતી નથી. આ વ્યાધિ કે ઉપાધિ વખતે જીવ જ્ઞાન શક્તિ-સમજજ્ઞા શક્તિ- સત્ત્વશક્તિ અને વિવેક દ્રષ્ટિને આધીન રહી સમાધિ કેળવે તેને સદ્ગતિ, પુણ્ય અને મોક્ષ મળે અને મન જેના હાથમાંથી છુટીને અસમાધિમાં પડે, અવિવેક-દુર્ધર્યાનમાં પડે તે દુર્ગતિમાં જાય, પુણ્યનો નાશ કરે, પાપ બાંધે અને મોક્ષ જવામાં વિક્ષેપ થાય. માટે જેના હાથમાં મન, તેને સમાધિ સુલભ. અને જેનું મન કર્મ-મોહ-અજ્ઞાન-અવિવેકના હાથમાં તે અસમાધિવાળો જાણવો.

(૭) આધિ એટલે મનની અસ્વસ્થતા, મનનું અસમતોલપણું. સમાધિવાળો સ્વસ્થ હોય તે બદલા વગર અને પૂર્વ અપકાર કરેલાને પણ સહાય કરવા તૈયાર થાય.

(૮) રાગ-દ્રેષ્ણની વૃત્તિમાંથી સ્વાર્થીપતા જન્મે છે જે અસમાધિરૂપ છે જ્યારે સમાધિ-સમતાની વૃત્તિમાંથી પરોપકાર, સહાયકતા જેવી તથા 'લેટ ગો' કરવાની વૃત્તિઓ જન્મે છે.

(૯) અનુકૂળતામાં ત્યાગવૃત્તિ-દાનવૃત્તિ-સંયમવૃત્તિ-ઉદાસીનવૃત્તિ સમાધિ કરાવે છે અને ભોગવૃત્તિ-સંગ્રહવૃત્તિ-અસંયમવૃત્તિ-રાગવૃત્તિ-પક્ષપાત-વૃત્તિ અસમાધિ કરાવે છે. તેથી ઉપરની વૃત્તિઓથી જીવની સમાધિ-અસમાધિ જાણી

શક્ય છે. ઉપરની સમાધિઓની વૃત્તિઓ કેળવવાથી અસમાધિ નાશ પામે છે અને સમાધિ આવે છે અને અસમાધિની વૃત્તિઓ કેળવવાથી સમાધિ નાશ પામે છે અને અસમાધિ જન્મે છે. એવી રીતે જીવની સહાયક વૃત્તિ સમાધિ સુચવે છે. સહાયની ઉપેક્ષા એ અસમાધિ સુચવે છે.

સહાયકવૃત્તિ તિર્યંગ પ્રત્યે હોય એને જીવદ્યા કહેવાય, દુઃખી માણસ પ્રત્યે હોય એને અનુકૂળ કહેવાય, પૂજ્ય પાત્રો પ્રત્યે હોય એને ભક્તિ કહેવાય. પૂજ્યો પ્રત્યે સહાય સિવાય પણ અર્પણ વૃત્તિ હોય એને પૂજા કહેવાય.

જેમ દ્રવ્યના અભાવે દુઃખીને દ્રવ્ય આપવું તે સહાયવૃત્તિ છે, તેમ સારા તત્ત્વબોધવાળાએ માર્ગના જ્ઞાન વગરના યોગ્ય જીવાને જ્ઞાન આપવું તે પણ સહાયવૃત્તિ છે.

આ સહાયવૃત્તિ અનુકૂળ વગેરેથી આવે છે. અને આ અનુકૂળ વગેરે જીવની તીવ્ર રાગદ્વેષની આધિની અસમાધિ દૂર થાય ત્યારે સમાધિ આવે તેમાંથી આવે છે. શરીરમાંથી સમાધિ આવે છે અથવા શમ એ સમાધિનું બીજું નામ છે. આવા સમાધિના અનેક જેદ પડે. પોતાની સારી પરિસ્થિતિમાં બીજાને થોડી સહાય કરે આ અલ્યસમાધિ કહેવાય, પોતાની સારી સ્થિતિમાં બીજાને પૂર્ણ સહાય કરે તે એથી ચીરીયાતી સમાધિ છે. તેમજ પોતાની દુઃખી સ્થિતિમાં પણ બીજાને અલ્ય મદદ કરે, આ પણ ગુણ છે. પોતાની નબળી સ્થિતિમાં બીજાને પૂર્ણ મદદ કરે તે વિશિષ્ટ સમાધિ છે.

કોઈ વ્યક્તિ યોગ્ય વ્યક્તિને સહાયક ન થાય તો તેનામાં અનુકૂળ નથી. તે ભૌતિક-આધ્યાત્મિક ગુણોને યોગ્ય નથી.

જે વ્યક્તિ ધર્મનિ, સાધુ-શ્રાવકને સહાયક નં થાય તેનું સમ્યગ્દર્શન નાશ પામે, મલિન થાય.

પોતાની સમાધિ બીજાની બાબુ સમાધિ ઉત્પત્ત કરે છે અને પછી આંતરિક સમાધિ પણ ઉત્પત્ત કરે છે. પોતાની અસમાધિ બીજાની પણ સમાધિનો નાશ કરે છે અને અસમાધિ ઉત્પત્ત કરે છે.

આધિ એટલે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોમાં, રોગમાં કે આરોગ્યમાં, મનની દીનતા કે અભિમાનતા, રાગદ્વેષજન્ય વ્યાકુલતા. એ વાદુતારહિતપણું, સમતોલ-પણું, સ્વસ્થપણું તે સમાધિ.

વ्याधि અને પ્રતિપક્ષથી આરોગ્ય લેવું. વ્યાવહારિક રીતે પ્રતિકૂળ સંયોગોને ઉપાધિ કહેવાય, પણ ઉપલક્ષણથી અનુકૂળ સંયોગો પણ ઉપાધિ સમજવા.

વ્યાધિ-ઉપાધિ, આરોગ્ય અને અનુકૂળતા વખતે આવિ ટથે અને સમાધિ આવે તો જ મોક્ષ મળે. રોગ કે આરોગ્ય જીવને મોક્ષમાં લઈ જતા નથી. પુત્ર કે અનુકૂળ પરિવારમાં અટવાયેલા પ્રમાદ-મોહને આધીન ધ્યેલા જીવો મોક્ષમાં જઈ શકતા નથી. પુત્રો કે પરિવાર અનુકૂળ હોવા છતાં જગૃત આત્મા આરાધનામાં આગળ વધે છે, અને મન પુત્ર-પરિવાર સાધન છે. સત્ત્વ આરાધના અને સમાધિ એ પ્રાથમિક સાધ્ય છે.

મનને સમાધિમય બનાવનાર સિદ્ધસ્વરૂપનું આત્મજ્ઞાન છે,

મનને સમાધિમય બનાવનાર દ્વય-ભાવ આશ્રવ અને સંવરનું જ્ઞાન છે.

મનને સમાધિમય બનાવનાર સંવેદનરૂપ અનુભવજ્ઞાન છે.

રાજમાર્ગ-ઉત્સર્ગ માર્ગની નીતિ એ સામાન્યથી સમાધિકારક છે, સમાધિ સુચક છે, પરંતુ તેવા સાવના અભાવમાં સમાધિ સાચવવા માટે બજીતિગત નીતિરીતિમાં ફેરફાર થાય, જેને અપવાદ માર્ગ કહેવાય, જેમકે પૂજા મધ્યાંકે કરવાની હોવા છતાં વેપાર વગેરેની પરવશતાના કારણે આદર-બજીતિ-સ્વસ્થતાથી કરવા માટે સવારના કરાય છે. પ્રભુભજી અને સ્વસમાધિ સાચવવા કાળ વગેરેમાં ફેરફાર કરવો પડ્યો.

વ્યાધિમાં સમાધિની પદ્ધતિ જુદી, આરોગ્યમાં સમાધિ પદ્ધતિ જુદી, પ્રતિકૂળ સંયોગોમાં સમાધિની પદ્ધતિ જુદી, અનુકૂળ સંયોગોમાં સમાધિની પદ્ધતિ જુદી. વ્યાધિમાં સમાધિ રાખવા માટે પૌડામાં દીન ન બને, દ્વાની કાળજી રાખે પણ મોડું-વહેલું, આધુ-પાછુ થાય તો અકળાય નહિ. અભક્ષ્ય ભોજન, રાત્રિ ભોજન કે પ્રતિજ્ઞાભંગ ન કરે, ગુસ્સો ન કરે, શાન્તિ-સ્વસ્થતાથી પડ્યો રહે, શક્યતા મુજબ જીપ-વાંચન વગેરે કરે, વૃત્તિ કંઈક સહનશીલ, ક્ષમાશીલ, પ્રસન બનાવે, કર્મ વિપાક વિચારે. સહનશીલતા ન કેળવે, ગુસ્સો કરે, અપ્રસન રહે તો અસમાધિ થાય.

આરોગ્યમાં કામકાજની પમાચકડી ન હોય, દોડધામ ન હોય, શાન્ત હોય, બીજાને તુચ્છ ન સમજે તે સમાધિનું ચિક્ક સમજવું. બીજાને તુચ્છ સમજે, ખૂબ મેળવવાનું ને ખૂબ બોગવવાનું મન થાય, જટાટ, ઉતાવળથી કામ કરે, કેઢી ચીજના પાવરની જેમ પાવર રાખે જેને દર્દ કહેવાય છે તે સુખની અસમાધિનું ચિક્ક છે.

આમ સમાધિ-અસમાધિની ચાવીનો જીણી જીવનમાં સતત સમાધિમય રહેવા પ્રયત્ન કરવો, મન તો અવળચેંકુ છે. ક્યારેક પ્રતિકૂળતામાં સમાધિ હોય અને અનુકૂળતામાં અસમાધિ, અનુકૂળતામાં સમાધિ, પ્રતિકૂળતામાં અસમાધિ, ક્યારેક નિમિત્ત વગર જ સમાધિ-અસમાધિ... શાલના પાને પાને કંડરિક, મંગુ આચાર્ય, પ્રસભચેંડ રાજ્યિ આઠિના દગ્લાબંધ દ્રષ્ટાંતો આપણાને આ જ વાત જણાવે છે ને... માટે સતત અભ્યાસ દ્વારા મનને સ્થિર અને સમાધિમય બનાવવા પ્રયત્ન કરવો, જેથી સિદ્ધિગતિ નિકટ આવે.



\* \* \* \* \*

**દમ શમ સમત્તમિત્તિ સંવેઅ વિવેઅ તિવ્યોનિવ્યોઆ ।**

**એ પગૂઢ અપ્પાવવોહવીઅસ્સ અંકુરા ॥**

\* \* \* \* \*

**‘આ’**તાના જ્ઞાન વગર જીવ આધ્યાત્મિક માર્ગ અને ઉત્ત્રતિ શી રીતે  
પામે?’ એ જેમ પ્રશ્ન છે તેમ શુદ્ધાત્માનું જ્ઞાન સોગનથી કે વર્ણનથી મળતું નથી  
તો શેનાથી મળે એ પણ પ્રશ્ન છે. સૂર્યોદય -અરુણોદયથી માંડીને બધી અવસ્થાઓ  
જેમ અનુભવગમ્ય છે તેમ આત્મજ્ઞાન પણ અનુભવ ગમ્ય છે.

એ અનુભવને લાવવાના ઉપાયો જે છે તે જ અનુભવ આવ્યા પછીના ગુણો  
પણ એ છે, અર્થાત્ ગુણોના ઉપાયોમાં પ્રવૃત્તિ અને દોષના કારણોનું રોકાણ તે  
આત્મબોધના કારણો-ઉપાયો છે અને તેનાથી જે ગુણો આત્મામાં આવે અને દોષો  
આત્મામાંથી જાય, ઘટે તે જ આત્મજ્ઞાન આત્મ-અનુભવરૂપી બીજના અંકુરા છે.

આ ગુણનો વિકાસ તે આત્મ-અનુભવનો વિકાસ છે. આ ગુણોના વિકાસથી  
બીજા ગુણાંતરો પ્રગટે-વિકસે. તે ગુણાનુભવ અને ગુણાલભિ બંને વધતા વધતા  
ગુણ પરાકાણાએ પહોંચે અને સર્વગુણમયતા-વ્યાપિતા થાય તે આત્માની શુદ્ધ  
અને સિદ્ધ અવસ્થા છે.

જેમ જેમ ગુણ (મોટા થાય) પ્રામ થાય, મજબૂત થાય, ગુણાંતરના ઉત્પાદક  
થાય તેમ આત્માના કર્મ-મોહ, અજ્ઞાન અને સંસારજન્ય દોષો ઘટતા જાય, નિર્બળ  
થાય, નાશ પામે અને અંતે આત્મા દોષ રહિત થાય છે. માટે દોષોના નાશના  
ઉપાયોમાં પ્રવર્તનું અને ગુણોની સિદ્ધિના ઉપાયોમાં પ્રવર્તનું તે આત્મજ્ઞાન-આત્મ  
અનુભવ અને એની પરાકાણારૂપ સિદ્ધ અવસ્થાને પામવાનો બ્યવહારનયનો રસ્તો  
છે, પ્રથમ પગથીયું છે.

આનાથી જે દમ વગેરે ગુણો આત્મામાં ઉત્પત્ત થાય તેનો અનુભવ તે  
આત્મજ્ઞાન-અનુભવનું નિશ્ચયનયનું પ્રથમ પગથિયું છે.

માટે દોષ અને દોષનો માર્ગ એ સંસાર છે. ગુણ અને ગુણના ઉપાય તે  
મોક્ષમાર્ગ છે, અને સર્વગુણોની પરાકાણા તે મોક્ષ છે. મોક્ષમાર્ગ અને મોક્ષ  
બંને આત્મ અનુભવરૂપ છે.

ગુજરો યદ્વારા અનંતા છે, છતાં ૫-૭ અતે બતાવ્યા છે. જે જીવન ઉપરોગી અને મુજબવૃત્તિએ મોક્ષમાર્ગ સાધક છે અને અનાથી વિપરિત દોપો મોક્ષમાર્ગ બાધક છે.

(૧) દમ=ઇન્દ્રિયદમન, મનનું પણ ઇન્દ્રિયના વિષયોમાંથી પાછા કરવું. સંસારનું મૂળ કાયાય છે કે વિષયો? એવો પ્રશ્ન થાય તો તેના જવાબમાં જલ્દાવવાનું, વિષયોના કારણો જ કાયાયો ઉત્તેજિત થાય છે, ટકે છે, વધે છે. વિષયો ઇન્દ્રિયો દ્વારા પોખાય છે, વધે છે. ઇન્દ્રિયોનું પ્રવર્તન મન દ્વારા અને આત્માના અશુભ સંસ્કાર દ્વારા થાય છે.

મૂળમાં આત્માના અશુભ સંસ્કાર નાખું કરવાના છે. તે સંસ્કારો પ્રધાનતથા મનથી પ્રવર્તે છે તેથી મનને અંકુશમાં રાખવાનું છે. આ અશુભ સંસ્કારોથી મન પ્રેરણાને અટકાવવી તે મનનું દમન છે. મનની આ પ્રેરણા અટકાવવા ભારભાવના, મૈત્રી આદિ ઝ ભાવના વગેરે અને આચારજ્ઞાન વિચારણા, અપાય વિચારણા, વિપાક વિચારણા વગેરેથી મન વારંવાર અને સતત ભાવિત બનાવવું. આ રીતે મનમાં વિષયોની રૂચિ કે દેખ ઊભો ન થાય અને થાય તો પણ મન છોડી દે. મન ઉપર આત્માનો અંકુશ રહે તો મનનું દમન છે. આ દમન ત્યાં સુધી કરવાનું હોય છે કે જ્યાં સુધી ભાવના દ્વારા શુભ સંસ્કારોથી કાયોપશમની પ્રબળતાથી મન સ્વયં શબ્દાદિ વિષયો પ્રત્યે રૂચિ-અરૂચિ રહિત બને.

આ ભાવના અને મનના દમન અંકુશને વેગ આપે છે ઇન્દ્રિયનું દમન, વિષયોની શક્ય નિવૃત્તિ, અશક્યમાં જાગૃતિ, પરિમિતતા વગેરે. અર્થાત્ જે વ્યક્તિ અનુકૂળ પાંચ ઇન્દ્રિયના વિષયો ન મળ્યા હોય ત્યારે જંખે છે, જેને મળ્યા તે તે ને સારા સમજે છે, ગમે છે, પોતાને મળેથી આનંદ થાય છે, જોવા ગમે છે, અનુભવવા ગમે છે, રાખવા ગમે છે, ઇન્દ્રિયોને તેમાં પ્રવર્તાવે છે. ભૂતકાળના વિષયભોગીની અનુમોદના થાય છે, તેને સુખી લાગે છે. આ બધી વિચારધારા એ મનનું અને ઇન્દ્રિયોનું પરવશપણું છે એથી વિપરીત મનની અવસ્થા અને ઇન્દ્રિયોનું રોકાણ, વિષયોનો ત્યાગ, અપરંસા, મનથી સારામાં અપાયનું ચિંતન, વિષયોની દુર્ગતિ દાયકતા વગેરે વિચારણા એ મન અને ઇન્દ્રિયોનું દમન છે. આ દમન એ આત્મજ્ઞાન અનુભવનું બીજ છે, અંકુર છે.

(૨) શમ :- વિષયો આત્મઅનુભવમાં બાધક છે, એનો ત્યાગ અને ઇન્દ્રિયદમન તે આત્મ અનુભવરૂપ છે અને વિશેષ આત્મ અનુભવમાં સહાયક

હે તેમ કખાયો અને ઉપલક્ષશોચી નોક્કખાયો આત્મશાંતિમાં રોષક, નાશક છે. તેની સામે કખાયોનો જ્ય, નોક્કખાયનો જ્ય તે આત્મગુણ, આત્મશાંતિ, આત્મ-અનુભવરૂપ છે.

આંશિક આત્મઅનુભવ વગરના જ્ઞવો બૌતિક આશંસા વગર ઈન્ડ્રિયદમન, મનદમન કે કખાય જ્ય કરી શકતા નથી. માટે કખાય જ્ય એ કર્તવ્ય છે.

શમનો એક અર્થ કોધનો જ્ય=ક્ષમા થાય છે તેમ બીજો અર્થ શાંતપણું, આકૃળતારહિતપણું. ચારે કખાય અને નવ નોક્કખાયથી જ્ઞવ અશાંત-આકુલ હોય છે, સુખી નહિ દુઃખી હોય છે તેથી કખાય નોક્કખાયના ઉદ્દ્યથી-રોકાણથી-નિગ્રહથી જ્ઞવ શાંત બને છે. આવું શાંતપણું આત્મ અનુભવનું સ્વરૂપ છે. કોષ-માન-માયા-લોલ વગેરે અનેક બાધનિમિતોમાં જ્ઞવ જટ લેવાય નહિ, ખળખળે નહિ, ફસાય નહિ, સ્વસ્થ રહે એ આત્મસત્ત્વ આત્મઅનુભવનો પ્રકાર છે.

(3) સમ્યકૃત્વ : સમ્યકૃત્વના બે પ્રકાર છે.

1. વ્યવહાર સમ્યકૃત્વ :- જે વીતરાગ સર્વજ દેવ, નિર્ભય ગુરુ અને શ્રી સર્વજ પરમાત્માએ પ્રરૂપેલો દાનાદિ ધર્મ માને, જ્યે તેને વ્યવહાર સમ્યકૃત્વ હોય.

2. ભાવસમ્યકૃત્વ :- આશ્રવને આત્મ સ્વરૂપના રોષક-નાશક જ્ઞાણો અને એનાથી ગભરાય, છોડે, કે અરુચિવાળો થાય અને સંવરતત્ત્વને સહાયક સમજ આચરે, ગમે. આ આશ્રવ-સંવર ભાવ અને આંતરિક એમ બે બેદ પડે છે. આંતરિક આશ્રવ-સંવર જે ઓળખે તે ભાવ સમકિતી હોય. ભાવ આશ્રવ-સંવર બહુધા તે ઓળખે, ક્યારેક ગુરુગમ ન હોય તો કોઈક ન ઓળખે તેમ પણ બને.

આંતરિક આશ્રવ-સંવરને ઓળખવાની શક્તિ અને ઓળખાણ આ આત્મ અનુભવમાં રહેલી છે. એ અનુભવશક્તિ જેટલી વિકસિત થાય તેટલા આશ્રવ સંવર સૂક્ષ્મ સૂક્ષ્મતયા ઓળખાય.

સમ્યકૃત્વના ભાવ આચારોથી દેવભક્તિ-ગુરુભક્તિ-ધર્મઆચાર પાલન, દેવસ્વરૂપજ્ઞાન-ગુરુસ્વરૂપજ્ઞાન-આચારજ્ઞાન હેઠોપાદેય જ્ઞાન આ બધાથી આચાર, આદર, ભાવ, ભક્તિ વગેરેથી કર્મધ્રાસ-પુન્યપ્રાપ્તિ-સામગ્રી-પ્રાપ્તિ થાય છે અને ભાવ જગાડનાર-કર્મનાશ કરનાર એવા સંયોગ અને આત્મવીર્ય ઉલ્લસિત થાય છે અને ભાવ સમ્યકૃત્વ આવે છે.

સર્વત્ર દ્રવ્યપાપ આચાર ભાવપાપને જન્માવે છે. દ્રવ્ય શુભ આચાર શુભભાવ જન્માવે છે. દ્રવ્ય સમ્યકૃત્વના આચારો ભાવ સમ્યકૃત્વ જન્માવે છે.

દ્રવ્ય સંયમના આચાર ભાવ સંયમ જન્માવે છે. માટે ભાવ સમ્બંધિત એ આત્માનુભવનું સ્વરૂપ છે. જેમ જેમ સ્વરૂપ સિદ્ધ અવસ્થાની સ્મૃતિ અને તેને અનુકૂળ આંતરિક સંવરની સ્મૃતિ-રૂપિ અને બાધક આંતરિક આશ્રવની સ્મૃતિ અને અરૂપિ તે પણ આત્મસ્વરૂપનું અનુભવ ચિન્હ છે.

(૪) મૈત્રી :- એ પણ આત્મજ્ઞાનનો અંકુરો છે, આત્મજ્ઞાન વગરનાને કોકમાં મિત્રતાની બુદ્ધિ હોય છે. તો કોકમાં શત્રુતાની પણ બુદ્ધિ હોય છે, અથવા શત્રુતાની બુદ્ધિની યોગ્યતા હોય છે, જેને કોઈ ઉપર શત્રુતાની-વિરોધી તરીકેની બુદ્ધિ નથી, બધા જીવાત્મા સ્વરૂપથી મારા સમાન શુદ્ધ સિદ્ધ પરમાત્મા છે તેથી બધાની મૂળભૂત સ્વરૂપના લક્ષણી સમાનતા છે, માટે મારે બધા સાથે મિત્રતા છે આવી બુદ્ધિ હોય તેને વ્યવહારમાં ઉપેક્ષા, માધ્યસ્થ ભાવ ઉચ્ચિત એવા અવિનયી, પાપી, અસાધ્ય નાસ્તિક જેવા જીવો ઉપર પણ શત્રુપણાનો દેખ ઉઠતો નથી.

જેમ સોનું કાદવમાં પડેલ હોય, અશુદ્ધિમાં હોય તો પણ સુવર્ણ ઉપર અરૂપિ થતી નથી. આવી મૈત્રી ભાવના યુક્ત ઉપેક્ષા-માધ્યસ્થ ભાવના વાસ્તવિક, સાલ્વિક છે, બાકીનાની અભ્યાસિક છે. આ મૈત્રીભાવ જીવના ઈર્ઝા, દેખ, કઠોરતા વગેરે દોષોનો નાશ કરીને આનંદ, સ્નેહ, નમ્રતા, મીઠાશ વગેરે ગુણો પેદા કરે છે. આત્મબોધ વગર મૈત્રી, પ્રમોદ, કરુણા ગુણ ઔપચારિક, અલ્પકાલીન, વિરોધી ભાવ યુક્ત હોય છે. જેમ રાગદેખ વિષય બેદધી સંસ્કાર રૂપે સાથે રહે છે, એ રીતે મિત્રતા, શત્રુતા, સ્નેહાણપણું, રૂક્ષતાપણું, પ્રમોદ અને ઈર્ઝા વિગેરે દ્વંદ્વો સાથે રહેતા હોય છે. જીવાં બંને રહે ત્યાં શુદ્ધ આત્મ અવબોધ નથી, માટે મૈત્રી એ આત્મબોધનું જ એક સ્વરૂપ છે.

કોઈના પર પણ શત્રુતાની બુદ્ધિ-કલ્પના ન થાય. માટે ‘અપરાધીશું પણ નાચ ચિંતવે, ચિંત થકી પ્રતિકૂળ’ તેમ બતાવ્યું છે.

આ મૈત્રીના વ્યવહારિક રૂપકો છે પ્રમોદ, કરુણા અને મધ્યસ્થપણું, મૈત્રીભાવ હોવા છતાં વ્યવહારમાં ગુણોની પ્રગટ અવસ્થા, અપ્રગટ અવસ્થા, પુન્યના ઉદ્યો, અનુદ્યો, શક્તિ સંપત્તા, અસંપત્તા હોય ત્યારે નીચેવાળા ઉપરવાળા ઉપર પ્રમોદભાવ કરે, ઉપરવાળા નીચેવાળા ઉપર કૃપા-દ્યા-સહાનુભૂતિ-કરુણાના ભાવ રાખે અને એ રીતે નીચેવાળા ઉપરવાળા જોડે શક્ય વ્યવહાર કરે. ઉપરવાળા પ્રાય: માધ્યસ્થ ઉપેક્ષા ભાવના વિષય નીચેવાળા માટે બનતા નથી. કષારેક નાસ્તિકપણા વિગેરે યુક્ત હોય ત્યારે વાસ્તવિક ગુણાધિક નથી તેથી તેવા ગુણોને અનુકૂળ નથી. તેવા ઉપર માધ્યસ્થભાવ વ્યવહારથી રહે, રાખવો. પણ આત્મગુણરૂપ મૈત્રી ત્યાં પણ રહે છે.

(૫) સંવેગપણું પણ આત્મબોધથી ઉત્પત્ત થાય છે. સંવેગનો અર્થ મોક્ષ અભિલાષા છે. સંવેગનું કાર્ય છે મોક્ષના કારણભૂત જ્ઞાનાદિત્રયનો અભિલાષ અને એ અભિલાષનું કાર્ય છે એના રનત્રયરૂપ કારણના વ્યવહારિક આચારોમાં પ્રવૃત્તિ અર્થાત् જો મોક્ષ અભિલાષ આવે તો જ્ઞાનાદિ રનત્રય, દાનાદિ અભિલાષ આવે અને જો જ્ઞાનાદિ-દાનાદિ અભિલાષ આવે તો એના કારણોમાં આચારોમાં જીવ ઈચ્છાપૂર્વક વેગથી અવિષ્ટ ટાળી પુરુષાર્થ કરીને પ્રવર્તે. એને રોકી શકાતો નથી, અટકાવી શકાતો નથી, આ એકથી બીજાની સિદ્ધિ પ્રામ થતી જાય છે એથી એ કાર્ય કહેવાય છે. પરંતુ બીજી રીતે વિચારીએ તો જ્ઞાનાદિમાં ઉપયોગ-આદર-કુશળતા પૂર્વક જો જીવ પ્રવર્તે તો આ પ્રવૃત્તિથી કર્મના ક્ષયોપશમ થાય અને ભાવથી જ્ઞાનાદિ પ્રામ થાય અને સતત આ પ્રયત્નથી ભાવ જ્ઞાનાદિની-ક્ષયોપશમભાવની નિરંતર વૃદ્ધિ થાય અને એના પરિણામે કાયિક ભાવરૂપ જ્ઞાનાદિ જે મોક્ષનું મૂળ સ્વરૂપ છે તે જીવને પ્રામ થાય છે. માટે મોક્ષમાર્ગ જ્ઞાનાદિ કહેવાય છે, તેમ પંચાચાર પણ કહેવાય છે. આ પંચાચારનું પાલન એ વ્યવહાર સંવેગ છે. તેનાથી અશુભ પાપ સ્વરૂપ પંચ અનાચાર અટકે છે, તેથી કર્મબંધ અટકે છે. અશુભ સંસ્કારની વૃદ્ધિ અટકે છે, પંચાચાર પાલનથી અશુભ કર્મ નાશ પામે છે, અશુભ સંસ્કાર ઘટે છે, આરાધનાને અનુકૂળ શુભ કર્મ ઉપાર્જન થાય છે, આત્મસત્ત્વ, જ્ઞાન શુદ્ધ થાય છે, આત્માનો પુરુષાર્થ અને ધૈર્ય પ્રગટે છે, વધે છે, આ રીતે આત્મા મોક્ષ પામે છે, માટે બીજાનો ભાવ અને ક્ષયોપશમરૂપ નિશ્ચયપર્મ જીવની શકાતો નથી. તેથી પરમાત્માએ નિશ્ચય ધર્મના ઉત્પત્તિના મુખ્ય કારણરૂપ પંચાચાર અને જ્ઞાન દ્વારા શુભ ભાવના રૂપ વ્યવહાર ધર્મ સ્થાપ્યો છે. નિશ્ચયવાળા વ્યવહારને અપનાવ્યા વગર રહેતા નથી. જેટલા આત્મા મોક્ષ ગયા એમાં મોટાભાગના જીવો વ્યવહાર ધર્મથી નિશ્ચય ધર્મ પામીને મોક્ષ ગયા છે માટે પંચાચાર અને એની અભિલાષા એ વ્યવહાર સંવેગ છે. રનત્રય અને તેની અભિલાષા એ નિશ્ચય સંવેગ સમજવા.

(૬) વિવેક - વિવેકથી મોક્ષ અને સંસારનો બેદ સ્પષ્ટ બને છે. મોક્ષ ગયા પછી ત્યાં સંસારના કારણો જ નથી તેથી મોક્ષ ગયેલા જીવો સંસારમાં આવતા નથી. પરંતુ સંસારમાં રહેલ જીવોને દ્રવ્યથી અને ભાવથી બંને રીતે સંસારના કારણો પણ હોય અને મોક્ષના કારણો પણ હોય છે. આની ચતુર્ભંગી કરવી.

(૧) દ્રવ્યથી અને ભાવથી મોક્ષનું કારણ.

(૨) દ્રવ્યથી અને ભાવથી સંસારનું કારણ.

(૩) દ્રવ્યથી મોક્ષનું અને ભાવથી સંસારનું કારણ.

(૪) દ્રવ્યથી સંસાર અને ભાવથી મોક્ષનું કારણ.

(૧) શ્રી પરમાત્મા વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર દેવનો ધર્મ મોક્ષ માટે સંવેગ-નિર્વેદ પૂર્વક આરાધાય. આવી આરાધના સમ્બન્ધાદ્યિ નિકટભવમુક્તિગામી જીવો પ્રાય: કરે.

(૨) સંસારની અદ્વાર પાપસ્થાનકની પ્રવૃત્તિઓ રસ-આનંદ-આદરપૂર્વક કરાય.

(૩) શ્રી પરમાત્માનો ધર્મ અનાદર-અવજ્ઞાથી કરાય. અચરમાવર્તવાળા અને મુક્તિદેખવાળા આવો ધર્મ પ્રાય: કરે.

(૪) સંસારની અદ્વારપ્રકારની પાપસ્થાનોની પ્રવૃત્તિ સંયોગાધીન, પરાધીન, પશ્ચાત્યાપથી, રસ રહિત, કરવી પડે માટે કરે, અનુપયોગથી કરે. ભાવથી, આંતરિક ઉપયોગથી બીજામાં પ્રવૃત્ત હોય, ભાવથી સાંસારિક વ્યવહારમાં પ્રવૃત્ત હોય. સમ્બન્ધાદ્યિ સંસારી જીવોની પ્રાય: આ અવસ્થા હોય છે.

આ ચતુર્ભગીમાં પ્રથમ બંગ વ્યવહારથી અને નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. બીજો તથા ચરમભંગ વ્યવહારથી સંસાર કહેવાય.

ત્રીજો બંગ વ્યવહારથી અગ્રધાન ધર્મ કહેવાય.

વિવેકી આત્મા આત્મબોધના બળથી ભાવ આશ્રવોનો શક્ય ત્યાગ કરે અને ભાવ સંવર આયરે એ જ રીતે વિવેકી આત્મા વિવેકના બળો આંતરિક આશ્રવ તેમજ ધર્મમાં અવજ્ઞા-અનાદર-ભ્રમ-અરુચિ-અનુપયોગ-અવ્યવસ્થિતતા, વગેરેનો ત્યાગ કરે.

આત્મામાં આ ત્યાગની રૂચિ, પકડ હોય તે પણ આંશિક વિવેકનું કાર્ય છે.

આ આશ્રવત્યાગ હોવાથી ભાવ આશ્રવો વધતી નથી. ભાવ આશ્રવોમાં જીવ આનંદિત કે ગાંડો થતો નથી તેથી ચોથા ભાંગવાળા ભાવથી સંસારી પક્ષે અને ભાવથી ધર્મ હોય છે. આ આત્મજ્ઞાનનું લક્ષ્ણ-ચિકિત્સા કે કર્મના ઉદ્યને પરાધીન એવો પણ આત્મા ભાવથી મોક્ષના સ્વરૂપને, આત્મબોધને વૈરાગ્ય દ્વારા અનુભવે છે, પ્રધાન કરે છે તેથી સંસારના કારણોમાં આનંદિત થતો નથી. આમ વિવેક એ પણ આત્મબોધનનું ચિકિત્સા છે. પ્રથમ બંગમાં ભાવ સંસારના કારણોનો ત્યાગ છે, સાથે અંતરમાં સંયમના-રહત્રયના કારણોના ઉપાદાન સાથે આદર-ઉપયોગ-જ્ઞાન-અભ્યાસ વગેરે છે તેથી તે પણ ભાવ આશ્રવ અને અંતર આશ્રવને છોડવાથી વિશેષ વિવેક સંપત્ત છે, માટે વિવેક એ આત્મબોધ છે.

જ્યાં ભાવ આશ્રવનો ત્યાગ કે ગૌણતા હોય, જ્યાં ભાવ સંવર જીવતો

જાગતો હોય, પ્રધાન હોય, જ્યાં દ્વય આશ્રવનો અણાગમો-ત્યાગ અને વિશેષ આનંદ, પ્રશંસા, ઉપભૂહલાં, અનુમોદના વિગેરે ન હોવાથી જ્યાં શક્યતા અનુરૂપ ઉલ્લાસથી સંત્વકોરવી દ્વય સંવર=બાધ આચાર ધર્મનું પાલન હોય તે વિવેકનું આંશિક સ્વરૂપ છે. આ આત્મબોધ વગરનાને ન હોય.

વિવેક એટલે શ્રદ્ધાયુક્ત, શાનપૂર્વક, બાધ-અભ્યંતર-આશ્રવ-સંવરનું એટલે કે બીજા શબ્દોમાં હેય-ઉપાદેયનું ચિત્તવૃત્તિમાં વિભાજન અને જીવન વ્યવહારમાં શક્યતા અનુરૂપ વર્તન. તે અંતરના આત્મજ્ઞાનને, સિદ્ધ સ્વરૂપની જંખનાને અને આંશિક જાંખી-અનુભવને સૂચયે છે.

(૭) તીવ્ર નિર્વદ એટલે કંટાળો, ઉપાદેયમાં કંટાળો એ પુદ્ગલાનંદી-અભ્ય, દુર્ભય અને ચરમાવર્તવતી ભારેકમી જીવનું લક્ષણ છે. જ્યારે હેયમાં કંટાળો એ ભય ચરમાવર્તવતી હળુકમી નિકટ મોક્ષગામી જીવનું લક્ષણ છે. હેય વ્યવહારિક અને આધ્યાત્મિક એમ બે બેઠે છે. વ્યવહારિક હેયમાં અપ્રશસ્ત વર્ણાદિ-અશુભ સંયોગોનો કંટાળો આવે તે તમામ સંસાર રસિક જીવને હોય છે.


સંસારની શુખ અવસ્થા ઋષિ-સિદ્ધિ-ધન-ધાન્ય-માન-પાન વગેરેમાં ધર્મ વૈરાગી, ત્યાગી આત્માને હેયતાનું ભાન થાય છે. એમાં એ કંટાળો, ઉદાસીન બને, ત્યાગ કરે, આ જે વૈષયિક સુખ સાધનના ત્યાગરૂપ હેય બુદ્ધિ એ વ્યવહારિક તીવ્ર નિર્વદ કહેવાય. 'સુરનર સુખ તે દુઃખ કરી લેખવે' માટે સુખમાં નિર્વદ તે તીવ્ર નિર્વદ કહેવાય. આ આત્મજ્ઞાન-સ્વાનુભાવ વગર નથી આવતો. એથી કથોપશમભાવની શક્તિઓ જે અપૂર્ણ છે, નાશવંત છે, જેમાં જીવ પ્રમાણી બની જાય તેવી શક્યતા છે એવી ઋષિ-સિદ્ધિ શક્તિઓ જે આત્મસ્વરૂપ નથી અને આત્મ સ્વરૂપને પામવામાં બાધક છે તેનો પણ તીવ્રનિર્વદ અહીં લેવાનો છે. માટે અધ્યાત્મગ્રંથોમાં વિષય વૈરાઘ્યને અપર=નીચેનો વૈરાઘ્ય કહ્યો અને ગુણ વૈરાઘ્યને પર=શ્રેષ્ઠ વૈરાઘ્ય બતાવ્યો છે, તે બંને એક જ છે.

બાધ અને આંતર સંસારના કારણો ઉપરના તીવ્ર નિર્વદથી પણ આંતરિક આત્મબોધ અનુભવાય છે. આત્મબોધને ઓળખાવવાના આ ચિહ્નો છે.


સારાંશ દમ-શમ-સમ્યકૃત્વ-મૈત્રિ-સંવેગ-વિવેક-તીવ્ર નિર્વદ આ જેને વક્ત-પણો, વિશેષપણો દેખાય, અનુભવાય તે આત્માનુભવનું સ્વરૂપ છે.

માટે આ ગુણો જેમ જેમ કેળવાતા જાય તેમ આત્માનુભૂતિ=આત્મસ્વરૂપનું ભાન થતું જાય છે, અને છેવટે જીવ શરીર આત્મ સ્વરૂપ પ્રાત કરી લે છે.





બીજાની સેવા કરનાર વ્યક્તિને (૧) સેવા  
લેવાની જરૂર ન પડે અર્થાત् રોગ ન આવે.  
(૨) રોગ આવે તો સેવા કરનાર તૈયાર હોય.  
(૩) પોતાને વિવેક-વૈરાગ્યના પ્રતાપે સ્વાભાવિક  
સમાધિ મળે. (૪) બીજા સમાધિ આપનાર  
અનાયાસે મળે....



જેના હદ્યમાં પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવ નથી  
તેની ઊંચામાં ઊંચી આરાધના પણ પરભવમાં સાથે  
નથી આવતી. કારણ કે બધી આરાધનાનું Power-house  
પરમાત્મભક્તિ છે. પાપનો ભય, પાપની  
જુગુખા અને પાપની નિવૃત્તિ, ધર્મની રૂચિ, ધર્મ પ્રત્યે  
સમર્પિતતા અને ધર્મમાં પ્રવૃત્તિ આ  
સમ્યકૃત્વના મૂળ પાયાઓ છે.

ધ્યાન એટલે માત્ર શાસોચ્છ્વાસ રોકવા કુ  
અમુક સમય પૂરતાં જ મનના સંકલ્પ-વિકલ્પ  
અટકાવવા તે પર્યામ નથી. રોજબરોજના  
પ્રસંગોમાં જીવનની રહેણી કરણીમાં હરકણે  
ચિત્તને વૈરાગ્યમાં રાખવું તે જ સાચું ધ્યાન છે.  
દુર્ધ્યાન કરાવે છે રાગ-દ્રેષ્ટ, તેનો લાસ વૈરાગ્ય  
વિના શક્ય નથી.

જેણે મનને સુધાર્યું તેનું બધું સુધરી ગયું પરંતુ મનને  
સુધારવા માટે પોતાની અવસ્થાને ઉચિત આચારના  
પાલનમાં દૃઢતા હોવી જોઈએ. જેટલો આચાર  
સ્વચ્છ અને દૃઢ તેટલું જ મન પવિત્ર અને સ્થિર  
બને છે.

દેવ-ગુરુ પ્રતિ સમર્પિતતા એ જ ધર્મનો પાયો  
છે. સમર્પણાભાવ વિનાનો અભાગી જીવ મોક્ષ  
તો નથી મેળવી શકતો, સંસારમાં પણ સુખી  
થઈ શકતો નથી, કારણ કે તેના જીવનમાં ધર્મ  
અને પુણ્ય બંનેનો અભાવ છે.

ઇન્દ્રસ્થ કર્મપરવર્ષ છે. સાવધાની હોય ત્યાં  
આત્માનો વિજય છે. ગફતલ થાય તો કર્મનો  
મોહનો વિજય થાય. કોઈ પણ ઉંમરમાં  
એક્સીડન્ટ થઈ શકે છે તેમ જ્યારે જ્યારે  
પ્રમાદ આવે ત્યારે કર્મો આત્મા પર ચઢી બેસે.

પાપનો ભય - પાપની જુગુખા અને પાપથી  
નિવૃત્તિ, ધર્મની રૂચિ - ધર્મ પ્રત્યે સમર્પિતતા  
અને ધર્મમાં પ્રવૃત્તિ આ સમ્યકૃત્વના  
મૂળ પાયાઓ છે.

બોર્ડ ઉપર ચોકથી લઘ્યું હોયતો ભીના કપડાંથી  
નીકળી જાય પણ રંગથી લઘ્યું હોય તો કાચ  
અને પતરીની જરૂર પડે અને જો ઓઈલપેનટથી  
લખેલું હોય તો એસીડ જ જોઈએ. તેમ  
અનાદિકાળથી અધર્મની વૃત્તિ અને પ્રવૃત્તિથી  
રંગાએલા મનને આચારોની ચુસ્તતા રૂપી ભીનું  
કપડું જરૂરી બને.  
જો અધર્મની વૃત્તિ અને પ્રવૃત્તિ  
દફતર હોય તો આચારોની ચુસ્તતાની પાછળ  
વિચારોનું પ્રેરકબળ જરૂરી બને. અને અતિગાઢ  
થયેલ દોષોને કાઢવા ગુરુસમર્પણ-ભાવનારૂપ  
આચારજ્ઞાન- વૈરાગ્ય ધ્યાન રૂપી એસીડ જોઈશે. જ....

વાંબ વાંબ ઉછળતાં મોજાઓ,  
ગમે ત્યારે આવી ચડતા તોકાનો,  
પાણીનું પ્રચંડ દખાણ અને પ્રાણવાયુનો અભાવ,  
પ્રાણધાતક જળચર જીવોના આકમણ,  
આ બધાનો સામનો કરીને દરિયાના પેટાળમાં ઉત્તરનાર  
મરજીવો જ મોતી અને રતો મેળવી શકે છે  
ગૂઢ અને ગંભીર વાણીમાં રચાયેલ,  
એક શબ્દમાં અનંત અર્થોથી ભરેલ  
આગમગ્રંથોમાંથી આત્મકલ્યાણકર ભાવોના  
રતો ગુરુકૃપાપ્રામ સંવિજન ગીતાર્થ ગુરુભગવંતો જ  
મેળવી શકે છે.

જિનશાસનની ઉજ્જવળ આચાર્ય પરંપરાને  
વધુ ને વધુ ઉજ્જવળ બનાવનાર  
ગીતાર્થશિરોમણી આચાર્ય ભગવંતશ્રીએ  
સુભાષિતરતોનો થાળ પરમકરુણાપૂત હદ્યથી  
આપણી સામે ધર્યો છે.  
એમાંનું એક એક રત અનંતકાળના  
ભાવદ્વારિદ્રયને દૂર કરવા સમર્થ છે,  
આવો, આપણા હદ્યની પછેડીમાં સમાય  
તેટલા રતોને ગ્રહણ કરીએ  
અને ભાવ અને ભાવનાથી સમૃદ્ધ બનીએ.....